

## ॥ અદ્યાય ૪૧ ॥

### સાઈ કૃપા, અનુગ્રહ, દાન

(સાઈની વાંદરાના અલ્લી મહંમદ ઉપર કૃપા કરવી અને દહાણુના બાળાસાહેબ દેવ ઉપર અનુગ્રહ કરવો.)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,  
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

શ્રી સાઈબાબાની કથાનો આ જ મહિમા છે કે તેને સાંભળવા માટે કથારેય પ્રોત્સાહનની જરૂર રહેતી નથી. શ્રોતાઓ પાછલા અધ્યાયોના અનુસંધાનને ધ્યાનમાં રાખીને સાંભળવા માટે બિલકુલ તૈયાર થઈને જ બેસે છે, જ્યાં કથાડ્યી અમૃત પીવા માટે શ્રોતાઓ સદા સાવધ હોય છે. ત્યાં ધ્યાન દઈને પ્રાર્થના કરવાની કોઈ જરૂર જ નથી હોતી. એમનું મન પહેલેથી જ એકચિત થેલું હોય છે. પોતાના ગુરુનો મહિમા ગાવાથી કે સાંભળવાથી ચિત્તવૃત્તિ નિર્મિત થાય છે અને તેમાં સ્થિર થઈને ધ્યાન સાથે જે નામસ્મરણ કરવામાં આવે તો તેમનું ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ સુખ આપનાર ઝૂપ પ્રગટ થાય છે. પાછળના અધ્યાયના એક વ્રતના ઉદ્ઘાપનની બધી વિધિ સાથે યથાસ્થિત સમાપ્તિ કેવી રીતે થઈ તે સાઈબાબાની પ્રત્યક્ષ હાજરીના આણસાર સાથે કહેવામાં આવ્યું છે. તેવી જ રીતે હવે શ્રીસાઈની માટીની તસ્વીર અચાનક દાભોલકરને ત્યાં કેવી રીતે આવી અને તેણે સમયસર ઈચ્છાની પૂર્તિ કેવી રીતે કરી તે હવે સાંભળો. એક હોળીના તહેવારના દિવસે, ‘હું આજે આવું છું’ અને મને તું ‘જમાડ’ એવું સાઈબાબાએ સ્વભાવમાં આવીને કહેલું. એમ તેમના મનની ઈચ્છા પૂર્ણ કરેતી, આ કથા સવિસ્તાર પહેલાંના અધ્યાયમાં કહેવામાં આવી છે. પણ આ મૂર્તિઝૂપ છબી બરાબર યોગ્ય સમયે જ કેવી રીતે આવી? આ કેવો ચમત્કર? તે હવે ધ્યાનપૂર્વક જોઈએ. (ઓ. ૧-૭)

અતી મહંમદ હકીકત કહેવા લાગ્યા અને તે વાત તેમને ખૂબ જ આશ્વર્યકારક લાગી. આ બાબાની એક ખૂબ જ મનોરંજક અને સ્પષ્ટ લીલા જ હતી. અલ્લી મહંમદે હોળીને દિવસે અને બપોરના જમવાના સમયે આવીને મને આનંદ વિભોર કર્યો હતો. આ તો પહેલાંની કથા થઈ, હવે શ્રોતાઓએ સાવધાનીપૂર્વક આગળનું વર્ણિન સાંભળવું. સાઈનું ચરિત્ર પાપમુકત કરનાંનું પાવન છે. અને તેમાંય આ કથા તો પૂર્ણ મીઠાસથી બેરેલી છે. શ્રોતાઓ પહેલેથી જ એકાગ્ર ચિત્તે બેઠેલા છે. વક્તા પણ સાઈનાં ચરણોમાં આસક્ત છે, કરણ કે આ સાઈનું ચરિત્ર તો અગાધ સમુદ્ર જેવું છે. શ્રીબાબા એટલે એક જીવતી જગતી પરોપકારની સાક્ષાત્ પ્રતિમા જ હતા. પોતાના દેહને હુંમેશાં તેમણે પરોપકાર કરવા માટે જ ખર્ચી નાખ્યો હતો. તેમણે પોતે દરેકની સાથે શત્રુત્વ વિહિન સ્થિતિ રાખી હતી. અને તેઓ હુંમેશા સત્કર્મો કરવાના કામમાં જ ખોવાયેલા રહેતા હતા. સારી નરસી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં આ શરીરનાં દેહકર્મો ધૂટતાં નથી. પરંતુ ગુરુ મનની વૃત્તિ પ્રેમભાવથી ગુરુચરણો તરફ વાળીને અને ભક્તોની યોગ્ય સંસારિક વ્યવહારની વ્યવસ્થા કરીને કેવી રીતે કંટાખ્યા વીના સંભાળ લેતા હતા. તે ગુરુના ચરણાં શ્રદ્ધા મૂકીને ઉત્તમ અનુભવ કરી જુઓ. આવી સ્થિતિ માગવાથી પણ મળતી નથી. તે તો ગુરુનાં ભજન કરવાથી પ્રાપ્ત થાય છે. જે ખૂબ પ્રયત્નોથી નથી મળતું તે ગુરુકૃપાના બળે સામે ચાલીને આવે છે. અભિમાનમાં છાકટા થઈને જેઓ સાઈની બારીકાઈથી તપાસ કરવા માટે આવ્યા, હતા તે પણ આખરે અભિમાન છોડીને દર્શનનો લહાવો લઈને સુખ અને સંતોષથી પાછા ફર્યા હતા. યશ, ઔદ્યાર્ય, જ્ઞાન, શાંતિ અને વૈરાગ્ય આ છ ભગવાનના.

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ઐશ્વર્યની જેમ શ્રી વિજણુ જેવા શ્રી સાઈબાબા પણ સંપૂર્ણ હતા. અમે કેટલા મોટા ભાગ્યશાળી કે, વિશ્વને ચૈતન્ય આપનાર એવો આ ખુદ પરમેશ્વર સાઈ. તેમની પૂજન અર્થના કે ભજન કર્યા વીના અમને દર્શન આપે છે? લોકો કહે છે કે દેવ ભક્તિથી પ્રસન્ન થાય છે જ્યારે અમારી પાસે તો ભક્તિનો અભાવ છે. આ સાઈમહારાજ એક મહાન મહાનુભાવ છે. દીનબંધુઓ માટે તેમનો સ્વભાવ એક માર્ગદર્શક અને દ્વારી સભર છે. આ વિષય ઉપરની કથા અલ્લી મહંમદ જ્ઞતે જ કહેશે, જેને શ્રોતાઓને આદરથી સાંભળવી જેથી તેમને સાઈલીલાની ગહનતા અને એમની મહાન અને અપાર શક્તિનો અને મહિમાનો અંદાજ આવશે. (ઓ. ૮-૨૦)

‘એક દિવસે મુંબઈના રસ્તા ઉપર ફરતો હતો ત્યારે મને સુંદર ચિત્રો અને તસ્વીરો વેચનાર વ્યાપારી દેખાયો. સંત મહાત્મા અને ઓલિયાઓનાં ચિત્રો ખૂણેખૂણેથી કાઢીને હું જેવા લાગ્યો. તેમાંથી એક મૂર્તિક્ષી તસ્વીર ગમી ગઈ. તેની મોહકતા કંઈક જુદી જ હતી. અને મારા આરાધ્ય દેવ પણ પહેલેથી તે જ હતા. એક તો મનમાં સાઈનું ગાંડપણ અને તેમાં પાછી આવી સુંદર મૂર્તિ નજર સામે જેઠિને તે વેચાતી લઈ લેવાની મને તીવ્ર ઇચ્છા જગ્યી. મેં તેની કિંમત રોકડી ચૂકવી દીધી. બાબા ઉપર મને ખૂબજ પ્રેમ હોવાને કારણે તે છભીને મેં મારે ઘેર ભીતે ટાંગી દીધી કે જેથી આમતેમ ફરતાં પણ તેમનાં દર્શન થચા કરે. હું દરરોજ ધરની બહાર જતાં અને આવતાં તેનાં દર્શન કરતો. તે જ છભી મેં તમને લાવીને આપી છે. તે મૂર્તિ તમને આપી તેના બે ત્રણ મહિના પહેલા મને જરા પણ સાચું લાગતું ન. હતું, તેથી હું મારા બનેવીને ત્યાં થોડા દિવસ માટે રહેવા ગયો હતો. મારા બનેવીનું નામ નૂર મહંમદ પીરભાઈ છે. મારો પગ સૂજવાના કારણે મારી ઉપર શક્રક્રિયા કરવામાં આવી હતી. આમ આવો નાદૂરસ્ત હોવાને કારણે ત્રણ મહિના સુધી હું તેમને ત્યાં જ રોકાયો હતો. આ ત્રણ મહિના દરમિયાન મારું પોતાનું ધર બંધ હતું. પ્રસિદ્ધ બાબા અબ્દુલ રહેમાન, મૌલાના સાહેબ મહંમદ હુસેન, શ્રીસાઈનાથબાબા અને તાજુદીનબાબા તેમની સૌની છભીઓએ મારા ધરની ભીત ઉપરની જગ્યા સહેજમાત્ર છોડી ન હતી. આ બધાં અને આવા અનેક મહાનુભાવોનાં છાયાચિત્રો મારા ધરની ભીત ઉપર ટાંગેલાં હતાં. તેમને પણ કાળના ચેકે છોડ્યાં નહીં. પરંતુ અહીંથા મારી આવી સ્થિતિ હોવાને કારણે આવાં અલભ્ય ચિત્રો ધરમાં હોવા છતાં મને સાડાસાતી શા માટે લાગવી જેઠિએ? મનમાં થયું કે જે વસ્તુ ઉત્પન્ન થાય છે તેનો નાશ નિવારી શકાતો નથી.’ (ઓ. ૨૧-૩૧)

આવી પરિસ્થિતિ હોવા છતાં તે બધી છભીઓમાંથી સાઈની છભી કેવી રીતે બચી ગઈ એ તો મને આજદીન સુધી કોઈ પણ સમજલી શક્યું નથી. આ વિષયને લગતી બધી કથા સાંભળીને તમને કદાચ આશ્રય તો અવશ્ય થશે. તેમજ શ્રીબાબાની બધી જ ચર અને અચર વસ્તુઓમાં એકદૃપતા. અને તેમની તર્ક વગરની કુશળતા તમને આપોઆપ સમજાઈ જશે. સંત બાબા અબ્દુલ રહેમાનની એક નાની છભી મહંમદ હુસેન, જેમનું પ્રચલિત નામ ‘થારિયા’ હતું તે તેમની પાસે હતી. તેમણે મને આ ચિત્રની એક નકલ આપી. તેને સારાં એવાં વર્ષો વિત્યાં હતાં. મારા સાળા અબ્દુલ રહેમાન બાબાના અનુયાયી હતા. માટે એ છભીની નકલ મેં તેમને આપી દીધી. તેમની પાસે પણ આ છભી તેમના મેજના ખાનામાં આઈ વર્ષથી પડી રહી હતી. એક દિવસે તે સહજ રીતે મળતાં તેમણે તે મુંબઈના કોઈ ફોટોગ્રાફરની દુકાનમાં લઈ જઈને અબ્દુલ બાબાના કણ્ણી એક મોટી છભી તેથાર કરાવી. તેમનો આશય એવો કે એ અબ્દુલ બાબાને એ તસ્વીર બેટ આપવી અને તેમ કરવાથી તેઓ પ્રસન્ન થઈ જશે. આ મોટી કરાવેલી છભીની બીજી અનેક નકલો કરાવી તે પોતાના મિત્રોમાં વહેચી દીધી. તેમાંની જ એક નકલ મને આપી હતી. તેને મેં મારા ધરની ભીત ઉપર ટાંગી હતી. પણ એક દિવસે અબ્દુલ રહેમાનનો દરબાર ભરાયો હતો. તે સમયે મારો સાળો નૂરમહંમદ એ સુંદર છભી તેમને પૂજ્યભાવથી અર્પણ કરવા માટે તૈયાર થયો. તે ચિત્ર જેઠિને અને તેનો આશય સમજુને અબ્દુલ રહેમાન ઘણાં જ ગુસ્સે થઈ ગયા. અને તેને મારવા માટે ઉઠ્યા. તથા તેનું અપમાન કરીને ત્યાંથી કાઢી મૂક્યો. તેને લીધે નૂરમહંમદનો ચહેરો ઉત્તરી ગયો. અને મોટી ચિંતામાં

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

પછ્યો. પછી તે દ્વાસાણો અને ઉદ્ઘાસ થઈને નિરાશ થઈને ‘પૈસાનો પૈસો ગયો અને ગુરુકૃપામાં વિધન ઉદ્ઘબવ્યું. મેં આજ સુધી ગુરુની કૃપા સંપાદન કરેલી હતી. પણ આજે તેમના ગુરુસાનું હું કારણ બન્યો.’ એવું કહીને, શંકાશીલ મને તે ચિત્રો પાણીમાં દૂખાડવાની શરૂઆત કરી. તેઓ ફરીથી બોલ્યા, ‘હવે આ સંતોની પ્રતિમાઓ કયારેય ઘરમાં રાખવામાં માલ નથી. તેને કારણે આજે હું ગુરુપ્રેમથી વંચિત રહ્યો. મેં વગર કામનો આવો નકામો ધંધો શા માટે કર્યો? જે છબીને કારણે મારા ગુરુ મારી ઉપર નારાજ થઈને મારું નુકસાન થયું તે શા કામનું? આ પણ એક પ્રકારની મૂર્તિપૂજન જ છે. જે મારા ગુરુને ગમતી નથી. તો તેમને નાખુશ કરી આવાં ચિત્રો મારે શા માટે રાખવાં? આ ચિત્રો મેળવવા માટે મારા સારા એવા પૈસા ખર્ચાઈ ગયા. પંચું તેમને હવે જ્યાસમાં આખ્યા વીના મારી પાસે બીજે કોઈ રસ્તો નથી. મારાં બનેવીએ આ છબી કોઈ માંગે તો પણ નહિ આપતાં. તે છબીઓ સાથે લઈને તેમને પાણીમાં પદ્ધરાવી દેવા માટે જ્યાં સ્ટીમરમાંથી માલ ઉતારાય છે અને ચઢાવાય છે તે સ્થળે એટલે કે ધક્કા ઉપર ગયા. તે છેક એપોલો બંદર ઉપર ગેટ વે ઓફ ઇન્ડિયા સુધી ગયા. ભાડાની એક નાવડી નક્કી કરીને જેટલું જ્યાય તેટલું સમુદ્રમાં દૂર જઈને તે છબીઓ સમુદ્રમાં પદ્ધરાવી દીધી. ત્યાં તે રોકાયા નહિ. તેમણે વાંદરા પોતાના નિવાસ સ્થાને જઈને તે જ વસ્તુની પાછી શરૂઆત કરી. પોતાના અંગત મિત્રોને આપેલી છબીની નકલો પાછી મારી લઈને તેમને કહ્યું, ‘બાબા અભદ્રુલ ગુસ્સે ભરાયા છે. જેણે તેણે પોતાને ત્યાંની છબીઓની નકલો પાછી આપવી નથી અને તેમને પાણીમાં પદ્ધરાવી દેવાયા.’ મને આપેલી મોટી છબી પણ પાછી મંગાવી લીધી. મારા ભાઈએ અને બહેનનો પણ આપેલી નકલો પાછી મેળવી લીધી અને આ પ્રકારે બધી જ છબીઓ પાછી આવી ગઈ. ત્યારબાદ છ એક છ છબીઓ લઈને વાંદરાના દરિયા કિનારે જ્યાં જમીન પૂરી થાય છે અને પાણી શરૂ થાય છે ત્યાં ધુઅંપુઅાં થતો પહોંચ્યો ગયા. તેમણે એક કોળીને બોલાવીને તે બધાં ચિત્રો એકી સાથે તેને સુપ્રત કરીને સમુદ્રના પાણીમાં જ્યાં સમાધિ અપાવી.’ (ઓ. ૩૨-૫૪)

હું તે વખતે તેના ઘરમાં પીડાગ્રસ્ત હાલતમાં પડેલો હતો. મને પણ એણે એવો જ ઉપદેશ કર્યો. ‘આ છબીની નકલો જ સંકટો નોતરે છે. એ બધી છબીઓને બેગી કરીને જ્યારે તું જઈને દરિયામાં એનું વિસર્જન કરી આવીશ ત્યારે જ તારા રોગનું અને દુઃખનું નિવારણ થશે.’ તેમની વાત સાંભળીને મેં મારા કારબારીને બોલાવી લીધો અને તેના હાથમાં ઘરની ચાવીઓ આપીને બધા સંતોની છબીઓ મંગાવી લીધી અને બનેવીને સૌંપી અને જે કાંઈ કરવું હોય તે માટે તેમણે જણાયું. તરત જ પોતાના મારીને બોલાવીને તેના દ્વારા ચિંમ્બાઈના દેવળ પાસેના દરિયામાં દૂખાડાવી દીધી. તેના બે મહિના બાદ મને થોડો આરામ લાગતાં હું પોતાના ઘરે પાછો ફર્યો અને ઘરમાં પેસતાં જ આશ્રયમાં ગરકાવ થઈ ગયો. તમને જે મેં તસ્વીર આપી છે તે દરવાજની સામેની ભીત ઉપર પહેલાંની માફક ટંગેલી જોઈને મને ખૂબ જ નવાઈ લાગી. કારબારીને બોલાવીને મેં બધી તસ્વીરો મોકલી આપી હતી છતાં આ એક છબી કેવી રીતે રહી ગઈ? ઉતાવળે મેં એને ભીત ઉપરથી ઉતારી લઈને મારા કબાટમાં સંતાડી દીધી. મારા મનમાં શંકા ઉત્પન્ત થઈ કે જો મારા સાળાની નજરમાં પડી તો તે તેને દરિયામાં દૂખાડવા માટે લઈ જશે. એની નજરે ચઢતાં મારો સાથો કોચિત થઈને આ ઘરમાં એને રાખવા દેશો નહિ. અને પોતાના હાથે જ તેને પાણીમાં પદ્ધરાવી દેશો. કયાં તો ઉતાવળ કરીને ગમે તેને કારણ વગર આપી દેશો. આમ કોઈ પણ જતનો વિચાર કર્યા વીના કોઈ પણ ત્રાહિત વ્યક્તિને તે છબી આપી દેશો તો. તેની દરરોજની પૂજન ઉપાસના વગેરે બરાબર નહિ થાય. અને હુંમેશને માટે એક ખટકો મારા મનમાં રહી જશે. માટે જ્યાં એ સુરક્ષિત રહે એવું યોગ્ય ઠેકાણું જોઈને તેમજ જે પોતાને ઘરમાં તેને વ્યવસ્થિત રીતે રાખે તેવી વ્યક્તિને આ તસ્વીર આપવી જોઈએ. મારું મન જ્યારે આ રીતે દ્વિધામાં પડવું હતું ત્યારે જણે સાઈભાબાએ જ મનમાં એક સારો વિચાર સૂચવ્યો કે, હવે મૌલાનાના દરબારમાં જવું અને આ વાત ઈસ્મુલને સમજાવવી. પછી હું જલ્દી જલ્દી પહોંચ્યો ગયો અને મુજલવર ઈસ્મુલને

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

આ બધી હકીકત એકાંતમાં ખૂબ જ શાંતિથી કહી સંભળાવી. બંનેએ નિર્ણય કર્યો કે આ તસ્વીર તમારા ધરે જ દાભોલકરને ત્યાં આપવી જેથી સુરક્ષિત રહેશે. માટે તે દિવસે અમે બંનેએ મનમાં નક્કી કર્યું કે, આ સમર્થસાઇની છબી તમને જ અર્પણ કરવી કે જેથી એ યોગ્ય ઠેકાણે રહે. અમે કરેલા નિશ્ચય પ્રમાણે તે મૂર્તિ લઈને અમે તમને આદરપૂર્વક આપી. અને તમારો જમવાનો સમય સચવાઈ રહે તે હિસાબે અમે તરત પાછા ફર્યા. આ લાંબી વાર્તા તે વખતે સંભળાવવા માટેનો સમય જ ન હતો. પણ કોઈવાર નિરાંતે મળીશું ત્યારે કહીશું એમ વિચારીને અમે નીકળી ગયા હતા. આજ કાલ કરતાં કરતાં આ અંગે નવ વર્ષનાં વહાણાં વિત્યાં. અને આજે આમ અચાનક જ આપણી એકબીજાની મુલાકાત થઈ. તેને કારણે પાઈ બધી વાતો યાદ આવી અને તમે પણ પોતાના સ્વખોમાં જેચેલ નવાઈ કહી સંભળાવી. માટે જ આ અપૂર્વ કથાનો સંબંધ અને તાત બેઠો, અને ખરી હકીકત બહાર આવી. ખરેખર બાબાની આ લીલા અદ્ભુત નથી કે? (ઓ. ૫૫-૭૩)

હવે એક બીજુ કથા કે જેમાં શ્રી બાબા પોતાના પ્રેમાળ ભક્તો સાથે કેવું ભાવપૂર્વક વર્તતા હતા એ સાવધાન ચિત્રે સાંભળો. જેને પણ પરમાર્થની ખરી ચાહના હોય એવા ભક્તો સાઇને ખૂબ ગમતા હતા. તેમની દરેક પ્રકારની અડચણો દૂર કરીને, આનંદની પ્રાપ્તિ કરાવી આપતા હતા. આ વિષે એક સરસ અનુભવ બાળાસાહેબ દેવનો છે. બાબાએ તેમની એક ટેક પૂર્ણ કરાવીને તેમના મનના કોડ પૂરા કર્યા અને તેમની ભક્તિ સમૃદ્ધ કરી હતી. દિવસ દરમ્યાન નોકરી કર્યા વીના ઉદ્દર નિર્વાહ માટે બીજે કોઈ ઉપાય ન હતો. પરંતુ રાતના સમયે પરમાર્થનું કાર્ય કરવા માટે બાધા શા કારણે આવવી જોઈએ? જ્ઞાનેશ્વરીનું વાંચન દરરોજ કરવું એવી તેમની ઘણા જ દિવસોની હોંશ હતી. પણ યેનકેન પ્રકારે કોઈ ને કોઈ વિધનો આવવાથી તેમનાથી તે બની શકતું નહીં. ભગવદ ગીતાનો અદ્યાય જેમ નિયમથી વાંચતો હતો, તેવી જ રીતે આ જ્ઞાનેશ્વરીનો નિયમ કોઈને કોઈ કારણે પાણી શકતો ન હતો. બીજે ગ્રંથો વંચાતા. પણ જ્ઞાનેશ્વરી માટેનો નિયમ કોઈ પણ સંનેગોમાં પાર પડતો ન હતો. એક વખત ત્રણ મહિનાની સણંગ રન લઈને બાળાસાહેબ દેવ શિરડી ગયા અને ત્યાંથી પોતાને ધેર પૌડ ગામમાં વિશ્રાંતિ કરવા માટે ગયા. ત્યાંના બીજી બધાં કામો પત્યાં અને દરરોજના નિયમ પ્રમાણેની પોથી પણ વંચાઈ. પણ જ્ઞાનેશ્વરી વાંચવાની ઠિચ્છા પૂર્ણ થઈ નહીં. જણે કે તેનો સમય જ પાક્યો નહોતો. જ્ઞાનેશ્વરી હાથમાં લેતા વેંત બીજી જ કોઈ વિચારો મગજમાં આવતા અને તેને કારણે ઉપરછલું વાંચન થતું, પણ મનમાં તેનો સંતોષ થતો નહીં, તથા નક્કી કરેલો નિયમ સિદ્ધ થતો નહીં. દરરોજની પાંચ ઓવીઓ પણ નિયમથી વાંચી શકતી નહીં. માત્ર પાંચ ઓવીઓ દિવસે વાંચવાનો મનસૂબો નક્કી કરતાં, તે પણ વંચાતી નહિ. પછી એવું જ નક્કી કર્યું કે સાઇમહારાજ જ્યારે પ્રેમથી જ્ઞાનેશ્વરી ‘વાંચ’ એવું કહેશે ત્યારે જ કોઈ પણ જતના મનોમંથન વીના પ્રયાસ શક્ય કરીશ. સાઈ ચરણોમાં અતૂટ વિશ્વાસ હતો માટે તેઓ જ્યારે આજ્ઞા આપશે ત્યારે જ જ્ઞાનેશ્વરી હાથમાં લઈશ, એવો વિચાર કરીને દેવે શાંતિથી નિર્ણય બાબા ઉપર છોડ્યો. (ઓ. ૭૪-૮૭)

ત્યારબાદ મહોદ્ય પર્વ આવતાં ઈ.સ. ૧૯૧૪ના ફેબ્રુઆરી મહિનામાં બહેન તથા અન્ય સૌને સાથે લઈને ગુરુ પૂજન માટે અને તેનું કૌતુક નિહાળવા દેવ શિરડી આવ્યા. ત્યાં બાપુસાહેબ જેગે તેમને પૂછ્યું કેમ ભાઈ આજકાલ આપ જ્ઞાનેશ્વરીનું વાંચન રોજ બરાબર કેમ નથી કરતા? તે સાંભળી દેવસાહેબે શું જવાબ આપ્યો તે સાંભળો. ‘મને જ્ઞાનેશ્વરી વાંચવા માટેની ખૂબ હોંશ છે, પરંતુ તે સિદ્ધ થતી નથી. હવે બાબા જ્યારે વાંચવા માટે આગ્રહ કરશે ત્યારે જ વાંચીશ.’ તે સાંભળી જોગસાહેબે એક યુક્તિ કહી કે, જ્ઞાનેશ્વરીની પોથી લાવીને સાઇબાબાના હાથમાં મૂકો અને તે તમને પાઈ આપે એટલે વાચવાની શક્યાત્મકતા કરવી. તે સાંભળીને દેવ બોલ્યા, ‘મારે કોઈ પણ પ્રકારની યુક્તિ અજમાવવી નથી અને મને તેની ઠિચ્છા પણ નથી. બાબાને મારા મનના વિચારોની ખબર છે. પછી તેઓ શા માટે મારા મનનો મનસૂબો પૂર્ણ કરી આપતા નથી? અને સાફ સાફ ‘વાંચવા માટે લે’ એમ કહેતા નથી.’ (ઓ. ૮૮-૯૨)

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ત્યાર પછી શ્રીસાઈબાબાના દર્શન કરતી વખતે બાળાસાહેબ દેવે એક ડ્રપિયો દક્ષિણા અર્પણ કરી. ત્યારે શ્રી બાબા બોલ્યા, ‘કેમ એક જ ડ્રપિયો ? વીસ ડ્રપિયા આપ્યા.’ દેવે વીસ ડ્રપિયા લાવીને આપ્યા. પછી રત્ને દેવને બાલકરામ માનકર મળ્યા તે સમયે દેવે તેમને સાઈકૃપા તેમના ઉપર કેવી રીતે ઉત્તરી તે વિષે હકીકત પૂછી. તેના જવાબમાં બાલકરામે ‘કાલે આરતી પછી આ બધી વિગત હું તેમને કહી સંભળાવીશ’ એવું આશ્વાસન આપ્યું અને દેવે કહ્યું, ‘સારું કંઈ વાંધો નહીં. બીજે દિવસે દેવ પાછા મસ્ટિજદમાં દર્શન માટે ગયા હતા ત્યારે બાબાએ તેમની પાસેથી ફરીથી વીસ ડ્રપિયા માંગ્યા અને દેવે આનાકાની વીના આપ્યા. ત્યાં ભક્તોની ગિરદી જેઠને દેવ પોતે થોડા દૂર અલગ જગ્યામાં જઈને બેસી ગયા. ત્યારે સાઈએ પૂછ્યું, ‘ત્યાં કથાં ગિરદીમાં જઈને સાંકડે માંકડે બેઠો છે ?’ દેવે જવાબ આપ્યો ‘બાબા ! અહીંયા છું ને ?’ બાબાએ ફરી કહ્યું, ‘તે સાત ડ્રપિયા કેમ આપ્યા ?’ દેવ બોલ્યા, ‘વીસ પૂરા આપ્યા’ બાબા ફરી બોલ્યા, ‘પૈસા કોના છે ?’ ત્યારે દેવે જવાબ આપ્યો ‘બાબા, તમારા જ’ ત્યારે બાબાએ કહ્યું, ‘તો પછી તમે દૂર કેમ બેઠા છો ?’ અહીંયા પાસે આવો અને સ્વસ્થ ચિત્તે નજીક બેસો’ આજા પ્રમાણે દેવ સાચ્યી મનોભાવનાથી ત્યાં પાસે આવીને બેસી ગયા. (ઓ. ૬૩-૧૦૦)

પછી દરરોજના કંઈ પ્રમાણે આરતી થઈ અને બધો જ ભક્ત સમુદ્દ્રાય પોતપોતાના ઘર તરફ પાછો ફર્યો. ત્યાં બાલકરામ સાથે મુલાકાત થતાં જ દેવે પોતાનો પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી. તેમના જીવનમાં બનેલો અગાઉનો ઇતિહાસ પૂછ્યો અને માનકરે દેવને વિગતવાર કહી સંભળાવ્યો. દેવે તેમને પૂછ્યું, ‘બાબાશ્રીએ તમને ઉપાસના માટે કેવી રીતે વાખ્યા ? બ્રહ્મચિંતન કેવી રીતે કરવું વગેરેની સમજ સમજનવી કે ? આ સર્વ બાબતમાં મારી જે જ્ઞાનવાની જ્ઞાસા છે, તે પૂર્ણ કરો !’ દેવની વિનંતી સાંભળીને તેમની જ્ઞાસા પૂરી કરવા માટે બાલકરામ જવાબનો આરંભ કરતા હતા, તેવામાં દેવને બાબાશ્રીએ બોલાવી લાવવા માટે સંદેશો મોકલ્યો. સાઈમહારાજ કેવા કાવાદાવાવાળા હતા તે જુઓ ! એમણે ચંદ્ર નામના રોગીને દેવને બોલાવવા માટે મોકલ્યો અને બાબાનો સંદેશો મળતાં જ પલભર વિલંબ કર્યા વીના દેવ બાબાને મળવા માટે આવ્યા. આ સમયે બપોરના ચાર વાગ્યા હતા. મસ્ટિજદની ભીતને બે હાથે ટેકવીને ઊભેલા શ્રીસાઈ દેવ સામે જ દેખાયા. પાસે આવતાં જ દેવે બાબાને નમસ્કાર કર્યા. બાબાએ તેમને પૂછ્યું, ‘ક્યાં કોની સાથે તમે શું વાતો કરતા હતા ?’ દેવે જવાબ આપ્યો, ‘કાકાસાહેબ દીક્ષિતિના મેડા ઉપર બાલકરામની સાથે બેસીને આપની કીર્તિના ગુણગાન સાંભળી રહ્યો હતો.’ પછી બાબાએ દેવને પચીસ ડ્રપિયા લઈ આવવા માટે આજા કરી અને દેવ તે પણ લઈ આવ્યા અને બાબાને અર્પણ કર્યા. ‘કટલા લાભ્યો છે ?’ એમ બાબાએ પૂછ્યું, ત્યારે દેવ બોલ્યા, ‘પૂરા પચીસ લાભ્યો છું.’ તે સમયે બાબાએ કહ્યું, ‘ચાલ અહીં આવ અને બેસ’ પછી બાબાની સાથે દેવ મસ્ટિજદમાં ગયા. બાબા થાંભતા પાસે બેઠા. મસ્ટિજદમાં એ વખતે ત્યાં કોઈ પણ હતું નહીં. બાબાએ કહ્યું, ‘મને ખબર ન પડે એવી રીતે તે મારું ચિંથરું ચોરી લીધું છે.’ ત્યારે દેવે બાબાને જવાબ આપતાં કહ્યું કે ‘મને એ ચીથરાની બાબતમાં કંઈ પણ ખબર નથી.’ આમ બોલતાં દેવ બાબાને સોંગાંધ્રૂવક કહેવા લાગ્યા ત્યારે બાબા બોલ્યા, ‘અહીંયા જ કંચાં છે તે જે.’ બોલ અહીંયા કથાં છે ચીથરું ?’ દેવે જવાબ આપ્યો. ત્યારે બાબા ઊભા થયા અને બોલવા લાગ્યા, ‘તું શોધી કાઢ, ચોરીની વૃત્તિ ખૂબ ખરાબ હોય છે. કોણ હરામખોર એ લઈ ગયો ? જે જરા, ત્યાં જ હોવું જેઠાએ.’ આ સાંભળીને દેવ શોધવા લાગ્યા, છતાં કાપડનું ચીથરું તેમને મળ્યું નહીં. તેથી વિચાર કરવા લાગ્યા કે તે કથાં હશે ? પણ તેમને કંઈ દેખાયું નહીં. (ઓ. ૧૦૧-૧૧૪)

અચાનક કપાળ ઉપરની કરચલીઓ સાથે ભરમો ચઢાવીને અહીંયા ત્યાં જેઠાને દેવ સામું જેઠાને શ્રીસાઈ એમના ઉપર ઉકખ્યા અને કહેવા લાગ્યા, ‘તું જ લબાડ છે, તારા સિવાય અહીંયા ચીથરું ચોરવા કોણ આવી શકે ? હું તો તને જ ચોર સમજું છું, તું શું અહીંયા ચોરી કરવા માટે આવ્યો છે ? તારા વાળ સર્કેદ થઈ ગયા પણ તારી દાનત ન સુધારી ? તારી તો

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

હું આ કુહાડીથી હત્યા કરીને કાપી નાખીશ. અને તને જનથી મારી નાખીશ. તું મારા હથમાંથી બચવાનો છે કેવી રીતે ? ત્યાં આવીને પણ તારો ખાત્મો કરી નાખીશ. ઘરથી શિરડી આવે છે ને આવા ધંધા કરવા માટે ? લે આ તારા પૈસા પાછા, જ મને મારું ચીથું પાછું લાવી આપ.' શ્રીસાઈનાથ તો કોદથી લાલચોળ થઈ ગયા હતા. તેમને મા અને બાપ સુધીની ગાળો પણ ભાંડી. ગાળો અને શ્રાપોનો વરસાદ વરસાવ્યો. બાબાનું શરીર આ સંતાપથી આગ ઓકવા માંડચું. આમ સાઈને ગુંસે થયેલા જેઠેને દેવ તો સ્તરથી થઈ ગયા અને ત્યાંને ત્યાં ચૂપચાપ ઊભા જ રહી ગયા. દેવ બાબાની એકદમ નજીક અને પાછા એકલા જ હતા. તેમને મનમાં એમ લાગવા માંડચું કે હવે માર ખાવાનો વારો આવવાનો છે. કદાચિત આ બાબાનું વિશ્વકૃપ દર્શન હોઈ શકે ! આવો વિચાર આવતા દેવના મનને આનંદ થયો. બાબા હવે હથમાં દંડુકો લઈને મારા ઉપર પ્રહાર કરવાના છે કે શું ? આજે હું બરોભર જલાઈ ગયો છું. હવે મર્યાદ જ સમજવાનું. તેમના મનમાં જેમ ફાવશે તેમ તે કરશે. પણ દેવસાહેબને આ ચીથરાનું પ્રકરણ શું છે, તે કંઈ સમજયું નહીં. 'જ નીકળી જ અહીંથાથી બાજુ ખસ.' એવું બાબા બોલતાની સાથે જ તેઓ મસ્નુદના પગથિયા તરફ બાજુએ સરકી ગયા. (ઓ. ૧૧૫-૧૨૪)

ચીથરાનો ગૂઢ અર્થ જેવી રીતે દેવ સમજુ શક્યા નહીં, તેવી જ રીતે હું પણ તેને સમજવા માટે અસમર્થ છું. સાઈની કૃપા થતાં જ હું શ્રોતાઓને તેનું નિવેદન કરીશ. પછી પા-કલાક બાદ દેવ બાબાની સામે આવ્યા. ગાળોની બૂમાભૂમ ચાલું જ હતી. બાબા બોલ્યા, 'ઉપર કેમ આવ્યો પાછો ? જ વાડામાં ચાલ્યો જ.' દેવે બાબાની આજ્ઞા માથે ચઢાવી અને ચરણસ્પર્શ કરી તેઓ વાડામાં પાછા ફર્યા. બનેલી બધી વાત જોગને અને બાલકરામને સવિસ્તારથી વર્ણન કરીને કહી સંભળાવી. લગભગ અર્ધો કલાક ગાળાગાળી અને બૂમાભૂમ ચાલી. ત્યારબાદ ચાર પાંચ કલાક પછી બાબા આવેલા બધા લોકોને બોલાવવા લાગ્યા. દેવ પણ ત્યાં આવ્યા, અને અન્ય ભક્તોની સાથે ત્યાં જઈને બેઠા. ત્યાં સાઈબાબા બોલવા લાગ્યા, 'આ ડોસાને મનમાં લાગી આવ્યું હશે. તે કહેતો હશે કે આ ચીથરાની વળી આટલી બધી શી કિંમત હશે કે આટલી બધી ગાળો અને શ્રાપ મારે સહન કરવા પડ્યાં ? પરંતુ ચીથું તો ચોરેલું જ હતું, માટે બીજો ઉપાય પણ ન હતો. તેથી બોલ્યા વગર રહેવાતું પણ ન હતું. 'અલ્લા બધું જેશે, અને સારું પણ એ જ કરશે,' અને તરત એ ક્ષમાનો સાક્ષાત્ અવતાર એવા બાબા દેવને બોલ્યા, 'એ ભાઈ દક્ષિણા આપશે કે ?' દેવે પૂછ્યું, 'કેટલી આપું ?' બાબાએ તરત જ જવાબ આપ્યો કે, 'હમણાં ને હમણાં બાર ડ્રિપિયા લઈ આવ.' દેવ પાસે એક જ નોટ બધી હતી. બીજી છૂટા ડ્રિપિયા ન હતા, માટે તેમણે બાબાને તે પ્રમાણે જણાવતાં, બાબા બોલ્યા, 'રહેવા હે, મને નથી જોઈતા, સવારના તો તે મને બે વાર દક્ષિણા આપી છે, મને એ યાદ ના રહ્યું.' તેમ છતાં દેવે કયાંકથી ડ્રિપિયા જમા કર્યા અને બાબાને લાવીને આપ્યા. સાથે સાથે બાબાનાં ચરણોમાં પડી નમસ્કાર કર્યા. પછી બાબાશ્રીના મુખેથી કયા શબ્દો બહાર પડ્યા તે જુઓ, 'શું રે તું આ શું કરી રહ્યો છે ?' 'કાંઈ નહીં' એવો દેવે જવાબ આપતાં બાબાએ દેવને આજ્ઞા કરી, 'નિયમથી પોથી વાંચવા લાગ. તું વાડામાં જઈને સ્વસ્થચિતે બેસ અને દરરોજ નિયમિત રીતે વાંચ્ય. વાંચતી વખતે બધાને તેનો અર્થ પણ ભક્તિબાવથી સમજલાને કહેતો જે. આપી જરીથી ભરેલો સુંદર શાલ તને આપવા માટે હું અહીંયા બેઠો છું. પછી આ ચીથરાં ચોરવા માટે શાથી જય છે ? ચોરીની દેવ તને શા માટે પડી ?' પોથીનું વાંચન કર્યું એવા શબ્દો બાબાના મુખેથી સંભળતા દેવને તે વાતનો અણસાર આવ્યો અને તેઓ ખૂબજ આનંદિત થયા. બાબાશ્રીની એ આજ્ઞા મુજબ તે દિવસથી દરરોજ જ્ઞાનેશ્વરીનું વાંચન અને વર્ણન એમણે શરૂ કર્યું.' (ઓ. ૧૨૫-૧૩૬)

દેવ મનમાં ને મનમાં કહેવા લાગ્યા, 'હવે મારી ઈચ્છા પ્રમાણેની આજ્ઞા મળી, વ્રત લીધાની ચિંતા દૂર થઈ. હવે જ્ઞાનેશ્વરી વાંચવાનો મારો નિયમ જળવાઈ રહેશે. હવે મારી પાસે ગુરુની આજ્ઞા છે. મારી ઉપર જ્ઞાનેશ્વર પ્રસંગ થયા છે. આજ સુધી જે કાંઈ થયું તે બધું હવે પાછળ છૂટી ગયું. હવેથી નિયમ પ્રમાણે તે જળવાશે. મારા મનની મને ખાત્રી છે,

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અને તેની ઉપર બાબાની આજ્ઞાનો પુરાવો છે. તેમની આજ્ઞાના પ્રભાવથી આ મારી પોથીનું પારાયણ કોઈ પણ પ્રકારની અડયણ વીના પાર પડ્યો. દંડવત્ પ્રણામ કરીને હું તમારી છત્રછાયામાં અનન્યપણે શરણે આવ્યો છું. આ બાળકને આપ હવે સંભાળી લો. અને મારો ધ્યેય પાર પાડો.' ચીથરાંની વાત ધ્યાનમાં આવી. બાલકરામને જે પૂછ્યું તે જ ચીથરાં અને બાબાને તે પસંદ ન હતું. માટે જ તેમને ગુસ્સો આવ્યો હતો. બાલકરામને ઉપાસના ઉપર કેવી રીતે ચઢાવ્યા ? પરખલનું ધ્યાન કેવી રીતે કરવું એ શિખવ્યું કે કેમ ? તે જે બાલકરામને પૂછેલું તે બાબાશ્રીને જરા પણ ગમ્યું ન હતું. ગમે તેવા અધરા પ્રશ્નોના ઉત્તર આપવા તેઓ પોતે સક્ષમ અને તત્પર હોવા છતાં આ બાબતની પૂછ્યપરછ શા માટે બીજને કરવી જેઠાએ ? માટે જ મને આવી રીતે અતિશય છેતર્યો. 'છેતર્યો' આ શાબ્દ વધુ પડતો ઉદ્ભ્રત છે. જેમનો પોતાના ભક્તો ખાતર અપાર પ્રેમ ઉભરાઈ જતો. તે ભક્તોને છેતરે કેવી રીતે ? એવું સ્વખ્ને પણ વિચારવું નહીં. 'છેતરવું' આ કિયાપદ યોગ્ય નથી. બાબાએ મને છેતર્યો નથી પણ 'શિખવાડચું' છે. તારા મનમાં જે કંઈ ઉદ્ભબે તે બધું મારે જ પાર પાડવાનું છે. (ઓ. ૧૪૦-૧૪૬)

શ્રીસાઈનાથ મહારાજ બહારથી કોધાયમાન દેખાતા પણ અંદરથી તેઓ સદાને માટે આનંદિત રહેતા. તેઓ બહારથી દુઃખી દેખાતા પણ મનથી તેઓ સંતુષ્ટ રહેતા. બહારથી કોધ બતાવવો અને અંદરથી ગૌરવ અને પરમ આનંદિત એવી આ સાઈની તીવાઓનું વૈભવપૂર્વક વર્ણન કરવું તે એક મોટું ભાગ્ય જ ગણાય. જેના મનમાં પોતાનું હિત સાધવાની તીવ્ર છિદ્ધા હોય તેની દિશિ પોતાનું હિત સાધવા માટે કાયમ માટે તત્પર જ રહેવાની. ગાળો તેમને માટે જાણે ફૂલોનો વરસાદ લાગતો. બાબાના આવા તીખા શબ્દો અને અશ્વીલ ભાષા સાંભળીને દેવનું મન જરાયે ડયું નહીં. તેમના મનમાં ગાઢ પ્રેમ ઉભરાઈ આવ્યો અને એ કટુવચનો તો જાણે કે ફૂલોની વર્ષા લાગી. ગાયના આંચળો દૂધથી ભરેલા હોય છે. પરંતુ તેમાંનું દૂધ ભાગ્યવાનને જ મળતું હોય છે. દેડકાઓને કમળના છોડની ઢંડીઓના છેડાઓનો સંગાય હોય છે. પણ ભમરો જ કમળના મકરંહનો સ્વાદ લૂંટો હોય છે. કમનસીબે દેડકાઓને કદાવમાં આહાર લેવો પડે છે. જ્યારે ભમરાના ભાગ્યની તો શી વાત કરવી ? બાબા કહેતા, 'તમે લોકો ખરેખર ભાગ્યવાન છો કે જેને લીધે આપણી એક બીજ સાથે મુલાકાત થઈ અને એકબિજનું સાંનિધ્ય પ્રાપ્ત થયું. મને પૂછ્યીને ફાવે તે શંકાનું નિવારણ કરી લો.' દેવ કહે છે કે, 'જુઓ, મારી પોતાની જુદ હતી કે બાબા જ્યાં સુધી 'વાંચ' એમ કહે નહીં ત્યાં સુધી હું જ્ઞાનેશ્વરી ખોલવાનો નથી, પરંતુ તે જુદ પણ બાબાએ પૂર્ણ કરી.' સાઈમાઉલી લાડ કેવા કરતી અને પોતાના બાળકોના કોડ કેવી રીતે પૂરા કરતી તેનો મધુર અનુભવ કરાવનારી આ બેનેડ ભક્તિની કથા છે. દેવ કહેતા, 'બાબા 'વાંચ' કહીને રોકાયા નહીં. વર્ષ પણ વિત્યું નહીં હોય એવામાં તેમણે સ્વખ્નમાં આવીને ફરી દર્શન આપ્યાં. અને મારી પૂછ્યપરછ કરી. સાંભળો હવે તે વાત. ઇ.સ. ૧૯૧૪ના એપ્રિલ મહિનાની બીજી તારીખ હતી. ગુરુવારનો દિવસ હતો. સવાર થતાં જ મને એક સ્વખ્નઝપી કૃપા થઈ. સાઈસમર્થ સ્વખ્નમાં આવ્યા. મેડી ઉપર મારી સાથે બેઠા અને પૂછ્યું, 'પોથી સારી રીતે સમજન્ય છે ને ?' મેં કહ્યું, 'નથી સમજણ પડતી.' તેમણે બીજે પ્રશ્ન કર્યો, 'પછી કયારે સમજવાનો.' મારી આંખોમાં પાણી ભરાઈ આચા, અને મેં શું જવાબ આપ્યો તે સાંભળો, 'આપની કૃપા વીના પોથી વાંચન એટલે ફક્ત ત્રાસ જ છે અને અર્થ વગરનું છે. સમજવી તો એથી પણ વધારે અધરી છે. બાબા ! આ હું તમને કહી દઉં છું.' ત્યારે બાબા બોલ્યા, 'પોથીના વાંચન સમયે તમે ખૂબ જ ઉતાવળ કરો છો. મારી સામે નજીક બેસીને વાંચ્યો જોઉં !' મેં પૂછ્યું, 'શું વાંચ્યુ ?' ત્યારે બાબાએ આધ્યાત્મનો નવમો અધ્યાય વાંચવા માટે આજા કરી. દેવ પોથી લેવા માટે ગયા એટલામાં તેમની આંખો ખૂલ્યી ગઈ. પોતાની સ્વખ્નવત્ અવસ્થા યાદ આવતાં દેવના મનમાં શું વિચાર આવ્યો હશે તેની શ્રોતાઓએ કલ્પના કરી લેવી.' (ઓ. ૧૫૦-૧૬૬)

વર્ષભર રાહ જેઠાને બાળ આપેલી આજ્ઞા પાળે છે ખરો ? તે આપેલો પાઠ દરરોજ કરે છે ખરો ? કયારેય કોઈ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કારણસર ચૂકી જતો નથી ને ? આવું સતત ધ્યાન કોણ રાખશે ? પોથી વાંચનારે ક્યાં સાવધ રહેવું, ક્યાં વિશેષ ધ્યાન આપવું તેની સાઈમાબડી સિવાય બીજું કોણ આત્મી આપી શકે ? આવી સાઈની અપાર લીલાઓ, આવા સ્વચ્છાન્દના અનુભવો, ભક્તોને અસંખ્ય વાર થયા હતા. એનો હું પ્રત્યક્ષ સાક્ષી છું. આ બધું મેં મારી નજરે જેયું છે, શ્રોતાગણો હવે આપ ગુરુ ચરણોમાં લીન થઈ અને આગળના અધ્યાયની નવીનતા તરફ ધ્યાન આપો. શ્રીસાઈસમર્થનાં ચરણકમળોને યાદ કરીને હું હેમાડપંત સદ્ભાવનાથી તેમને દંડવત્ત પ્રણામ કરું છું અને સંપૂર્ણપણે એમના શરણે જરૂર છું. કારણ કે તેને લીધે જ સંસારનાં મોટાં ભાગનાં દુઃખોથી છૂટકારો મળે છે. હેમાડપંતને માટે શ્રીસાઈ જ સંસારનો સ્વાર્થ છે અને સાઈ જ અત્યંત ઉત્તમ સુખ આપનારો પરમાર્થ છે. સાઈ મહારાજ જ તેમને કૃતાર્થ કરશે એવી તેમના મનમાં મક્કમ ધારણા છે. (ઓ. ૧૬૭-૧૭૩)

સર્વનું કલ્યાણ થાઓ, આ પ્રકારે સંત અને સજજનની પ્રેરણા પામેલા ભક્ત હેમાડપંત રચિત  
શ્રીસાઈસમર્થના ‘સાઈ - કૃપા - અનુગ્રહ - દાન’ નામનો એકતાલીસમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે.

## શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણા.



## અધ્યાય ૪૧ નું અર્થ વિવરણ.

પાછલા ૪૦મા અધ્યાયમાં દાખોલકરને ત્યાં (હેમાડપંતને) એમના ધરે હોળીના દિવસે બાબાએ માટીના મૂર્તિઝીપી છબી દ્વારા ધરે આવવાની કથા, અને આ અધ્યાયમાં એ છબી અલીમહંમહના ધરે ભીત ઉપર ટાંગેલી બીજી બધી છબીઓ સાથે સમુદ્રમાં ન દૂબાડતાં દીવાલ ઉપર તેજ અવસ્થામાં રહી તે કથા કહેવાઈ. આ બે માંથી સાઈબાબાએ સગુણ ભક્તિ વિષે પોતાની માન્યતાઓ પ્રગટ કરી છે. હેમાડપંતને એ માટીની મૂર્તિવાળી છબી એટલે મળસ્કે સ્વજ્ઞમાં દર્શન આપીને પોતે જતે સાઈબાબા જ છે એવું મનમાં ઠસાયું. અને મહંમહના બનેવીના કહેવાથી મૂર્તિપૂજન ઉપરની શ્રદ્ધા દદ થતાં બાબાની તસ્વીર પાણીમાં દુબાડી નહીં તે ચમત્કાર બતાવીને તેમની ડગમગેલી શ્રદ્ધા પણ દ્રદ કરી દીધી. સગુણ ભક્તિનો મહિમા હેમાડપંતે ૧૧મા અધ્યાયમાં ૧૧, ૧૨ અને ૧૫ થી ૧૭ કંઈક ગાયા છે.

સાઈબાબા સગુણ ભક્તિ ઉપર ભાર આપતા, અને મૂર્તિપૂજને હુંમેશા ઉતેજન આપતા હતા. દેવદેવીઓ અને સંતોની છબી ઉપર હાર ચઢાવીને તેમની પૂજન અર્થના કરવી, મંદિરોમાં મૂર્તિઓની ઉપાસના કરવી, અને રામજજન્મ જેવા ઉત્સવો ઉજવવા. એટલું જ નહિ પણ ચલણી સિક્કા અને પાદુકાઓ દેવસ્થાનમાં મૂર્તીને તેમનું પૂજન કરવું પણ બાબાને ખૂબ પસંદ હતું. મુંબઈના હરિશચંદ્ર પિતળેને બાબાએ ત્રણ ઇપિયા આપીને તેની પૂજન કરવા માટે કહ્યું હતું. તેમજ સૌભાગ્યવતી પ્રધાનને અને બીજ અમુક ભક્તોને તેમની ઠિચ્છાઓને માન આપી પોતાની ચાંદીની પાદુકાઓની પૂજ માટે

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પરવાનગી પણ આપી હતી. મેધાને શિવલિંગ આપ્યાની અને શિરડીના અન્ય ગ્રામહેવતાઓની પૂજા કર્યા વીના બાબા પોતાની પૂજા કરવા દેતા નહિ. તે બાબતમાં આપણે આગળ વાંચી ચૂક્યા છીએ. કાકા મહાજની જેઠે ગયેલા એક નિર્ગુણ ઉપાસકને તો તેના પોતાના સ્વર્ગરસ્થ સગા બાપના જ અવાજમાં ચમત્કાર બતાવીને બાબાએ તેને સગુણ ઉપાસક બનાવ્યો હતો. એટલું જ નહિ પણ બાબાની કરેલી મૂર્તિપૂજા પણ વ્યર્થ ન હતી. તે કેવી સાર્થક હતી તે અનેક વખતે પ્રમાણ સાથે સિદ્ધ કરીને બતાવ્યું હતું. ઉદાહરણ તરીકે વાંદરા મુકામે બાબાસાહેબ તર્ફથી પોતાની છબીને અર્પણ કરેલ ખડીસાકરનું નૈવેદ્ય ખાવા માટે શિરડીથી પોતે દરરોજ ત્યાં કેવી રીતે જતા હતા, તે અંગે બાબાએ તેમનાં પત્ની અને છોકરાને કહ્યું હતું. તેવી જ રીતે બાળાબુઅા સુથાર ઉર્ફ અવાચીન તુકારામ, ઈ.સ. ૧૯૧૭ની સાલમાં પહેલી જ વાર શિરડી ક્ષેત્રે ગયા હતા, ત્યારે બાબાએ તેમને ચાર વર્ષ અગાઉ પોતાની છબીને નમન કર્યું હતું. એ સાબિત કરી પોતાની તેમની સાથે પહેલેથી જ ઓળખાણ છે એમ જણાવ્યું હતું.

ત્યાર પછી બાળાસાહેબ દેવની જ્ઞાનેશ્વરી વાંચવાની કથા ઉપરથી આપણાને બે વસ્તુ વ્યવસ્થિત રીતે સમજાય છે. પહેલી એ કે બાબાના કોધનું કારણ અને તેનો મર્મ અને બીજી વાત એટલે બાબાની પરમાર્થ તરફની ભક્તોની પસંદગી વિરોની તાતાવેલી અને પોથીનું ભક્તોએ પારાયણ કેવી રીતે કરવું તે માટેની શિખામણ. બાબા ઓચિંતા ગુસ્સે થતા અને તેઓ ગુસ્સે થાય ત્યારે પાસે જવાની કોઈ હિંમત કરતું નહિ. પણ આ તેમનો ગુસ્સો ઉપર ઉપરનો ફક્ત બતાવવા પૂરતો જ રહેતો. અંદરથી તેઓ દ્વારાનું ઝરણું હતા એવું અદ્યાય ૧૧માં હેમાડપંતે કહ્યું છે.

શ્રીબાબાના કોધ અને આણગમા પાછળ કોઈ હેતુ ચોક્કસ રહેતો. અગિયારમાં અદ્યાયમાં કલ્યાણ નિવાસી હજુ ઉપર બાબા ગુસ્સે થયા હતા. તેનું કારણ હાજુના મક્કા મદ્દીનાની હજના અહંકારને તોડવા માટે અને તેની ભક્તિની અને નિષ્ઠાની પરીક્ષા કરવા માટે. પછી તેમને આદર સત્કારપૂર્વક પોતાની પાસે રાખ્યા હતા. અદ્યાય ૩૪માં માધવરાવ દેશપાંડેની ટચીલી આંગળીએ સાપે ઊંખ મારતાં તેઓ મરિયુદ્દમાં દોડતા આવ્યા હતા. તે વખતે બાબાએ ‘ભટૂરહચા ! ઉપર ચદીશ નહિ, ચાલ નીકળ જે અહીંથી નીચે ઉત્તર’ આવી બૂમાબૂમ કરી હતી. પણ તે બૂમ બરાડામાં પણ સાપનું એર ઉતારવાના મંત્રનું સામર્થ્ય હતું. ત્યાર પછી તેને ‘સુવા નહિ દેતા,’ એવો સંદેશો વારંવાર મોકલાવ્યો હતો. તેમના જીવન માટેની તેમને કેટલી બધી કાળજી હતી ! સાઈમહારાજના આવા વિચિત્ર પ્રકારના કોધ વિષેના કેટલાયે દાખલા આપી શકાય તેમ છે. બાબાએ દેવસાહેબ ઉપર મારા ચીથરાં ચોરે છે એવો આરોપ મૂકીને કપાળ ઉપર કરચલીઓ પાડીને તથા ભ્રમરો ચઢાવીને જે કોધ બતાવ્યો હતો તે આખરે તો તેમના કલ્યાણ માટે જ હતો. તેમને ઉપાસનાની અને બ્રહ્મ ચિંતનની શિખામણ જાતે જ આપવી હતી અને જ્ઞાનેશ્વરીની જુદ પુરી કરીને કેવી રીતે વાંચવી તેનો સબક શિખવાહચો હતો. બાબા દેવને, ‘પોથી વાંચતી વખતે ઉતાવળ ન કરતાં ધીમે ધીમે અર્થ સમજુને વાંચવી અને વાંચતી વખતે અર્થનું વર્ણિન બીજાઓને પણ સમજવીને કહેવું.’ એવું ભારપૂર્વક કહ્યું હતું તે ઉપરથી સાઈસચ્ચરિત્ર બીજાઓને પણ કેવી રીતે વાંચવું તે બાબતમાં બાબાના વિચારો આપણને સમજાય છે. આ પહેલાં પણ અદ્યાય ૧૮માં ગુરુ ચરિત્રની પોથી વાંચેલા સાડેને પોથી એક પુરાણિકની માફક વર્ણન કરીને સ્વભન્માં દર્શન દઈને તે વાંચવા માટે બાબાએ જણાવ્યું હતું. માટે જ આ ઉપરથી શ્રી સાઈસચ્ચરિત્ર અથવા જીજે કોઈ પણ ધાર્મિક ગ્રંથ વાંચતી વખતે તેને ધીમે ધીમે અર્થ સમજુને વાંચવો તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ એવો ચોખ્ખો નિર્દેશ કર્યો છે.



## ॥ અદ્યાય ૪૨ ॥

### શ્રીસાઈનાથ નિર્વાણમ् - ૧

(શ્રીસાઈનાથ મહારાજનું આ જગત છોડીને જવું)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,  
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદ્ગુરુ સાઈનાથ મહારાજને વંદન.

હે દાતા, ઉદ્ધારતાથી આપનારા સદ્ગુરુ ! હે મહાપ્રસિદ્ધ ગોદાવરી નદીને કઠિ વિહાર કરનારા મૂર્તિમંત પરબ્રહ્મ સ્વરૂપ  
અને લંગોટી ધારણ કરેલા શ્રેષ્ઠ સંત ! તને મારાં કોટિ કોટિ વંદન. સંસારની નદી પાર કરવાની માર્ગ બતાવનારા હીન અને  
દુઃખીઓને પોતાનાં ચરણોમાં સહારો આપનારા અને ભક્તોની કાર્ય સિદ્ધિ માટે જણે કે કલ્પતરું જેવા સાઈનો સંતક્ષપી  
અવતાર છે. પાછલા અધ્યાયમાં સાઈની મૂર્તિની છભીનું પાણીમાં વિસર્જન ટાળીને તેનું રક્ષણ કેવી રીતે થયું તેની સરસ  
મજાની કથાનું નવાઈબર્યું કૌશલ્ય કથન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે એક ભક્તના સ્વખનમાં આવીને તેની તીવ્ર ઈચ્છા  
કેવી રીતે પૂર્ણ કરી તથા કેવી સ્પષ્ટ આજા આપીને તેની પાણે જ્ઞાનેશ્વરી વંચાવી, તે વિષે કહેવામાં આવ્યું છે. ટૂકાણમાં  
ગુરુકૃપાનો સુયોગ આવે એટલે આ સંસારના અને બીજા જન્મના ડરનો કોયડો ઉક્લી જય છે. તેની ચિંતા ભક્તને રહેતી  
નથી. મોટામાં મોટો ફાયદો તે કે મોક્ષ માર્ગના દ્વાર ખુલ્લી જય છે અને દુઃખનું સીધું ઢપાંતર સુખમાં થઈ જય છે. સદ્ગુરુનાં  
ચરણોનું નિત્ય સ્મરણ કરવાથી વિદ્ધનો નડતા નથી અને મરણને સથવારો મળે છે. સંસારનાં દુઃખોની યાદ પણ રહેતી  
નથી. માટે આ સાઈસમર્થની કથા જેના શ્રવણની ખરેખર પવિત્રતા પ્રાપ્ત થાય છે માટે શ્રોતાઓએ આ કથા પોતાના  
ફાયદા માટે સાંભળવી. હવે આ અધ્યાયમાં આપણે સાઈબાબાના સ્વભાવનું વર્ણિન કરીશું અને તેમાં રહેલ ઉગ્રતા અને  
સૌભ્યતા કેવી હતી તે જોઈશું. (ઓ. ૧-૮)

અત્યાર સુધી ચિત્ત એકાગ્ર કરીને જેવું બાબાનું આચરણ સાંભળ્યું તે જ રીતે દેહત્યાગની કથા પણ ધ્યાન દઈને  
સાંભળશો. શિરડીના લોકો ખરેખર ભાગ્યવાન છે કારણ કે પચાસ વર્ષથી પણ વધારે વર્ષો સુધી તેમણે શ્રી સાઈબાબાનો  
સહવાસનો લાભ ભોગવ્યો છે. તેમજ તેમનું સુખ અને આનંદ પણ ભોગવ્યું છે. શકે અદારસો ચાલીસમાં (૧૮૪૦)  
દક્ષિણાયનમાં સૂર્યનારાયણ ભગવાન વિષવૃત્તતાની દક્ષિણ દિશા તરફ જય છે. કર્ડ સંકાંતિથી મકરસંકાંતિ સુધીનો સમય  
એટલે કે જેઠ અથવા તો અખાઈ મહિનાથી પોષ મહિના સુધી છ માસનો સમય ગણાય છે. દક્ષિણાયનના પ્રથમ મહિનામાં  
જ અધ્યિન માસમાં શુક્ત પક્ષમાં વિજ્યા દશમીએ બાબાનો દેહ વિત્ય થયો. અંગ્રેજ ક્લેન્ડર પ્રમાણે એ મંગળવાર ૧૫  
ઓક્ટોબર ૧૯૧૮નો દિવસ હતો. મુસલમાનોની મહોરમ મહિનાની દમી તારીખ હતી અને તે દિવસે કટલની રાત હતી.  
મહમદ પયંગંબરની પુત્રી ફાતિમાનો બીજે પુત્ર હજરત હુસને અને તેની સાથે તેમના કુટુંબના અનેક યુવકોની ખલીફા  
ધળદાના સૈનિકોએ કટલ કરી તેની આગળની રાત તે કટલની રાત તરીકે ઓળખાય છે. મુસલમાનો મહોરમના મહિનાને  
પવિત્ર અને શ્રેષ્ઠ માને છે, અને દશ દિવસ સુધી તાજીયા અથવા તાખૂત બનાવીને તેનું સરધસ કાઢે છે તથા હજરત  
હુસેનના આ વંશની હત્યા તે કારણે થયેલો શોક મનાવે છે. દશોરાના દિવસે બીજા પ્રહરમાં બપોરના સુમારે અઢી વાગ્યાના  
સમયે શ્રી સાઈનાથ મહારાજે આ જગત છોડીને જવાની નિર્વાણની તૈયારી કરી. ભગવાન બુદ્ધની જ્યતિનો જન્મ દિવસ

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

તે જ સાઈબાબાની પુણ્યતિથિ હતી. દેવદેવીઓની જન્મ જ્યંતિના ઉત્સવો જે રીતે ઉજવવામાં આવે છે. તેવો જ સંતોની પુણ્યતિથિનો પણ ઉત્સવ ઉજવવામાં આવે છે. બપોરે સાઈબારે દશભીનો સમય પૂરો થયો અને એકાદશીની શક્રાત થઈ. તેથી એમ કહેવાય કે બાબાશ્રીના નિર્વાણની પણ એકાદશી જ ગણાય પરંતુ તિથિની શક્રાત સૂર્યોદયથી ગણવામાં આવે છે. માટે તે દિવસે સૂર્યોદય સમયે દશોરાની દશભી તિથિ હતી. માટે શ્રી સાઈમહારાજનો નિર્વાણદીન વિજ્યાદશભી ગણાય છે. માટે તે દિવસે પુણ્યતિથિનો ઉત્સવ ઉજવવામાં આવે છે. મંગળવાર કતલની રાતનો આ અતિ પ્રસિદ્ધ પવિત્ર દિવસ હતો. માટે સાઈમહારાજે તે જ દિવસે ‘બ્રહ્મજ્યોતમાં પોતાની આત્મજ્યોત’ મેળવી દીધી. બંગાળનો આ દુર્ગાપૂજની સમાપ્તિના દિવસનો પ્રસિદ્ધ તહેવાર ગણાય છે. આખા ઉત્તર હિન્દુસ્તાનમાં આ એક ભારે આનંદ ઉત્સવનો દિવસ મનાવવામાં આવે છે. આ રીતે જેતા સાઈનાથનો નિર્વાણનો આ દિવસે હિંદુઓ, મુસલમાનો, બૌદ્ધર્ભમાં માનનારાઓ બધાને માટે સમસ્ત ભારત દેશના લગભગ બધા જ પ્રાંતોના લોકોનો માનિતો, પવિત્ર તહેવારના દિવસ તરીકે ઉજવાય છે. (ઓ. ૮-૧૭)

શકે ૧૮૩૮ (ઇ.સ. ૧૮૧૬) ના વિજ્યાદશભીના દિવસે સાંજના સમયે (પ્રદોષ સમયે) બાબાશ્રીએ હવે પછી બનનારી આ ઘટનાની સૂચના આપી હતી અને ભવિષ્યવાણી કરી હતી. કેવી એ એક અદ્ભુત લીલા ! હવે, હું તમને કહું છું. શ્રોતાઓને આશ્ર્ય અવશ્ય થશે અને બાબાશ્રીની કોઈને પણ સાધારણ રીતે ન સમજય તેવી કુશળ કળાઓ અને યોજનાઓનો ઘ્યાલ આવશે. ઇ.સ. ૧૮૧૬ના દશોરાના તહેવારને દિવસે સીમા ઉલ્લંઘનના સમયે સાંજે પાછા ફર્યા બાદ પહેલાં કયારેય ન બની હોય તેવી એક અવિસમણીય લીલા બની. આકાશમાં જેમ અચાનક મેઘ ગર્વે અને વીજળીના કડાક થાય તે પ્રમાણે બાબાશ્રીએ પોતે પ્રત્યક્ષ જમદશિનું રૂપ ધારણ કર્યું. એકાએક પોતે માથે બાંધેલો ફડકો અને વસ્તો, લંગોટ સુદ્ધાં છોડી દઈને બાબાએ બધી જ વસ્તુઓને ધૂણીમાં ફેકી દીધી અને મોટો ભડકો કર્યો. એક તો પહેલેથી જ ધૂણીમાંનો અન્ધી બરાબર સળગેલો હતો તેમાં આ બધી આહુતિ પદ્ધરાવાઈ જેથી અગનજવાળાઓ ઉપર ઊંચે સુધી ઉઠવા માંડી અને ભક્તોનો જીવ તાળવે ચોંટચો. આ બધું એકદમ અચાનક જ બની ગયું. બાબાના મનમાં શું હતું એ તો કોણ જણે ? પણ સીમા ઉલ્લંઘનના સમયે તેમની કિયા ખૂબ જ બયંકર બીક પમાડે તેવી હતી. ધૂણીની અન્ધીએ પોતાનું તેજ પ્રસરાવેલું પણ તેના કરતાં વિશોષ તો બાબાશ્રીનો તેજપૂજ જગહણતો હતો અને એક તેજસ્વી સ્વરૂપ પ્રગટચું. ત્યાં ઊભેલા સૌની આંખો બીડાઈ ગઈ અને એટલો બધો પ્રકાશનો જગમગાટ થયો કે, દૈક્કને તે તરફથી મો ફેરવી લેવાં પડ્યાં હતાં. સંતના હાથની તે આહુતિથી અન્ધિનારાયણ પ્રસન્ન થઈ ગયા હતા. અને તેઓ જમદશિના પુત્ર પરશુરામ જેવા ખૂબ જ ગુસ્સામાં લાલચોળ નશે બાબાની બિલકુલ જ દિગંબર અવસ્થા થઈ ગઈ હતી. જેમણે તે દશ્ય નજરોનજર જેથું તેમની આંખો તો ધન્ય થઈ ગઈ. બાબા કોથથી ભભૂકી ઉઠ્યા હતા. અંગારા જેવી લાલચોળ આંખો ફાડીને તેઓ એકદમ બરાડી ઉઠ્યા. ‘કરો હવે નિર્ણય હું મુસલમાન છું કે હિંદુ ?’ ફરીથી જેરથી ત્રાટક્યા, ‘અરે આજે જેઠ લો હું હિન્દુ છું કે મુસલમાન અને પોતાના મનની ઠિચ્છા પ્રમાણે ખાત્રી કરી લો અને તમારી શંકાનું નિવારણ કરો.’ આવું ભયંકર દશ્ય જેઠને ત્યાં ભેગા થયેલા ભક્તજીનો તો થરથર કાંપવા લાગ્યા અને બાબાશ્રીનો શાંત કેવી રીતે પાડવા તેની ચિંતા કરવા લાગ્યા. ભાગોજ શિંદે ભલે રક્તપિત્તનો રોગી હતો, પણ બાબાનો તે પરમ ભક્ત હતો. તેણે થોડી ધીરજ ધરી અને હિંમત કરીને બાબા પાસે ગયો. તેમણે બાબાને લંગોટ પાછો પહેરાવ્યો અને બોલ્યો, ‘બાબા ! આ તમારા કેવા ચાળા છે ? આજે દશોરાનો તહેવાર છે અને સીમા ઉલ્લંઘન છે ને ?’ ત્યારે બાબાએ ગુસ્સામાં જવાબ આપ્યો, ‘માંડું આ જ સીમા ઉલ્લંઘન છે.’ અને જેરથી પોતાનો દંડકો પછાડવા લાગ્યા. (ઓ. ૧૮-૩૧)

આમ બાબા ધૂણી પાસે બિલકુલ નગ્ન અવસ્થામાં ઊભા રહ્યા. એ દિવસે ફરી ચાવડી સરધસનો વારો હતો. તે

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

હવે કેવી રીતે પાર પાડવો તેની બધાને ચિંતા થઈ. ચાવડી સરધસનો સમય રાતે નવ વાગ્યાનો હતો. રાતના દસ વાગ્યા આવ્યા પણ બાબા કંઈ શાંત પડ્યા નહિ. લોકો બધા એક પણ શબ્દ બોલ્યા વીના પોતપોતાની જગ્યાએ સ્તબ્ધ થઈને આ દશ્ય જેતા જ રહી ગયા. જેતનેતામાં રાતના અગિયાર વાગ્યા, ત્યારે તે સમયે બાબા થોડા શાંત દેખાયા. તેમણે નવો કોરો લંગોટ અને કફ્ફિ પહેલી લીધાં. ચાવડીનો ઘંઠનાહ થયો. લાંબા સમયથી સ્તબ્ધ બેસી રહેલા લોકોએ પાલખી ઉપર શુંગાર સજવાનું શડ કર્યું અને આશા લઈને પાલખીને આંગણામાં લાવ્યા. ચાંદીનો દંડો, પતાકાઓ, ચમ્ભરો, છત્ર નિશાનો વગેરે એક રાજને શોભે તેવી રીતે શાળાગરેલી દર વખતની માફક નીકળતી સરધસની સવારી માસ્ટિઝદની બહાર નીકળી. અનેક વાદોનો એક જ સૂર ઉઠ્યો અને સાઈમહારાજનો જ્યુ જ્યકારનો ગગનબેઢી ધોષ થયો. તે જ્યુ જ્યકારના ઊંચા બૂલંદ અવાજના નાહનું શું વર્ણન કરવું ? જ્યાં ત્યાં આનંદનું વાતાવરણ ઊભરાઈ ગયું હતું. પછી બાબાશ્રીએ એક સ્વચ્છ સફેદ કપડું ઝાટકીને પોતાના મસ્તક ઉપર બાંધ્યું અને ચલમ, તમારું અને દંડ હાથમાં ધારણ કરીને નીકળી પડ્યા. જ્ઞાણે કે ચાવડી માટે આ જ એક મોટું પણ સારું મુર્દૂત હતું. કોઈ છત્રી, કોઈ ચમ્ભર, કોઈએ મોરનાં પીંછાના સુંદર પંખા જેવાં જુમરો તો કોઈના હાથમાં ગરુડનું નિશાન કે રાજ રજવાડાઓને શોભે તેવી મસ્તક ઉપર ધરવાની છત્રી હતી. કોઈ હાથમાં છડી પોકારનારાનો દંડ લઈને નીકળ્યા. આમ નિમિત્ત બનાવી બાબાએ બધાને અણસાર આપ્યો હતો કે સંસાર સાગરની સીમા ઓળંગવા માટે દરેરાનો દિવસ જ એક સારો દિવસ છે. તે કારણે દરેરાના દિવસે જ બાબાએ પોતાનો દેહ છોડ્યો અને આ પૃથ્વીને અર્પણ કરી દીધો. આ ફક્ત સૂર્યબ્યું જ નહિ પણ અનુભવ કરાવ્યો અને બતાવી આપ્યું. પોતાના શરીરક્ષપી વસ્ત્રોના યોગ સામર્થ્યથી ઉત્પન્ન કરેલા અશ્રિમાં જ આ દિવસે આહૃતિ આપી. ઈ.સ. ૧૯૧૮ની સાલનો આ દરેરાનો શુભ દિવસ હતો, જેને બાબાશ્રીએ શુભમુર્દૂત બનાવ્યું અને પોતાના બ્લાસ્ટિપમાં લીન થએ એકરૂપ થઈ ગયા. (ઓ. ૩૨-૪૩)

બાબાનો બીજો એક અનુભવ લખતાં લખતાં મને યાદ આવ્યો કે આ વિજ્યાદશમીનો દિવસ તો પહેલેથી જ નક્કી હતો. શિરડીના રામચંદ્ર દાદા કોતે પાટીલ એક વખત કોઈક રોગથી અતિશય પીડાતા હતા. જીવ હરી લે તેવું સંકટ તેમનાથી સહન થતું ન હતું. તે રોગને બોગવવું તેમને માટે ખૂબ જ ત્રાસદ્યક થઈ પડેલું. તેમણે કોઈ પણ ઉપાય બાકી રાખ્યો ન હતો. પણ જ્યારે કોઈ પણ રીતે આ રોગ કાબૂમાં ન આવતાં તેમને જીવન પ્રત્યે આણગમો ઉત્પન્ન થયો અને પાટીલ પુષ્કળ કંટાળી ગયા. મનની જ્યારે આવી પરિસ્થિતિ હતી તેવી સ્થિતિમાં એક દિવસે અહંકાર રાતે તેમના ઓશિકા પાસે બાબાશ્રીની મૂર્તિ એકાએક ઉપસ્થિત થઈ. પાટીલે તેમનાં ચરણો પકડી લીધા અને બોલ્યા, ‘મને મોત કયારે આવશે બસ એટલું કહો. મને આવી જુંઘાનો કંટાળો આવ્યો છે. મને હવે મરણનો જરા પણ ભય રહ્યો નથી કે નથી તે વિશેની ચિંતા. મૃત્યુ કયારે મને મળવા માટે આવવાનું છે તેની ખરેખર હું રાહ જોઈ રહ્યો છું.’ તે સાંભળીને કરુણામૂર્તિ શ્રી બાબા બોલ્યા, ‘રામચંદ્ર ! તું જરા પણ ચિંતા કરીશ નહીં. તારી ઉપર આવી પડેલો ભય હવે ટળી ગયો છે. તું નકામી ચિંતા કરતો નહીં. તને હવે શેની બીક રાખવાની છે ? તારી હુંડી ન વટાવતાં પાઈ વાળી છે અને તારું મરણ ટળી ગયું છે. પણ મને તાત્યા પાટીલની કંઈ આશાજનક સ્થિતિ દેખાતી નથી. શકે અદરાસો ચાતીસ (ઇ.સ. ૧૯૧૮ની સાલમાં) દક્ષિણાયન અશ્વિન મહિનામાં શુક્લપક્ષે વિજ્યા દશમીના દિવસે, તાત્યા અક્ષય પદ્મના પામશો. પણ આ વાત કોઈ પણ દિવસે તેની સામે કરતો નહિ. તેના મનમાં તેનો ડર પેસી જશો, અને તેની ચિંતામાં જ તે ખલાસ થઈ જશો. મરવું કોઈને પણ ગમતું નથી.’ (ઓ. ૪૪-૫૩)

આમ બે વર્ષની અવધી પૂરી થઈ, તાત્યાનો અંત સમય પાસે આવ્યો અને રામચંદ્રને તેની ચિંતા થવા લગ્ની. બાબાશ્રીના શબ્દો એટલે સોનાની લક્ષીર ગણાય. તાત્યા પાટીલથી આ વાત ગુપ્ત રાખવામાં આવી હતી પણ બાળ.

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

શિંગીના કાન પર આ વાત નાખવામાં આવી અને બીજી કોઈને તે કહેશે નહિ તેવી વિનંતી કરવામાં આવી. રામચંદ્ર પાટીલ અને બાળા શિંગીને તાત્યાની ચિંતા થવા લાગી. અહીંથા રામચંદ્ર પાટીલ બીમારીમાંથી બેઠો થઈ ગયો અને તેનો ખાટલો છૂટ્યો. દિવસો ગણતા ગણતામાં ન સમજલય તેવી રીતે કાળ સરકી ગયો. બાબાના બોતનો તાળો કેટલો આશ્વર્યકારક છે તે જુઓ ! શકે ૧૮૪૦નો ભાડ્રપદ મહિનો પૂરો થયો અને અશ્વિન મહિનાની શક્રાત જ થઈ એવામાં તાત્યાબા પથારીવશ થયો. ત્યાં તાત્યાને તાવ આવવા માંડ્યો અને અહીંથા બાબાને ઠંડી ચઢવા માંડી. તાત્યાનો ભરોસો બાબા ઉપર અને બાબાનું રક્ષણ કરનાર તો શ્રીહરિ જ હતા. તાત્યાની મજબૂરી એટલી પથારી છૂટે નહીં અને બાબાના દર્શને પણ જવાય નહિ. શરીરમાં થઈ રહેલી અનેક ધ્યાતનાઓ તેનાથી સહન થતી ન હતી. તે પોતાના દુઃખી ત્રાસેલો હતો છિતાં તેનું ચિત્ત તો બાબામાં જ ચોટેલું હતું. હવે એમને માટે હલનચલન શક્ય ન હતું. દિવસે દિવસે તેમની બીમારી વધતી જ ગઈ. શિરડીમાં બાબાનું શરીર તાવને કારણે ઘણું જ દુઃખવા લાગ્યું. બાબાને શરીરનું કષ દિવસે દિવસે બમણું વધતું ગયું. અને બીમારીએ તેમને ભરડો લીધો. જેત જેતામાં બાબાએ ભાખેલી તારીખ અને દિવસ પાસે આવવા લાગ્યાં. અને બાળા શિંગી અને રામચંદ્ર પાટીલને પરસેવો થવા માંડ્યો. તેઓ બોલ્યા, ‘બાબાનું કહેવું ખરું હતું એવું હવે ચોખ્યું દેખાવા લાગ્યું છે. આ ચિહ્નનો પણ કંઈ સારાં દેખાતાં નથી, આ બીમારીનું પ્રમાણ વધતું જય છે.’ સુદુર પક્ષની દર્શામી આવી. તાત્યાની નાડી ધીમી પડવા માંડી અને શાસોશ્વાસ પણ નીચે બેસવાં માંડ્યા. તાત્યા મૃત્યુના મુખે આવી પહોંચ્યો અને આપ્તજનોમાં ગભરાટની લાગણી ફેલાઈ. છિતાં આગળ ઉપર એક આશ્વર્ય થયું. તાત્યા ઉપરનો તે મૃત્યુનો ભય ટળી ગયો. તાત્યા રહ્યો અને બાબાએ જ પોતાની જીવનલીલા સંકેતી લીધી. જાણે કે અદલાબદી થઈ ગઈ. હવે જુઓ બાબાના શબ્દો ! તાત્યાના નામે જરા પણ સમય ચૂક્યા વીના પોતાના પ્રયાણની તૈયારી કરી દીધી. આ સૂચના પહેલેથી આપીને તેમણે ભવિષ્યવાણી સાચી કરી દેખાડી. બાબાની આ યોજના પાર પડી, ત્યાં સુધી કોઈના પણ ધ્યાનમાં આ વાત આવી નહીં. લોકો કહે છે કે, ‘બાબાએ પોતાના દેહનો બલી આપીને તાત્યાનું મૃત્યુ ટાય્યું.’ તેમની લીલાની તેમને જ ખખર. (ઓ. ૫૪-૬૮)

દેહ જે દિવસે મૂક્યો એ રાત્રી અરુણોદય સમયે (સૂર્યોદય પહેલાનો દોઢ કલાક) દાસગણુને પંદરપુર મુકામે સ્વપ્નમાં આવીને કહ્યું કે, ‘મસ્નિજદ દસડી પડી છે. શિરડીના વાણિયાઓએ મને ખૂબ સત્તાવ્યો છે. હવે અહીંથાથી નીકળીને જઈ રહ્યો છું. તારી પાસે આટલે દૂર જલ્દી જેઠીને આવ્યો છું. મને ખોરસલ્લીનાં ફૂલોથી ઢાંડી હે. આટલી મારી ઈચ્છા પૂર્ણ કર. ચાલ ઉઠ અને જલ્દી શિરડી આવ.’ એટલામાં શિરડીથી પત્ર પહોંચતા બાબાશ્રીએ સમાધિ લીધી તે બાબતની માહિતી મળી અને તે સંદેશો મળતાં જ એક પણ ક્ષણનો વિલંબ ન કરતાં દાસગણુ શિરડી જવા માટે નીકળ્યા. આખા શિષ્ય પરિવારને સાથે રાખીને સમાધિની સામે તેમણે આહે ગ્રહર નામઃસ્મરણ અને ભજન કીર્તનની ધૂમ મચાવી. હરિનામ ઝીપી ફૂલોનો અતિ સુંદર હાર ગુંથીને સમાધિ ઉપર અન્નદાન સાથે ચઢાવ્યો. અખંડ નામ ધૂનથી શિરડી જાણે કે, ‘પૃથ્વી ઉપરનું વૈકુઠધામ બની ગયું.’ નામ ધોષનો જાણો મેળો ભરાયો ન હોય ! દાસગણું મહારાજે પણ નામસ્મરણની ધૂમ મચાવી. (ઓ. ૬૮-૭૫)

દશેરા સાથે બાબાને પ્રેમ શા માટે હતો ? તો સાડાત્રણ મુહૂર્તપૈકી દશેરાનું આ મુહૂર્ત કોઈ સ્થળે જવા માટે અને કોઈ પણ કાર્યના પ્રારંભ માટે વિશેષ શુભ ગણવામાં આવે છે. તે વાત બધાંને ખખર છે. પણ આમ કહેવું એ પણ બરાબર નથી. જેને જેવું કે આવવું જ નથી તેને વળી કર્યું નિર્વાણ ? અને વળી શું આ જગતને છોડીને જવું ? મુહૂર્તની એને શી જરૂર ? જેને ધર્મ અર્ધમનાં બંધનો જ નથી, જેણો બધાં જ બંધનોમાંથી મુક્તિ મેળવેલી છે અને જેમના પ્રાણનું અતિક્રમણ નથી, તેને વળી નિર્વાણ કેવું ? ‘બ્રહ્મૈવ સન્ભ્રહ્યાખેતિ’ આ બૃહદારણ્યક ઉપનિષદમાંનું

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અધ્યાય ૪ ખ્રાત્મણ છમાંના છઠા મંત્રનો શબ્દ છે. તેનો ભાવાર્થ કંઈક આમ છે. ‘કંઈ પણ ઈરછા વીના પુરુષને કર્મફળ ન હોવાને કરણે પૂનર્જન્મ હોતો નથી. માટે એના પ્રાણનું અતિક્રમણ પણ થતું નથી. તે આ જગતમાં જ બ્રહ્મ થઈને બ્રહ્મપને પ્રાપ્ત થઈ જય છે.’ એવી જ રીતે સાઈમહારાજનું પણ જવું કે આવવું ન હતું. પછી નિર્વાણ સ્થિતિ એ વળી કઈ સ્થિતિ? ઉત્તરાયણ હોય કે દક્ષિણાયન હોય જેને પ્રયાણ કરવાનું જ નથી હોતું અથવા કાળકમે જેમ દીવો ઓલવાઈ જય છે, તે પ્રમાણે જેના પ્રાણ ત્યાંના ત્યાં જ પોતાના જ આત્મામાં લીન થતા હોય છે, તેમને શું? દેહ તો ઉઠીનો લીધેલો હોય છે. પંચમહાબૂતનો તો કર્જ આપવાનો વ્યવસાય છે અને શાહુકારીનો ઘંધો છે. તેની પાસેથી આ દેહ ઉધાર લીધેલો છે. પોતાનાં કામ પૂર્ણ થતાં જેને તેને એ પાછો આપવો પડે છે. પાછળથી બનનારી ઘટનાની સૂચના પહેલેથી જ આપાને બાબાશ્રીએ લોકોને આશ્રમચકિત કર્યા. તેમના નિર્વાણ પછીનો અમૃત્ય સમય પસાર થઈ ગયો પણ તેમની કીર્તિ કાયમી રહી ગઈ. (ઓ. ૭૬-૮૨)

તાવનું આવવું એ તો એક નિમિત્ત હતું. લોકોની આ સર્વ સાધારણ રીતનું અનુકરણ કરવા ખાતર બાબા ક્યારેક જાણી જોઈને શરીર મરડીને પોતાની અસ્વસ્થતા દાખવતા તો ક્યારેક કણસત્તા. પરંતુ મનથી સદા તેઓ સાવધાન હતા. દિવસ દરમ્યાન સુમારે દા થી ૧૦ની વચ્ચે નિર્વાણકાળ પાસે આવતાં સાઈબાબા પૂર્ણ ભાનમાં પોતાની મેળે જ ઊઠીને બેઠા થઈ ગયા હતા. તે વખતે તેમની મુખ્યાકૃતિ જોઈને ભક્તજનોમાં આશાદ્વપી સમુદ્રમાં ભરતી આવી અને તે અશુભ સમય હવે ટળી ગયો છે. તેવું બધાને લાગવા માંડચું. આ પ્રમાણે ખિન્ન હદ્દે દુઃખી મનથી આ બેઠા હતા, તે વખતે બાબાનો અંતસમય પાસે આવ્યો અને ખરેખર શું બન્યું તે સાંભળો. દેહત્યાગ કરવાની એકાદ ક્ષણ પહેલાં બાબાના મનમાં શું આવ્યું એ તો ભગવાન જાણો! તે દાનઘર્મ કરવાનો સમય છે, એમ જાણીને તેમણે કફનીના ગજવામાં હાથ નાંખ્યો. લક્ષ્મીબાઈ શિંદે નામની સહાયુણી બાઈ જેનું વર્તન પણ એના નામને શોખે તેવું જ હતું, અને જે સદાને માટે સાઈચરણોમાં આસક્ત હતી તે સમયે બાબાના સાંનિધ્યમાં હતી. એક પળભરમાં પોતાનો દેહ છોડી દેવાનો છે, તે શ્રીબાબા સમજી ચૂક્યા હતા. તેમણે ખૂબજ ઉદારતાથી લક્ષ્મીને કંઈક દ્રવ્યનું દાન કર્યું. (ઓ. ૮૩-૮૯)

લક્ષ્મીબાઈ શિંદે મસ્ઝિદના કામકાજ સંબંધી નિયમોનું નિયમિત પાલન કરતી. દિવસ દરમિયાનની દરરોજની પદ્ધતિ એવી રહેતી કે, શ્રી સાઈબાબાનો દરબાર બધાને માટે જ ખૂલ્લો રહેતો. મોટે ભાગે તો કોઈને માટે પણ ત્યાં જવા આવવાની રોકટોક ન હતી. પરંતુ રાત્રીના સમયની મર્યાદાના કર્જ નિયમો હતા. સાંજની બાબાની પૂરી થાય કે ત્યાંથી લોકો પોતપોતાને ધેર પાછા જતા. ત્યારબાદ બીજે દિવસ ઉ઱્યા બાદ જ આ મસ્ઝિદમાં જઈ શકાતું હતું. પણ ભક્ત મહાણસાપત્તિ, દાદા કેળકર અને લક્ષ્મીબાઈ શિંદેની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને રાતના સમયે પણ મસ્ઝિદમાં આવવા જવાની કોઈ મનાઈ ન હતી. તે જ લક્ષ્મીબાઈ લગભગ દરરોજ શાક અને ભાખરી ખૂબ પ્રેમથી બાબાને મોકલતી હતી. તેની આ નિઃસ્વાર્થ સેવાનું શું વર્ણન કરું? તે રોટલી કે ભાખરીની જે હકીકત સાંભળશો તો બાબાની અપાર દ્યાનો અંદાજ આવશે અને ફૂતરો તથા ફૂક્કર સાથેની તેમની એકરૂપતા સમજશે. તેથી મનમાં આશ્રમ પણ થશે. એક દિવસે સાંજના સમયે બાબા મસ્ઝિદની ભીત સાથે પીઠ ટેકવીને પ્રેમથી વાતો કરતા હતા. એટલામાં લક્ષ્મીબાઈ ત્યાં આવ્યાં. તાત્યા પાટીલ પણ હતા. સાથે અન્ય બીજી માણસો પણ હતા. લક્ષ્મીબાઈએ સાઈને નમસ્કાર કર્યા. તેને જેતાં જ બાબા બોલ્યા, ‘લક્ષ્મી! મને ખૂબ ખૂબ લાગી છે.’ તે સાંભળીને લક્ષ્મીબાઈએ જવાબ આવ્યો, ‘બાબા હું હમણાં જ ભાખરી લઈને આવું છું.’ બસ હું જવા માટે નીકળી. જેવી આવી તેવી જ પાછી જઉ છું અને ભાખરી લઈને આવું છું. એવું કહીને તેઓ તરત જ ત્યાંથી નીકળી પડ્યાં, ઘેર જઈને સમય ન બગાડતાં ચાર ભાખરી, ભાળ ચટણી સાથેનું કોરું ભોજન લઈને તરત જ પાછાં ફર્યા અને બાબાની સામે તે મૂકી દીધું. બાબાએ તે ભોજન તરત જ ઉંચકીને પાસે ઊભેલા એક ફૂતરાની

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સામે મૂકી દીધું. આ જોઈને લક્ષ્મીબાઈ કકળી ઉઠ્યાં તેમને થયું કે હું જે આટલી ઉતાવળે ગઈ અને ઊભા ઊભ ભાખરીઓ બનાવીને લાવી તેની બસ આટલી જ કિંમત ? તમે તો ફૂતરાને ઘન્ય કરી નાખ્યો. ખરી ભૂખ તો તમને લાગી હતી ને ? પછી તે ભૂખનું શું થયું ? મોઢામાં એક પણ કોળિયો મૂક્યો નહિ અને મને વગર ફોગટની દોડાદોડી કરાવી. ત્યારે બાબા બોલ્યા, ‘શા માટે વગર કામનું ખોટું લગાડે છે ? આ ફૂતરાનું પેટ ભરાઈ રહ્યું છે તેનાથી મને સમાધાન થયું છે તું એવું અવશ્ય સમજ. આ ફૂતરામાં જીવ નથી કે ? પ્રાણીમાત્રમાં ભૂખ એક સરખી જ હોય છે. ભલે તે મૂગું છે અને હું બોલી શકું છું, છતાં અમારી ભૂખમાં કોઈ ફરક હોય છે ખરો ? ભૂખથી આકુણ વ્યાકુણ થયેલા પ્રાણને અન્ન ખવડાવતાં, તે અન્ન મારા જ મોમાં જય છે એમ તું સમજ. આ સર્વ સામાન્ય ઠેરવેલાં વથનો ધ્યાનમાં રાખ.’ (ઓ. ૬૦-૧૦૫)

આમ આ સાહો વ્યવહારિક પ્રસંગ હતો. પરંતુ તેમાં ઉપદેશ તો પરમાર્થનો જ હતો. શ્રીસાઈમહારાજના આવા ઉપદેશો અને બોધ એટલે જાણે પ્રેમસનો પરિપક્વ પ્રસાદ હતો. સહેલી વ્યવહારિક ભાષામાં સમજાવીને તેઓ પરમાર્થની ઝૃપેખા અંકિત કરી આપતા હતા. કોઈપણ પ્રકારના મર્મ કે દોષ ન બતાવતાં ભક્તોને મધુર અને પ્રેમાળ ઉપદેશ કરીને તેઓ સંતુષ્ટ કરતા. તે દિવસથી બાબાના ઉપદેશ પ્રમાણે લક્ષ્મીની ભાખરી પણ શક થઈ. દરરોજ ભાખરીને દૂધમાં ચોળીને એનો ચૂરો કરી તે પ્રેમપૂર્વક રાખી મૂકતી. અને બાબા પણ બનાવીને રાખી મૂકેલી ભાખરી નિયમિત રીતે પ્રેમથી અને ભક્તિથી આરોગ્યા લાગ્યા. એકાદ્વાર તેમાં થોડું મોડું થઈ જતું તો તેમને ચાલતું નહીં અને તેના વીના બીજું જમવાનું પણ ભાવતું નહીં. લક્ષ્મીની ભાખરીને લાવવામાં મોડું થાય તો તેમાં વાંધો લેતા નહીં પણ લક્ષ્મીબાઈની આ પ્રેમ અને ભક્તિવાળી ભાખરી ખાધા વીના તેઓ જમવાનું શક કરતા જ નહીં. પછી ભલેને થાળીમાં પિસ્સેલું ઠંડુ પડી જય કે ભૂખને કારણે બીજાં બધાં સમસ્યીને બેસી રહે. છતાં લક્ષ્મીની ભાખરી આવ્યા વીના પંગત શક થતી નહીં. થોડા સમય બાદ બાપોરના અઢી કે ત્રણ વાગ્યાના સુમારે બાબાશ્રી લક્ષ્મીબાઈની હાથથી બનાવેલી સેવની ખીર દૂધમાં બનાવડાવીને મંગાવતા અને જોડે બેસાડીને ખૂબ પ્રેમથી નક્કી કરેલા પ્રમાણામાં સ્વીકારતા. તેમાંથી જે બચતું તે બધું રાધાકૃષ્ણમાઈને મોકલાવી આપતા હતા. તે પણ લક્ષ્મીબાઈ જાતે જ જઈને પોતાના હાથે પહોંચાડી આવતાં હતાં. રાધાકૃષ્ણમાઈને પણ બાબાના હાથનું એકું ખાવાનું ખૂબ જ ગમતું અને ભાવતું હતું. દેહ વિસર્જનની કથા ચાલી રહી હતી તેમાં આ ભાખરીની લાંબી કથા અને નિરસ વાર્તા શા માટે ? શ્રોતાઓ મહેરભાની કરીને એવું કહેતા નહિ. આ કથા સાઈમહારાજની સર્વ વ્યાપકતા દર્શાવી રહી છે. આ જે બધું જડ અને ચેતન દર્શમાન થાય છે, તેનાથી પણ પેસે પાર સાઇ વસ્તુમાત્રમાં, જીવનમાત્રમાં ઠસોઠસ નિરંતર ભરેલા છે. તેમને જન્મ પણ નથી અને મરણ પણ નથી. તેઓ તો અજરાયમર છે. આ કથામાં છૂપાયેલું આ જ એક તત્ત્વ છે. લક્ષ્મીબાઈની વાત એકએક સહજ રીતે યાદ આવી જતાં કહી અને કદાચ શ્રોતાઓ માટે જ તે યાદ આવી હતી એમ હું માની લઈ છું. (ઓ. ૧૦૬-૧૧૬)

આવી લક્ષ્મીબાઈની પ્રેમાળ અને નિઃસ્વાર્થ સેવા સાઈ કેવી રીતે જુલી શકે ? તે અંગેની નવાઈભરી અને હકીકિતવાળી વાતો. શ્રોતાઓએ આદરપૂર્વક સાંભળવી. પ્રાણ કે આચ્યો હતો અને શરીર નક્કામું થઈ ગયું હતું, છતાં છેલ્લી ઘડીએ દેહત્યાગ કરતી વખતે બાબાએ લક્ષ્મીબાઈને પોતાના હાથે દાન કરેલું. પહેલાં પાંચ અને ત્યારબાદ ચાર ઝિયા ગજવામાંથી બહાર કાઢીને તેમની હથેળી ઉપર મૂકેલા. આ તેમનું છેલ્લું કાર્ય હતું. શું આ નવ પ્રકારની કરવામાં આવતી નવધા ભક્તિનો અણસાર હતો કે, નવરાત્રિનું દુર્ગા કે અંબિકાનું પૂજન હતું, અથવા આજે દર્શરાને દિવસે સીમા ઓળંગવાની પૂજન માટેની દક્ષિણા હતી શ્રીમહૃદાગવતપુરાણમાંની શ્રીકૃષ્ણે ઉદ્ઘવને આપેલ શિષ્યના નવ લક્ષ્મણોની સ્થિતિ જેની બાબાએ યાદ દેવડાવવી હતી કે કેમ ? ભાગવતના અગિયારમાં સંધારા દસમા અદ્યાયના છઠ્ઠા શ્લોકનું આશ્રય જુઓ. એમાં શિષ્યે ગુરુ પાસેથી કમાઈ કેવી રીતે કરવી અને તેને માટે કઈ રીતે વર્તવું એ કહેવામાં આવ્યું છે. પહેલા પૂર્વાધીમાં પાંચ વાતો

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કહેવામાં આવી છે, અને ઉત્તરાર્ધમાં ચાર વાતો કહેવામાં આવી છે. બાબાએ પણ આ જ કમ ધાર્યો હતો. જાળો કે તેમનો આ જ કહેવાનો ઉદ્દેશ હતો. શિાય અમાની અર્થાત્ માન સન્માથી દૂર રહેનારો, દક્ષ એટલે સારા સારનો વિવેક સમજુને નિર્ણય લેનારો, નિર્મત્સર અર્થાત્ કોઈ વ્યક્તિ ઉપર પણ દ્રેષ્ટ કે વૈરભાવના વીના, નિર્મભ એટલે માલીતુ પણાના ભાવ વીનાનો. જેને ગુરુ સિવાય બીજ વિષય પ્રત્યે આસક્તિ કે ભમત્વ નથી તેવો, ગુરુ-સેવા-પરઃગુરુ જ પોતાને માટે માતા-પિતા સુહ્યદ છે તેમ માનીને તેની સેવામાં સદાએ તત્પર રહેનારો અને પરમાર્થ જીજાસા તત્પર એટલે વિષયોનો સ્વાર્થ છોડીને પૂર્ણ તત્ત્વને જણાવા માટે જ પરમાર્થના માર્ગે જનારો હોવો જોઈએ. તેમજ એનું અંતઃકરણ સહા નિશ્ચિલ રહેવું જોઈએ. તેના મનમાં મજલક, છણકપટ અથવા નિંદાનો ભાવ નહીં હોવો જોઈએ. અને ગુરુની સાથે બીજાઝરી વાતો નહીં કરનારો હોવો જોઈએ. ઢૂંકાણમાં, આ જ બધા ગુણો વહે શિષ્યે ગુરુમાં સ્થિર રહેવું જોઈએ. આ રીતે શ્રીસાઈનાથ પોતાનો હેતું વ્યક્ત કરતા હતા. સંતો હંમેશાં પોતાના ભક્તો ઉપર ફૂપા કરે છે. લક્ષ્મીબાઈ પોતે પૈસે ટકે અને ખાદ્યોપદે સુખી હતી. નવ ડ્રેપિયાની તેને નવાઈ ન હતી. તે પણ એટલા ડ્રેપિયા આરતીમાં મૂકી શકી હોત. પણ આ દાન તેને માટે અપૂર્વ હતું. એનું પરમ ભાગ્ય કંઈક જુદું જ હતું. માટે જ સાઈના પોતાના હાથે સાઈકુપાનાં નવરત્નોનો હાર તેના નસીબે આવ્યો. આવા નવ ડ્રેપિયા તો કેટલાએ અર્થાત્ ગયા હરો અને અર્થાત્ પણ ખરા. છતાં તેને મળોલું આ દાન અમૂલ્ય અને અપૂર્વ હતું. તેમના જીવનના અંત સુધી સાઈબાબાની યાદ આપતું રહ્યું. (ઓ. ૧૧૭-૧૨૮)

હેણું અવસાન સમીપ છે છતાં ધ્યાન દ્વારા ચાર અને પાંચનો મેળ બેસાડીને બાબાએ લક્ષ્મીબાઈને જીવનભરની પોતાની યાદગીરી આપી દીધી. આવું સાવધાનીપૂર્વકનું પોતાનું વર્તન બતાવીને પાસે ભેગા થયેલા ભક્તોને જમવા મોકલી આપ્યા. માત્ર ગણાવા પૂરતાં ગામના બે ત્રણ જણા જેવા કે નાનાસાહેબ, નિમોણકર, માધવરાવ દેશપાંડશામા, બધાલ કોતે પાઠીલ અને લક્ષ્મીબાઈ શિંદેને પાછળ બેસી રહેવા માટે કહેતા જણાયા હતા. અમુક અતિશય પ્રેમાળ ભક્તોએ કપરો સમય આવવાનો છે. તે જાળીને બાબાથી દૂર ન જવાની જુદ કરી હતી. પણ અંતઃસમયે પોતાના મોહના સંકટમાં તેઓ પહે નહિ તે માટે હોથ કે બીજાં કારણોસર તે બધાને જાળો કે બાબાએ ઉતાવળથી ત્યાંથી વિદાય કરાવ્યા હતા. બાબાએ નિર્વાણનો સમય ખૂબ જ નાલુક છે તે સમજુને બાપુસાહેબ બુદ્ધી, કાકાસાહેબ દીક્ષિત વગેરેને ‘વાડામાં જલ અને જમી પરવારી પછી આવો.’ એવું કહીને મોકલ્યા હતા. સાઈએ પોતાના ભક્તોની મનની બેચેન અવસ્થા વજતાં અને પોતાનું મન ચલીત થતાં બધાને કહ્યું, ‘જલ જલ, જમી પરવારીને આવો’ એવી આજ્ઞા તેમણે કરી હતી. આવા આ બધા દરરોજના સોબતીઓ અને સાક્ષીઓ તથા રાત દિવસ સાથે ને સાથે રહેનારા સખા, ભલે મનથી અસ્વસ્થ હતા છતાં આજ્ઞા થતાં જ જવા માટે તૈયાર થયા હતા. આજ્ઞાનું ઉલ્લંઘન કરવું અશક્ય હોવાથી અને સાંનિધ્ય ત્યન્ય નહિ તેમજ બાબાનું મન પણ તોડી શકાય નહિ. આથી તેઓ સૌ વાડામાં જમવા માટે ગયા. બાબાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ભક્તોને માટે હવે શું ખાવાનું ને શું જમવાનું ! તેમનો જીવ તો બાબામાં જ પરોવાયેલો હતો. સાઈ મહારાજની યાદ મનમાંથી એક ક્ષણ માટે પણ દૂર કરવી તે શક્ય ન હતું. છતાં પણ તેઓ જમવા માટે બેઠા એટલામાં તરત જ તેમને પાછા બોલાવાનો સરેંદર્શો આવ્યો અને અહંકારી જમણ છોડીને તેઓ સૌ દોડતા દોડતા મસ્નિદમાં પાછા આવ્યા. પરંતુ બાબાની મુલાકાત માટે તેઓ કાયમને માટે ભૂખ્યા જ રહ્યા. (ઓ. ૧૩૦-૧૩૯)

આયુષ્ય મર્યાદાર્થી તેલ ખલાસ થતાં પ્રાણકૃપી જ્યોત મંદ થઈને બાબાશ્રીનો નિષ્પ્રાણ દેહ બધાલ કોતે પાઠીલના ખોળામાં વિશ્રામ પામ્યો. બાબા જમીન ઉપર બેઠાં હતાં અને બેઠાં બેઠાં જ પોતાને હાથે અંત સમયે દાનધર્મ કરીને પોતાના દેણું વિસર્જન કર્યું હતું. સાઈ સમર્થી પોતાના મનની વાત કોઈને પણ ન સમજવા દેતાં એવું વાતાવરણ ઊભું

---

### શ્રી સાઈનું સત્ય ચિત્ર

---

કરીને જોત જોતામાં પોતાનો દેહ છોડ્યો હતો અને પોતે બ્રહ્મલીન થઈ ગયા હતા. દેહનો અને માયાનો બુરખો ધારણ કરીને સંતપુરુષો આ જગતમાં અવતાર ધારણ કરે છે અને તેમનું કાર્ય પૂર્ણ થતાં તરત જ અવ્યક્તમાં સમર્સસ થઈ જાય છે. જેવી રીતે એક કલાકાર અનેક પ્રકારનાં પાત્રો ભજવે છે અને અનેક પ્રકારના સ્વાંગ રચે છે, ઇતાં અંતર્મનથી પોતાની જતને સંપૂર્ણપણે ઓળખતો જ હોય છે. માટે જ પૂર્ણપણે પોતે અવતાર ધારણ કરેલા ને વળી મૃત્યુનો ભય કેવો ? સમાજ વ્યવસ્થાના રક્ષણ માટે જેણે અવતાર લીધો અને કાર્ય પૂર્ણ થતાં અવતાર પૂરો કર્યો. તે કંઈ જન્મ અને મરણથી બંધાયેલો થોડો જ રહેવાનો હતો ? તેઓ તો પોતાની જ ઈચ્છાથી દેહ ધારણ કરે છે. પરબ્રહ્મ જ જેનો વૈભવ છે, તેમને મૃત્યુની સંભાવના કેવી ? આજ વૃત્તિનો જે હંમેશાં અનુભવ કરે છે. એની ઉપર ઉત્પત્તિ અને નાશનું પરિણામ કેવી રીતે થઈ શકે ? કર્મ કરતાં દેખાય ઇતાં તેમને થોડાં પણ કર્મ કરેલાં જ નથી હોતાં. કારણ કે હુંપણું ન હોવાને કારણે કર્મ કરતી વખતે પોતે તે કરી રહ્યા નથી એવું તેઓ હંમેશાં સમજતા હોય છે. ‘નાભુક્તં ક્ષીયતો કર્મ’ કર્મના ફળ ભોગવ્યા વીના કર્મનો નાશ થતો નથી એવું ધર્મશાસ્ત્રોમાં કહેલું રહેસ્ય છે. પરંતુ બ્રહ્મને જ્ઞાનનારાઓના મનમાં કોઈપણ પ્રકારની ગેરસમજ હોતી નથી. દેશ વસ્તુમાં તે બ્રહ્મને જ જોતો હોય છે. છાન્દોગ્ય ઉપનિષદ ૩-૧૪-૧માં કહ્યું છે કે ‘સર્વ અલ્લિવં બ્રહ્મ’ જગતમાં જે કાંઈ દેખાય છે. તે બધું જ બ્રહ્મ છે. કર્મ ફળોનો આ સમુદ્દ્રાય કરેલાં કર્મનું પરિણામ જ હોય છે અને તેનું જુદાપણું જાણીતું છે. પરંતુ છીપલા ઉપર ઝપા જેવું તેજ જોતાં તેને પણ બ્રહ્મજ્ઞાનીઓ બ્રહ્મ જ માનતા હોય છે. બાબા જેવી માયાણુ માઉલી મૃત્યુના મુખે કેવી રીતે પડી ? ગળે દિવસને રાત્ર અંધારી, એવી આ વાત થઈ ! (ઓ. ૧૪૦-૧૫૦)

હવે આ અધ્યાય અહીંયા જ પૂર્ણ કરીએ. પ્રત્યેક મહિના દીઠ ઓવીઓની કોઈ નિશ્ચિત મર્યાદા પાળીએ. અધ્યાય વગર કામનો લંબાવવાથી શ્રોતાઓ અસ્વસ્થ અને દુઃખી થઈ જશે. બાકી રહેલી નિર્વાણની કથા કર્મ અનુસાર આગળ ઉપર સાંભળવા મળશે. હેમાટે સાઈ સમર્થનું શરણું લીધું છે. તેમની ફૂપાથી તેઓ ફૂતાર્થ થયા છે. (ઓ. ૧૫૧-૧૫૨)

**સર્વનું કલ્યાણ થાઓ. આમ સંત અને સજજનોની પ્રેરણા પામેલા ભક્ત હેમાટપંત રચિત શ્રીસાઈસમર્થના  
સત્ય ચિત્રનો ‘શ્રી સાઈનાથ - નિર્વાણમ् - ૧’ નામનો બેતાલીસમો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે.**

**શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણા.**



## અધ્યાય ૪૨ નું અર્થ વિવરણ

ઉપર અધ્યાયમાં વળું કર્યા પ્રમાણે તાત્યા પાટીલ ૧૯૭૮ના દશેરાએ જ ભરણ પામશે તેવું ભવિષ્ય ભાગીને ઇ.સ. ૧૯૯૬ના દશેરાના સીમા ઉલ્લંઘનના પ્રસંગે અપૂર્વ કોધ અને હિંગંબર અવસ્થામાં આવીને સાઈબાબાએ બતાવ્યું કે પોતાના નિર્વાણનો સમય આવી રહ્યો છે, અને એવી સૂચના પોતાના હિંદુ ભક્તોને આપી હતી. તેવી જ સૂચના તેમણે પોતાના મુસલમાન ભક્તોને પણ તેમના ધર્મના રીત રિવાજ પ્રમાણે તૈયાર કરીને આપી હતી, એ સાંભળો. ઔરંગાબાદ જિલ્લાના વૈન્ઝપુરના નિવાસી ઈમામભાઈ છોટેખાન નામના બાબાશ્રીના ભક્તને પ. પૂ. નરસિંહ સ્વામીએ ૧૯૭૬ની સાલમાં કરેલા નિવહેન ઉપરથી આપણને જાણવા મળે છે.

ઇ.સ. ૧૯૭૮માં દેહત્યાગ પહેલાં કેટલાક મહિનાઓ અગાઉ બહેબાબાના કાસીમ નામના છોડી રોટલીઓ અને રંધેલાં ભરદાં આપીને બાબા બોલ્યા હતા, ‘ઔરંગાબાદ જ શમસુદ્દીન ફીર મીયાંને મળીને આ બધી વસ્તુઓ અને ૨૫૦ ડિપિયા આપી દે જે. એમને કહેને, ‘મૌલૂ અને કવ્વાતી કરાવજે, અને ન્યાસ પણ કરાવજે.’ મૌલૂ એટલે મહંમદ ફેંગભરનાં ગીતો ગાવાં. કવ્વાતી એટલે તબલાના તાલ ઉપર ઢેકો દઈ સાથું સંતોનાં ગીતો ગાઈને તાલ મેળવવો અને ન્યાસ એટલે રંધેલું અજ્ઞ પ્રસાદ તરીકે લોકોમાં વહેંચવું. કાસીમને બાબાએ એક ગલગોટાનાં ફૂલોનો હાર પણ આપ્યો હતો અને કહેલું કે, આ બંને મિયાના ગળામાં પહેરાવજે અને કહેને કે, ‘નવ હિન નવ તારીખ અલ્લા મીયાંને અપના ધુનિયા લગાયા. મર્જ અલ્લાકી !’ અર્થાત્ નવમીના દિવસે નવમી તારીખે અલ્લાએ પોતે જ મૂકેલા દીવાને લઈ જશે, જેવી અલ્લાની ઈછા તે સાંભળીને કાસીમે કહ્યું કે, ‘મને ઔરંગાબાદ વિષે કંઈપણ ખાસ માહિતી નથી.’ આવું જણાવતા બાબાએ તેને કહ્યું હતું કે, ‘જતી વખતે તારી સાથે છોટેખાનને લઈ જશે.’

છોટેખાન, કાસીમ અને તેમનો નોકર અમરી આ ત્રણ સાથે ઔરંગાબાદ ગયા હતા અને સ્ટેશન પર ઉત્તર્યા હતા. તે સમયે ત્યાં જ ફીર સમસુદ્દીન જેમને છોટેખાન ઓળખતો હતો, તેઓ જતે જ ત્યાં આવીને ઊભા હતા. ‘સાઈ ફીર પાસેથી કોણ મહેમાન આવ્યા છે ?’ એવું પૂછતાં છોટેખાને અને કાસીમે તેમને સલામ કરી. પછી સમસુદ્દીન ફીર બાબાએ કાસીમને જે પણ કંઈ કહેવાનું કહ્યું હતું, તે શબ્દે શબ્દે વિગતવાર કહ્યા હતા, કાસીમે બસો પચાસ ડિપિયા આપતાં ત્યાં તેમને ન્યાસ કરીને ખૂબ લોકોને જમાડયા હતા અને રાતના મૌલૂ અને કવ્વાતીનો કાર્યક્રમ પણ રાખ્યો હતો. બીજે દિવસે આ બધા લોકો બજેમીયાંને ત્યાં ગયા હતા. બજેમીયાં તે વખતે એક હાથ ઊંચો કરીને અને બીજે હાથ નીચે રાખીને ઊભા હતા. તેમના નજીકના માણસોએ છોટેખાન અને સહકાર્યકારોને બજેમીયાંને કહ્યું હતું કે તમે ત્યાં જતા નહીં. તે ગુસ્સાથી ઉછળશે. આથી છોટેખાન અને સાથીઓ થોડો સમય ત્યાં જ રોકાયા હતા. પછી થોડીલાર ધીરજ ધરીને છોટેખાને બજેમીયાંના ગળામાં બાબાએ આપેલો પેલો ગલગોટાનો હાર પહેરાવ્યો હતા. તરત જ બજેમીયાં ઊંચો કરેલો હાથ નીચો પાડીને બોલ્યા હતા, ‘નવ હિન નવ તારીખ અલ્લામીયાં અપના ધુનિયા લગાયા મર્જ અલ્લાકી !’ બજેમીયાંએ આકાશ તરફ નજર નાખેલી અને તેમની આંખો આંસુઓથી છલકાઈ ગયેલી. બાબાશ્રીના દેહત્યાગના દિવસો પાસે આવી ગયા છે તે જાણીને તેઓને ખૂબ દુઃખ થયેલું. આ પછી બરાબર ચાર મહિને બાબાશ્રીએ પોતાનો દેહ છોડી દીધો હતો. ‘નવ હિન નવ તારીખ’ એટલે મુસલમાનોની નવ તારીખ. બાબાએ મોહરમ મહિનાના નવમાં દિવસે એટલે કે કટલની રાતે દેહ મૂકી દીધો હતો.



## ॥ અધ્યાય ૪૩ ॥

### શ્રીસાઈનાથ નિર્વાણમ् - ૨

(શ્રીસાઈનાથ મહારાજનું આ જગત છોડીને જવું)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,  
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદ્ગુરુ સાઈનાથ મહારાજને વંદન.

ગયા અધ્યાયમાં સંત શ્રી સાઈનાથ સમર્थના નિર્વાણનું વર્ણન કરવામાં આવ્યું. હવે એમાં જે કંઈ બાકી રહી ગયું છે તે આ અધ્યાયમાં પૂર્ણ કરવામાં આવશે. પોતાને માટે અલોકિક પ્રેમ ઉત્પન્ન કરાવવા સાઈનાથ મહારાજ જાતે જ સમર્થ છે. હેમાદ્રપંત તેમનાં ચરણોમાં નિષાની પરાકાશાએ પહોંચ્યા અને તેમનું ચરિત્ર લખી રહ્યા છે. બાબા પોતે જ ભક્તિ અને પ્રેમ આપે છે અને તે જ વાતો તેમના ચરિત્રનો મહિમા વધારી રહી છે. તેમનાં ચરણોમાં ભજન જેવાં સત્કૃત્યોનું ગૌરવ મળે છે અને ત્યાં જ સંસાર પ્રત્યેનો વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. માટે કાયા, વાચા અને મનથી તેમને હજરો વંદન કરું છું. તેમના મહિમાની કલ્પનાના અનન્યભાવે તેમના શરણે જવાથી થાય છે. અસંખ્ય ભેગાં થયેલાં પાપોનો ભારો અને મળ ધોઈને શુદ્ધ કરવા માટે અને તથા મનના શુદ્ધિકરણ માટે બીજાં બધાં સાધનોની મદદ લેવી વ્યર્થ છે. હરિના ભક્તોની યશગાથાઓ યાદ કરવી અને તેનું જ ભજન કરવું. આ સિવાય બીજે ચિત્ત શુદ્ધિનો એનાથી વધારે સરળ માર્ગ ગમે તેટલું શોધવા છતાં પણ જરૂરો નહીં. (ઓ. ૧-૬)

પાછળના અધ્યાયનું અનુસંધાન ધ્યાનમાં લઈએ અને તેનું થોડું મનન કરીએ. સાઈ એ નિજનંદ અવસ્થાનું મૂળ સ્થાન છે. હવે આપણું વ્યાખ્યાન આગળ ચલાવીએ. પાછળ સવિસ્તારથી જણાયું છે કે બાબાએ વિજ્યાદશમીના જ દિવસે શા માટે પ્રયાણ કર્યું અને તાત્યાબાની નિમિત્તે પહેલેથી જ ભવિષ્યવાણીનું કેવી રીતે સુચન કરેલું ? પછી દેહના અંત સમયે ધર્મનું આચરણ પાળીને લક્ષ્મીને દાન કેવી રીતે આપ્યું તેનું વર્ણન કરવામાં આવ્યું હતું. હવે આ અધ્યાયમાં પોતાનો અંતસમય પાસે આવ્યો છે તે જણીને સાઈ મહારાજે પોતાના કલ્યાણ માટે બ્રાહ્મણોના મુખે રામાયણ કેવી રીતે સાંભળ્યું હતું તેનું વર્ણન કરવામાં આવશે. સમાધિ સ્થાનની યોજના કેવી રીતે કરવામાં આવી હતી અને અકલ્યિત રીતે બાબાની તે ગમતી ઠિક કેવી રીતે હાથમાંથી પડી ગઈ હતી તે ધ્યાન દઈને સાંભળો. એક વખત બાબા ત્રણ દિવસ માટે સતત બ્રહ્મરંધમાં એટલે કે મસ્તક ઉપરના તાળવાના ભાગમાં પ્રાણ ચઢાવીને બેઠા હતા. ત્યારે લોકોને તે સમાધિગ્રસ્ત સ્થિતિ ન સમજતાં તેમનું અવસાન થયું છે તેમ લાગ્યું હતું. તે લોકોએ સાઈનાથ મહારાજની ઉત્તરક્રિયાની પણ તૈયારી કરી નાખી હતી. પરંતુ પછી બાબાના પ્રાણ એકાએક શરીરમાં પ્રવેશતાં તે માણસો મનથી કેવા હેબતાઈ ગયા તે પણ જોઈશું. (ઓ. ૭-૧૩)

આ નિર્વાણની કથા સાંભળીને શ્રોતાઓ કંટાળશે. મૃત્યુના શોકની કથા મોટાભાગે સાંભળવી કોઈને ગમતી નથી. પરંતુ આ સાધુ સંતોના નિર્વાણની કથાઓ શ્રોતાઓને પાવન કરનારી હોય છે, માટે લંબાણ ના વધે એની બીકથી પૂર્ણ સમાધાન થાય ત્યાં સુધી દુક્ટે દુક્ટે વાંચવી. દેહ છોડ્યા બાદ પૂનર્જન્મ વીનાની આત્મસુખ પામેતી એવી શાશ્વત સ્થિતિ તેને મેળવવામાં કઢીન ગતિ બાબા પ્રાપ્ત કરી ગયા. દેહ ધારણ કરેલો હતો ત્યારે તેઓ વ્યક્ત હતા, અને દેહત્યાગ બાદ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અવ્યક્ત થઈ ગયા. તેમણે જે કાર્ય માટે અવતાર ધારણ કરેલો તે કાર્ય પૂરું થતાં અવતાર સમાપ્ત થયો. અને હવે બધાં જ કાર્યમાં અને ઘટઘટમાં વ્યાપેલો એવો એમનો સંબંધ સુસ્પષ્ટ થયો. તેમનું એક સ્થળ ઉપર મર્યાદિત રહેવું સમાપ્ત થવું અને સર્વ વ્યાપકતા પામ્યા. તેઓ પૂર્ણપણે સનાતન થઈ ગયા અને પોતાના જ સ્વ સ્વરૂપમાં એકદ્વિતી થઈ ગયા. સાઈમહારાજ બધાને માટે એક જીવન જીવવાનું કારણ હતા, અને બધાના જીવ કે પ્રાણ હતા. સાઈમહારાજ સિવાય શિરડીની પ્રણ નિરાધાર થઈ ગઈ. સાઈશરીર ઠંડુ પડતાં અનર્થ થયો. આબાલવૃદ્ધ બધાં જ શોકમાં દૂખી ગયાં અને દેરેકના જીવ ઉપર આવેલો પ્રસંગ વીતી ગયો. તાવ જેવી અનેક પીડાઓ સંસારમાં જીવનારાઓની પાછળ હંમેશને માટે પહેલી હોય છે. પણ ત્યાણી પુરુષોના રસ્તે જવાની મર્યાદાઓ આ પીડાઓને કદી પણ ઓળંગતી નથી. પોતાના જ તેજને પ્રજ્વલિત કરીને સંત પુરુષો તેમના પોતાના દેહને બાળતા હોય છે. તે જ પ્રકાર બાબાએ પોતાને માટે કરી બતાવ્યો ને! જે ન થવું જોઈએ તે થઈ ગયું. સાઈ ભગવાન બ્રહ્મસ્વરૂપમાં એક થઈ ગયા અને લોકો તેમજ ભક્તગણો અંદરોઅંદર ખૂબ જ દુઃખી થયા. એક ઉંડી ધેરા શોકની લાગણીમાં સૌ ગરકાવ થઈ ગયા, ‘મસ્નિદ્રા છોડીને ન ગયો હોત તો સાંચું થાત, વીના કારણે બાબાની આખરી મુલાકાત હું ચૂક્યો, પાસે હોત તો કંઈક ઉપરોગમાં આવ્યો હોત. આવા મહાન અને મુખ્ય પ્રસંગે જ ભાવીએ બાન કેમ ભૂલાયું હરો?’ આવા અનેક પ્રકારના મનના વિચારોથી તે સમયે જે તે ભક્તો ખૂબ દુઃખી થવા માંડ્યા. અંત સમયે બાબાના મનમાં શું હતું તે કોઈ સમલ શક્યું હોત ? ન હતી ગળામાં કોઈ ધરર કે ન હતી કોઈ શ્વાસોચ્છવાસમાં તકલીફ કે તેમનું જોરથી ઉછળવું. ન હતી ખાંસી કે ન હતી કફની તકલીફ, અથવા ન હતું જીવનું ગભરાવું કે આકળ વિકળ થવું. બાબા તો ખૂબ જ આનંદથી પ્રયાણ કરી ગયા. ‘હવે કયાં એ સાઈ દર્શન ? હવે કયાં એ બાબાના પગ દાબી આપવા ? કયાં હવે તેમનાં ચરણોને ધોવાં અને તીર્થ લેવું ?’ આવા અંતિમ સમયે પાસે ઊભેલા પ્રેમાળ ભક્તોએ બાબાએ શા માટે દૂર કરી દીધા, અને તેમના જીવોમાં કાયમનો વસવસો રહી ગયો ? નિર્વાણના સમયે પોતાની નજીકના ગમતા માણસોને પાસે ઊભેલા જોઈને બાબાનો પ્રેમનો છેલ્લો કદાચ આવી શક્યો હોત ! સાયુજ્ય મુક્તિનું સ્થાન પ્રાપ્ત કરવામાં પ્રેમના પાશ આડા આવે છે. વખતસર જે તેમને તોડાય નહિ તો પછી વાસનારહિત મુક્તિ કેવી રીતે મળી શકે ? જે આવું ન બનતાં દેહ પડે અને તરત જ મરણ આવે તથા જીવ ઉપર ચેઢે તો તરત જ નવા સંસારમાં તે દાખલ થાય છે અને પાછું વાસના અને આશા આકંક્ષાઓનું બજ્જર ફરી શક્ય થાય છે. આ પ્રકારને ટાળવા માટે સાધુસંતો ખૂબ જ સાવધ રહે છે. બાબાના મનમાં પણ કદાચ વિચાર આવ્યો હરો કે, આ પ્રચાલિત ઝડી ચાલુ રાખવી, અને મૃત્યુના સમયે તે જ બાબતમાં સાવધાની વર્તવી. સૌને દૂર કરીને એકાંતમાં જે આરાધ્ય દેવ કે ગુરુની મૂર્તિનું ધ્યાન કરવું હોય તેને ખ્લેલ વીના તે સમયે પોતાના ચિત્તની સામે લાવીને મનને શાંત કરવું જોઈએ. ‘અંતે મતિઃ સા ગતિઃ’ મરણના સમયે જેવા વિચારો આવે છે તે જ પ્રમાણે નવો જન્મ મળે છે. આ એક પ્રસિદ્ધ કહેવત લગભગ બધા જ જાણતા હોય છે. માટે ભગવદ ભક્તો એ બાબતને પોતે જાતે જ આચરણમાં મૂક્તા હોય છે. તેમની લોક વહેવાર રાખવાની આ જ એક રીતે છે. ગીતાના ટમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે, અંતકાલેય મામેય સ્મરન્મુક્તયા કલેવરમ् । યઃ પ્રયાતિ સ ભ્રમ્ભાવં યાતિ નાસ્ત્યત્ર સંશયઃ ॥૫॥ યં યં વા સ્મરન્મુક્તયં ત્યજત્યન્તે કલેવરમ् । તં તમેવૈતિ કૌતેય સદા નદ્ભાવભાવિત: ॥૬॥ અંત સમયે જે માંચું જ સ્મરણ કરીને દેહ છોડે છે તે મારા જ સ્વરૂપને પામે છે, એમાં કોઈ જ શંકા નથી ॥૫॥ અંતકાળે મનુષ્ય જે જે ભાવની એટલે કે મનસ્થિતિની યાદ કરતાં કરતાં આ દેહ છોડે છે, તે તે મનઃસ્થિતિમાં રંગાયેલો હોવાને લીધે તેને જ ફરી પામે છે ॥૬॥ (ઓ. ૧૪-૩૪)

ચૌદ દિવસ બાકી રહ્યા હતા. બાબાનો નિર્વાણનો કાળ પાસે આવવા લાગ્યો હતો. એવું જાણીને બાબાશ્રીએ વજે નામના એક ભક્તને રામયાણ વાંચવા માટે બેસાડ્યો. વજે મસ્નિદ્રામાં બેઠા અને પોથી પુરાણ શક્ય થયું. બાબા તેને

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

શાંતિથી સાંભળવા લાગ્યા. આમ આઠ દિવસ વીતી ગયા. પછી બાબા બોલ્યા, ‘પોથી અટક્યા વીના વાંચવાનું ચાલુ રાખો.’ ત્યારે વજે રાતદિવસ ત્રણ દિવસ સતત વાંચતા રહ્યા. પછી થાકીને અશક્ત થઈ જવાને લીધે વાંચતા વાંચતા કંટાળ્યા. આમ બીજી ત્રણ દિવસો પસાર થઈ ગયા. પછી બાબાએ શું કર્યું? ‘પોથીનું વાંચન પૂર્ણ કરાવ્યું. વજેને ત્યાંથી દૂર કરી દીધા અને પોતે એકાંતમાં મન્ત્ર રહ્યા. શ્રોતાઓ પૂછશે કે બાબાએ વજેને કેમ દૂર કર્યા તો તેનું કારણ શું તે સાંભળો. તો હું તમને મારી બુદ્ધિ પ્રમાણે સમજલવીને કહી રહ્યો છું. દેહત્યાગ પાસે આવતાં સાધુ સંતો અને સજજન લોકો પોથી પુરાણ વંચાવીને તેને સાંભળી લે છે, તેમજ પૂરી સાવધાનીથી તેને સાંભળીને ધ્યાનમાં રાખે છે. મહર્ષિ વેદ વ્યાસના પુત્ર શુદ્ધેવળજુએ સાત દિવસ શ્રીમહદ્ભાગવતપુરાણ કહું હતું, જે સાંભળીને રાજ પરીક્ષિત તૃપ્ત થયા અને સુખેથી મરણ પામ્યા હતા. ઈશ્વરની લીલા સાંભળતાં અને સ્મરણ કરતાં કરતાં તેમની જ મૂર્તિ, દશ્ટિ સામે રાખીને જેને મૃત્યુ આવે છે તે જ પોતાનું કલ્યાણ સાધી શકે છે. સાધારણ રીતે જન સમુદ્ધાયની મનની સ્થિતિ આ પ્રકારની હોય છે. સંત સ્વયં તેને આચરણમાં લાવે છે. સમાજ વ્યવસ્થાનો અને રક્ષણનો માર્ગ તેઓ કઢી પણ છોડતા નથી. મોટે ભાગે તેને માટે જ તેઓ અવતાર ધારણ કરે છે. જેને આ પંચમહાભૂતોના બનેલા શરીર વિષે કાળજી નથી હોતી તેવી વ્યક્તિઓને આ શરીર છોડતી વખતે દુઃખ કે શોકનો આવેગ રહેતો નથી. તેમની દશ્ટિએ આ એક નૈસર્જિક અથવા તો મૂળ પ્રકૃતિને અનુસરીને બનનારી સ્વાભાવિક જ ઘટના હોય છે.’ (ઓ. ૩૫-૪૫)

અહીંયા શ્રોતાઓના મનમાં શંકા ઉત્પન્ન થશે કે, જે જીવાત્મા બ્રહ્માનંદના સુખમાં ખોવાયેલો હોય છે તેને માયા મોહનો સંસર્ગ થાય છે, આ બોલવું શોભે છે ખરું? જે આત્મસ્વરૂપે જગૃત છે અને જેનું ‘અલ્લાહ માલિક’ એ જ લક્ષ છે તેમને વળી ભક્તોની પાસે રહેવું કે એની અદ્યણું કેવી રીતે હોઇ શકે? તેમનો તો સંસાર પૂર્ણ થયેલો છે. પરમાર્થ પણ એક જ જગ્યાએ અટકેલો છે તથા જુદાપણું જડમૂળથી નીકળી ગયેલું છે અને તેઓ પોતે સ્વસ્વરૂપમાં લીન થયેલા હોય છે. આ અક્ષરસ: સાચું છે. તેમાં દેશમાત્ર પણ અસત્ય નથી. પરંતુ સંતજ્ઞનો લોક ઉદ્ધાર અને અવતાર કાર્ય પૂર્ણ થતાં ફૂલકૃત્ય થઈ જાય છે. સંતોમાં કામ, કોધ, લોભ, મોહ, મદ અને મત્તસર જેવા વિકારો હોતા નથી. તેઓ સદાને માટે અવ્યક્ત સ્થિતિમાં જ રહેતા હોય છે અને ભક્તોનો ઉદ્ધાર કરવા માટે જ પૃથ્વી ઉપર પ્રગટ થતા હોય છે. તેમને વળી મરણ કેવું? દેહનો અને ઇન્દ્રિયોનો સહયોગ એટલે જન્મ થબો એમ કહેવાયું છે અને દેહ અને ઇન્દ્રિયોનો વિયોગ એટલે મૃત્યુ છે. સંસારમાં અટવાઈ જવું અથવા એમાંથી સંપૂર્ણ છુટવું તેને જ જન્મ મરણનું નામ આપવામાં આચ્યું છે. જન્મની પાછળ મરણ જેડાયેલું જ છે. તે બંને એક બીજાથી જુદાં નથી હોતાં. મરણ એ જીવની સ્વાભાવિક સ્થિતિ છે. અને જીવન અથવા તો જીવવું તે એક અસ્વભાવિક સ્થિતિ અથવા તો વિકૃતિ છે. મરણને મારીને જે બચી જાય છે અને કાળના માથા ઉપર પગ મૂકીને અને તેને દ્વારાવીને તેની ઉપર કાબૂ મેળવે છે તેવાને આયુષ્ય મર્યાદાની પરવા કઈ હોઇ શકે? તેમણે પોતાની સ્વેચ્છાએ જ આ અવતાર લીધેલો હોય છે. ભક્તોના કલ્યાણ અર્થેની તેમની તીવ્ર ઈચ્છાને કારણે અનેક પ્રકારે અવતાર ધારણ કરે છે તેવા લોકો કંઈ જન્મ મરણથી થોડા બંધાવાના છે? આ બંને કલ્યાણાઓ સંદર્ભ મિથ્યા છે. દેહ પડતા પહેલાં જ જુઓ, જેણે દેહની રાખ કરી નાખી છે, તેને વળી મરણનો ડર કેવો? તેમની સામે મરણ એ રાખ જ છે. મરણ એ દેહની મૂળ અને સ્વભાવિક સ્થિતિ છે, એક પ્રકૃતિ છે, અને જીવન અથવા તો જીવતા રહેવું એ દેહની બદલાયેતી માનસિક સ્થિરતાનો બગાડ કરનારી સ્થિતિ એટલે કે વિકૃતિ છે. એવું બુદ્ધિમાન લોકો માને છે. (ઓ. ૪૬-૫૬)

શ્રીસાઈસમર્થ તો સંપૂર્ણ આનંદથી ભરેલા હતા. જેમને દેહનું ઉત્પન્ન થવું એટલે કે જન્મવું તે બાબતની ખખર જ નહીં અથવા તો દેહના અસ્તિત્વની જણકારી પણ ન હતી. એવા દેહને મરણ કાર્યાંથી હોય? સાઈમહારાજ તો સંપૂર્ણ પરબ્રહ્મ હતા. પરબ્રહ્મને જન્મ મરણ કેવી રીતે હોઇ શકે? જેમને બ્રહ્મ એટલું જ સત્ય અને બાકીનું જગત મિથ્યા છે એવું

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

લાગતું હોય તેવાને દેહભાન ક્યાંથી હોઈ શકે ? તેમને માટે પ્રાણ ધારણ કરવો કે છોડી દેવો, તેવી જ રીતે કોઈની પણ નજરે ન પડતાં ભટકતાં રહેવું, આ બધું આખરે તો ભક્તોના ઉદ્ધાર માટે જ યોગ સામર્થ્યની કરેલી લીલાઓ જ છે. લોકો સમજે છે કે સૂર્યને ગ્રહણ લાગ્યું છે અને તે સંપૂર્ણ હંડો થઈને અદ્યથ થઈ ગયો છે. પરંતુ આ માત્ર એક દસ્તિનો ભ્રમ છે. તેવી જ વાત સંતોના મરણની છે. સંતપુરુષોને આ શરીર એ પણ કેવળ એક ઉપાધીઝ્યુપ જ લાગે છે. તે શરીરના માનસિક કે શારીરિક દુઃખની એમને શી પડી હોય ? દૈવ યોગે અમુક આધિ વ્યાધિઓ શરીરમાં હોવાની તેમને શુદ્ધિ પણ નથી હોતી. ભક્તોના પૂર્વજન્મનાં સંપાદન કરેલાં પુણ્યોના હિસાબે જ એકાએક સંગૃહિત થયો છે. અવ્યક્ત અવસ્થામાં જે ભક્તિથી સંપત્ત થયો છે તે જ આ ભક્તોને સહાય કરવા માટે પ્રગટ થયો અને તરત જ શિરડીમાં દર્શન દીઘાં. હવે ભક્તના કાર્યનો ઉદ્દેશ પૂર્ણ થતાં કહેવાય છે કે તેમણે દેહ છોડ્યો. પરંતુ આમ બોતવા ઉપર કોણ વિશ્વાસ મુક્શો ? યોગીઓને કંઈ જગતમાંથી જવાની કે ફરી જન્મ લેવાની ગતિ હોય છે ખરી ? સ્વેચ્છા મરણ પ્રમાણે સાઈસમર્થે પોતાનો દેહ યોગ અન્નિમાં બાળ્યો. પોતે અવ્યક્તમાં લીન થઈ ગયા. અને ભક્તોના હૃદયમાં વાસ કર્યો. જેના કેવળ નામ સ્મરણથી મરણ જેવી વાતની હરિત ટકી તેને વળી મરણની અવસ્થા કેવી ? તેઓ તો પોતાની પૂર્વની અવ્યક્ત સ્થિતિને જ પ્રાપ્ત થયા છે. જે સ્થિતિની સામે પાર જઈને સાઈબાબા અવ્યક્તમાં વિલીન થઈ ગયા. પણ ત્યાં સ્વસ્વરૂપની સ્થિતિમાં રહીને પણ ભક્તોને તેઓ સદાય જગૃત રાખતા રહ્યા છે. ચૈતન્યથી જે પૂર્ણપણે ભરેલો છે અને જેનો ભક્તોના હૃદયમાં કાયમનો વાસ છે તે મહાપુરુષને શું મરણ પામ્યો છે એમ કહી શકાય ? મનને આવું બોલેલું ગમતું નથી. માટે જ આ અનાદિ અને અનંત સાઈ વિશ્વના પ્રલયના સમયે પણ જીવતા અખંડ અને અડગ રહેશે. તે જન્મ મરણના ચકરાવામાં કયારેય પડશે નહીં. જ્ઞાનેશ્વર મહારાજ શું મરણ પામ્યા છે ? ત્રણસો વર્ષ પછી પણ તેમણે ફરીથી દર્શન આપ્યાં. એકનાથ મહારાજ તેમને મળીને આપ્યા અને આ જગત ઉપકાર કર્યો. (ઓ. પાઠ-૬૬)

આમ કૃપાવંત એકનાથ મહારાજ પૈઠણમાં તુકારામ મહારાજ દેહૃતમાં શ્રી ગુરુચરિત્રમાં વર્ણવેલા અને શ્રીદત્તના શ્રીપાદવલ્લભ સ્વામી પદ્ધીના બીજન અવતાર હતા. જે વાડી ઔદૃંબરમાં રહેતા હતા. તેમણે ઈ.સ. ૧૮૮૬માં સમાધિ લીધી. નરસિંહ સરસ્વતી કે જેમણે ઈ.સ. ૧૮૮૬માં સમાધી લીધી. સમર્થ રામદાસ સ્વામી સતારા પાસે પરતળીમાં અક્કલકોટ સ્વામી અક્કલકોટમાં અને માણિકપ્રભુ હુમણાબાદમાં કણાટકના બિદ્ર જિલ્લાના હુમણા બાદમાં પ્રસિદ્ધ થઈ ગયા. તેવી જ રીતે આ શ્રીસાઈનાથ મહારાજ શિરડી ખાતે પ્રસિદ્ધ થયા. જેના મનમાં જેવી શ્રદ્ધા હોય એવો આજે પણ તેને અનુભવ થાય છે. જેને આવો અનુભવેલો અને સિદ્ધ થયેલો પ્રભાવ હોય તેમને મરણની સ્થિતિ વળી કેવી રીતે આવે ? ભક્તોનાં કાર્યોમાં સદાય ભદ્ર કરનારા સાઈનાથે શિરડીમાં દેહ રાખ્યો છે. તેમ છતાં તેઓ સર્વ સ્થાવર જંગમ વસ્તુઓમાં નિર્ગુણ સ્વરૂપમાં ઝ્યપમાં સમાયેલો છે. તેઓ ઈચ્છા પ્રમાણે અવતાર ધારણ કરીને અને લીલાઓ કરવા માટે સમર્થ છે. સંતજનો સ્ત્રીના ગર્ભાશય સિવાય પણ પ્રગટ થતા હોય છે અને મૂર્તિમંત બ્રહ્મસ્વરૂપ હોવાને કારણે તે પુણ્યતામાઓ પરોપકાર કરવા માટે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. અવતારીને જન્મ મરણની સ્થિતિ આવતી નથી. પોતાનું કાર્ય પૂર્ણ થતાં તેઓ પાછા અવ્યક્તમાં એકઝ્યપ થઈ જય છે. દેહ સાધારણ રીતે સાડાત્રણ હાથ લાંબો હોય છે. બાબા થોડા એમાં જ સમાઈને રહેવા વાળા છે ? તેમને કોઈ જુદા રંગના કે આકારના કહેવું યોગ્ય નથી. જેમને અણિમા-ગરીમા જેવી આઠ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થયેલી હોય છે તેમનું ઐશ્વર્ય લોકોના આવવા જવાથી ઓછું વત્તું થતું નથી. તે તો તેમનું કાયમ ટકે તેવું પોતાનું ઐશ્વર્ય હોય છે તેવી તેમની જ્યાતિ છે. આવી રીતે મોટા મહાત્માઓનો પ્રગટ થવાનો ઉદ્દેશ ફક્ત લોક કલ્યાણ માટે જ હોય છે. પ્રગટ થનારાને કમશા: દેખાતા રહેવું અને અદ્યથ થવું એવી સ્થિતિ રહેવાની. સંતો લોકોને ભેગા કરી ઉદ્ધાર માટે અને વૃત્તિ ધર્મ તરફ વાળવા માટે અને સતકર્મો તરફ પ્રેરણા માટે તત્પર હોય છે. જન્મ છે

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સધળા ડ્રોમાં જે જ્ઞાનનો બંડાર છે અને હંમેશાને માટે આત્માદીપી સ્વકૃપમાં લીન છે. તેને માટે આ દેહનું જતન કરવું કે તેનું ભરણ પામવું તે સરખું જ છે. (ઓ. ૭૦-૮૧)

આમ બાબાનો દેહ પડતાં જ દુઃખના ઊગરો ઘસી પડ્યા. આખા શિરડી ગામમાં હાહકાર મચી ગયો. શિરડીની જનતા ઊંડા શોકમાં ઊતરી ગઈ. બાબાના સમાચાર વાયુવેગે ફેલાતાં લોકોનાં હદ્યમાં દુઃખોનાં બાણ વાગ્યાં. દરરોજનો વહેવાર અને નિત્યક્રમ બધો જ ખોરવાઈ ગયો. સર્વત્ર એક ન સમજન્ય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. બધું જાણે ખેદાનમેદાન થઈ ગયું. એ અમંગળ સમાચાર પ્રસરતા દરેકને ઊંડો વજધાત લાગ્યો. વિચારશીલ લોકો અને બુદ્ધિજીવીઓ એકાંત શોધીને મૌન ધારણ કરીને એક તરફ બેસી ગયા. બીજાનો તો પોક મૂકીને જેર જેસેથી આંકંદ કરવા લાગ્યા. પ્રેમના અતિરેકથી ઢુંધાયેલા અનેકના કંઠ ભરાઈ આવ્યા. અસંખ્ય આંખો રડી ઊઠી અને એ ઉદ્વેગ દર્શાવનારા શબ્દો જેવા કે, ‘શિવ શિવ હરે હરે’ નીકળી પડ્યા. ધેરેધેર ધમાત મચી ગઈ અને આંકંદ ફેલાઈ ગયું. હદ્યમાં દુઃખી અને ગભરાટની લાગણી સાથે શિરડીની પ્રજા મસ્ઝિદ તરફ દોડવા લાગી. મહારાજનું દેહાવસાન થયું છે તે જાણીને ગામ લોકો માટે આ પ્રસંગ અતી દુઃખ બની ગયો. તેઓ બોત્યા, ‘હે પ્રભુ ! આ કેવો દારુણ પ્રસંગ ! હદ્ય ફાટી જય છે.’ જેણે સાંભળ્યું તેણે મસ્ઝિદ તરફ દોટ મૂકી. મસ્ઝિદનો સભામંડળ ખીચોખીય ભરાઈ ગયો. ત્યાંનું એ કરુણ વાતાવરણ જેઠિને હદ્ય ફાટવા માંડચું અને દુઃખ સહન ન થતાં લોકો પોકે પોકે રડવા લાગ્યા. ગયો એ શિરડીનો વૈભવ પતી ગયો. બધી જતનાં સુખ અને સૌભાગ્ય છીનવાઈ ગયાં. દરેકની આંખો રડી ઊઠી અને દરેક માણસ ધીરજ ખોટ બેઠો. જેણી સાત પુણ્યોમાં ગણાત્મી થાય છે, અને જેણે બાબા પોતે દ્વારકામાઈ એવું હંમેશા નિશ્ચયથી કહેતા હતા, તે મસ્ઝિદનું હવે શું મહત્વ ! તે સાત મુક્તિ ધામો અયોધ્યા, મયુરા, માયા, કાશી, કાંચી, અવન્તિકા। પુરી, દ્વારાવતી ચૈવ સમૈતા મોકાદાયિકા ॥ છે. નિર્માણ કહો કે, નિર્વાણ કહો કે, નિધન કહો દ્વારકા એ સાયુજ્ય મુક્તિનું સ્થાન છે. ચાર પ્રકારની મુક્તિઓમાંની એક સાયુજ્ય મુક્તિ છે. જેમાં ઈશ્વર અને પ્રાણ એક થઈ જય છે. આ સ્થાનમાં તેને પ્રવેશ મળે છે. જે ઈશ્વરના સતત અનુસંધાનમાં છે. (ઓ. ૮૨-૮૨)

ગુરુરાજ સાઈરાયતો ભક્તોના રક્ષણકર્તા માબાપ અને તેમના ભક્તો માટે વિશ્રાંતિનું સ્થળ છે તેની સતત યાદ આવ્યા કરે છે. બાબા વગરની શિરડી ઉજ્જવલ થઈ ગઈ. દિશાઓ ઉદાસ અને શૂન્ય થઈ ગઈ. પ્રાણ નીકળી ગયા બાદ જે દેહની સ્થિતિ થાય છે તેવી જ સ્થિતિમાં આખું શિરડી ગામ મૂકાઈ ગયું. તળાવમાંથી પાણી સૂકાઈ જતાં જેમ જળચાનાં સરોવર, પુત્ર વિયોગવાળું ધર, અને દીવાની જ્યોત વિનાનું મંહિર શોભતાં નથી તેમ આ મસ્ઝિદમાં શૂન્યાવકાશ થઈ ગયો. જેમ એક કર્તાઈર્તા પુરુષ સિવાયનું ધર, રાજ વીનાની રાજધાની, અને દ્રવ્યહીન ખજનો નકામા છે તેમ બાબા વીના શિરડી જાણો કે વેરાન થઈ ગઈ. કુમળા બાળકને જેવી રીતે મા, અને ચાતકને મેઘની પહેલી બુંદનો પ્રેમ હોય છે એવો જ પ્રેમ શિરડીવાસી ભક્તોને બાબા માટે હતો. શિરડી મૃતપ્રાણ થઈ ગઈ. પાણી વીનાની માછલી તેમ તરફડે તેમ શિરડીની પ્રજા અંતર મનથી તરફડવા લાગી. જેવી રીતે પત્ની તેના પત્તિ તરફથી તરછોડાઈ જય છે, એક દૂધ પીતા બાળકને મા ત્યજી દે છે તેમ ખોવાઈ ગયેલી ગાયના વાઇરાની જેમ શિરડીના લોકોની સ્થિતિ થઈ ગઈ. આખું ગામ અને ગલીએ ગલી અસ્ત વ્યસ્ત થઈ ગઈ અને ગામ શોકગ્રસ્ત હાલતમાં દૂબી ગયું. સાઈમહારાજને લીધે જ આ શિરડી એક પવિત્ર યાત્રાનું ધામ બની ગયું. શ્રીસાઈનાથ દરેકને માટે એક છત્ર જેવા હતા. કોઈ મોટે મોટેથી રડવા લાગ્યા, કોઈ આંકંદથી ઓળટવા લાગ્યા, અને અમુક લોકોથી આ દુઃખ સહન ન થતાં, તેઓ બેબાન થઈને પડી ગયા. લોકો ખૂબ જ દુઃખી થયા હતા. શિરડીના નરનારીઓના દુઃખોનો કોઈ પાર ન હતો અને અન્નજણ છોડીને તેઓ એક દ્વામણી હાલતમાં મૂકાઈ ગયા. સાઈબાબાની આવી વિદાય ગામના લોકો માટે દુઃખી પરાકાશ થઈ હતી અને આબાલવૃદ્ધ ભક્તોના મનમાં

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અશાંતિ થઈ ગઈ હતી. જ્યાં એક વખતે રસપૂર્ણ ઉપદેશ સાંભળવા મળતો હતો અને જ્યાં રોજ અનેક પ્રકારના આનંદના અનુભવો થતા હતા. વળી જ્યાં મન ફાવે ત્યારે જઈ શકાતું તે મસ્ઝિદ હવે ઉજાજ થયેલી ભાસતી હતી. જે શિરડીમાં દરરોજ મંગળકારી દોડા દોડી રહેતી હતી તેનું મૂળ કારણ તો બાબા જ હતા. માટે તેમની આમ અચાનક વિદ્યાયથી ગામ લોકોના મનમાં તેનો અફાટ પસ્તાવો હતો અને મનમાં ખરખરો હતો. (ઓ. ૮૩-૧૦૬)

હે આનંદના મૂળ એવા મૂર્તિમંત આનંદ સ્વરૂપ સાઈનાથ ! આપે ભક્તોના કાર્ય કરવા માટે જ આ દેહ ધારણ કર્યો હતો, અને તેનો હેતુ સિદ્ધ થઈ જતાં આ શિરડી નગરીમાં તમે દેહ છોડ્યો અને વિદેહી થઈ ગયા. મનથી બુદ્ધિભંશ થયેલા એવા અમને બધાને આપ આઠ પ્રહર અને રાત દિવસ આગસ વીના ઉપદેશ કરતા રહ્યા. પણ જેવી રીતે એક ઊંધા મૂકેલા ઘડા ઉપર પાણી, તેવી જ રીતે અમારી ઉપર કરેલો આપનો ઉપદેશ ઉપર ઉપરથી વહી ગયો અને એક ટીપું પણ મનમાં ગયું નથી. ‘તમે કોઈને પણ માંકું લાગે તેવું વાંકું બોલશો તો તેનું દુઃખ તરત મને થશો.’ આ તમારું હર હંમેશા કહેવું હતું. પરંતુ તેને અમે માન્યું નહિ. અમે આવા તમારા કેટલા અપરાધી છીએ કે જેમણે તમારા આ કલ્યાણકારક શબ્દો ધ્યાનમાં લીધા નહિ. એ આજા ભંગનું પ્રાયશ્રિત આપે અમારી પાસે આવી રીતે પૂર્ણ કરાવ્યું ? બાબા ! તે બધાં પાપોનો ઘડો ભરાયો છે કે શું ? તો હવે તેનો પશ્ચાતાપ કરીને શોફાયદો ? જે ભોગવાનાનું છે તે હવે ભોગવે જ છૂટકો છે. શું તેને કારણે અમારાથી કંટાળીને આપે અમારાથી પહ્દો કરી લીધો ? કાળે અમારી ઉપર એવો હલ્લો બોલાવ્યો કે કપાળ ફૂટીને જેરથી બોલતાં બોલતાં તમારું ગળું સુકાઈ ગયું. અને અમારી આ બેપરવાહી જેઠાને એવું લાગે છે કે તમારા મનમાં અમારે માટેનો તિરસ્કાર પેદા થયો. જેને કારણે આપે અમારાથી રિસાઈને પહેલાનો બધો જ પ્રેમ ભૂલાવી હીધો અને ઝણાનુભંધ પૂર્ણ કરીને એકાએક તમારા પ્રેમનો ઉભરો ઓસરાવી હીધો ? આપ આમ સહેજવારમાં અમને છોડીને જતા રહેવાના છો તેની જે અમને વહેલી જાણ થઈ હોત તો ખૂબ જ સારું થયું હોત. અમે લોકો થોડા સાવધ તો થઈ ગયા હોત. અમે તો બધા સુસ્તીમાં રહ્યા અને ઉંઘતા ઝડપાયા અને અંતે આવા ફસાયા. અમારું હોવું ન હોવું બધું સરખું જ છે. અમે ગુરુદોહી સાબિત થયા. ખરા સમયે અમે કંઈ જ કરી શક્યા નહિ. આપની પાસે સ્વસ્થપણે બેસવું જેઠતું હતું તે પણ અમારાથી બની શક્યું નહીં. દૂર દૂરથી શિરડી આવેલા તો ગાપ્યાં હાંકતા જ બેસી રહ્યા. અમે એક તીર્થધામમાં આવ્યા છીએ તે પણ સંદર્ભ ભૂતી ગયા, અને ત્યાં પણ મનમાં ફાવે તેવું જ વર્ત્યા. (ઓ. ૧૦૭-૧૧૬)

જાની, વિદ્ધાન પંડિતો, અભિમાનીઓ, સીધાસાહા અને બોળા ભાવિકો અને સંશયખોર એવા અનેક પ્રકારના ભક્તો હતા. પણ સાઈભહારજાન તેમને બધાને એક ઝૂપે જેતા હતા અને માનતા હતા. ભેદભાવ અને ઓછા વત્તાની વૃત્તિ તેમનામાં ન હતી. જગતમાં જેને ઈશ્વર સિવાય અન્ય કોઈ પદાર્થ જ દેખાતો નથી. તેમની જેવાની દાખિ આ પ્રકારની હોવાને કારણે તેઓ પોતાને પણ જુદા સમજતા ન હતા. ભક્ત તે પણ ઈશ્વર છે અને ગુરુ પણ ઈશ્વરથી અળગો નથી. પરંતુ ભક્ત અને ગુરુ આ બંનેને પોતપોતાના સ્વરૂપનું ભાન ભૂલાતાં એક બીજામાં બેદ ઉત્પન્ન થાય છે. મૂળમાં તો આપણે પણ ઈશ્વરનો જ અંશ છીએ. પરંતુ પરમાર્થની ઝપેખાનાનું વિસ્મરણ થયું તે જ આ જેદભાવનાં લક્ષણો છે. અને અધિકતાની પણ તેને જ કહેવાય. એક સાર્વભૌમ રાજને પોતે બિક્ષા માંગવા માટે ઘેરઘેર રજગતો હોય એવું સ્વભાવ આવે છે પરંતુ જગત થતાં પોતાને પોતાના મૂળ રાજના દરજામાં અને અવસ્થામાં જુએ છે. જગત અવસ્થામાં જે એકાદ કામમાં પ્રવૃત્ત હોય છે તે સ્વભાવીલ દશામાં નિવૃત્ત થઈ રોકાઈ જય છે. પોતાના અનુભવોથી મળેલી ખરી જગૃતિ એટલે જ પૂર્ણ અદ્વૈતમાં લીન થવું એવું થાય. જાની અને આજાની આમ બંને પ્રકારના આશ્રિતો ઉપર બાબાનો અત્યંત પ્રેમ હતો. તેમને એ બધા પોતાના જીવ કરતાં પણ વધારે વહાલા હતા, ત્યાં કિંચિત પણ ભેદભાવ ન હતો. તેઓ સાક્ષાત્ મનુષ્યરૂપે હેઠ જ હતા. આવી જે પ્રતીતિ હતી તો પછી તેમના લાડ કરનારા બધા ભક્તોનો નાશ કેમ થયો ? કોઈને ધન સંપત્તિ આપી તો

## શ્રી સાઈનું સત્ય ચિત્ર

વળી કોઈને સંસાર સુખ અને સંતતિ આપી. જેને કારણે તેઓ મોહમાં પડ્યા અને ખરી જ્ઞાન પ્રાપ્તિથી વંચિત રહ્યા. બાબા ક્યારેક કોઈની સાથે હસીમન્જક અને આનંદ કરતા. તો એવા માણસોમાં અભિમાન ઊભરાઈ જતું કે બાબાનો આપણી ઉપર અલોકિક પ્રેમ છે. એવો પ્રેમ તેઓ બીજાની ઉપર બતાવતા ન હતા. તેવી જ રીતે જે બાબા ગુસ્સે થઈને બે શાખાઓ કહેતા તો લોકો બોલતા કે, ‘એ તો એમનો માનીતો નથી. અમારા પ્રત્યે એમને ધણો જ આદર છે. બીજાને તે માન નથી આપતા.’ આવી જ રીતે પોતાની જાતને શાંત્વના આપતા. બાબાને આવી વાતોનો સ્વન્નમાંય ખ્યાલ ન રહેતો. અમે જ વગર કારણે અમારા જ કલ્યાણના માર્ગને માટે બેધ્યાન કર્યું અને ખરું કર્તવ્ય તો ભૂલી ગયા. સહનસીબે પરબ્રહ્મની આવી સગુણ મૂર્તિ ઉશીકા પાસે હોવાં છતાં ખરા કામને ભૂલી જઈને, હંઘમશકરી તરફ વધારે ધ્યાન આપું અને મોજ માણી. શિરદીમાં પહોંચતા જ બાબાશ્રીના દર્શન કરવાં, ફળકૂલ અર્પણ કરવાં, પરંતુ દક્ષિણા માંગતાં જ ત્યાં જ પાછળ હટવું અને ત્યાંથી સરકી જવું એવી ભર્યાદાવૃત્તિ હતી. (ઓ. ૧૨૦-૧૩૩)

જ્યારે આપ અમારા હિત માટે ઉપદેશની આવી વાતો કહેતા હતા ત્યારે અમારી નિજદાસ્તિ જોઈને ખરેખર બાબા તમે દુઃખી થયા અને સ્વર્ગે સિધાવ્યા છે કે શું ? હવે આપની એ નિજનંદમાં મન્ન થયેલી સ્થિતિ ફરીથી અમારી આંખોની સામે આવરો ખરી ? તે આનંદમય મૂર્તિ ગઈ, ખોવાઈ ગઈ. હવે તે જન્મોજન્મ સુધી જેવા મળવાની નથી, અરે.... અરે ! અમારું આ અધોર કર્મ તો જુઓ ! હથમાં આવેલા અમારા ‘સાઈ સખાને’ અમે ગુમાવ્યો છે. કોઈ પણ પ્રકારના કારણ વીના વહેનારા જરણાને માટે અમે આજે પારક થઈ ગયા. ‘કોઈને ત્રાસ આપવો કે છેતરવો એ સાચું નથી, તેને કારણે મને દુઃખ પહોંચે છે.’ એવું આ બાબાનું વારંવાર કહેવું હતું. અમે તે ધ્યાનમાં લીધું નહિ અને અનેક જગડા ઊભા કર્યા. ભક્તોને અને અભક્તોને ત્રાસ આપતાં આપતાં અમે સાઈનાથને ગુમાવી બેઠા. એનો આજે ભયંકર પદ્માતાય થાય છે અને તેમની ઉપદેશ વાણી યાદ આવે છે. ‘આઠ વર્ષનો બાળક થઈને આ જગતમાં હું ફરી પાછો પ્રગટ થઈશ.’ એવું મહારાજે ભક્તોને કહ્યું હતું. મૂળ પોથીના બોધમાં જેનો પાન નંબર બે ઉપર સ્વ. કાકાસાહેબ દીક્ષિતે કહ્યું છે કે, ‘આ લેખકની સામે મહારાજે પોતે આવા ઉદ્ગાર કાઢ્યા હતા કે, હવે જે આપણે જઈએ છીએ તે હવે આઠ વર્ષે પાછા મળીશું.’ અહીંથા વાંચકોએ, ‘આઠ વર્ષનો થઈને’ આ શબ્દ ઉપર વ્યવસ્થિત ધ્યાન આપવું. આનો અર્થ, ‘આઠ વર્ષના બાળક ઇઝે પ્રગટ થઈને’ એવો સ્પષ્ટ થાય છે. આ સંતના શાખાઓ છે, કોઈએ પણ તેને કારણ વીનાના વ્યર્થ માનવા નહિ. કૃષ્ણ અવતારમાં વિષણુ ભગવાને પણ આવી જ લીલા કરી હતી. હેવકી માતાની સામે કારણૂહમાં આઠ વર્ષની વધે સુંદર તેજસ્વી રૂપ, અને કાંતી ધરાવનારી ચાર હાથો વાળી શાંકો ધારણ કરેલી કૃષ્ણની મૂર્તિ પ્રગટ થઈ હતી. તે પાછળનું કારણ એ હતું કે પૃથ્વી ઉપરનો પાપનો ભાર ઓછો કરવો, પછી ત્યાં દીન દુઃખી અને ભક્તોનો ઉદ્ધાર કરવો તે તેમનો ધ્યેય હતો. તો પછી આપણે મનમાં શાંકા શા માટે કરવી જોઈએ ? સંતોના કૌશલ્યની આપણે કલ્યાણ પણ કરી શકતા નથી. આ કોઈ એક જન્મનો સંબંધ નથી. પણ છેલ્લી બોસેર પેઢીઓનો અણાનુંબંધ અને સંબંધ છે. આવું બાબાએ ભક્તોને એકવાર વાતવાતમાં કહ્યું હતું. પ્રેમનો આવો બંધ લગાવીને મહારાજ પ્રવાસ ઉપર ગયા છે એવું સમજ લઈને તેઓ ફરી પાછા આવવાના છે. એવો ભક્તોના મનમાં સંપૂર્ણ વિશ્વાસ છે. કેટલાકને તેમણે પ્રત્યક્ષ દર્શન આપ્યાં છે. પુષ્કળ લોકોને સ્વન્નમાં અનુભવદ્ધી દિશાંત આપ્યાં છે અને આજે પણ અનેકોને ગુપ્તપણે ચમત્કાર બતાવી રહ્યા છે. શ્રદ્ધા વીનાના માટે તેઓ ગુપ્ત છે, પરંતુ બાવિકો માટે તેઓ પોતાના સ્થાને જ જણાય છે. જેથી જેમના મનની ભાવના તેવા જ અનુભવ પ્રાપ્ત થાય છે. શ્રી સાઈબાબા ચાવડીમાં ગુપ્ત રૂપે, મસ્નિજદ દ્વારકામાઈમાં બ્રહ્મ રૂપે, સમાધિ મંદિરમાં સમાધિસ્થ અવસ્થામાં અને સર્વત્ર સુખરૂપે અનુભવાય છે. માટે ભક્તોએ હવે પોતાના મનમાં એક વિશ્વાસ રાખવો કે સાઈસર્થને આ જગતમાં રહેવા માટે કોઈ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પણ ચીજવસ્તુ અહચણદ્ધ નથી. તેમનું અહીયા રહેવું અખંડ અને અક્ષય છે. દેવ હંમેશા પોતાના નિજધામે જય છે. પરંતુ સંતોને તો અહીયા જ બ્રહ્મત્વ પ્રાપ્ત થયેલું હોય છે. તેમને જવું કે આવવું પડતું જ નથી. તેનો અહીયા જ આનંદ સ્વરૂપમાં એકદ્વિતીય થઈ જતા હોય છે. માટે જ નાના મોટા સૌને નમૃતાપૂર્વક નમસ્કાર કરીને હવે વિનંતી કરું છું કે તમે ઉત્સુક થઈને સાંભળો, ‘જેમની ઉત્તમ કીર્તિ છે, એવી વ્યક્તિની સંગત કરો, ગુરુચરણોમાં નિષ્કામ પ્રીતિ જોડો, તેમજ ગુરુના ગુણોનું વર્ણન કરવા માટે આસક્તિ અને નિર્મળ ભક્તિ ઉત્પન્ન થવા દો. ગુરુચરણોમાં કદી પણ ન તૂટનારી ભક્તિ વધારે દદ થાઓ, સ્નેહનો સંબંધ ધૂઠો ન થાય અને ભક્ત રાતદિવસ સુખ સંપન્ત રહે.’ (ઓ. ૧૩૪-૧૫૨)

પછી શ્રી સાઈનાથ મહારાજના પાર્થિવ દેહની અંત્યેષ્ટિ કેવી રીતે કરવી તે વિષેનો વિચાર તેમના શિષ્યો અને ગામના લોકો કરવા લાગ્યા. શ્રીમંતુ બાપુસાહેબ બુદ્ધી મોટા ભક્ત હતા. ભવિષ્યના સ્મારક તરીકે સમજુને જણે કે ગંજવર સુખકારક વાડો તો તેમણે કાયમનો જ બંધાવી દીધો. ત્યાર બાદ આખરે તે શરીરને કયાં રાખવું જોઈએ તે વિષય ઉપર છત્તીસ કલાક વિચાર વિમર્શ થયો અને જે થવાનું હતું તે જ આખરે થયું. એકે કહ્યું કે, આ મૃતદેહનો હવે હિન્દુઓનો સ્પર્શ પણ થયો જોઈએ નહિ અને વિધિપૂર્વક મુસલમાનોના કથસ્તાનમાં લઈ જઈએ. બીજાન્યોએ અભિપ્રાય આપ્યો કે તે મૃતદેહને ખુલ્લી જગ્યા ઉપર લઈ જઈને રાખો. ત્યાં તેમની એક સુંદર કષ્ટર બનાવી તેમાં તેમનું દફન કરવું. ખુશાલચંદ મારવાડી અને અમીર શક્કર એમના પણ આવા જ વિચારો હતા. પરંતુ ‘આ શરીર વાડામાં જ રહે’ એવા બાબાના ઉદ્ગાર હતા. રામચંદ્ર પાટીલ કે જેમને બાબાએ મૃતપાય બીમારીમાંથી બચાવ્યા હતા, અને જેમના સ્વર્ણમાં આવીને તાત્યા પાટીલના દેહાંતનો દિવસ અને સમય બતાવીને પોતાના નિર્વાણની સૂચના આપી દીધી હતી તે મોટા કદાવર, અહગ અને નિશ્ચયપૂર્વક કામ કરનારા અને કાર્યક્ષમ હતા. તેઓ ગ્રામઅધિકારી અને બાબાશ્રીના પ્રેમાળ સેવક પણ હતા. તેમણે ગામવાસીઓને કહ્યું, તમારા વિચારો ગમે તે હોય પરંતુ અમને તે જરા પણ માન્ય નથી. બાબાને વાડાની બહાર કે બીજી કોઈ પણ જગ્યા ઉપર એક ક્ષણભર પણ હું રાખવા માટે રાજ નથી. હિન્દુઓ પોતાના ધર્મના અનુસાર અને મુસલમાનો તેમની રીતે વિચાર કરવા લાગ્યા. આ માટેની યોગ્યતા અને અયોગ્યતાની ચર્ચા રાતભર ચાલી. અહીયા લક્ષ્મણમાભામા પોતાના ધરમાં ભરનિદ્રામાં હતા. સમય સવારના મળસ્કાનો હતો, એવા સમયે બાબાએ તેમનો હાથ પકડીને ઉઠાડ્યા અને બોલ્યા, ‘ઉઠ, ચાલ જઈદી કર, આજે બાપુસાહેબ જોગ આવવાના નથી. હું મરી પરવાર્યો છું એવું એ સમજ રહ્યો છે. પૂજન સાથે તું મારી કાકડ આરતી ઉતાર.’ આ સાંભળીને લક્ષ્મણમાભામા સમયસર દરરોજના નિયમ પ્રમાણે પૂજની સામગ્રી લઈને મસ્તિષ્કદમાં આવ્યા અને પૂજન કરવા માટે તૈયાર થયા. તેઓ શિરડી ગામના જ્યોતિષી હતા. માધવરાવના-શામાના તેઓ સગા મામા હતા. દરરોજ પ્રાતઃકાળે તેઓ બાબાની પૂજન કરતા હતા. મામા એક મહાન ડાઢીચુસ્ત બ્રાહ્મણ હતા. વહેલી સવારે સ્નાન કરી, ઘોયેલાં સ્વરસ્છ વસ્ત્રો પહેરી તેઓ બાબાશ્રીના દર્શને આવતા. બાબાનાં ચરણો ઘોઈ ચંદ્રન અને ચોખા ચદાવીને તેઓ પુષ્પ અને તુલસી અર્પણ કરતા. તેમજ ધૂપ, દીપ અને આરતી તથા નૈવેદ્ય કરતા હતા. પ્રાર્થનાપૂર્વક દંડવત્ત પ્રણામ કરીને બાબાના આશીર્વાદ લઈને તે સૌને અષ્ટગંધનો ચાંલ્યો કરતા અને બાબાને ધરાવેલા નૈવેદ્યનો પ્રસાદ સર્વને વહેંચીને તેઓ પોતાના નિત્યક્રમ માટે જતા. ત્યાંથી ગણપતિ, શનીદેવ, શંકર અને મારુતીનું પૂજન કરતા. આમ બધા ગામના દેવોની આ જેષીજ પૂજન કરતા હતા. માટે બાબાશ્રીના મૃતદેહની પણ તેમણે પ્રેમ અને ભક્તિબાવ સહિત પૂજન વિધિ કરી. મામા આમ તો પહેલેથી જ નિષ્ઠાવાન હતા. તેમાં પાછો સ્વર્ણના આદેશનો સાક્ષાત અનુભવ થયો હતો માટે પહેલાં મુખ ઉપરથી ઓદાહેલું વસ્ત્ર દૂર કર્યું. તે પછી ચરણ સેવા કરી. ત્યારબાદ હાથ પગ ઘોઈને શુદ્ધ જગ્યાનું આચમન લઈને યથાવિધિ

---

### શ્રી સાઈનું સત્ય ચરિત્ર

---

પૂજન કર્યું. બાબાને સાષાંગ પ્રણામ કર્યા અને હાથમાં કાકડ આરતી લઈને તેઓ મૃતદેહ પાસે આવ્યા. મૌલવી વગેરે મુસलમાન ધર્મના સૂફી સંતોષે સ્પર્શ કર્યાનો વિરોધ દર્શાવ્યો. પરંતુ મામાએ તે કોઈનું જરાપણ સાંભળ્યું નહીં. બાબાશ્રીને ગંધ લગાડી પૂજન પણ પૂર્ણ કરી. મૃતદેહ હતો પણ એ સાઈસમર્થનો હતો, પોતાના આરાધ્ય દેવનો હતો. બાબા હિંદુ હતા કે મુસલમાન એ તો મામા સ્વર્ખમાં પણ વિચારતા ન હતા. તે પૂજય શરીરમાં જ્યારે પ્રાણ હતો, ત્યારે તેમની પૂજનો કેટલો મોટો સમારંભ થતો ! એ જ હવે મૃતઅવસ્થામાં છે ? તો પૂજનો વૈભવ ફક્ત ઔપચારિક ન હોવો જોઈએ. તેમાં બાબાશ્રીની આ સ્થિતિ જોઈને મામા પહેલેથી જ ખૂબ દુઃખી જિન્ન થયેલા હતા. ફરી દર્શન દુલ્લભ થશે, માટે છેલ્લું પૂજન કરવા માટે તેઓ આવ્યા હતા. આંખમાં આંસુ સમાતાં ન હતાં અને તેમનું મન ઝુસકાં ભરતું હતું. મામાથી બાબાની આ અવસ્થા જોઈ શકાઈ નહીં. રડતાં રડતાં તેમના હાથ પગ કાંપવા લાગ્યા અને મન બીલકુલ ઉદાસ થઈ ગયું. નિરાશામાં ખૂબ જ દુઃખી હવે તેમણે વાળેલી મુઠીઓ ઉધારીને તેમાં પાનનું બીડું અને દક્ષિણા મૂકીને મૃતદેહ ઉપરનું વસ્ત્ર ઓઢાડીને મામા ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ બપોરની આરતી બાપુસાહેબ જોગે બીજાઓની સાથે રોજના નિયમ પ્રમાણે કરી. (ઓ. ૧૫૩-૧૭૮)

હવે પછીનું વૃત્તાંત આગળના અધ્યાયમાં કહેવામાં આવશે. કેવી રીતે બાબાશ્રીના દેહ ઉપર અતિ ઉત્કૃષ્ટ જગ્યા ઉપર હિંદુ ધર્મ અનુસાર મૃતદેહના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી. કેવી રીતે બાબા સાઈની ખૂબ મનપસંદ અને અનેક વર્ષોના સહવાસવાળી ઠેટ તૂટી અને તેમના કાર્યના અંતની અશુભ ઘડીની સુચના તેમને મળી. હમણાં જે પ્રસંગ આવ્યો છે તે જે બત્તીસ વર્ષ પહેલાં બાબાએ જ્યારે બ્રહ્માંડમાં પોતાના પ્રાણ ચઢાવેલા તે વખતે શરીર પર આવ્યો હોત તો કેટલી કઠીન સમસ્યા પ્રાપ્ત થઈ હોત અને તે સમયે સાઈનાથ મહારાજને ભક્ત મહાળસાપત્રિએ રાત અને દિવસ કેવી રીતે સંભાળીને રાખ્યા હતા, તેમજ સૌ એ આશા છોડી હેતાં બાબા ફરી થી કેવી રીતે બેઠા થયા હતા. તે બધું સવિસ્તાર વર્ણન કરવામાં આવશે. (ઓ. ૧૮૦-૧૮૩)

આવા યોગાચાર્ય નેમણે આમરણ બ્રહ્મચર્યનું પાલન કર્યું અને જે જ્ઞાનીઓમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાની છે તેના ઐશ્વર્યનાં તો શું વખાણ કરવાં ? જેમની પ્રસિદ્ધી મહાન છે તેમને સદ્ગુરૂએ નમસ્કાર કરીએ. આ ગરીબ હેમાડ તેમને અનન્યપણે શરણે આવેલો છે. (ઓ. ૧૮૪-૧૮૫)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલા ભક્ત હેમાડપંત રચિત.

શ્રી સાઈસમર્થના સત્ય ચરિત્રનો ‘શ્રી સાઈનાથ નિર્વાણમ् - ૨’ નામનો તેતાતીસમો અધ્યાય

અહીં સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણા.



## અધ્યાય ૪ ઉનું અર્થ વિવરણ

આ અધ્યાયમાં બાબાના નિર્વાણનું વર્ણન વાંચીને મનુષ્યને પોતાની ઉત્તમ ગતિ પ્રાપ્ત કરવા માટે મૃત્યુ સમયે શું શું કરવું જોઈએ તે બાબતમાં જાણે કે બાબાએ તેનો ઉકિલ બતાવ્યો છે એમ લાગે છે -

(૧) મૃત્યુ પાસે આવી રહ્યું છે, એવો ભાસ થતાં રામાયાણ ભાગવત જેવા ગ્રંથો કે પોથીઓનું વાંચન કરાવવું અને ધ્યાનપૂર્વક સાંભળવું જેથી મનુષ્યોનું ધ્યાન સંસારથી દૂર થઈને ઈશ્વર તરફ વળે અને પરમાર્થ અને મોક્ષના વિચારો મનમાં ઉત્પત્ત થાય. ‘અંતે મતિ: સા ગતિ.’

(૨) મરણના દિવસો પાસે આવી રહ્યા છે, એ જાણ્યા બાદ, પ્રેમબંધનનો મોહ આડો આવશે માટે નજીકનાં અને પોતાનાં અંગત સગાંસંબંધીઓને દૂર કરી દેવાં અને પાસે હોથ છતાં તેમની સાથે બોલવાનું ટાળવું. કારણ કે ભાવનાઓના આવેગ ઉદ્ભબતા વાસનાઓમાં વધારો થઈ નવા સંસાર સાથે જડાઈ જવાનો ફરી પાછો સંભવ રહે છે.

(૩) મરણ પહેલાં યોગ્ય વ્યક્તિ કે સંસ્થાને દ્રવ્ય કે ઘાન્યનું અંતિમ દાન કરવું.

(૪) આમ અંત સમયે મન ઈશ્વરમય કરી, કે ગુરુમાં એકાગ્ર કરીને શાંત ચિત્તે પ્રાણ છોડવો.

તેવી જ રીતે નિર્વાણના બીજે દિવસે વહેલી સવારે દાસગણુ મહારાજને પંદરપુર મુકામે અને લક્ષ્મણમામાને શિરડીક્ષેત્રે સ્વખનમાં આવીને અમુક સુચનાઓ આપી તેનું વર્ણન આવેલું છે. તે ઉપરથી બાબાએ એ જ સિદ્ધ કર્યું છે કે, પોતે દેહ ત્યાગ કર્યા પછી પણ આ જગતમાંથી વિદ્યાય લીધી નથી. પ્રિસ્ટી ધર્મમાં ઠસુ પ્રિસ્ટને શુક્વારે (Good Friday) વધસ્તંભ પર લટકાવ્યા બાદ ત્રીજ દિવસે રવિવારે (Easter Sunday) એમનું ઉત્થાન (Resurrection) થયું હતું એવું માનવામાં આવે છે. પણ સાઈબાબા તો આ જગતમાંથી વિદ્યા જ નથી અને આજરોજ પણ હજરાહજૂર છે. આજે લગભગ ૮૮ વર્ષ વિત્યા બાદ પણ અનેક ભક્તોને તેઓ દર્શન આપી રહ્યા છે. તેનું એક મહત્વનું પ્રમાણ એટલે ગુજરાતના સંત પૂ. શ્રીમોટા જેમણે ઠ.સ. ૧૮૭૬ની સાલમાં દેહત્યાગ કર્યો, તેમનો અનુભવ હું કહી રહ્યો છું. પૂ. મોટા એમના આત્મચરિત્રમાં લખે છે કે, ઠ.સ. ૧૮૮૮ની સાલમાં એટલે કે સાઈમહારાજની મહાસમાવિનાં લગભગ ૨૦ વર્ષ પછી પાકિસ્તાનના કરાંચી મુકામે બાબાશ્રીએ તેમની સામે વારંવાર પ્રગટ થઈને તેમને જીવનમુક્ત થવાની યોગીકઢિયાઓ શિખવાડી હતી.

પૂ. મોટાને તે સમયે જીવંત હતા એવા અનેક સંતોષે માર્ગદર્શન આપ્યું હતું. પણ તેમનું કહેવું હતું કે, ‘શ્રી સાઈબાબાએ જ મારી સાધનાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. (Shri Sai Baba gave final touches to my spiritual progress). આવું સાંભળીને સાઈબાબાના પોતાનાં નીચે આપેલાં વચ્ચનો સાચાં સાબિત કર્યા છે.’

જઉં હું જેકે છોડી પ્રાણ । હું કહું છું તે માનો પ્રણામ ।

દેહ ત્યાગા પછી ભવિષ્યમાં પણ હાડ મમ બોલશે સમાધિમાંથી ॥૧૦૫॥

હું શું પણ મહારી સમાધિ । બોલતી રહેશે તમારી સાથ ।

રહેશે ડોલતી તેની સાથ । અનન્ય શરણાગતની ॥૧૦૬॥

દશ્ટ દૂર થઈશ એ ચિંતા । મહારે માટે ના રાખતા ।

મહારા હાડ સાંભળશો બોલતાં । તમારી સાથ હિતરહસ્ય કહેતાં ॥૧૦૭॥ અધ્યાય - ૨૫

નિત્ય હું જીવંત જાણ એ જ સત્ય । નિત્ય લ્યો એની પ્રતીતિ અનુભવો ॥૫॥

- શ્રી સદગુરુ સાઈબાબાનાં વચ્ચનો

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

બીજુ કહેવાની વાત એકે ઓ. ૧૫૫માં ‘ત્યાર પછી તો એ શરીર। કયાં રાખવું એ વિષય ઉપર। થથો કલાક છત્રીસ વિચાર। ને થનાર તે થઈ ગયું ॥’ એવું જે કહેવામાં આવ્યું છે એમાં ‘છત્રીસની’ આ સંખ્યા કંઈ બરાબર નથી. બાબાનું નિર્વાણ મંગળવારે ૧૫મી ઓક્ટોબરના રોજ બપોરે ૨-૩૦ના સમયે થયું. તે પછી છત્રીસ કલાક તેની ઉપર ચર્ચા વિમર્શ થયો એટલે, આમ જેવા જઈએ તો બુધવાર ૧૬ ઓક્ટોબરના રાતના લગભગ ૨-૩૦નો સમય થાય છે, અને પછી શ્રીબાબાનો દેહ વાડામાં સમાધિસ્થ ગુરુવારના દિવસે એટલે ૧૭મી ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યો હોવો જેઠાએ. પરંતુ જાણીતા ભક્તોનાં નિવેદનો ઉપરથી બાબાના નશ્વરદેહને શિરડીમાં પાલખી સરઘસમાં ફેરવીને બુધવારે ૧૬ ઓક્ટોબરની સાંજે બુદ્ધીના વાડામાં સમાધિસ્થ કરવામાં આવ્યો, એવું ખાત્રીપૂર્વક જાણવા મળે છે. ત્યારે આ ચર્ચા ચોવીસ કલાક કરતાં વધારે, એટલે કે બુધવારે ૧૬ ઓક્ટોબરના રોજ અઢી વાગ્યા કરતાં વધારે ચાલેલી લાગતી નથી. માટે આ જગ્યા ઉપર ‘છત્રીસ’ આ શબ્દનો અર્થ જેવો ને તેવો ન લેતાં તેને એક અતિશયોક્તિ અલંકાર સમજુને એમાં ‘ખાસા કલાકો’ એવો વ્યવહારિક અર્થ લેવો જેઠાએ એવું મને લાગે છે. પહેલાં અધ્યાય ૧૧માં ચાર વખતના હજાર ચાલીસ | આપણે ડ્રિપિયા કે એને પૂછી ॥૮૭॥ માંગો તો દઉં ચાલીસ લાખ ચાલીસ હજારનો હિસાબ શો ॥૮૮॥ અને અધ્યાય ૮માં બાર બાર કોઈ માંગતા | જઈ ગામલોકેને ત્યાં ॥૮૯॥ હેમાડપણે આ અતિશયોક્તિ અલંકારનો ઉપયોગ કર્યો છે. આ વાત બાબતે તેમજ લક્ષમણમામાને સ્વપ્ન આવ્યું તે દિવસ માટે અને બાબાનાં નિર્વાણ પ્રસંગ વિષે અને અનેક વાતો વિષે ઘણી બધી શંકાઓ ભક્તોને છે. તેમનું નિવારણ કરવા માટે અને તેમને આ વિષેની એકદમ સ્પષ્ટ અને અધિકૃત માહિતી મળે માટે શ્રીસાઈલીલાના પહેલા વર્ષના અગિયારમાં અંકમાં (પોષ શકે ૧૮૪૫) પૃષ્ઠ ૪૮-૪૯ ઉપર પ્રસિદ્ધ થેલો શ્રીમંત બાપુસાહેબ બુદ્ધીના જમાઈ શ્રી ગણેશ ગોવિંદ નરકે, એમ. એ. કલકત્તા, એમ. એસ. સી. (માનચેસ્ટર) તેમને ધી ઓનરેબલ શ્રી ગણેશ શ્રીકૃષ્ણ ખાપર્ટ, એડવોકેટ, અમરાવતીના શિરડીથી તા. ૫-૧૧-૧૯૧૮ના રોજ લખેલ પત્ર જ નીચે રજૂ કરી રહ્યો છું.

શ્રી દાદાસાહેબને,

તા. ૫-૧૧-૧૯૧૮ શિરડી

કૃ. અ. શિ. સા. ન. વિ. વિ. આપે નાગપુર ચિ. કેશવરાવને મોકલાવેલ પત્ર અહીંથા તીર્થસ્વરૂપ બાપુસાહેબને મોકલાવી આપેલ છે, અને તેના સંબંધમાં માહિતી બાપુસાહેબના કહેવાથી જ આપી છે.

સપેભ્યરના અંતમાં મારી પુના ખાતેની નોકરીની સમય મર્યાદા પુરી થતાં હું અહીંથા તા. ૨-૧૦-૧૯૧૮ના રોજ આવ્યો ત્યારે તે વખતે શ્રીસાઈ સમર્થ માંદા જ હતા. તા. ૨૮-૮-૧૯૧૮ના અરસામાં શ્રીને તાવ આવ્યો અને તે પછીના બરાબર સત્તરમાં દિવસે શ્રીએ દેહ મૂક્યો. તાવ તો બે ત્રણ દિવસ જ રહ્યો હતો. પરંતુ ત્યારબાદ પ્રાયોપવેશન કર્યા પ્રમાણે શ્રીએ અન્ન વજ્ય કર્યું હતું. તેને કારણે તેમના શરીરમાં દિવસે દિવસે શક્તિ જરાપણ રહી ન હતી. સાઈસમર્થના અમુક ઉદ્ગારો નિર્વાણ સૂચક હતા. છતાં તે કોઈના ધ્યાનમાં આવ્યા નહીં. બહાર ગામના બીજા ભક્તોમાંથી તાવ આવ્યો ત્યારે માત્ર કાકાસાહેબ એકલા જ અહીંથા હતા. પણ તેમને તરત જ કેટલાક કારણસર મુંબદી પાછા મોકલી આપ્યા. તેઓ સમર્થની તબીધતના સમાચાર સાંભળતા નિર્વાણના ત્રણ ચાર દિવસ પહેલાં જ અહીં આવ્યા. લગભગ દોઢ બે વર્ષથી નાનાસાહેબ નિમોણકર શ્રીસાઈસમર્થની સાથે જ રહીને રાતદિવસ તેમની સેવા કરતા હતા. તે વાતની તો આપને અવશ્ય માહિતી હશે જ. એ સિવાય પણ બુદ્ધી, જેગ, ભાટે, માધવરાવ વગેરે શિરડીમાં જ હતા. શ્રીસમર્થનું દિવસમાં બે વાર લેંડીબાગ પર અને ગામમાં બિક્ષાટન માટે જવું નિત્ય ક્રમ અનુસાર હતું. શ્રી સમર્થ ફેરી માટે પગપાળા જ જતા પણ બંને બાજુએથી તેમને પકડી રાખવાવાળાઓ બાપુસાહેબ બુદ્ધી અને નિમોણકરને મોટે ભાગે શ્રીને લગભગ ઉચ્કિને જ લઈ જવા પડતા. નિર્વાણના એક બે દિવસ પહેલાં ફેરી અને સવારની બિક્ષા માંગવી બંધ થઈ ગઈ હતી. શ્રી સમર્થ ‘ચિત્તા કરતા નહિ’ જેવાં વચ્ચનો કહીને ધીરજ આપતા હતા. તેમણે પોતાના પ્રયાણના સમયનો જરાપણ આણસાર કોઈને

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પામવા દીધો નહીં. શ્રી સમર્થ અખંડ સાવધાન હતા અને છેલ્લી ઘડી સુધી સાવધ હતા. તેમજ ધીરજ આપતા હતા. મંગળવારે તા. ૧૫ ઓક્ટોબર બપોરની આરતી પત્યા બાદ, બાપુસાહેબ, કક્ષાસાહેબ વગેરે ભક્તો પોતાને ઘેર જમવા માટે મોકલી આપ્યા હતા. આ બધા ભક્તો દરરોજ સાઇસમર્થની સાથે મસ્નિજદમાં બેસીને જ જમતા હતા. તે જ દિવસે આ રીતે પોતપોતાને ઘેર મોકલીને પોતે અહીં આ લોક છોડીને પ્રયાણ કર્યું તે વખતે પાસે લક્ષ્મીબાઈ, બયાળુ, ભાગોળુ, બાળા શિંપી, લક્ષ્મણમામા, નાનાસાહેબ નિમોણકર અને બીજા થોડા ભક્તો ત્યાં હાજર હતા. માધવરાવ દેશપાંડે નીચે પગથિયા ઉપર બેઠા હતા. લક્ષ્મીબાઈને ગજવામાંથી નવ ડિપિયા કાઢી આપ્યા અને થોડીવાર પછી કહેવા લાગ્યા, ‘અરે હવે મને અહીંથાં સાંનું લાગતું નથી, વાડામાં લઈ ચાલો એટલે મને સાંનું લાગશે.’ બાપુસાહેબ બુદ્ધીના પથ્થરના વાડાનો ઉલ્લેખ બાબા ‘દગડી વાડા’ આ શફુથી કરતાં હતા. આ જ છેલ્લી આજા હતી અને પાછળથી તે પ્રમાણે થયું. બયાળના શરીર ઉપર ટળી પડીને પ્રાણ છોડ્યા હતા. શ્રીસાઇસમર્થ હંમેશની માફક બેઠા જ હતા. આખી બીમારી શ્રી સાઇસમર્થે બેસીને જ કાઢી હતી. ચાવડીમાં થોડો સમય જ તેઓ શરીર લંબાવતા હતા. શ્રીનો શ્વાસ ધીમો પડવા લાગેલો. ભાગોળુનું ધ્યાન ગયું અને તેમણે નીચે બેઠેલા નાનાસાહેબ નિમોણકરને કહ્યું કે નાનાસાહેબ પાણીની જારી લઈ સમર્થને પાણી પીવડાવવા લાગ્યા. ત્યારે તે પાણી મોઢામાંથી બહાર નીકળી જવા લાગ્યું. તેની સાથે એમણે જેરથી ‘દેવા’ કહીને ચીસ પાડી. શ્રીએ માત્ર એક વખત આંખો ઝોલીને જેયું અને ધીમા અવાજમાં ‘ઓ’ કહીને હુંકાર ભર્યો અને પ્રયાણ કર્યું. મંગળવારે તા. ૧૫મી એ બપોરના અઢી વાગ્યાના અરસામાં દેહ મૂક્યો.

શ્રીના વાડામાં લઈ જવાના ઉદ્ગાર ધ્યાનમાં રાખીને બધાએ બાપુસાહેબ બુદ્ધીના વાડામાં શ્રીનો દેહ મૂકવા માટે આયોજન કર્યું અને એ પ્રમાણે મંદિરના મધ્યભાગમાં શ્રીને સમાધિ આપવા માટે ખોદકામ શરૂ કર્યું. સાંજના સમયે રાહતાથી ફેલદાર આવ્યા અને તે જ નિશ્ચય કાયમનો કર્યો કે જ્યાં ગોપાલકૃષ્ણની મૂર્તિ સ્થાપવાનું આયોજન કરવામાં આવેલું ત્યાં જ શ્રીની સમાધિ થઈ. તે વચલા ઓરડામાં ખોદકામ રાતભર ચાલુ રહ્યું હતું. બીજી દિવસે થોડાં વિધન આવ્યાં. સવારના મુંબદીથી અમીરભાઈ આવ્યા અને કોપરગાંવના મામલતદાર સાહેબ આવી પહોંચ્યા. તેમને વાજો પડ્યો. અમક લોકો શ્રીને બહાર જેતરમાં ખુલ્લી જગ્યામાં લઈ જવા માટે આગળ કરવા લાગ્યા. મામલતદારે લોકમત લીધો, ત્યારે બે ની વિરુદ્ધમાં એક મતે બુદ્ધીના વાડામાં જ શ્રીના દેહને મૂકવાની વાત જહેર થઈ. કોપરગાંવના મામલતદાર અહમદનગરના કલેક્ટરને આ પ્રકરણ સૌંપવા લાગ્યા અને તે પ્રમાણે કક્ષાસાહેબ દીક્ષિત નગર જવા રણ થયા. ત્યારે શ્રીસાઇસમર્થની પ્રેરણાથી વિરોધ કરનાર સમૂહે અનુકૂળ મત આપવાનું દેરવીને સર્વાનુમતે જ બાપુસાહેબ બુદ્ધીના દગડીવાડામાં જ સમાધિ બનાવવાનું આયોજન કાયમી ધોરણે નક્કી કર્યું. એકાદશીને દિવસે બુધવારે સાંજના સમયે શ્રીનો દેહ સરથસ આકારે ફેરવીને લાવવામાં આવ્યો. અને વાડાના મધ્યમાં મંદિરના વચલા ઓરડામાં મુકવામાં આવ્યો। તે જગ્યાની શોભા પ્રત્યક્ષ્ય જઈને જેયા વીના સમજશે નહીં. મંદિરના ગર્ભગૃહની લંબાઈ પહોળાઈ જેટલી હતી તે બધી જ ભક્તોની ભીડથી ભરાઈ ગઈ. વાડાનું કામ જ્યારે હાથમાં લેવામાં આવ્યું ત્યારે શ્રી સમર્થ આ સ્થળની શોભા આટલી બધી વધારશે એની કલ્પના પણ ન હતી. અને કલ્પના થાય પણ કેવી રીતે? શ્રીબાબા હંમેશા કહેતા હતા કે, ‘અમે તો વાડામાં જઈને જ રહેવાના! પરંતુ શ્રી હૃતાત હતા ત્યારે કોને આવો વિચાર આવે? વાડામાંની સમાધિ પાસે મનને ખૂબ આનંદ થાય છે. શિરડીમાં મનને પહેલાં જેવો જ આનંદ મળે છે. શ્રીબાપુસાહેબના ઉમદા ભાગ્યનું શું વર્ણન કરવું? પ્રત્યક્ષ દેવ ધરમાં આવીને બેઠા. મંદિર બનાવડાવ્યું એ સાઇએ સાર્થક કરી બતાવ્યું. અહીંથાં હિંદુ વિધિ પ્રમાણે પૂજન અર્થન વિધિ વિધાન ચાલ્યા જ કરે છે. કોઈ પણ અડચણ ઊભી થવાનો સંભવ નથી. વિદ્ધાન લોકોની બાળ બાબાએ સંભાળી લીધી, અને પોતાનો દેહ તેમના હવાલે કરી દીધો. નિર્વાણના ચાર પાંચ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

દિવસો પહેલા સોનીની મા ને બોલાવીને શ્રીએ કહ્યું હતું કે, ‘હવે મને મસ્નિદમાં કંટાળો આવ્યો છે, ચાવડીશી પણ કંટાળો છું, હવેથી તો હું વાડામાં જઈને બેસીસ. ત્યાં ભણ લોકો-પ્રાત્યાંશો મારી સંભાળ લેશો.’ જેગાનાં મોટાબેનને ચાર પાંચ વર્ષ પહેલા હાથ પકડીને લઈ આવીને બાબાએ તેમને આ જગ્યા બતાવવા કહ્યું હતું કે, ‘આ પથરાળ ઉકરડા જેવી, ખાડા ખબુચડાવાળી જગ્યા મારી છે. અહીંથા પથ્થરની ઠમારત બનવાની, અને હું ત્યાં જ બેસવાનો છું.’ શ્રીસાઈ સમર્થનો સંકલ્પ પહેલેથી જ નક્કી હતો, એવું લાગે છે. પરંતુ શ્રીસાઈનાથ મહારાજે કોઈ પણ વાતની જાણ કોઈને પણ થવા દીધી નહીં. તે અંતરમનની પ્રેરણા આપતા રહ્યા. ખૂબ આનંદ થયો. શ્રીબાપુસાહેબના શીર ઉપર જવાબદીમાં હવે વધારો થયો છે. મંદિરનું કામ પણ પૂર્ણ કરાવવાનું છે. શ્રીની પૂજન અર્થના કાયમી ધોરણે નક્કી કરવાની રહેશે. તેઓ હવે સમાધિ છોડીને જય એવું લાગતું નથી.

શ્રીસાઈબાબાએ નિર્વાણ બાદદેકઢેકાણે દાદાંત આપ્યાં. સવારે લક્ષ્મણ ભટને દાદાંત આપીને કહ્યું કે, ‘પેલો બાપુસાહેબ ઊંઘી રહ્યો છે, ચાલ ઉઠ, મારી કાકડ આરતી કર.’ તે પ્રમાણે લક્ષ્મણ ભટે સ્નાન કરી બુધવારે સવારે મસ્નિદમાં જઈને પાર્થિવદેહની પૂજા આરતી કરી. પંદરપૂરમાં દાસગણુને દાદાંત આપીને કહ્યું કે, ‘મસ્નિદ મારા શરીર પર ધરી પડી છે. બોરવલ્લીનાં ફૂલો મારી ઉપર પદ્ધરાવવા માટે આવ.’ તા. ૨૭-૧૦-૧૯૧૮ના રોજ બાબાના તેરમાના દિવસે મોટો ઉત્સવ થયો. જ્યાં ત્યાંથી ભક્તોની મંઠળીઓ આવી હતી. ભંડારામાં લાડુનું પ્રયોજન કર્યું હતું. ભંડારાની ફાળવણીમાં લગભગ રૂ. ૨૪૦૦/- સુધીની રકમ ભેગી થઈ હતી. બાબાના નાનાસાહેબ ચાંદોરકર જેવા અસિમ ભક્તો પણ હાજર રહ્યા હતા. રાધાકૃષ્ણબાઈ પૂજન અર્થનાનો ખર્ચ તેમાંથી નીકળતો હતો. તે કોઈ આજે પણ પહેલાની માફક કામ કરી રહી છે. કારોબારી મંઠળીએ એક પંદર માણસોની કમિટી નીભિ છે. શ્રી બાપુસાહેબ બુદ્ધી તેના અધ્યક્ષ ચૂંટાઈ આવ્યા છે અને તેઓ તેની વ્યવસ્થા કરશે. એ પ્રમાણે એની વ્યવસ્થા તા. ૨૪ ડિસેમ્બર સુધીમાં નક્કી થઈ છે. નાતાલમાં તા. ૨૪/૨૫/૨૬ ના રોજ બધાં ભક્તગણો અહીંથા ભેગા થવાના છે અને તે વખતે શ્રીની સંસ્થા અંગેના લાગુ પડતા નિયમો નક્કી કરીને સંસ્થાને એક જીવંત સ્વરૂપ આપવામાં આવશે. તે સમયે આપ જરૂરથી પદ્ધરાશો. પત્ર વિસ્તારપૂર્વક પણ ઉતાવળમાં લખેલ છે. લખવામાં કરેલી ભૂલો બદલ ક્ષમા કરશો. હું બે ત્રણ દિવસમાં નાગપુર આવીશ. વધુમાં મળીશું ત્યારે. પત્ર મળ્યે જવાબ આપવા વિનંતી.

આપનો નમ્ર

ગણપતી નરકે

તા.ક. - શ્રીનો દેહ ચોવીસ કલાકથી પણ વધુ પડી રહ્યા બાદ પણ (stiff) અક્કડાઈ ગયો ન હતો. બીજ દિવસે મોમાંથી થોડું લોહી નીકળી રહ્યું હતું. હાથ પગ જકડાયા વીના આમતેમ વ્યવસ્થિત હુલાવી શકતા હતા. કફની ફાડ્યા વગર કાઢી શકાઈ હતી. છેલ્લી કફની વાડામાં જ આપણે ઘેર છે.



## ॥ અદ્યાય ૪૪ ॥

### શ્રીસાઈનાથ નિર્વાણમ् - ૩

(શ્રીસાઈનાથ મહારાજનું આ જગત છોડીને જવું)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળહેવતાને વંદન,  
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

હે ચૈતન્ય સભર સાઈનાથ મહારાજ બધાં જ સુખોનું તું આશ્રયસ્થાન છે. બધાં જ ઐશ્વર્યનો તું ભંડાર છે. તારી કૃપા માત્રથી ભક્તોની ગરીબી અને નબળાઠ દૂર થઈ જય છે. તને અમારાં કોટિ કોટિ નમસ્કાર. તારાં ચરણોમાં સહજ વળીને નમસ્કાર કરવાથી પણ માણસોના બધાં જ પાપો ઘોવાઈ જય છે. જે ભક્તિભાવથી તારું પૂજન કરશે તે તો એનાથી પણ વધારે પાપરહિત, પવિત્ર અને ધન્ય થઈ જશે. જેનો હસ્તો ચહેરો નિરખીને સંસારનાં બધાં જ દુઃખોનો નાશ થાય છે, અને ભૂખ તરસ આપોઆપ દૂર થાય છે. જેને કશાની ઈચ્છા નથી કે જરા સરખુ અભિમાન નથી, જેના મનમાં લોભનું નામોનિશાન નથી, જે વાસનારહિત છે તેના મહિમાનું હું શું અને કેટલું વણન કરું ? અપકાર કરનારા ઉપર પણ તે ઉપકાર કરે છે, એવી જેના મનની વૈરાગ્ય સભર શાંતિ છે તેને એક પળ માટે પણ ભૂલશો નહીં. તેને આપણા હૃદયમાં સાચવી રાખો. (ઓ. ૧-૫)

શ્રી રામની કે કૃષ્ણ ભગવાનની આંખો કમળ જેવી સુંદર હોય છે. સંતોને એક જ આંખ હોય છે અથવા આંધળા હોય છે. દેવડ્રષે સુંદર દેહ હોય છે. જ્યારે સંતોનું સ્વરૂપ કાયમ આનંદમય હોય છે. ઈશ્વરની દશ્ટિ તો તેને પોકારતાં જ આપણા તરફ વળે છે, જ્યારે સંતની દશ્ટિને અંત કે મધ્યદા હોતી નથી, તેમની દશ્ટિ સૌ ઉપર એટલે કે તેમને યાદ ન કરનાર ઉપર પણ હોય છે. ઈશ્વરે કહ્યું છે, ‘યે યથા માં પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહ્મ્મ ॥’ ભગવદ્ ગીતા, અ. ૪ ચલોક ૧૧ અર્થાત્ ‘જે જેવી રીતે મારી ભક્તિ કરે છે તેને હું એવું ફળ આપું છું.’ જ્યારે સંતોનું અંત:કરણ નિંદા કરનારા માટે પણ રડે છે. પ્રભુ શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ અને સાઈનાથ સમર્થ આ ત્રણોમાં કોઈ પણ જાતનો ફરક નથી. નામથી જુઓ તો તે ત્રણ દેવતા છે પરંતુ તે સૌ અંતે તો એક જ છે. તેમને મરણ આવે છે એવું કહેવું તે પણ તદ્દન વ્યર્થ છે. કાળ ઉપર જેમની પોતાની સત્તા છે, તેમને કંઈ મરણની પીડા હોઈ શકે ? આપણને પ્રારંભ અથવા તો સંચિત કર્મો શું છે તે સમજનું નથી અને ક્ષયમાણની પણ જાણકારી નથી. ગુરુરાજ સાઈમહારાજ દ્યાળું છે તે જાણીને તેમની સામે હું યાચના કરું છું. વાસનાઓનાં અનેક પ્રકારનાં તોફાનો ઉછળતાં હોવાને લીધે અમારા મનને શાંતિ નથી. હે બાબા ! તમારી કૃપા વીના મનને સ્થિરતા મળવાની નથી. (ઓ. ૬-૧૧)

પાછળના અદ્યાયની શરૂઆતમાં વચન આપ્યું હતું. પરંતુ તે પાળી શકાયું નથી, અને સંપૂર્ણ વર્ણન પણ થઈ શક્યું નથી. હવે તેને પૂર્ણપણે સાંભળો. પાછળના અદ્યાયમાં પોતાનો અંત:કાળ પાસે આચ્યો છે તે જાણીને મહારાજે ચૌદ દિવસ સુધી એક બ્રાહ્મણના મુખે રતહિવસ ધ્યાનપૂર્વક રામાયણ સાંભળ્યું હતું. તે સાંભળતાં સાંભળતાં બે અદ્વાહિયાં વિત્યા બાદ દશેરાના દિવસે બાબાએ દેહ છોડ્યો. પછી બાબાનો દેહત્યાગ થતાં લક્ષ્મણમામાચે તે પવિત્ર મૃતહેનું પૂજન કરેલું અને બાપુસાહેબ જેગે આરતી ઉતારેલી. ત્યારબાદ હિંદુ મુસલમાનોએ તે મૃતહેને યોગ્ય રીતે નિકાલ કેવી રીતે કરવો તેનો વિચાર

## શ્રી સાઈનું સત્ય ચિહ્ન

કરવામાં છત્રીસ કલાક થયા હતા. આ બધું પાછળના અધ્યાયમાં કહેવામાં આવ્યું છે. (ઓ. ૧૨-૧૬)

પોતાની સમાધિનું સ્થાન બાબાએ પહેલેથી કેવી રીતે નક્કી કર્યું હતું. તથા કલ્પનામાં પણ ન હોય તેવી બાબાની મનગમતી ઈટ કેવી રીતે પડી ગઈ હતી, અને એકવાર ત્રણ દિવસ સુધી બાબાના પ્રત્યાંદમાં પ્રાણ હતા. આ સમાધિ હતી કે દેહનું અવસાન હતું, તે અંગે સર્વે જણ સંશયમાં પડ્યા હતા. શાસોક્ષાસ બિલકુલ રોકાઈ ગયેલો જેઠેને બાબાશ્રીનું આવું સમાધિગ્રસ્ત સ્થિતિમાંથી પાછું બેઠા થવું અશક્ય લાગતું હતું. આ રીતે ત્રણ દિવસ વિત્યા બાદ પ્રાણ નીકળી ગયા છે એવું ચોક્કસ લાગવા માંડચું અને તેમની અંતિમ વિવિ કરવાની બાબતમાં લોકો વિચાર કરવા લાગ્યા. આવા આ પ્રસંગને મનથી સમાજ થઈ બાબા એકાએક દેહભાનમાં આવ્યા, અને લોકોની ચિંતા દૂર કરીને બધી વાતો શ્રોતાઓએ પ્રેમથી સાંભળવાથી મનમાં આનંદ થશે અને જીવ ભરાઈ આવશે. આ કોઈ કથા નથી, આ તો મોટી સંદૂકમાં અમૂલ્ય સાધેરતન મુકેલું છે. તેને પ્રેમપૂર્વક ઉઘાડીને જુઓ અને દર્શનનો લહાવો લો. આ આખા અધ્યાયમાં શ્રીસાઈબાબા જ સર્વત્ર દેખાશે. તે સાંભળવાથી તમારા મનની ઈચ્છાઓ બધી પૂર્ણ થશે, અને તેનું સ્મરણ કરવાથી તમને તેનું શિરછત્ર મળશે. જેનું આચરણ ખૂબ સુદૃઢ અને ઉદાર હતું, એવા શ્રીસાઈનાથ મહારાજનું આ ચિહ્નિત્ર ભક્તિભાવથી એકચિત્તે સાંભળવા માટે તૈયાર થાય. આવી પવિત્ર કથાઓ સાંભળીને ભક્તોનાં મન કયારેય તૃપ્ત થતાં નથી. છતાં તેમના ચિત્તમાં પરમ આનંદ ફેલાઈ જય છે. સંસાર ચક્કમાં કષોથી થાકેલા અને મનથી ભાંગી પહેલાં ને વિસામો મળે છે અને મન પ્રસંગ થતાં હર્ષોલ્લાસ ફેલાઈ જય છે. આવી આ સાઈ મહારાજની કથા એકદમ નિર્ભળ અને શુદ્ધ સુખ આપનારી છે. કેટલીયે વાર સાંભળ્યા પછી પણ તે હંમેશાં નવીન જ ભાસે છે. સુખનું તે જ લક્ષણ છે. માટે જ સંત કાતીદાસે કહ્યું છે કે, ‘પ્રતિક્ષણં યત્ત્રવતામુપैતિ તદેવ ઇપં રમણીયતાપા: ।’ જે પ્રત્યેક ક્ષણે નવું બને છે, તે જ રમણીયતાનું ઇપ છે. માટે આ પવિત્ર સંતકથા બીજી તરફ ધ્યાન ન જવા હેતાં અનન્યપણે સાંભળો. (ઓ. ૧૭-૨૭)

પાવન મૂન્દેહની યોગ્ય વિધિ કરવા માટેનો વાદવિવાદ અને ચર્ચા કરતાં બધા ભક્તો થાક્યા. અને પછી શું અનુભવ થયો તે જુઓ. બુદ્ધીના વાડામાંનો મોટો વચ્ચેનો ઓરડો જેમા અંદરના બાગથી મુરલીધર શ્રીકૃષ્ણની મૂર્તિની સ્થાપનાની યોજના હતી, તે જ સ્થળ પછી બાબાની સમાધિ માટે નક્કી થયું. શરૂઆતમાં જ્યારે વાડાનું ખોદ્કામ ચાલતું હતું તે વખતે મહારાજ લેંડીબાગ તરફ જતાં, માધવરાવની વિનંતી સાથે સંમત થઈને પોતે માથું હલાવીને અનુમતિ આપી હતી. બાબાના હાથમાં શ્રીફળ મૂકીને માધવરાવે પ્રાર્થના કરી હતી, ‘દેવા ! મુરલીધરની સ્થાપનાની જગ્યા ઉપર ખોદ્કામ ચાલુ થાય છે. તમારી કૃપાદિષ્ટ તેના ઉપર કરવી.’ બાબા તે શુભ સમયની અનુમતિ આપતાં બોલ્યા હતા કે, ‘વધેરી નારીયેળ, આપણે સર્વ બાળગોપાળ અહીંયા જ સમય પસાર કરીશું. અહીંયા ઉઠતાં બેસતાં સુખદુઃખની વાતો કરીશું. અને અહીંયા જ બધા છોકરાને શાંતિ મળશે.’ શરૂઆતમાં બધાને એવું જ લાગેલું કે, બાબા તે અમસ્તુ બોલ્યા છે પરંતુ પાછળથી જ્યારે તેનો અનુભવ કર્યો ત્યારે તેમાં છુપાયેલું સત્ય સમજયું. મહારાજનો દેહન્યાગ થતાં મુરલીધરની સ્થાપના બાજુએ રહી, અને એની જગ્યા ઉપર સાઈ-શરીર કાયમને માટે સુરક્ષિત રાખવા માટે આ ઉત્તમ સ્થાન લાગ્યું. ‘આ શરીર વાડામાં પડો’ આવા જે બાબાના છેલ્લા ઉદ્ગારો હતા તે જ પ્રમાણે અંતમાં સૌ એકમતે વિચારોથી સહમત થયા અને મહારાજ પોતે જ મુરલીધર બની બેઠા. શ્રીમંતુ બુદ્ધી વગેરે સર્વ હિંદુ મુસલમાન ભક્તો આ જ વિચાર ઉપર રાજી થયા અને વાડો સતકાર્ય માટે ઉપયોગી બન્યો. આવો કિંમતી, બહુમૂલ્ય વાડો હોવા છતાં બાબાનો આ પવિત્ર દેહ બીજે કરો મુકવાની જે વ્યવસ્થા થઈ હોત તો આ વાડો ઉપયોગ વિનાનો રહી અત્યંત વેરાન થઈ ગયો હોત. આજે ત્યાં જે

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ભજન, પૂજન, કથા, કીર્તન, પુરાણ, વાંચન અને અતિથિઓ અન્નદાન થાય છે તેનું મુખ્ય કારણ સાઈમહારાજ જ છે. આને પણ ત્યાં સંતપ્તિ, લઘુરુદ્રનું અને મહારુદ્રનું જે પછન કે સ્તુતિ થાય છે તેમજ દેશ વિદેશથી જે ભક્તોનું આગમન થાય છે. તે સૌનું કારણ પણ શ્રીસાઈનાથ મહારાજ જ છે. માટે સંતોના આવા બોલ અક્ષરે અક્ષર સાચા સમજુને કાનમાં સંધરી રાખો. તેઓ કંઈ પણ અછાતું બોલે છતાં તે વચનનું અપમાન કે તેનો ત્યાગ કરતા નહિ. તેમનું બોલેલું ધણીવાર અર્થ વગરના લવારા જેવું અને ગુંચવાડો ઉભો કરે તેવું દેખાય છે અને તેને સમજવામાં પણ અધરું લાગે છે. છતાં વખત જતાં તેનો અર્થ ચોખ્ખો દેખાવા માંડે છે. (ઓ. ૨૮-૪૨)

મહારાજના દેહ પડવાના થોડા સમય પહેલાં શિરડી આતે મસ્નિદ્રમાં આગળ ઉપર બનનારી અમુક ઘટનાઓના અપશુકન થાય. તે પૈકી એક જ ઘટના હું શ્રોતાઓને અહીંથા કહી રહ્યો છું. કારણ કે તમામ કહેવા જતાં ગ્રંથનું કદ પ્રસરણ વધી દરે. કેટલાંયે વર્ષોથી બાબાશ્રીની પાસે એક જૂની ઠેઠ હતી. તેની ઉપર બાબા હાથ મુકી આસન લગાવી (યોગની અમુક ચોક્કસ પ્રકારની પલાંઠી વાળીને) બેસતા હતા. તે ઠેઠનો ટેકો લઈને બાબા રાત પડતાં હંમેશા એકાંતમાં મસ્નિદ્રની અંદર સ્વસ્થ મનથી આસન લગાડીને બેસતા હતા. આવો ક્રમ કેટલાંયે વર્ષો સુધી કોઈ પણ જતની અડચણ વીના ચાલ્યો હતો. પણ થવા કાળે જે કાંઈ થાય છે તેમાં કોઈનું કંઈ પણ ચાલતું નથી અને અચાનક જ એમાં કોઈ વિક્ષેપ આવી પડે છે. બાબાશ્રી મસ્નિદ્રમાં હતા નહીં, તે સમયે એક નાનો છોકરો મસ્નિદ્રમાં કચરો વાળનો હતો. બોધપરનો કચરો કાઢતી વખતે તે ઠેઠ થોડી ઉંચકાઈ એનો તૂટવાનો સમય આવી ગયો હશે. એટલે તે છોકરાના હાથમાંથી છટકી ગઈ અને ઘડ ફીને નીચે પડી અને તેના બે ટુકડા થઈ ગયા. આ માહિતી મળતાં જ બાબા બોલ્યા, ‘આ ઠેઠ નહીં મારાં કર્મ ફૂટ્યાં’ એવું બોલીને બાબાને ખૂબ અનુંગ્યા ઉપજ અને તેમની આંખોમાંથી દુઃખના આંસુ નીકળી ગયાં. જે ઠેઠના સહારે બાબા યોગાસનો કરતા હતા, એ જ્યારે તૂટી ગઈ ત્યારે બાબાશ્રીનું હદ્દ્ય દુઃખી થયું અને અવાજ ઝંઘાઈ ગયો. ખૂબ જૂની પુરાણી આ ઠેઠ પોતાના આસનના મૂળ આધાર સમી હતી તે એકાએક તૂટી ગયેલી જેઠને સાઈમહારાજને મસ્નિદ્ર સુનકાર ભાસવા લાગી. સાદી પકવેલી માટીની આ ઠેઠ પણ બાબાશ્રીને અતિશય ઘારી હતી. એની આવી દશા જેઠને સાઈનાથ મનથી ખૂબ જ દુઃખી થયા. તેની ઉપર કલાકો ને કલાકો સુધી ધ્યાન ધરીને તે યૌગિક અવસ્થામાં બેસીને પસાર કરતા હતા. માટે એ ઠેઠ ઉપર તેમને ખૂબ પ્રેમ હતો. ‘જેની સંગતમાં હું આત્મચિંતન કરતો હતો, અને જે મારા જીવ કે પ્રાણ જેવી હતી, એણે મારી સોભત ત્યજ દીધી માટે હવે એના વીના હું હવે જીવવાનો નથી. આ ઠેઠ પણ મારા જન્મની સાથી હતી. મને છોડીને તે હવે ભાંગી ગઈને !’ એવા એના ગુણ ગાઈને એની યાદમાં, સાઈમહારાજનું દિલ રડી ઉઠ્યું. (ઓ. ૪૩-૫૬)

આ ઠેઠ વિષે હ. ભ. પ. દાસગણુ મહારાજે પોતાના ભક્તિસારામૃતમાં અધ્યાય પર-પત વચ્ચે એક કથા કહી છે. મરાઠાવાડમાં પરભાણી જિલ્લામાં શેલૂ મુકામે બાબા નાનપણમાં પોતાના ગુરુ ગોપાળરાવ દેશમુખ ઉંફ વેકુંશાને ત્યાં રહેતા હતા. તે વખતે દેશમુખનો પોતાના આ બાળશિષ્ય ઉપર ખૂબ જ પ્રેમ હતો. તે જેઠને તેમની નજીકનાં સગાં અને ગામવાસીઓને આ બાળક ઉપર ઠીરાં થતી. તેમણે તેને મારમારી ખતમ કરી નાખવાનો પેતરો રચ્યો. એક હિવસે બાળસાઈ પોતાના ગુરુની આગળ સૂછ ગયા હતા. તે સમયે પેલા ઠીરાંણુ લોકોએ દૂરથી ઠેઠ ફેંકીને મારી. દેશમુખે તે ફેંકાયેલી ઠેઠને જેઠ લીધી અને તેને પોતાના યોગના સામર્થ્યના બળથી અધવચ્ચે જ રોકી લીધી. અને બાબાને આ ઘાતમાંથી બચાવી લીધા. બાબાએ એ ઠેઠ સંભાળીને રાખી મૂકેલી. પણ ત્યાર પદ્ધી લોકો તરફથી આ બાબતની તકલીફો વધવાથી તેમજ બાબાશ્રીના જીવનને ઘોકો છે એમ સમજુને ગોપાળ ગુરુજીએ બાબાને ત્યાંથી નીકળી પશ્ચિમ તરફ ગોદાવરી નદીના દક્ષિણે ગમન કરવાની સલાહ આપી. સર્દેશો અને ગુરુઆજાનું પાલન કરતી વખતે બાબાએ પેલી ઠેઠ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ગુરુચરણોનો પ્રસાદ સમજુને પોતાની સાથે લઈ લીધી.

મહારાજનો દેહ સમાધિમાં મુક્તી વખતે આ હેઠ એમના ભાથા તરફથી રાખવામાં આવી છે, એવું કહેવામાં આવે છે. અહીંથા વાંચકોને સહેલે શંકા થરો કે આ હેઠ ક્ષાળાંગૂર નથી કે ? તો પછી તેનો શોક શા માટે કરવાનો ? પ્રથમ નજરે આવી શંકા કોઈના પણ મનમાં આવી શકે. તો બાબાશ્રીના ચરણોમાં નમસ્કાર કરીન આ શંકાનું નિવારણ કરવા માટે હું પ્રયત્ન કરું છું. આ વિશ્વનો ઉદ્ધાર કેવી રીતે થશે તથા ગરીબ અને પામર મનુષ્યો આ સંસાર સાગરને કેવી રીતે પાર કરશે, તે માટે જ તો સંત પુરુષોનો અવતાર હોય છે. તેમને બીજે કોઈ આશય જ નથી હોતો. હસવું, રડવું, રમવું વગેરે સામાજિક વ્યવહારનો તો તેમનો ફક્ત અભિનય જ હોય છે. એવું સમજુને સંસારમાં વર્તવા માટેનો સાર છે. શ્રેષ્ઠ લોકો જેવી રીતે વર્તતા હોય છે તેવી જ પ્રથા સામાન્ય રીતે લોકોમાં પ્રચલિત થવા માંડે છે અને તેને જ પ્રનાલ અપનાવી લે છે. સંત ભલેને પૂર્ણ જ્ઞાની હોય અને આ જગતમાંની એમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થયેલી હોય છીતાં તેઓ લોકકલ્યાણ માટે જ અને તેમના ઉદ્ધાર માટે જ સજજ હોય છે. (ઓ. પ૭-૬૧)

આ દેહ અવસાનના પહેલાં બત્તીસ વર્ષો પૂર્વે (ઇ.સ. ૧૮૮૬માં) બાબાની સમાધિ બની ગઈ હોત. પણ મહાણસાપત્રિએ ખરેખર બુદ્ધિ વાપરીને આ આપત્તિયોગ ટાજ્યો હતો. આ દુષ્ટ યોગ જે ટાળવામાં ન આવ્યો હતો તો બધાંને આ સાઈનો આવા સરસ સહવાસનો મોકો કેવી રીતે મળ્યો હોત ? આજથી તેતાલીસ વર્ષો પહેલાં જ શ્રીસાઈબાબાનો વિયોગ થવાનો આ ખરાબ યોગ સર્જન્યો હોત. માગસર મહિનામાં પૂર્ણિમાના દિવસે બાબાને દમની બીમારી શરૂ થઈ અને તેઓ અસ્વસ્થ થઈ ગયા હતા. દેહના નૈસર્જિક ભોગ સહન કરવા માટે જ એમણે બ્રહ્માંડમાં પ્રાણ ચઢાવ્યા હતા, ‘હવે આજથી ત્રણ દિવસ માટે, અમે બ્રહ્માંડમાં અમારા પ્રાણ ચઢાવીએ છીએ, અમને જગૃત કરતા નહીં.’ એવું બાબાએ કહી રાખેલું. ‘પેલા સભામંડપનો ખૂણો જેયો.’ એવું કહીને એ ડેકાણે બાબાએ આંગળી વડે ઇશારો કરીને બતાયો અને કહ્યું કે, ‘ત્યાં સમાધિ ખોર્દાને મને મૂકી દેને.’ પછી મહાણસાપત્રિ તરફ જેઠિને તેઓ ફરીથી સ્પષ્ટપણે બોત્યા, ‘ત્રણ દિવસ સુધી મારા તરફ દુર્લક્ષ કરીને મને ભૂલી ન જતા. મને જ્યાં મૂકો તે જગ્યાનું નિર્દર્શન કરવા માટે ત્યાં બે નિશાનીઓ મૂકી રાખને.’ અને આ પ્રમાણે બોલતાં બોલતાં બાબાએ બ્રહ્માંડમાં પોતાનો પ્રાણ ચઢાવી દીધો. એકાએક ચક્કર આવીને કોઈ પડી જય એ પ્રમાણે એમનું શરીર બેશુદ્ધ થઈને પડ્યું અને મહાણસાપત્રિએ તેમની બોચી નીચે પોતાની પલાંઠીનો ટેકો આપ્યો. બીજી બધા તેઓ પાછા શુદ્ધિમાં આવશે તેવી આશા છોડી દીધેલી. રાત્રીનો સમય હતો, દશ વાગ્યા હતા ત્યારે આ પ્રસંગ બન્યો તેથી લોકો ચૂંપ થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા, ‘કેવો અચાનક આ પ્રસંગ ! શ્વાસ ચાલતો નથી, નાડી ઘબક્કી નથી, શરીરમાંથી પ્રાણ નીકળી ગયો લાગે છે.’ ગામવાસીઓની બયંકર સ્થિતિ થઈ ગઈ. પણ બાબા તો અમર્યાદ સુખમાં વિહાર કરતા હતા. ત્યાં મહાણસાપત્રિ સાવધાનીપૂર્વક સાઈને સંભળતા, જગતા બેસી રહ્યા. સાઈસમર્થે પોતે સમાધિ ખોદવાની આજ્ઞા આપી દેખેલી છીતાં એવું કરવાની કોઈની હિંમત ચાલી નહીં. બાબા સમાધિગ્રસ્ત થયા છે એ સાંભળીને ગામ આપું ત્યાં બેગુ થઈ ગયું. લોકો વિસમય પામી આ બધું જેવા લાગ્યા. પણ ભગતે-મહાણસાપત્રિએ પોતાની પલાંઠી ઉપરથી બાબાનું મસ્તક હુટાવ્યું નહીં. (ઓ. ૬૨-૭૪)

પોતાનો પ્રાણ ગયો છે એવું જાણતાં ભક્તોને એકાએક આધાત પહોંચશે, માટે ત્રણ દિવસ મને સાચવીને રાખજે એવું કહીને સાઈબાબાએ લોકોને ફિસાવ્યા. શ્વાસોશ્વાસ બંધ થઈ ગયો, બધી ઇન્દ્રિયો સજજાડ અને ચેતન વીનાની થઈ ગઈ. હલનયલન પણ થંભી ગયું અને મુખનું તેજ પણ ઝાંખું પડી ગયું. આજુબાજુમાં શું થઈ રહ્યું છે તેનું ભાન પણ જતું રહ્યું. બોલવાનું બંધ પડી ગયું. અને હવે બાબા ફરીથી પાછા શુદ્ધિમાં કેવી રીતે આવશે તેની સૌને મોટી ચિંતા થઈ. બે દિવસ વિત્યાબાદ શરીરમાં કોઈ ચેતન જેવું દેખાયું નહીં. મૌલવી, મુલ્લા, ફરીર વગેરે આવ્યા અને આગળનો વિચાર

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કરવા લાગ્યા. અપ્પા કુલકણી અને કાશીરામ શિંગી પણ આવ્યા. તેમનો પણ મત પાકો થયો કે બાબાશ્રીએ પોતાના સુખનું ધામ પામી લીધું છે અને હવે એમના દેહને વિશ્રાંતિ આપવી પડશે. કોઈક બોલ્યા, ‘હજુ થોડી રહે જુઓ, બહુ ઉતાવળ સારી નહીં. આ આપણા બાબા બીજી બાબાઓ જેવા નથી. તેમનાં વચનો હંમેશા સાચાં પડ્યાં છે.’ તરત બીજીએ જવાબ આપ્યો, ‘શરીર ઠંડુગાર પડ્યા પછી એમાં ચેતન ફરી પાછું ક્યાંથી આવશે? આ બધા કેવા મૂર્ખ છે? હવે તો બતાવેલી જગ્યામાં ખાડો ખોઢો અને બધાને બોલાવો તથા સમયસર મુઢી માટી નાખી અંતિમ સંસ્કાર પતાવો, ચાલો બધી તૈયારી કરો.’ આમ વાદવિવાહમાં ત્રણ દિવસની બાબાએ આપેલી મુદ્દત પૂર્ણ થઈ અને પછી મળસ્કે સવારના ત્રણના સુખમારે બાબાના શરીરમાં ચેતન ફરી પાછું આવવા માંડયું. આસ્તે આસ્તે શુદ્ધ આવવા માંડી તેમજ શરીરમાં હલચનચતુન અને અંગમરોડ થવા લાગ્યાં. શાસોશ્વાસની ધમણ ચાલુ થઈ અને પેટ પણ હાલતું દેખાયું. ચહેરો પ્રસંગ દેખાવા લાગ્યો, આંખો ઉઘડવા લાગી અને જગ્યાત અવસ્થાનાં લક્ષણો દેખાવા માંડયાં. જાણે કે દેહભાન ભુલાઈ ગયેલાને ફરી પાછી એની યાદ આવી. અથવા તો ખોવાયેલો ખજનો મજ્યો હોય અને બંડાર મળી ગયો હોય એવી સ્થિતિ થઈ. સાઈનાથ મહારાજ પાછા શુદ્ધિમાં આવતાં બધા પ્રસંગ થઈ ગયા. દેવકૃપાથી વિધન ટળી ગયું એમ વિચારીને ભક્તો આશ્રયમાં ગરકાવ થઈ ગયા. ભગત મહાણસાપત્રિએ સાઈસમર્થના મુખ તરફ આનંદથી અને આશ્રયથી જેયું. અને મહારાજે પણ પોતાની ગર્હન સાધારણ હલાવી. આમ એ લયંકર પ્રસંગ ટબ્બો, અને મૌલવી, ફકીરોના મોઢાં ઉતરી ગયાં. જે મૌલવી કે ફકીરોનું સાંભળીને ભગતે સાઈની આજા પાળવામાં બેપરવાઈ કરી હોત, કે ઢીલ કરી હોત તો કંઈક અધિતિ કે અયોગ્ય બન્યું હોત. તેતાલીસ વર્ષ પહેલાં જ સમાધિ ખોદાઈ ગઈ હોત અને પછી બાબાશ્રીના આ સુખકારક સુંદર દર્શનનો લહાવો ક્યાંથી મજ્યો હોત? ભક્તો ઉપર કૃપા અને ઉપકાર કરવા માટે જ સમાધિ અવસ્થાનું વિસર્જન કરી સાઈબાબા પાછા બેઠા થયા, અને ભક્તોના મનનું સમાધાન થયું. ભક્તોના કાર્યોમાં જે સંપૂર્ણ ખૂપેલો અને થકેલો છે, પરમાનંદમાં જે મભ થયો હોય તેને વહેલો કેવી રીતે જગાડી શકાય? ખરેખર બાબાની લીલાઓ સમજવી ખૂબ જ અધરી છે. બાબાને સંપૂર્ણ શુદ્ધિમાં આવેલા જેઠિને ભક્તજનો ખુશખુશાલ થઈ ગયા. તે દર્શન માટે દોડતા જવા લાગ્યા. આમ બાબાશ્રીનું સમાધિસ્થ અવસ્થામાંથી ફરી પાછું ઉઠ્યું બધાને માટે સુખકારક નીવડયું. (ઓ. ૭૫-૮૩)

પહેલાની કથાના અનુસંધાનમાં આખરી દેહઅવસાનનું સંપૂર્ણ વર્ણન આજ સુધીનું જેવું યાદ આવ્યું તે પ્રમાણે કર્યું છે. દેરેક શ્રોતાઓને ક્ષાળાભર માટે પણ મનમાં વિચાર કરવો કે પહેલી સમાધિમાંથી બાબાશ્રી ઉઠ્યા. માટે હર્ષ અને આખરનું દેહઅવસાન થયું માટે શોક શા માટે કરવો? બંને વસ્તુમાં મેળ બેસતો નથી. શું આ આણસમજપણું નથી? સાડાત્રણ હાથના આ સ્થૂળ દેહનો બોને ખેંચવા માટેનો સરંજલમ એ જ ઇન્દ્રિયોનું આધારભૂત એક માળખું છે, એ કોઈ આપણો વિરાટ સાઈ થોડો જ છે? આ ભૂલભરેલો ભ્રમ છોડી દો. શ્રી સાઈબાબા બધાં ડ્રોથી પર છે. દેહ તો નાશવંત છે. બ્રહ્મ જ સ્વતંત્ર અને નાશરહિત છે. આ દેહ પંચમહાભૂતોમાંથી તૈયાર થયેલો છે જ્યારે એ બ્રહ્મ નથી ઉત્પન્ન થતું કે નાશ પામતું. એ દેહમાંનું શુદ્ધ સત્ત્વયુક્ત જે બ્રહ્મસ્વરૂપ ચૈતન્ય છે તે, આ જરૂર ઇન્દ્રિયોને ચલાવે છે. એ વસ્તુનું નામ શ્રીસાઈ છે. એ બધી ઇન્દ્રિયો કરતાં પણ ખૂબ આગળ અને ઉપર છે. ઇન્દ્રિયો જરૂર હોય છે. ઇન્દ્રિયોને એની જણા નથી હોતી. એ જ ઇન્દ્રિયોને કાર્ય કરવા માટે પ્રવૃત્ત કરે છે અને પ્રાણી માત્રમાં જીવ બક્ષે છે. તે શક્તિનું નામ સાઈ છે. એના સિવાયની આ બ્રહ્માંડમાં કોઈ જગ્યા ખાતી નથી, એના વીના દરો દિશાઓ વેરાન ભાસે છે. એ જ ચરાચરમાં ભરેલ છે. જુઓ! એ જ સ્થિતિ આ સાઈના અવતારની છે. પહેલાં એ અવ્યક્ત હુતી, નામઝીપે એ વ્યક્ત થઈ પછી પોતાનું અવતાર કાર્ય પૂર્ણ થતાં અવ્યક્તતમાં પાછી એકરૂપ થઈ ગઈ. અવતારી પુરુષો દેહ છોડીને પોતાના પરમ ધારે પાછા સિદ્ધાવે છે. તેવી જ આ સાઈશ્રીની કરણી થઈ. ગુપ્ત રાખવું જેઠિએ માટે મનમાં આવતાં. દત્તઅવતારી શ્રીનૃસિંહસરસ્વતી જેવી રીતે

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

ગણગાપુરથી પર્વતયાત્રાએ જલ્દ છું એમ કહીને નીકળી ગયા હતા. અને ભક્તોએ તેમને રોકતાં, ‘મારું આ જેવું ભક્તોના કલ્યાણઅર્થે જ છે. હું ગણગાપુર છોડવાનો નથી.’ એવું કહીને તેમણે ભક્તોના મનનું સમાધાન કર્યું હતું. ‘કૃષ્ણાનદીના કઠી વહેલી સવારે સ્નાન કરવું. બિંદુક્ષેત્રે અનુષ્ઠાન કરવું, અને મઠમાં પાહુકાપૂજન કરવું. ત્યાંજ મારો નિરંતર નિવાસ રહેશે.’ તેવી જ શ્રીસાઈનાથ મહારાજની પણ સ્થિતિ હતી, અને હાલમાં પણ છે. એમનું નિધન ફક્ત લોકવ્યવહાર પૂરતું જ હતું. આમ જેવા જઈએ તો બધી જ જઈ અને ચેતન વસ્તુઓમાં અને બધાના હૃદયમાં શ્રીસાઈમહારાજ વાસ કરે છે. જેવી જેની મનઃસ્થિતિ હોય છે તેવો જ તેને હુંમેશા અનુભવ થાય છે. કોઈએ આ વાત પર જરાય શંકા કરવી નહીં. શ્રીસાઈમહારાજ મૃત્યુથી પર છે. સાઈસમર્થ ગરીબો અને દુઃખિયારા ઉપર દ્વારા કરનારા છે. શરણે આવેલા સાદા ભોળા ભક્તિયુક્ત અંત:કરણવાળાઓ માટે તો તેઓ પાલનકર્તા છે. ખૂબ જ શ્રેષ્ઠ દરજાના પ્રેમના તેઓ ખૂબ્યા છે અને દેશની સાથે લાગાડી અને ભમતા દાખવનારા છે. ભલે મનુષ્યની આંખો હવે તેમને જેદી શકતી નથી, છતાં તેઓ સર્વવ્યાપી છે. સૂક્ષ્મતામાં પોતે છૂપાયેલા છે તેઓ અમને તેમનું ઘેલું લગાડી રહ્યા છે. તેમને વળી મરણ એ તો એક ઢોંગ હતો. અમારા જેવા ભક્તોને ફસાવવાનો એક સ્વાંગ હતો. કોઈ પણ પ્રકારની ઉણિપ વીનાના અનેક ચમતકારિક લીલાઓ બતાવનારા તેઓ પરમેશ્વર હતા. વિનાશ પામીને તેઓ અવિનાશી થયા. તેમને માટે જે પ્રેમ છે બસ. તેનો જ પીછો કરી અંતમાં તેમને જ મેળવીને આપણે આપણું કાર્ય સાધી લઈએ. તેમનું ખરા મનોભાવથી પૂજન કરવાથી, ભક્તિભાવથી સ્મરણ કરવાથી, બધા ભક્તોને તેમનો પરચો, અનુભવ અને સર્વવ્યાપકતાનો ક્યારેને ક્યારે તો અંદાજ આવે જ છે. ચૈતન્ય સ્વરૂપ ધરાવનારાને ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો ડર નથી હોતો. સોનાના દાગીના ઘડતાં ફહેલાં પણ તે સોનું હોય છે અને તેના વિવિધ પ્રકારના ધાટના દાગીના ધડાવ્યા બાદ પણ એ પોતાનું સોનાપણું છોડતું નથી. જુદા જુદા ધાટના દાગીના તો સર્વનાશ પામનારાં ઝપાન્તરો હોય છે. ફરી તેને તેના મૂળ ઝપમાં ઝપાન્તર કરી શકાય છે. પણ તેને શુદ્ધ ચોખ્યું કરતાં, નામ, ઝપ, આકાર કાઢી નાખતાં પાછું મૂળઝપમાં સોનું જ થઈ જય છે. છતાં આ સદા કાયમ ટકનારા સોનામાં, એટલે કે, ચૈતન્ય સ્વરૂપ સાઈમાં, આ હેમાદ્રિપંત જડમૂળથી પૂર્ણપણે ઓગળી જવા માંગે છે, અને આવા ગુણોયુક્ત સાઈનાં ચરણોમાં વિશ્વના પ્રલય સુધી વાસ કરવાની ઠચ્છા ધરાવે છે. (ઓ. ૮૪-૧૧૮)

પછી બાબાનું તેરમું પૂરું કર્યું. ભક્ત રત્ન બાળાસાહેબ ભાટેતે ગામના પ્રાબ્લણોની સાથે મળીને બાબાની ઉત્તરકીયા વિધિનો આરંભ કરેલો. પહેલેલા વસ્તે સ્નાન કરી, બાળાસાહેબ ભાટેએ તલની અંજલિ અને તર્પણ કરેલું. સાઈબાબાની બારમાંની વિધિ તથા દર મહિને સતત એક વર્ષ સુધી શાસ્ત્રોના આધારે શ્રાદ્ધ કાર્ય વખતસર પતાવ્યાં હતાં. ભક્તે શ્રેષ્ઠ ઉપાસનીએ બાપુસાહેબ જેગની સાથે ગંગાના પવિત્ર કિનારે જઈ હોમ હવનનું કાર્ય પતાવી પાર પાડ્યું. બ્રહ્મભોજન, અપ્રદાન અને યથાવિધિ દક્ષિણાદાન કરીને શાસ્ત્રોક્ત બધી વિધિઓ તેઓ તરત પાછા ફરેલા. હવે બાબા ભલે નથી કે તેમની સાથે ઉઠવું, બેસવું કે બોલવું પણ રહ્યું નથી. તેમ છતાં મસ્તિજીદમાં નજર પડતાં જ તે બધાં ભૂતકાળનાં સંભારણાં અને સંવાદો થાદ આવે છે. બાબાની હંમેશાની બેસવાની પદ્ધતિના દર્શનના સુખનો અનુભવ કરવા માટે કાગળ ઉપર ચિત્રદ્રષ્ટે દોરવામાં આવેલી ઉત્તમ તસ્વીરની મસ્તિજીદમાં સ્થાપના કરવામાં આવેલી છે. સાઈબાબાનો દેહ દિશ્થી અદશ્ય થયો હોવા છતાં આ છબી જેયા પછી ફરી તેઓ આંખો સામે આવી જય છે, અને ભાવિક ભક્તો મહારાજને મૂર્તિમંત દશામાં પાછા જેદી શકે છે. શામરાવ, જેમની અટક જયકર હતી, એમણે આ સુંદર તૈલીચિત્ર તૈયાર કરેલું. આવી આ મનોહર આબેહૂબ છબી બાબાની સતત યાદ કરાવતી રહે છે. બાબા આજે દેહધારી નથી, છતાં જે તેમનું સ્મરણ કરે છે તેમનું તેઓ હૃદાત હતા તે રીતે સહેલે કલ્યાણ કરે છે. કોઈને કંઈ કહ્યું હોય અથવા કંઈ પણ અનુભવવાનું મળ્યું ન હોય તો તેમનું દેહાવસાન થઈ ગયું છે માટે હવે રહી ગયું તેવું નહીં. બાબાના બોલ એટલે બ્રહ્મદેવ માણસના લલાટે

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

લખેલા વિધિના લેખ તે કદાપી ઓટું ન છરવાનું ભવિષ્ય છે. વિશ્વાસ મુકીને તેનો અનુભવ કરવો. ભલેને તરત અનુભવ ન પણ થાય પણ થોડો સમય વિત્યા બાદ તેનો અનુભવ જરૂરથી થશે. (ઓ. ૧૧૬-૧૩૩)

જેગનું નામ આવતાં કથામાં એક બીજી નાની કથા યાદ આવી. તેની અસાધરણતા સાંભળશો તો મહારાજનું પ્રેમાળપણું દેખાઈ આવશે. આ સંવાદ ભલે થોડો નાનો હોય, છતાં ગુરુભક્તો માટે અતિ બોધપ્રદ છે. વૈરાગ્યની જેને જાણ થાય છે તે ભાગ્યવાન છે અને સંસારમાં જે બંધાઈ જય છે. તેને કમભાગી જ સમજવો. એક દિવસ જેણે બાબાને ખૂબયું, ‘હજુ મારી સ્થિતિ આવી કેમ ? મારું નસિબ આવું વિચિત્ર કેમ ? મારી આ સ્થિતિ સુધરશે ક્યારે ? હે દેવ ! મને તમારી અનન્ય સેવાનો મોકો પુષ્ટળ વર્ષો સુધી મબ્બો છતાં આ ચંચળ મનને શાંતિ કેમ નથી મળતી ? આવો કેવો હું દુર્ભાગી ? આ સત્સંગની બસ આટલી જ કમાઈ ? સંતોના સંગનું સારું પરિણામ મારા દેહને ક્યારે ભોગવવા માટે મળશે ?’ પોતાના પરમ ભક્તની આ વિનંતી સાંભળીને સાઈસમર્થે ખૂબ પ્રેમથી શું જવાબ આપ્યો તે સાંભળો. તેમણે કહ્યું ‘દુષ્કર્મની હોળી થશે, પાપપુણ્યોની ઘૂળઘાણી થશે અને તારે ભખે જ્યારે હું એક ઝોળી જેઠિશ, ત્યારે જ તને હું ભાગ્યશાળી માનીશ. બ્રહ્મથી આપણે જુદા છીએ એવું દાખવનારી દેક ઉપાધીઓનો તું ત્યાગ કરીશ ભગવંતની ભક્તિનો તને કાયમનો નાદ લાગશે અને બધી આશાઓનાં બંધનો પૂર્ણપણે તુટશે ત્યારે હું તને ભાગ્યશાળી માનીશ. જ્યારે તારું મન વિષય વાસનાની ઈચ્છા ત્યજશે, હું અને તું પણ તને અયોગ્ય લાગવા માંડશે, જીબ ઉપર અને જી સહ્યાસ તથા સંભોગ ઉપર તારી રુચિ નહીં રહે, તેમજ તેની ઉપર કાબૂ મેળવીને તું પોતાની જતને યોગ્ય બનાવીશ ત્યારે હું તને ભાગ્યશાળી માનીશ. ત્યારપછી થોડા સમય બાદ બાબાના શબ્દો સાચા પડ્યા. સદગુરુની કૃપાથી જેગને બાબાના કહ્યા પ્રમાણે વૈરાગ્ય પ્રાપ્ત થયો. પુત્ર અને સંતતિનાં બંધનો તો હતાં જ નહીં. પત્નીને પણ સદગતિ આપી. પોતાના દેહટ્યાગ પહેલાં એકદેરે સર્વસ્વનો ત્યાગ થયો અને સંન્યાસ અને વૈરાગ્ય સહજ રીતે પ્રાપ્ત થયું. જેગ પણ ખૂબ પુણ્યશાળી અને ભાગ્યવાન હતા. મહારાજનાં વચ્ચનો તદ્દન સાચાં પડ્યાં. છેલ્લી ઘડીએ સંન્યાસ સંપત્તિ થઈને તેઓ સાકોરીમાં ઈ.સ. ૧૯૨૬ની સાલમાં બ્રહ્મલીન થયા. જે પ્રમાણે સાઈનાથ મહારાજે ભવિષ્યવાણી કરેલી એવી જ તેમની આખરની સ્થિતિ થઈ. મહારાજનું બોલવું પણ સાર્થક થયું. જેગ નસિબદ્ધાર તો ખરા જ. સ્વ. બાપુસાહેબ જેગની સમાધિ સાકોરી મુકામે એકમુખી દાતમંહિર પાસે બાંધેલી છે.’ (ઓ. ૧૩૪-૧૪૬)

તાત્પર્ય એકે દીનબંધુઓ ઉપર દ્વારા કરનારા અને ભક્તોના કલ્યાણ કરવામાં છું પરોવનારા સાઈ મહારાજ, શિરીમાં સવાર, બપોર અને સાંજ ઉપદેશક્રીપી અમૃતવર્ષાની રેલમછેલ કરી નાખતા તે હવે સાંભળો. ‘જેને મારી જ મોટી રુચિ છે, જેને હું જ વહાલો લાગુ છું, અને જેને મારી જ રુચિ છે તેની નજરોમાં હું સતત રહું છું. મારા વીના જેને જગત નિર્જન લાગે છે અને મુખમાં સદાને માટે મારી જ વાતો હોય છે તેમને મારું અખંડ ધ્યાન થાય છે, જેની જીબ ઉપર મારા જ નામનો ધોષ હોય છે અને જ્યાં ત્યાં મારું જ ચરિત્ર એ ગાતો ફરે છે. આમ મારી સાથે એકદ્વિતી થતાં તેનાં સારાં નરસાં બંને પ્રકારનાં કર્મોના કર્તાપણાનો હક્કાર એ બનતો નથી. જ્યાં મારી સેવા માટેની આવી ઉત્સુકતા હોય છે ત્યાં જ હું રાત દિવસ હોતો હોઉં છું. મને અનન્યપણે શરણે આવીને જે મારું સતત સ્મરણ કરે છે તેનું મારા માથા ઉપર ઝાણ છે, જેને હું એનો ઉદ્ધાર કરીને ચૂકવી દેતો હોઉં છું. પહેલાં મને અર્પણ કર્યા વીના જે જમતો નથી અને પીતો પણ નથી એવું જેને મારે માટે આકર્ષણ છે તેની ઈચ્છા પ્રમાણે આધીન થઈને વર્તું છું. મારી જ જેને ભૂખ અને તરસ છે તેને મારા કરતાં પણ વિશેષ મહત્વનું બીજું કંઈ પણ નથી, એવા ભક્તો ઉપર મારું કાયમ ધ્યાન રહે છે. અને હું તેની ઈચ્છા પ્રમાણે વર્તતો રહું છું. મા, બાપ, સગાં-વહાલાં, સ્નેહી સંબંધી, બેરી, છોકરા વગેરેની માયા મમતામાં જે ફસાયેલો નથી તે જ મારાં ચરણોમાં શાંતિ પામે છે. ચોમાસામાં મોટા ઘોડાપૂર આવેલી અનેક નદીઓ સમુદ્રમાં જઈને મળે છે, ત્યારે તે નદીઓ પોતાનું નદીપણું એટલે કે અસ્તિત્વ ભૂલી જય છે, અને પોતે

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પણ મહાસાગર જ બની જય છે. તેનું રૂપ બહલાઈ જય છે અને તેનું જળ સમુદ્રમાં ભળી જય છે. નહીંઓ અને સમુદ્રનો સંગમ થઈને તેમનાં લગ્ન થઈ જય છે. તથા બનેનું એકત્વ થઈ જય છે. જેમનું જુદાપણું એકદૃપતામાં ખોવાઈ જય છે. આવી એકતા પ્રાપ્ત થાય એટલે મારા ભક્તો પોતાનું નામ અને સ્વરૂપ પણ ભૂતવા માંડે છે અને મને તેઓ આપોચાપ સ્વાભાવિક ગુણોથી પોતાના જેવો જુએ છે. તેને મારા સિવાય કોઈ અન્ય સ્થાન નથી. હું કોઈ પારસમણિ નથી પરંતુ સાદો પથરો છું આવું જલેર કરવા માટે પુસ્તકિયા પંડિતોએ બબડાઈ કરી લોખંડના ટુકડા ભેગા કરીને મારી ઉપર પ્રહાર કરતાં તે લોખંડના ટુકડા સોનામાં રૂપાંતર થઈ ગયા. મારુ પથરપણું ખોટું જલેર થયું અને તેના અનુભવથી તેઓ આશ્વર્યચક્રિત થઈ ગયા. જરા પણ અભિમાન વીના સાચા હદ્યથી અને અંત:કરણથી જે મારે શરણે આવશે ત્યારે તેનાં અજ્ઞાનનો નાશ થશે. અને ત્યારબાદ જ્ઞાનનો ઉપદેશ સાંભળવાનું કારણ રહેતું નથી. અજ્ઞાનતા દેહભાન ઉત્પન્ન કરે છે, દેહભાન લીધે જ આધિ-વ્યાધિ-ઉપાધિ વગેરે હોય છે. એ દેહભાન જ આત્મસિદ્ધિને પ્રતિબંધક એવી વિધિ નિષેધ તરફ માણસને ઘસડી જય છે. તમે કહશો, હમણાં હું ક્યાં છું ? તમને હું કેવી રીતે મળી શકીશા ? તો હું તમારા હદ્યમાં વસેલો છું. અને કષ્ટ કે પ્રયત્ન વીના ખૂબ નજરીંકથી તમને મળી શકીશા. તમે કહેશોકે, હદ્યમાં વાસ કરનારો આ કોણ અને કેવો હોય છે તેનાં લક્ષણ અને નિશાનીઓ કઈ ? તેને આપણે કેવી રીતે ઓળખવો ? તો હવે ધ્યાન દઈને સાંભળો, અને તેનું સ્પષ્ટ વિવરણ જુઓ. આ સૂચિમાં અનેક રૂપો અને નામો ભેદભાનાં છે, જેનું માપ કાઢી શકાય તેમ નથી. તે અવધિ માયાના જ સ્વરૂપમાં છે. તેવી જ રીતે, સત્ત્વ, રજ અને તમ આ જે ત્રણ ગુણોથી પર જે સત્તાની પ્રેરણા હોય છે તેને જ આ હદ્યસ્થાનનાં રૂપ તરીકી ઓળખવા જોઈએ. નામરૂપ વીનાનું જે બચેલું તારું જે તું પણું એને જ હદ્યસ્થાનનું લક્ષણ સમજ્ઞને એને શરણે જા. હું જ એ હદ્યસ્થ પરબ્રહ્મ સાઈ છું. એવું તું જોઈશ તો તે જ દાખિ વિસ્તારીને સર્વ પ્રાણીમાત્રમાં પોતાના જેવું જ શૈષ્ઠત્વ તને દેખાવા લાગશે અને મારા વીનાની કોઈ પણ ખાલી જગ્યા. તને નજરે ચઢ્યો નહીં. આમ અભ્યાસ કરતાં કરતાં મારી વ્યાપકતાનો તને અંદાજ આવશે. પછી મારે સાથે એકદૃપ થઈને તું પૂર્ણ અનન્યનો ઉપભોગ કરી શકીશા. ચૈતન્યના સ્વરૂપમાં ધ્યાન કેન્દ્રિત થશે, અંત:કરણ શુદ્ધ થશે, અને ગંગાના જળને સ્પર્શ કર્યા વીના તને ગંગાસનાનો લહાંખો મળશે. સ્વાભાવિકપણે સજ્ઞયેતાં પ્રાકૃતિક કર્મોના અભિમાનને પકડી રાખવાથી માણસને ઘણ બંધનો બાંધે છે. જ્ઞાનીજનો તને સ્પર્શવા દેતા નથી. મનથી તેઓ સહાને માટે સાવધ રહે છે. પોતાના સ્વરૂપમાં લીન થઈને તે બેસે છે, અને મનને પણ ચલિત થવા હેતો નથી. એને માટે સમાધિ લગાવવી કે એમાંથી ઉઠીને બેઠા થવું આ બંનેની આવશ્યકતા નથી હોતી. એ હંમેશા ચાલતાં બોલતાં સ્વરૂપદ્ધે સ્થિત હોય છે.' (ઓ. ૧૪૭-૧૭૨)

માટે શ્રોતાઓનાં ચરણોમાં માથું મુકીને તેમને અતિ પ્રેમપૂર્વક હું વિનંતી કરું છું કે, દેવ, સંત, કે ભક્ત આ સર્વે ઉપર પ્રેમ અને આદર રાખવો. સાઈબાબા અનેકવાર આમ કહી ગયા છે કે, 'કોઈ અગર કોઈને પણ જે દુઃખ થાય તેવું બોલે તો સમજને કે મારી ઉપર જ કરેલ કોઈ માર્ભિક પ્રહાર છે, અને મારા જ કોઈ અત્યંત નાજુક ભાગ ઉપર કરેલો આ ધા છે. કોઈ કોઈને પણ ખરાબ શર્દૂમાં તડક્ક બોલી નાખે તો તેનાથી મને જ ત્રાસ થવાનો છે અને તે જ જે શાંતપણે સહન કરે તો તેનાથી મને લાંબા સમય સુધી પહોંચે એટલું સમાધાન અને સંતોષ થશે.' આવા આ શ્રીસાઈ મહારાજ અંદરથી અને બહારથી પ્રાણીમાત્રમાં વ્યાપેલા છે. એક પ્રેમ સિવાય તેમને બીજી કોઈ વસ્તુ ગમતી નથી. આવો આ અત્યંત મંગલદાદી અને શૈષ્ઠ અમૃતરૂપી ઉપદેશ મહારાજના મુખેથી હંમેશા વહ્યા કરતો હતો. જાણે કે ભક્તો ખાતર મૂર્તિમંત્ર પ્રેમ જ વહેતો હતો. આ ક્યા ભાગ્યશાળીને ખબર નથી ? જેમને સાથે બેસીને જમવાનો લાભ મળ્યો, જેમની સાથે તેઓ હસ્યા, રમ્યા, જેમના મનને ચટકો લગાવ્યો, એવા માણસોના મનની હવે બાબાના ગયા બાદ શી પરિસ્થિતિ થતી હશે ? હવે તેમને કેવું લાગતું હશે ? તે ખોવાયેલી પ્રતિબા પાછી મળવી જોઈએ. એવા ભક્તોના મનમાં કેવો વિરહ થતો હશે ? આવી આદરણીય વ્યક્તિના જમવાના ડેકાણે હું તો માત્ર તેમના વધેતા ઘટેલા અન્નનો અધિકારી છું, અને એવા પવિત્ર અન્નના કણકણ ભેગા.

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કરીને એક એક દાણો તેમાંનો વહેંચીને તેનો આનંદ બધામાં જ લુટાવા માંગુ છું. (ઓ. ૧૩૩-૧૭૯)

ઉપર જણાવેલા જેના વિષે કથા થઈ એ કંઈ હેમાડપંતને ખબર છે? સાઈસમર્થ તેમના વક્તા છે અને લખનારા અને લખાવનારા પણ એ જ છે. આ સાઈસમર્થના ચરિત્રનું વર્ણન કરતાં કરતાં મારું મન તૃપ્ત થતું નથી. મારા મનને આ કથા કહેવાનું ઘેલું લાગ્યું છે અને શ્રોતાઓને પણ એ સાંભળીને આનંદ થાય છે. એ સિવાય પણ જે સાઈ મહારાજની કીર્તિ ભજે છે અને સદ્ગ્રાવથી જે સાંભળે છે તેઓ બંને સાઈ સ્વરૂપમાં જ ઓતપ્રોત થઈ જય છે, એટલું મનમાં ચોક્કસ જણી લેને. હવે આ અધ્યાય પૂરો કરીને હેમાડપંત તેને સાઈબાબાનાં ચરણોમાં અર્પણ કરી રહ્યા છે. હવે પછીનું વર્ણન આગળના ઉપરના અધ્યાયમાં આવશે. (ઓ. ૧૮૦-૧૮૩)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલા ભક્ત હેમાડપંત રચિત,  
શ્રીસાઈસમર્થના સત્યચરિત્રનો ‘શ્રીસાઈનાથ - નિર્વાણમ् - ૩’ નામનો ચુંમાળીસમો અધ્યાય  
અહીંયા સમાપ્ત થાય છે.

## શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણ.



## અધ્યાય ૪૪નું અર્થ વિવરણ.

આ અધ્યાયમાં સાઈ મહારાજની ગમતી ઠીક તૂરી જવાની અને બત્તીસ વર્ષ પહેલાં તેમણે પોતાના નિવાણના ત્રણ દિવસ માટે લગાવેલી સમાધિનું વર્ણન કરવામાં આવ્યું છે. ઠીક આટલાં વર્ષો પાસે સંભાળીને રાખી હતી. અને તેના તૂર્ણવાથી મહારાજે કરેલા શોક ઉપરથી તેમનો એ ઠીક પ્રત્યેનો અગાધ પ્રેમ-ગુરુપ્રસાદ અને ગુરુભક્તિ ચોખ્યી હેખાઈ આવે છે. ખ્રિસ્તાંડમાં પ્રાણ ચઢાવીને શરીર બિલકુલ ચેતન વીનાનું કરીને અને શાસોશ્વાસ વગરનું મૃત:પાય કરીને ત્રણ દિવસો બાદ શુદ્ધિમાં લાવીને મહારાજે પોતાની થોગ સાધનાનું અને પરિપૂર્ણતાનું પ્રાવિષ્ય બતાવી આપ્યું છે. તે પહેલાં અધ્યાય હમાં મહારાજ જે થોગસાધનાઓના પ્રયોગો આચરતા હતા, એનું વર્ણન આપ વાંચી ચૂક્યા છે -

સમાધિ સાથે અંડયોગ । ધોતી પોતી ઈત્યાદિ પ્રયોગ ।

કદી તો હાથપગ શિરવિયોગ । કદી વળી પૂર્વવત્ સંયોગ ॥૩॥

ઉપર જણાવેલ મુર્કેલ થોગ સાધનાઓના પ્રકારો જેતાં અને નીચે દર્શાવેલી સામ્યતાઓ ઉપરથી શ્રી મહારાજ નાથપંથી સંત હતા એવું ધણા લોકોનું માનવું છે -

(૧) ભસ્મ અથવા તો ઉદ્દી - ભસ્મ કહો કે ઉદ્દી કહો, બંને એક જ વસ્તુ છે. નાથપંથીઓ જે પ્રમાણે પ્રસાદી આપ્તિ વખતે અથવા તો દુઃખોનું નિવારણ માટે ભસ્મ આપતા તે જ પ્રમાણે બાબાશ્રી પણ ઉદ્દીનો જ ઉપચાર કરતા હતા.

(૨) ધૂળી - નાથપંથી યોગીઓના મઠમાં ધૂળી સતત પ્રજ્ઞવલિત રહેતી. બાબાની દ્વારકામાઈમાં પણ ધૂળી કષ્યમ પ્રજ્ઞવલિત રહેતી હતી.

## શ્રી સાઈનું સત્ય ચિત્ર

(૩) અભિ નાટક - સળગતી જવાળાઓ સામે આંખો મિંચ્યા વીના એકીસે બેસીને જેયા કરું. આ એક ખૂબ જ અધરી સાધના છે. તેને માટે કહક ભ્રષ્ટચર્ચ અને બીજાં અનેક બંધનો પણવા પડે છે. માટે આ સાધના સામાન્ય માણસો કરી શકતા નથી. મહારાજ આ સાધનામાં દરરોજ અને નિયમિતપણે બેસતા હતા.

તે હેઠનો આધાર લઈ । નિત્ય એકાંતમાં થતાં રાત્રિ ।

બાબા મસ્નિદમાં સ્વસ્થ મનથી । આસન મારી બેસતા ॥૪૬॥ અધ્યાય - ૪૪

(૪) કફની - નાથપંથીઓની કફનીની માફક જ બાબા પણ તે જ પ્રકારની કફની ધારણ કરતા હતા. નાથપંથીઓ માત્ર ભગવા રંગની કફની ધારણ કરતા, જ્યારે બાબા સફેદ રંગની કફની પહેરતા હતા. જે ભગવો બાબાએ ધારણ કર્યો હતો તો બેદભાવ જેવું લાગત. અને હિંદુ મુસ્લિમાનમાં એકતાના તેમના કાર્યમાં બાધા આવત માટે જ કદાચ તેમણે માત્ર સફેદ રંગ ઉપર પોતાની પસંદગી ઉતારી હતી.

(૫) ગુરુનું મહત્વ - નાથપંથમાં ગુરુને અસાધારણ મહત્વ આપવામાં આવે છે. બાબાશ્રી લીમાના ઝાડ નીચેના પોતાના ગુરુસ્થાનકને કેટલું મહત્વ આપતા હતા, એ અંગે મારે વારંવાર કહેવાની જરૂર નથી. સાઈના બોલવામાં પણ ગુરુનું નામ વારંવાર આવતું. અનેક વખતે ભક્તોને મહારાજે પોતાના ગુરુમહારાજની મહત્તા વર્ણન કરેલું છે.

(૬) જીવ બ્રહ્મસેવા - જીવમાત્ર ઉપર મનુષ્યે દ્વારા રાખવી. જીવ, જંતુઓ ઉપરનાં દુઃખના ભોગ ઓછા કરવા, કરારણ કે પ્રત્યેક જીવ આખરે એક અંતર્યામી બ્રહ્મ જ છે. નાથપંથીઓ જીવબ્રહ્મસેવા ગામેગામ ફરીને કરતા હતા, જ્યારે સાઈનાથે આ સેવા માત્ર શિરડીમાં જ રહીને આદરી. અસાધ્ય રોગીઓનાં જખમો બાબા પોતાના હાથે ધોઈને તેમના દ્વારાદુરુ કરતા હતા. એ બાબતથી કોણ અન્યાન્ય છે ? તેમજ નાથપંથી રોગના ઉપચાર કે સંકોદેભાંથી ઉતારા માટે ભસ્મ જ મંત્રીને આપતા, તે જ પ્રમાણે મહારાજ પણ ઉદ્દી આપીને ભક્તોનાં ભલભલાં દુઃખો દૂર કરતા હતા. સાઈનાથે વર્ષો વર્ષથી આદરેલા નાટકને લીધે, એ ઉદ્દીને પણ મહાન શક્તિ પ્રાપ્ત થયેલ હતી. જે આજ હિન્સુધી છે.

અવર્ચીન કાળમાં નાથ સંપ્રદાયમાંના એક સર્વ શ્રેષ્ઠ યોગીરાજ માધવનાથ મહારાજ (ઇ.સ. ૧૮૫૭-૧૯૩૬)ના 'માધવનાથ દીપ્પ્રકાશ' નામના ચારિત્રણથના રરમા પ્રકારણમાં નીચેની ઓવીઓ જેવા મળે છે -

શ્રી પરમહંસ શીલનાથ । શ્રીસદગુરુ સાઈનાથ ।

ધુંડીરાજ પળુસીમાં । શ્રી ગજનન શૈગાંવમાં ।

ગોપાળદાસ નરસિંગ । મહારાજ નાશિકમાં ॥૧૦૮॥

આ પંચ રતનો નાથના । પરમ હૃતા એકબીજમાં પરોવાયેલા ।

ચાલતો કારોબાર એકબીજની સાથે । અંતર મનની શક્તિથી ॥૧૧૦॥

તેવી જ રીતે ઉપર જણાવેલ શ્રી યોગીરાજ શીલનાથ મહારાજનો 'શ્રી શીલનાથ યોગશ્રમ દેવાસ - ૨' પ્રસિદ્ધ થયેલ હિન્દી ભાષામાંના જીવન ચરિત્રમાંના પાન નંબર ૨૧૦/૨૧૧માં નીચે પ્રમાણેનો ઉલ્લેખ છે -

**'મહૂની અંગ્રેજ છાવણીમાં -'**

દેવાસ પાછા આવતા પહેલાં શ્રીગુરુમહારાજ મહૂની અંગ્રેજ છાવણીમાં તે સમયના કમાંડિંગ ઓફિસરની પ્રાર્થનાને માન આપીને મહૂ છાવણીમાં ઉત્ત્યા હતા । અનેક અંગ્રેજ સૈનિકોએ આપનાં દર્શન કર્યા । કમાંડિંગ ઓફિસરે ગુરુમહારાજના સ્વાગત માટે સૈનિક માનવદંનાનું આપોજન કર્યું હતું । આ જ મુકામે શ્રીબાળાસહેબ રેણેએ શ્રી ગુરુમહારાજની પદરામણી પોતાના ઘરે કરાવી હતી અને ગુરુમહારાજ એમને ઘેર ગયા હતા । બાળાસહેબ રેણે શ્રીસાઈબાના લક્ષ્ણ હતા. તેમના

## શ્રી સાઈનું સત્ય ચટિત્ર

ઘરમાં શ્રીસાઈનાથ મહારાજની છબી જોઈને ગુરુમહારાજ બોલ્યા, ‘આ અમારા ભાઈ શિરડીમાં રહેનારા છે’। આ સાંભળીને બાળાસાહેબ રેગે ખૂબ આનંદ થયો હતો। દેવાસ રાજ્યનું મધ્યપ્રેદેશમાં વિલિનીકરણ થવાના સમયે, બાળાસાહેબ રેગે દેવાસ-ઇંગ્રીઝી પાતીના દિવાન હતા।

શ્રી સંત શ્રીરામભારુતી મહારાજ નામના એક નાથપંથી તરીકી પ્રસિદ્ધ પુરુષ થાણા, કલ્યાણ અને ભિવંડી વિસ્તારમાં શતકના અંતમાં અને વીસમાં શતકના પૂર્વાધમાં થઈ ગયા. તેઓ સાઈનાથ મહારાજના સમકાળીન હતા. આ મહાન સંતના સ્મણાર્થે, દાદર, થાણા, કલ્યાણ વગેરેના રસ્તાઓને એમનું નામ આપીને તેમની સ્મૃતિ ભાવિકોએ અજરામાર કરી છે. શ્રીરામભારુતી મહારાજ સાઈનાથે પોતાના ગુરુવત્ત પૂજય માનતા હતા. એટલું ૪ નહીં પણ વારંવાર કહેતા હતા કે શ્રીસદ્ગુરુ બાલમુકુંદ સ્વામીએ અમારા ખરા, પણ નાથપંથના આધગુરુ શ્રીસાઈનાથ એ અમારે માટે આહિનાથની જગ્યા ઉપર છે. ઈ.સ. ૧૯૧૦ની સાલમાં રામભારુતી મહારાજ શિરડી મુકામે શ્રીસાઈનાથ મહારાજના દર્શને આવ્યા ત્યારે સાઈબાબાના આનંદનો પાર રહ્યો ન હતો. ભક્તોને તેમણે પહેલેથી ૪ જાણાવી દીધું હતું કે, ‘મારો ભાઈ મને મળવા માટે આવી રહ્યો છે. અરે ! મારો તો આવતી કાલનો સોનાનો દિવસ છે ભાઈ ! અરે મારી તો કાલે દિવાળી છે રે !’ રામભારુતી અને તેમની સાથેના બીજી બધા શિરડી આવી પહોંચ્યા ત્યારે બાબાશ્રીની બપોરની આરતી ચાલતી હતી. કોઈ દિવસ નહિ પણ તે દિવસે બાબાએ આરતી રોકાવી દીઘેલી. બાબા રામભારુતીને છાતીએ વળગાડી જેરથી ભેટી પડ્યા હતા. અને બાબાએ પોતાના આસનથી થોડા સરકીને બાજુએ ખસી જઈ, અહ્યા આસન ઉપર તેમને બેસાડ્યા હતા, અને પછી આરતી ફરી પાછી શક્ક કરાવવા માટે ભક્તોને કહ્યું હતું. આ ઉપરથી બાબાનો નાથપંથીઓ સાથેનો ખૂબ ૪ ગાડ સંબંધ દેખાઈ આવે છે.

પરમ પૂજય સ્વામી રામભાબા જેમનું હાલમાં ૪ એટલે કે ઈ.સ. ૧૯૮૮ની મહાશિવરાત્રીના દિવસે મુંબઠ મુકામે ૧૨૬ વર્ષની વધે નિર્વાણ થયું. જેમનું શ્રીસાઈસચ્યારિત્રના અધ્યાય રઉમાં વાર્ષિન કર્યા પ્રમાણે એક ‘યોગાભ્યાસી’ તરીકે ઈ.સ. ૧૯૯૪ની સાલમાં શ્રીબાબા સાથે શિરડી મુકામે મુલાકાત થઈ હતી. તેમનું પણ કહેવું હતું કે, સાઈમહારાજ નાથપંથી હતા. તેમણે મને ઉપર આપેલા શ્રીશીલનાથ મહારાજના જીવન ચરિત્રનો હિન્દી ઉતારો વાંચી સંભળાવ્યો હતો. સ્વામી રામભાબાનો શ્રીશીલનાથ મહારાજ સાથે ઘણા લાંબા સમયનો ગાડ પરિચય હતો. સ્વામી રામભાબાનું કહેવું હતું કે નાથપંથીઓ જ્યારે પણ અમુક સમય બાદ સમાધિઅવસ્થામાં જય છે ત્યારે એક નાથની બદલીમાં બીજે નાથ એ શરીરમાં પ્રવેશ કરે છે. સાઈમહારાજની બાબતમાં પણ ઈ.સ. ૧૯૮૬માં પોતાની ઉમરના ૪૮માં વર્ષે ત્રણ દિવસ સમાધિ લેતા પહેલાં, અને તેમનાં કાર્યોમાં અને ત્યાર બાદ એમના આખરી દેહઅવસાન સુધીનાં ૨૨ વર્ષના સમય દરમિયાન તેમનાં કાર્યોમાં ખૂબ ૪ મોટો તફાવત દેખાઈ આવે છે. તેમના અવતારનાં ખરાં કાર્યો અને જગતભરની પ્રસિદ્ધિની શક્કાત્ત ત્યાર બાદ ૪ થઈ હતી. તે કંઈ પણ હોય યોગી મહાત્માઓની કરણીની તેમને ૪ ખબર. બાબા નાથપંથી હતા કે ન હતા, પણ આપણે તો માત્ર ‘સાઈનાથ’ કહીને સંબોધિત કરીએ છીએ. એનો અર્થ એ કે આપણે તેમના પોગબળની શ્રોષ્ટા અને સિદ્ધત્વ માન્ય રાખીએ છીએ. અને એટલું ૪ નહીં, તેમને આપણાં ‘નાથ’ એટલે સ્વામી કે માલિક સમજને સ્વીકારીએ પણ છીએ. અને અમારા જેવા અજાણ ભાવિક ભક્તો માટે તો આટલું ૪ પૂરતું છે.

॥ નમામીશ્રરં સદગુરુ સાઈનાથમ ॥

॥ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જગ ॥



## ॥ અદ્યાય ૪૫ ॥

### શ્રી ગુરુચરણ મહિમા

(શ્રી ગુરુનાં ચરણોનો મહિમા)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,

શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

સહજ રીતે ઘંઠીના પથથર ગોઠવીને અને દળીને, જેણો પોતાનું ચરિત્ર લખાવવા માટે પ્રવૃત્ત કર્યો અને ભક્તોને સારા માર્ગ દોરવા માટે જેણો પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું તેનું કૌશલ્ય કેટલું અલોકિક હશે ! મોક્ષ એ ચારેય પુરુષાર્થોમાં માનવીનો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન છે. પણ એનાં કરતાં પણ વધારે સમર્થ અને બળવાન ગુરુનાં ચરણો છે. આવા ગુરુનાં ચરણોના તીર્થનું સેવન કરવાથી મોક્ષ આપોઆપ શિષ્ય કે ભક્તની પાસે આવે છે. ગુરુ જે કૃપા કરે તો જ આ સંસારમાં સુખ મળે છે. ન બનવાનું અને ન ધારેલું પણ બની જય છે અને પળભરમાં સામે પાર પહોંચાડી દે છે. (ઓ. ૧-૩)

સાઈનાથ મહારાજની આ કથાઓ આટલી સંક્ષિપ્તમાં કહી છતાં, આ પોથીનો વિસ્તાર વધી ગયો. સાઈની કીર્તિ અમર્યાદિત છે. તેનાં હું કેટલાં વખાણ કરું ? જેના દર્શનથી મન હંમેશા તૃપ્ત થતું, જેના સહવાસમાં પરમ આનંદનો અહેસાસ થતો, જેના સ્મરણ માત્રથી સંસારના કાર્યો, ચિંતા અને ડર દૂર ભાગી જતાં એ સાઈમૂર્તિનું સ્વરૂપ હવે દાખિમાંથી અદ્દય થઈ ગયું છે. જેને કારણો ભક્તોની પરમાર્થ તરફ વૃત્તિ વળતી હતી અને જેને કારણો માયા અને મોહના મુખમાંથી ધૂટકારો મળતો હતો. તથા અત્યંત કલ્યાણ પ્રાપ્ત થતું હતું તેવી એ સાઈ મહારાજની પ્રતિમા આંખો સામેથી છીનવાઈ ગઈ છે. જેને કારણો મરણ પછીના બીજ જન્મનો ડર ન રહેતો તેમજ જેને કારણો ન્યાય નીતિથી અને સચોટપણો જીવન જીવવાની બુદ્ધિ જગૃત થઈ હતી અને મુસીબતના સમયમાં મનને ધીરજ મળતી હતી તે સાઈમહારાજનું અસ્તિત્વ આંખોથી ઓઝલ થઈ ગયું છે. આપનું મૂર્તિ સ્વરૂપ અમારી મધુર સ્મરણ શક્તિમાં સંધરીને મહારાજ પોતાના કાયમના મુકામ-નિજધામ સિધાવ્યા છે અને પોતાની અવતાર લીલા સંકેલી લીધી છે. તેમની યોગ્યતાની અથવા તો અવસ્થાની કલ્પના પણ કરવી આપણા માટે શક્ય નથી. અવતારી કાર્યો પૂર્ણ થતાં આ પૂર્થી ઉપરથી નાશવંત આકૃતિ અદ્દય થઈ તેમ છતાં આ ગ્રંથદ્વારી સાહિત્યિક તેમની મૂર્તિ ક્ષણે ક્ષણે તેમની યાદ આપતી રહેશે. તે ઉપરાંત આ ગ્રંથમાંની કથા સાંભળવાથી મનને જે એકાગ્રતા મળે છે, અને તેનાથી જે શાંતિ ઉત્પન્ન થાય છે તેનું હું કયા શબ્દોમાં વર્ણિન કરું ? આપ સર્વ શ્રોતાઓ સુશ્રી ! તમારી સામે હું તો અલ્પ બુદ્ધિનો અને અણસમજું માણસ છું. તેમ છતાં આ સાઈમહારાજને અર્પણ કરેલા શબ્દોનું ધર્મકાર્ય છે. માટે શ્રોતાઓએ તેનો ફૂતશ બુદ્ધિથી આદર કરવો. બધાના હિત ખાતરનું આ શાબ્દિક ધર્મકાર્ય મારા જેવા મંદબુદ્ધિનાને આગળ ધરીને પોતાના કાર્યને પૂરેપૂરું સમજનાર શ્રી સાઈમહારાજ મારી પાસે પૂર્ણ કરાવી રહ્યા છે. મને એકાગ્ર કરીને સાઈચરણોમાં વંદન કરીને જે કોઈ આ મહામંગલદાયી અને પાવનકારી કથા સાંભળશે અને જે ભક્ત ભક્તિમય થઈ પોતાનું હિત સાધવા માટે ઉત્સુક હશે તથા એકાગ્ર ચિત્તે અને એકાગ્ર મનથી તેનું સેવન કરશે તેનું ધારેલું કાર્ય મહારાજ જ પાર પાડી આપશે. તેવી જ રીતે આ સંસારનાં કાર્યો અને પરલોકનાં કાર્યો પૂર્ણ કરી આપશે અને એને ફૂતાર્થ કરશે. સાઈમહારાજ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

માટે આપેલી સેવાઓ કયારેય વ્યર્� જવાની નથી. ચુંમાળીસમાં અધ્યાયના અંતે સાઈનું નિર્વાણ સાંભળ્યું છતાં આ પોથીની પ્રગતિ આગળ ઘણી વધી રહી છે. શું આ ચર્મતકાર નથી? પાછલા અધ્યાયોમાં યથાક્રમ સાઈનાથના નિર્વાણના વર્ણનનો અંત આવ્યો. છતાં સાઈલીલાનો કાંતવાવાળો કરોળિયો પળજર માટે પણ વિશ્રાંતિ લેવા તૈયાર નથી. ખરું જેતાં એમાં કોઈ પણ જાતનું આશ્વર્ય નથી. મરણ તો ફક્ત દેહને હોય છે. આ સાઈમહારાજ તો દેહથી ઘણા જ પર હતા. પહેલાંની માફક પાછા તેઓ અવ્યક્તમાં જઈને બેઠા છે. દેહ ગયો, આકાર અલોપ થયો છતાં અવ્યક્તદ્વારે જેવા હતા તેવા જ તે રહ્યા છે. દેહત્યાગ પછીની તેમની લીલાઓથી પણ ભક્તો પરિચિત છે. લીલાઓ પણ અસંખ્ય છે, વર્ણન કરતાં ગ્રંથનો વિસ્તાર વધે નહીં, માટે ફક્ત સાર જ શ્રોતાઓની સામે મૂકીએ. (ઓ. ૪-૨૦)

ઘન્ય છે તે અમારાં ભાગ્યની સ્થિતિ કે જેને લીધે બાબા શિરડીમાં અવતર્યા. તે જ સમયે અમને તેમના સત્તસંગનો લાભ વારંવાર સહેલાઈથી મળ્યો. આમ હોવા છતાં જે અમારી સંસારમાંથી નિવૃત્તિ થઈ નહીં અને દુશ્શર પ્રત્યેનો પ્રેમ દફથથ્યો નહીં તો એનાં કરતાં વધારે અધઃપતન બીજું કયું હોઈ શકે? બધી દશોદશ ઇન્દ્રિયોને સાઈની જ ભક્તિ પ્રાપ્ત થાય તે જ તેમને માટેના ભજનની ખરી સ્થિતિ હોઈ શકે. આમ પણ આંખોથી સાઈની મૂર્તિ જેતી વખતે બોલવા માટે મોકું સિવાઈ જવું જેઠાએ. કાન વડે સાઈનું કીર્તન સાંભળતી વખતે જુભ જાણે કેરીના રસનો મધુર સ્વાદ ચાખવામાં મશ્શ થાય છે તેમ થવી જેઠાએ અને સાઈનાં ચરણોનો સ્પર્શ કરતી વખતે નરમ ગાહી જેવો સ્પર્શ છોડવાનું મન નહિ થવું જેઠાએ. સાઈથી જે ક્ષાળભર માટે પણ દૂર થાય તે કંઈ સાઈભક્ત કહી શકાય? તેવી જ રીતે સંસારથી જે વિરક્ત નથી તેને શું સાઈચરણોમાં આસક્ત કહી શકાય? એક પોતાના પતિ સિવાય રસ્તામાં સામે મળનારને સસરા, દિયર કે ભાઈ સમજુને પતિવ્રતા ક્ષી તેને નમરસ્કાર કરવા માટે તૈયાર થઈ જય છે. તેનું મન નિશ્ચલ હોય છે. પોતાનું ઘર તે કદાપિ છોડતી નથી. પોતાના પતિ ઉપર તેને અપાર પ્રેમ હોય છે. બીજા પુરુષને પોતાનો પતિ સમજુને તેની સામે જોવાની પણ તેને ઇચ્છા નથી હોતી. તેને માટે પોતાનો પતિ જ એનો પરમેશ્વર હોય છે. બીજે કોઈ એની બરાબરી કરી શકતું નથી. તેની પ્રત્યેની જ એની એકનિષ્ઠ જવાબદારી અને પ્રીતિ હોય છે. શિષ્યોનો પણ ગુરુચરણોમાં આવો જ પ્રેમભાવ હોય છે. શિષ્યના પ્રેમને ઉપમા આપવામાં આવે છે. પરંતુ શિષ્યના ગુરુપ્રેમની કોઈ સીમા જ નથી હોતી. તે પ્રેમના મહિમાની ઉત્તર શિષ્યને જ ખબર હોય છે. (ઓ. ૨૧-૩૦)

જેમની સંસારમાં જ કોઈ મદ્દ મળી શકતી નથી, તેઓ પરમાર્થ માટે સહાય કેવી રીતે કરી શકવાના છે? વેવાઈ હોય કે જમાઈ હોય, પત્ની હોય અથવા અન્ય કોઈના ભરોસે રહેવું નહિ. માબાપ આનિયતાથી માયા લગાડે છે. વારસદાર પુત્ર ધનદોત્તત માટે ટાંપીને બેઠા હોય છે. જ્યારે પત્ની પોતાનું સૌભાગ્ય ટકાવી રાખવાની ચિંતામાં હોય છે. પરંતુ પરમાર્થમાં સહકાર આપનાર કે જેડીદાર કોઈ મળતો નથી. તો જેના થકી પરમાર્થ પ્રાપ્તિ કરી શકાય તેનો વિચાર કરી નિર્ણય કરવામાં આવે તો છેલ્લે તે પણ આપણી પોતાની ઉપર જ નિર્ભર થાય છે. નિત્ય શું અને અનિત્ય શું તેની ઉપર ગૂઢ ચિંતન કરીને આ લોકનાં કે પરલોકનાં ફળ લોગવવાની ઇચ્છા છોડી દઈને શરૂ, દમ વગેરે છ ના સમુદ્દ્રાને સાધ્ય કરીને જે મોક્ષ મેળવવા માટે પ્રયત્નો કરે છે તે ઘન્ય થઈ જય છે. બીજની આશા છોડીને મક્કમ આત્મવિશ્વાસ કેળવીને જે કોઈ પોતે પોતાને માટે તૈયારી કરે છે તે જ પરમાર્થ સાધી શકે છે. બ્રહ્મ તે જ એક ટકનાર સત્ય છે. આ જગત તો કાયમ રહેનાર નથી. ગુરુ તે જ માત્ર બ્રહ્મ છે. બધી અનિત્ય વાતોનો ત્યાગ કરીને ગુરુ જ ફક્ત ધ્યાન કરવા માટે યોગ્ય છે. એવી સતત ભાવના મનમાં રાખવી એ જ પરમાર્થ માટેનું સાધન છે. ફાલતુ વસ્તુઓનો ત્યાગ કરવાથી સંસારમાં વૈરાગ્યની ભાવના ઉત્પન્ન થાય છે. સદ્ગુરુ જ પ્રતિનિધિત્વ સભર લાગવા માંડે છે, અને બધા જ પ્રાણીમાત્રમાં એક જ દુશ્શરનો વાસ છે, એવો વિશ્વાસ બેસે છે. એને જ એકાત્માની ઉપાસના કહેવામાં આવે છે. ડરથી અથવા પ્રેમથી જેને જેનું સદાયે

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ધ્યાન રહે છે તે ધ્યાન કરનાર પોતે જ જે પ્રમાણે કંસ, રાવણ અને કીડો એ અનુકૂળ કૃષણ, રામ અને ભમરો બની ગયા, તેવી જ રીતે ધ્યાન કરેલી વસ્તુ જ દ્યેય થઈ જય છે. ધ્યાન કરતી વખતે દ્યેય સિવાય બીજુ કોઈ પણ બાબત મનમાં હોવી જેઠાં નહીં. મોક્ષની પ્રાપ્તિ માટે ધ્યાન લેવી બીજુ કોઈ સાધના નથી. આ ધ્યાનનો જે પોતાની જલ્દે જ અભ્યાસ કરે છે તેને મુક્તિ તરત જ મળે છે. પછી ત્યાં જન્મ-મરણ ક્યાંથી હોઈ શકે? ત્યાં જીવભાવ તો સંપૂર્ણ વિસરાઈ જય છે, દુનિયાદારી તરફ ધ્યાન ઘટવા માંડે છે અને આત્માના અનુસંધાનમાં ધ્યાન લાગવાથી સુખ મળે છે. માટે જ કહું છું કે, પોતાના ગુરુના નામનો જલ્દ કરવાથી પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. અને પ્રાણીમાત્રામાં ભગવાનનાં દર્શન થાય છે. નામનો મહિમા આના કરતાં બીજે વિરોધ કર્યો હોઈ શકે? જેના નામનો આવો મહિમા છે, તેને મારા સદ્ગુરૂપૂર્વકનાં નમસ્કાર કરને. તેને હું કાયા, વાચા અને મનથી શરણે જાઉ છું. આ અર્થને સ્પષ્ટ કરી બતાવવા માટે એક વાત શ્રોતાઓને હવે કહી રહ્યો છું. તો એને એકચિત્તે પોતાના હિત ખાતર સાંભળવી. (ઓ. ૩૧-૪૨)

સ્વ. કાકાસાહેબ દીક્ષિત સાઈ સમર્થની આજાથી નિયમિત રીતે એકનાથી ભાગવત વાંચતા હતા, તે સૌ જણે છે. એક દિવસે દીક્ષિતે કાકા મહાજનીના મુંબથ મુકામે ચોપાટી ઉપર આવેલા બંગલે જમવાનું પતી ગયા બાદ આ પોથી નિયમ પ્રમાણે વાંચવા માટે લીધી. અનુકૂળ પ્રમાણેનો એ ભાગવતનો અદ્વિતીય અને સુંદર એવો અધ્યાય બીજે સાંભળીને શ્રોતાઓનાં મન સુખ પામ્યાં. કાકા મહાજની બાબાશ્રીના ભક્ત માધવરાવની સાથે એકચિત્તે એ ભગવદ્બક્તિ સાંભળવા બેઠા હતા. સદ્ગુરૂએ એ કથા પણ અતિશય રસપૂર્ણ હતી અને જેને લીધે શ્રોતાઓની હોંશ પૂરી થઈ અને ભાગવત ભક્તિ તરફનો પ્રેમભાવ વધે તેવી ચોખવટ થઈ. ઋષભકુળની કીર્તિ વધારનાર નવબંધુ કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પિપ્પલયાન, અવિહોત્ર, દ્રમિલ, ચયસ અને કરભાજનનું જ મધુર આનંદદાયક અને બોધપ્રદ કથન નીકળ્યું. તે નવે નવ ભગવદ્ સ્વર્ગ હતા. તેમનામાં અપાર ક્ષમા અને શાંતિ હતી. ભગવત ધર્મનો મહિમા સાંભળીને જનકરાજ સ્તરથી અને ચક્કિત થઈ ગયા, શાશ્વત કલ્યાણ એટલે શું, હરિની પરમભક્તિ તે કથી, હરિની માયા પાર કરવી સહેલી કેવી રીતે થાય? તો ગુરુનાં ચરણ એ જ અતિ કલ્યાણકારક હોય છે. કર્મ અને અકર્મ આ બધાનો સાર એક જ કે ગુરુ એ જ પરમાત્માનું રૂપ છે. અને ગુરુભક્તિ કરવી તે જ ભગવદ્ધર્મ છે. દુભિતનાથે હરિનું શ્રી વિષણુનું ચરિત્ર કહીને દરેક અવતારનું વિશેષજ્ઞપે વર્ણન કર્યું છે. તેવી જ રીતે પૂર્ણ અવતાર કેવી રીતે ઓળખવો તે કહીને નારાયણના રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી આગળ ચમેસ જનકરાજ માટે ભક્તિ ન કરવાચાળાઓ માટે દુર્ગતિનું વર્ણન કર્યું છે. અને વેદોએ કહેલાં કર્માન કરવાથી સર્વસ્વનો નાશ કેવી રીતે થાય છે તે પણ કહ્યું છે. બધાનાં હૃદયમાં ભગવાનનો વાસ છે માટે કોઈનો પણ દ્વેષ કરશો નહિ. દરેકના દેહમાં પરમેશ્વરને જોવો. તેના વીના થોડી પણ જગ્યા ખાતી નથી. છેલ્સે નવમા કરભાજને, કૃત, તેતા અને દ્વાપર યુગોમાં કયા કયા દેવોની મૂર્તિની આરાધના અને પૂજા કરવી જેઠાં તે બાબતનો નિર્ણય કહ્યો છે. કલિયુગમાં હરિનાં કે ગુરુનાં ચરણોનું સ્મરણ કરવું તે એક જ ઉત્તમ સાધન છે. તેને કારણે સંસાર કેવી રીતે તરવો અને પૂર્ણજન્મનો ભય દૂર થઈ જય છે.

શરણાગત થવા માટે હરિશુરુચરણ જ તેમનું સંરક્ષણ કરનારું સ્થાન છે. (ઓ. ૪૩-૪૭)

આમ પોથી પૂરી થતાં કાકાસાહેબે પ્રશ્ન કર્યો, ‘કહેવી પણ ભાઈ આ નવનાથની કરણી? તેમની વૃત્તિની કલ્પના જ કરી શકાય નહીં.’ પછી પ્રેમથી તેમણે માધવરાવને કહ્યું, ‘કેટલી અધરી આ ભક્તિ? અમારા જેવા મૂર્ખાંઓ માટે તે પાળવાની શક્તિ કયાંથી? અમારા હાથે તો આ જન્મોજન્મનાં પણ થનાર નથી. કયાં એ મહા પ્રતાપી નાથ અને કયાં આપણા જેવા જન્મનજીત પાપી! આ ભક્તિ કંઈ સહેલી છે? મૂર્તિમંત સત્ય અને જ્ઞાન જેને હોય છે તે ધન્ય થાય છે. આવી ભક્તિ અમને પ્રાપ્ત થરો ખરી? તેને માટે કોઈ રસ્તો છે ખરો? હું તો હવે હતાશ થયો છું. અને મારા હાથપગ ગળી ગયા છે. આપણો આ જન્મ વેડફાઈ ગયો હોય એવું લાગે છે.’ કાકાસાહેબ સ્વભાવથી ઘણા જ પ્રેમાળ હતા. તેમના જીવને આવી વિરહની

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ચિંતા કેમ થવા લાગી ? સારી એવી સ્થિર વૃત્તિ ચંચળ શા માટે થવી જોઈએ ? શામાના મનમાં મુંજવણ વધી ગઈ. શામા એટલે માધવરાવ, જેમને કાકા ઉપર મનથી ખૂબ પ્રેમ અને લાગણી હતી. તેમને કાકાનો આ સ્વભાવ અને તેમની ઉપર થયેલો લાચારીનો આ પ્રભાવ ગમ્યો નહીં. તેથી તેઓ બોલ્યા, ‘જેણે બાબાડ્યી અલંકાર ઘારણ કરી ફરવાનું ભાગ્ય મળ્યું હોય, તેણે આવું દ્વારાજનક અને લાચાર મૂકું શા માટે કરવું જોઈએ ? વ્યર્થ છે તેમનું જીવતા રહેવું ! સાઈચરણોમાં જેને અટલ શ્રદ્ધા છે તેના મનમાં આવી ગરબદ શા માટે ? નવનાથની ભક્તિ પ્રબળ છે. તો શું આપણી ભક્તિ પ્રેમળ નથી ? એકનાથ મહારાજના વિવરણ સાથેનો ભાગવતનો અગિયારમો સ્કંધ અને ભાવાર્થ રામાયણનો પાઠ નિત્ય વાંચવો. તેવી બાબાની એકદમ સ્પષ્ટ આજા તમને શું નથી ? તેવી જ રીતે ભગવાનના અને ગુરુનાં ચરણોનું સ્મરણ કરતા રહેવું તે મહારાજની સર્વ સામાન્ય શિખામણ નથી ? તેમાં જ આપણા સંસારનો ભય પાર કરી જવાની સાધના છે. પછી તમારી ચિંતાનું કારણ શું છે ?’ છતાં કાકાને પેલા નવ યોગીઓનાં ચરિત્રો તલવારની ધાર ઉપર ચાલવા જેવા લાગ્યાં. તેમના નિયમો આપણા જેવા થોડા ભક્તો પણ સાધરો કે નહીં તે જ ચિંતા સતત રહેતી. તેમને મનમાં એમ થયું કે નવ યોગીઓની ભક્તિ જ અતિ શ્રેષ્ઠ છે. આપણામાં તે કેવી રીતે પ્રગટ થશે ? એવું જે થાય તો ઈશ્વરને પામ્યાનો આનંદ મળે. કાકાને આ ચિંતા ખાઈ જવા લાગી અને ઉઠતાં બેસ્તાં તે જ વિચાર મનમાં ધોળાવા લાગ્યો. એના બીજે જ હિવસે ચમત્કાર થયો, જે શ્રોતાઓએ સવિસ્તાર સાંભળવો. (ઓ. પ૮-૭૦)

અનુભવનું આશ્રમ્ય જુઓ ! તે સમયે સવારે આનંદરાવ, જેમની અટક ‘પાખાડે’ હતી, તેઓ માધવરાવને શોધતા આવ્યા. તે પણ બિલકુલ ભાગવત વાંચનના સમયે જ આવ્યા, અને માધવરાવ પાસે બેસીને પોતાના સ્વર્ણની નવાઈ કહેવા લાગ્યા. અહીંથી પોથીવાંચન ચાલુ હતું અને ત્યાં બંને જણા ધીમા અવાજે એકબીજની સાથે વાતોમાં પડ્યા. તેને કારણે શ્રોતા અને વક્તાની મનની એકાગ્રતા બંગ થઈ. આનંદરાવ મનના ચંચળ હતા. તેઓ માધવરાવને પોતાના આવેલ સ્વર્ણની વાત કરવા લાગ્યા. આમ તેઓ બંને ગુપ્તસુપ્ત કરતાં બેઢા હતા એમાં થોડો સમય પોથી વંચાયા વીના પડી રહી. પછી કાકાસાહેબે તેમને પૂછ્યું, ‘એવી તે વળી શી નવાઈ છે ? તમે બંને આજે બહુ જ આનંદિત દેખાવ છો ? એમને પણ શું છે તે કહોને ?’ તે સાંભળી માધવરાવ બોલ્યા, ‘કાલે તમને શંકા થઈ હતી ને ? હવે તેનું સમાધાન જુઓ. સંસાર સાગર પાર ઉત્તરવાનું ભક્તિનું લક્ષ્ણ જુઓ. પાખાડેને બાબાએ સ્વર્ણ અને દર્શન કેવી રીતે આપ્યું તે સાંભળો. તમારી શંકાનું નિવારણ થઈ જશે. અને ગુરુચરણોમાં નમસ્કાર કરવા જેટલી જ ભક્તિ પૂરતી હોય છે, એ વસ્તુ જરૂર સમજશે.’ તે સ્વર્ણનો ચિતાર સાંભળવાની બધાને પ્રબળ ઈચ્છા થઈ, વિશેષ કરીને કાકાસાહેબને કારણ કે તેમને જ પ્રથમ શંકા હતી. બધાની ઈચ્છા જોઈને આનંદરાવે સ્વર્ણની વાત શરૂ કરી. સ્વર્ણ અને શ્રદ્ધાયુક્ત મનોવૃત્તિવાળા શ્રોતાઓને આશ્રમ્ય થશે. ‘એક જગ્યાએ મહાસાગરમાં કમરભર પાણીમાં હું ઊભો હતો, ત્યાં કલ્પના પણ ન કરી શકાય તેવી રીતે શ્રી સાઈસમર્થ મારી આંખોની સામે દેખાયા. રત્નજડીત સિંહસન હતું અને તેની ઉપર સાઈસમર્થ બિરાજમાન હતા. તેમનાં ચરણો સમુદ્રના પાણીમાં દૂબેલાં હતાં. આવું તેમનું સુંદર ઝપ્પ મેં જેયું. એમનું આવું મનોહર ઝપ્પ જોઈને મને ખૂબ જ સારું લાગ્યું. આ એક સ્વર્ણ જ છે એનું મને ભાન જ રહ્યું નહિ અને મહારાજના દર્શનથી મન અતિશય પાવન થઈ ગયું. શું એ યોગાનુયોગ કે આશ્રમ્ય ! માધવરાવ ત્યાં જ ઊભા હતા. મને તેઓ ભારપૂર્વક બોલ્યા, ‘આનંદરાવ ! મહારાજને પગે લાગો.’ મેં તેમને જવાબ આપ્યો કે, ‘મારી પણ ખૂબ જ ઈચ્છા છે, પરંતુ તે ચરણો તો પાણીમાં દૂબેલા છે. મારા હૃથમાં ભલા એ કેવી રીતે આવશે ? ચરણો પાણીમાં દૂબેલા હોવાને કારણે મારું મસ્તક તેમનાં ચરણો ઉપર કેવી રીતે મૂકું ? મારે હવે શું કરવું જોઈએ તે સમજાતું નથી.’ તે સાંભળીને માધવરાવે સાઈબાબાને શું કહ્યું તે સાંભળો, ‘હેવા ! તારા પાણીમાં દૂબેલા પગ બહાર કાઢ જોઉં !’ માધવરાવે આમ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કહેતાં જ બાબાએ તરત ચરણો બહાર કાઢ્યા અને આનંદરાવે પણ ક્ષણનોથ વિલંબ ન કરતાં એ તેમને પકડીને ન મસ્કાર કર્યા. આમ ચરણ પકડવાથી બાબાએ આશીર્વાદ આપ્યા, ‘જા.... રે તારું કલ્યાણ થશે, ડરવાનું કોઈ જ કારણ નથી.’ બાબાએ બીજું પણ કહ્યું, ‘જે ! મારા શામાને રેશમી કિનારવાળું એક ધોતિયું તું આપે, જેથી તને સુખ પ્રાપ્ત થશે.’ તે આજા શિરોમાન્ય રાખીને હું એ રેશમી કિનારવાળું ધોતિયું લઈ આવ્યો છું. કાકાસાહેબ ! આપ એ પોતાના હાથે માધવરાવ લે એવું કરો. મારી આ વિનંતી માન્ય રાખો. આ ધોતિયું માધવરાવે પહેરે એવું કરો અને આમ કરવાથી મારા મનને અતિ આનંદ થશે અને તમારું મારા ઉપર ઋણ રહેશે.’ આનંદરાવની આ વાત માધવરાવે પણ પોતે સાંભળી હતી. કાકાસાહેબ તે વચ્ચે તેમને આપવા લાગ્યા ત્યારે તેઓએ એનો સ્વીકાર કર્યો નહિ. તેમનું એવું કહેવું હતું કે આ તો આનંદરાવને આવેલું એક સ્વપ્ન છે. મને એ બાબતનો કોઈ અણસાર તો મળવો જ જેઠાંએ. કોઈ પણ પ્રકારનું દાંત કે સ્વપ્ન આવ્યા વગર મારે તે વચ્ચે સ્વીકારવું નથી. એ સાંભળીને કાકાસાહેબ બોત્યા, ‘હવે આપણે બાબાએ બોલેલાં તે સત્ય વચ્ચનોનો અનુભવ કરી લઈએ. ધોતિયું લેવું યોગ્ય છે કે અયોગ્ય છે એ ચિંઠીઓ નાખવાથી ખબર પડશે. જેવી ચિંઠી બાબા ઉચ્કાવશે તેવી જ તેમની આજા હતી એવું આપણે માની લઈશું.’ આમ કહીને તે પ્રમાણે વર્તવા માટે તેમણે બાબાનાં ચરણ પાસે ચિંઠીઓ મૂકી. (ઓ. ૭૧-૮૫)

કાકાસાહેબને સંપૂર્ણ ભરોસો સાઈબાબા ઉપર હતો. કોઈ પણ વસ્તુના પ્રયોજન પહેલાં તેઓ સાઈની પ્રેરણા મેળવતા અને ત્યારબાદ જ આગળ ઉપરનો વહેવાર કરતા. આ તો બાબાની હ્યાતી હતી ત્યારની વાત થઈ. પરંતુ તે પછી પણ આ કમ તેમના ગયા બાદ પણ ચાલુ રહ્યો હતો. ચિંઠીઓ ફેંકીને જ તેઓ આજા મેળવતા, અને તે જ પ્રમાણે ખાત્રીથી તેઓ વર્તતા. પછી એ કાર્ય મોટું હોય કે નાનું. ચિંઠી દ્વારા આજા લીધા વીના તેઓ પ્રાણ નીકળી જય તો પણ કાંઈ કરતા નહીં. બાબાની આજા જ તેમને માટે બધી જ કસોટીઓનું પ્રમાણ હતું. આ દેહ જ જ્યારે આપણો નથી, જેને એક વખત બાબાનાં ચરણોમાં વહાવી દીધો છે તો પછી તેની હાતચાલ ઉપર આપણો શો અધિકાર ? જુઓ ! આ એક ભાવનાને કારણે લાખો ઢાપિયાની કમાઈ ઉપર લાત મારી પણ તે નિશ્ચય તેમણે ભરતાં ચુંધી કાયમ રાખ્યો. ‘તારું આ ઈમાન-મારા ઉપરની અનન્ય શ્રદ્ધા ફળદાઈ નીવડશે. તારે માટે તો હું વિમાન મોકલાવીશ. તેમાં બેસાઈને હું તને લઈ જઈશ. તું તારા મનથી નિશ્ચિંત જ રહે.’ બાબાનાં આ ફૃપાવચનો પાછળથી અક્ષરે અક્ષર સાચાં પડયાં. કાકાસાહેબનું અવસાન કેવી અપૂર્વ સ્થિતિમાં થયું એ સાઈલીલાના વાંચકોને ખબર જ છે. તે સ્થિતિની યાદ આવતાં, તે વિમાનમાં જવું તે વળી શું ? અને ગુરુના નામ સ્મરણ સાથે ભરણ તે વળી શું તે વિચાર જરૂર આવે છે. આમ તો દીક્ષિત જતે નિશ્ચયના પાક અને ખબરદાર હતા અને એમનું ચિત્ત સદાને માટે સાઈચરણોમાં વ્યસ્ત રહેતું હતું. પોતાના અંત મિત્રોને પણ આવી જ શિખામણ આપતાં આપતાં તેઓ ગુરુચરણોમાં વિલીન થયા. (ઓ. ૮૬-૧૦૨)

સર્વનું કલ્યાણ થાઓ. આમ સંત અને સજજનોની પ્રેરણા પામેલા, હેમાઉપંત રચિત, શ્રીસાઈ સમર્થના.

સત્ય ચરિત્રનો ‘શ્રી ગુરુચરણ-મહિમા’ નામનો પિસ્તાળીસમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે.

શ્રી સદગુરુ સાઈનાથને અર્પણ.



## અધ્યાય રૂપનું અર્થ વિવરણ

સાઈબાબા જ્યારે શિરડીમાં હૃત્યાત હતા, તે વખતે દેરેક દેરેક બાબતમાં તેમની સલાહ લેવાની અને એ જ પ્રમાણે વર્તવાની મોટા ભાગે ભક્તોને ટેવ હતી -

સાઈનાથ મહારાજના દેહત્યાગ પછી એવી એક સ્થિતિ નિર્માણ થઈ, કે જેને કારણે કાકાસાહેબ દીક્ષિત જેવા ભક્તોએ પણ ઉપર જણાવ્યા પ્રમાણે મહારાજની તસ્વીરની સામે ચિઠ્પીઓ મૂકીને તેમની સલાહ લેવી એવી શરૂઆત થઈ અને તે પદ્ધતી ખૂબ જ યથાર્થી નીવડી. જેનો અનુભવ દેરકને થયો. ભાઉસાહેબ ધૂમાળ, રધુવીર ભાસ્કર પુરંદર વગેરે ભક્તો પણ એ જ પદ્ધતિનો ઉપયોગ બાબાની આજા મેળવવા માટે કરતા રહ્યા. આસ તો મદ્રાસના સ્વ. પ. પૂ. નરસિંહ સ્વામી, જેમણે ૧૯૭૭ થી ૪૦ ની સાલ દરમિયાન અંગેળુમાં સાઈબાબાના ચરિત્ર ઉપર અનેક સંશોધન પૂર્ણ પુસ્તકો લખ્યાં અને ભારતના દક્ષિણ ભાગમાં સાઈનાથ મહારાજનો ખૂબ પ્રચાર કર્યો. તેઓ પણ ચિઠ્પીઓ નાખીને મહારાજશ્રીના વિચારો જાણી લેતા અને તેમને હંમેશા એકદમ યોગ્ય અને કલ્યાણકારી ઉત્તરો મળતા હતા. આ બાબતનો તેમના ચરિત્રમાં તેમણે ચોખ્યો ઉત્સેખ કર્યો છે.

જ્યારે આવા મોટા મોટા પ્રખર ભક્તો આવી સાઢી સરળ યોજેલી યુક્તિ અજમાવતા અને એના જવાબ અપ્રત્યક્ષરૂપે સાઈમહારાજ આપવા માટે જ્યારે તૈયાર રહેતા, ત્યારે લોકો પોતાનાથી શ્રેષ્ઠ ગણાતા એકાદા સાઈ ભક્તને ત્યાં જઈને તેમના પગ ઉપર માથું મુકીને તેમની મારફતે બાબાને શા માટે પ્રક્રષ્ટ પૂછવવા માંગે છે તે સમજનું નથી. હું મારા પોતાના રૂપ વર્ણના અનુભવો ઉપરથી છાતી ઢોકીને કહું છું કે આ પ્રકારે ખરી શ્રદ્ધાથી કોઈ પણ ભક્ત જે પોતાની અંગત મૂંઝવણોના પ્રશ્નો પૂછશે તો મહારાજ તરફથી આજે પણ તેનો જવાબ મળી શકે છે. ફક્ત તેને માટે નીચે જણાવેલ શરતોનું પાતન થવું જોઈએ.

(૧) પ્રક્રષ્ટ પૂછનારાએ સાઈમાલિક જ પોતાના એકમાત્ર તારણહાર છે તે ભાવનાથી તેમના શરણે જવું જોઈએ અને શ્રદ્ધા અને સભૂરી રાખીને તેનો ઉત્સેખ મેળવવો જોઈએ.

(૨) એક વખત ચિઠ્પી નાખી ને પ્રક્રષ્ટ પૂછ્યા બાદ એનો ઉત્તર મળતાં તે પ્રમાણે જ વર્તવું જોઈએ. સમજે કે જવાબ મનનો ધારેલો ના નીકળે અથવા તો બીજા વ્યક્તિ દ્વારા કોઈ કારણસર કહીને એની વિશુદ્ધ વર્તવાની સલાહ આપે કે તે માટે જુદ કરે છતાં આપણો નિશ્ચય છોડવો ન જોઈએ. તેના કરતાં તો પ્રક્રષ્ટ પૂછવો જ નહીં.

(૩) મળેલ જવાબ યોગ્ય છે કે નહિ તેની પ્રતીતિ મળે ત્યાં સુધી ધીરજ રાખવી જોઈએ. શરૂઆતમાં એકાદ વખત ઉત્સે જ અનુભવ મળે તેથી ભક્તોએ ગભરાઈ ન જતાં, સાઈમાલિક છેલ્લે પોતાનું કલ્યાણ જ કરવાના છે, એની દઢ શ્રદ્ધા મનમાં રાખવી જોઈએ.

(૪) એક વખત પ્રક્રષ્ટ પૂછ્યા બાદ તેનો જવાબ ગમે કે ન ગમે, તેને ફરીથી પૂછવા માટે એ જ પ્રક્રષ્ટ કરવો નહીં. સાઈબાબા પોતાનો જવાબ ક્યારેય બદલતા નથી.

(૫) પ્રશ્નો એકસરખા અને નાની નાની બાબતો માટે પૂછીને મહારાજને વગર કામનો ત્રાસ આપવો નહીં. ખૂબ જ અંગત અને કઠીન સમસ્યા હોય તો જ તેની રજૂઆત સાઈમાલિકની સામે કરવી. ક્યા નંબરની ટિકિટ લઈશું તો લોટરી લાગશે, ક્યા ઘોડા ઉપર શરત જતાશે, બાળક છોકરો હશે કે છોકરી? આવા મૂર્ખાંભી ભરેલા પ્રશ્નો પૂછવા નહિ. મહારાજ કોઈ બનનરમાં બેઠેલા જ્યોતિષી નથી અને ત્વરિત વગર કષે પૈસા કમાવાના ખોટા માર્ગે કોઈને ઉતેજન પણ આપતા નથી. સાત્વિક વૃત્તિના ભક્તોને સંકટમાંથી ઉગારવા માટે, વિકટ સમસ્યાઓવાળી પરિસ્થિતિમાં છોડવવા માટે અને

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સંસારના યોગ્ય એવા નિર્ણયો લેવા માટે તેઓ આજે પણ માર્ગદર્શન કરી રહ્યા છે. અને તેમાં પણ ખાસ કરીને આધ્યાત્મિક બાબતોને લગતા પ્રશ્નો અને પરમાર્થના માર્ગની સમસ્યાઓના જવાબો તેઓ ખૂબ જ મનથી અને પ્રેમથી આપે છે.

(૬) પ્રશ્ન પૂછવા માટે શિરડી અથવા કોઈ શ્રેષ્ઠ સાઈભક્તને ત્યાં જવાની કંઈ જરૂર નથી. કોઈ પણ સાઈભક્ત પોતાના ઘરે બાબાની છબી કે મૂર્તિની સામે તેમનાં ચરણો ઉપર ચિઠી મૂકાવીને કોઈ એક બાળક દ્વારા તેમાંની એક ચિઠી બેંચાવી બાબાનું સચોટ માર્ગદર્શન આજે પણ મેળવી શકે છે.

હવે પહેલાની એ પદ્ધતિ એટલે ચિઠ્પવાળી આ યુક્તિ બંનેએ એટલે કે આનંદરાવે અને માધવરાવે અપનાવી. કારણ કે બંનેને કાકાસાહેબ ઉપર અતિશય પ્રેમ હતો. ત્યારબાદ સમય ન વેદફિતાં તેમણે ચિઠીઓ લખી નાખી. એક ચિઠીમાં, ‘ધોતિયું લેવું’ અને બીજી ચિઠીમાં, ‘એનો કરવો અસ્વીકાર’ એવું લખીને સાઈમાલિકના છાયાચિત્રનાં ચરણોમાં મૂકી હીધી. ત્યાં એટલામાં જ ત્યારા રહેલા એક બાળકને બોલાવીને તેમાંની એક ચિઠી ઉચ્કાવતા માધવરાવે ધોતિયું લઈ લેવું એવી આજા થઈ. બધાને આનંદ થયો. અને કાકાસાહેબે એ રેશમી કિનારીવાળું ધોતિયું માધવરાવને પહેરાવ્યું. આનંદરાવનું આ સ્વખન હતું અને માધવરાવની આ ચિઠી હતી. બંનેનો એકબિલ ઉપર વિશ્વાસ બેઠો અને બંને સુખ સંપત્ત થયા. તેમને આ મળેલો પરમાણંદ તો મનમાં સમાતો ન હતો. માધવરાવ મનથી ખુશ થયા, અને આનંદરાવને પણ તે વાતનો સંપૂર્ણ સંતોષ થયો. સાઈભક્તિની અને એની વૃદ્ધિની પરાકાશ થઈ, અને કાકાની શંકાનું પણ નિરાકરણ થયું. (ઓ. ૧૦૩-૧૧૦)

આ આખી કથાનો સાર એ જ છે કે, પૂર્ણ વિચાર કરીને ગુરુનાં ચરણો ઉપર મસ્તક ઝૂકાવ્યા બાદ ગુરુના મુખેથી નીકળેલા શબ્દો તરફ ધ્યાન આપવું. આપણા કરતાં પણ આપણી અવસ્થા, આપણા આ જગતમાં કરવાનાં કાર્યો અથવા તો મનમાં ઉદ્દ્દ્દુદ્દુનારા વિચારો એ આપણા ગુરુ સવિસ્તારપણે જાણતા જ હોય છે. તેમજ આપણો ઉદ્ધાર કેવી રીતે કરવો તે બાબતની પણ તેમને સંપૂર્ણ ખબર હોય છે. જેવો રોગી તેવું જ તેનું નિદાન અને તેવી જ તેની દવા અને અનુપાન, સદ્ગુરુ શિષ્યને સંસારઢી રોગના નિવારણ માટે આપતા હોય છે. ગુરુ પોતે જે આચરણ કરે છે તે તેનું અનુકરણ આપણે કરવું નહીં અને તે પ્રમાણે વર્તવું પણ નહીં. પરંતુ તેમના મુખમાંથી જે આપણે માટે શબ્દો નીકળે તેની ઉપર ધ્યાન આપવું, વિશ્વાસ મૂકવો અને તેમનું જ ચિંતન સહાને માટે કરવું. તેમના મુખેથી નીકળેલા શબ્દરૂપી બોલ તમારા પોતાના ઉદ્ધારનું કારણ બનશે એ વાત સહા ચાદ રાખણે. ગુરુ જે પોથીપુરાણ વાંચવા માટે કહે છે તે એમનાં જ વચ્ચનોનું સ્પષ્ટીકરણ હોય છે. આપણે તો ફકત ગુરુ ઉપદેશ જ ધ્યાનમાં રાખવો. તે જ આપણે માટે વેદવાક્ય કે શબ્દ પ્રમાણ સમજવું. કોઈ પણ સંતના શબ્દો ધ્યાનપૂર્વક સાંભળવા. તેનો અનાદર કદાપિ કરવો નહીં. પરંતુ આપણી મા ગુરુમાવતી જેવી રીતે આપણું કાળજીપૂર્વક જતન કરે છે, એવું બીજું કોઈ કરી શકશો ખરું કે ? પોતાના બાળક માટે માયાનું ખરું બેંચાણ તથા ઉમળકો અને મભતા તેનામાં હોય છે. બાળકને તેના પોતાના સુખ અને સાહેબીની કલ્પના પણ નથી હોતી. બાળક માગે તે પ્રેમ અને લાડ એ માઉલી પૂર્ણ કરતી હોય છે. આ સૂચિમાં સંતો ગળાય નહીં એટલા છે. પરંતુ ‘આપણો બાપ તે આપણો બાપ’ આ સાઈનાથ મહારાજના મુખમાંથી નીકળેલા શબ્દોમાં જે કરુણાનો આતાપ છે તેને હદ્યરૂપી કાગળ ઉપર કોતરી રાખો. માટે જ સાઈમુખના જે શબ્દો છે એની ઉપર ખૂબ ધ્યાન આપવું. અંતે એ કૃપાનો બંડાર સંસારનાં આપણાં ત્રણે પ્રકારનાં દુઃખો દૂર કરશો. તેમની યુક્તિઓની તેમને જ ખબર. આપણે માત્ર તેમની અદ્ભુત લીલાઓ સહજ રીતે જે દેખાડે છે તે ફકત કૌતુકથી બંને આંખોથી જેથા કરવી. બીજે કોઈ કહી રહ્યો છે એમ સમજને તેમનું ખરું જ સાંભળી લેવું. પરંતુ આપણે ધ્યેય છોડવું નહીં અને પોતાનાં ગુરુના વચ્ચનોને ભૂલવા નહીં. તેમાં જ આપણું પરમ કલ્યાણ છે. તેમાં જ આપણા સંસાર અને

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પૂનર્જન્મનો ભય દૂર કરીને પાર ઉત્તરવું છે. તેમાં જ આપણું બધું પોથીપુરાણ છે અને જ્ય, તપ અને અનુષ્ઠાન પણ તે જ છે. સૂર્યની સામે વળી અંધકાર કેવો? આવા ગુરુ પુત્ર માટે સંસારસાગર નથી જ. તમે આ સૃષ્ટિમાં કેટલાયે દૂર કે પાસે હો, સાત સમુદ્રની પણ પેલે પાર હશો, છતાં એ ગુરુનો ભક્તો ઉપર અત્યંત પ્રેમ હોય છે. (ઓ. ૧૧૧-૧૨૫)

આમ લખતાં લખતાં, એકનું જેઠને બીજાએ એવું કર્યું તો એનો લુબ દુઃખમાં કેવી રીતે પડે છે, એ વિષેની એક વાર્તા મને યાદ આવી, જે હવે હું કહી રહ્યો છું. એક વખતે બાબા મહાણસાપત્ર સાથે મસ્તિષ્ઠમાં હતા, તે સમયે પહેલાના લાકડાના પાઠિયા ઉપરના બિછાનાની એકાએક તેમને યાદ આવી. તે લાકડાના પાઠિયાની પહોળાઈ સવા વેત એટલે લગભગ એક ફૂટની હતી. તેના બંને છેઠે ચીફ્ટી બાંધીને તેને મસ્તિષ્ઠના આડા બે મોભના લાકડાં સાથે બાબા લટકાવતા હતા અને એનો હિંચકો બનાવતા. અંધારામાં સૂવું નહીં માટે ઓશિકાની જગ્યાએ અને પગ તરફ બાબા ચાર ઝૂણે દીવા પ્રગટાવીને પાઠિયા ઉપર તેઓ સૂઈ જતા. આ પાઠિયા વિષેની બધી જ વાતો અને મહિમા ૧૦મા અધ્યાયમાં પહેલાં જ વર્ણવેલાં છે. હવે એ પાઠિયાનો મહિમા સાંભળો. એક દિવસે બાબાશ્રી એ પાઠિયાનું શું મહત્વ તે વિષે મનથી એવું સરસ વર્ણન કરી રહ્યા હતા, એવામાં કાકસાહેબ દીક્ષિતના મનમાં એક વિચાર આવ્યો તે હવે સાંભળો. તેઓ બાબાને બોલ્યા, ‘પાઠિયા ઉપર જ જે સુવાનું ગમતું હોય તો તમારે માટે પ્રેમથી સરસ રીતે લટકાવી આપું. પછી તેની ઉપર આરામથી અને સ્વસ્થ ચિંતે લંબાવને.’ સાઈબાબાએ જવાબ આપ્યો, ‘મહાણસાપત્રને નીચે મૂકીને હું પોતાની મેળે ઉપર કેવી રીતે સૂઈ શકું? હું તો નીચે જ સરો છું?’ એ સાંભળીને કાકા ઝૂબ પ્રેમથી બોલ્યા, ‘બીજું એક પાઠિયું લટકાવી આપું. એકની ઉપર આપ સુને અને બીજી ઉપર મહાણસાપત્ર સૂઈ જશે,’ બાબાએ ફરીથી ઉત્તર આપ્યો, ‘એ શાનો પાઠિયા ઉપર સૂવાનો? જેની શરીરની સંપૂર્ણ યોગ્યતા હશે તે જ પાઠિયા ઉપર સૂઈ શકવાનો. લટકતા પાઠીયા ઉપર સૂવું કંઈ સહેલું નથી. મારા વીના બીજું કેઠ તેની ઉપર સૂઈ શકવાનું છે બંધું? નિંદ્રા છોડી દઈ, આંખો ખુલ્લી રાખી જે રહી શકે તે જ આ પાઠિયા ઉપર સૂઈ શકે. હું જે ઉંઘવા લાગું તો આ મહાણસાપત્રને આજ્ઞા કરું છું કે, મારી છાતી ઉપર હાથ મૂકીને મારી પાસે બેસી રહે. તેનાથી એક કામપણ થતું નથી. બેઠો બેઠો ઝોકાં ખાય છે. આ પાઠિયાનો હિંચકો તેના કામનો નથી. એ તો ફક્ત મારી જ પથારી છે. મારા હદ્યમાં નામઃસ્મરણ એકસરખું ચાલુ જ હોય છે. તેની ખાત્રી કરવા ત્યાં હાથ મૂકીને જુઓ. મારી આંખ બંધ થઈ જાય તો મને જગાહો. આવી આજ્ઞા આપવા છતાં તેને ઉંઘ આવી જાય છે અને તેનો હાથ પથ્થર જેવો જરૂર થઈ જાય છે. પછી ‘ભગત’ કહીને બૂમ મારતાં જ આંખો ઉધાડી બેઠો થઈ જતા તે ગભરાઈ જાય છે. જેનાથી જમીન ઉપર બેસી શકાતું નથી, જેની બેઠક સ્થિર નથી, જે મનુષ્ય ઉંઘ જેવા તમોગુણનો સેવક છે, એ ઉંચે પાઠિયા ઉપર કેવી રીતે સૂઈ શકે?’ માટે જ સાઈમહારાજ વખતોવખત ભક્તોનો પ્રેમ જેઠને કહેતા હતા કે, ‘આપણું આપણી સાથે, બીજાનું બીજા જેઠે’ પોતાની શક્તિ પ્રમાણે ફાલે તેમ પોતે જ કરવું, અને બીજાને તેના પ્રમાણે કરવા દેવું. પોતે એવું કરવાની ભાંજગાડમાં પડવું નહીં. આપણું કર્મ જ આપણી સાથે આવતું હોય છે. અને બીજાનું બીજા સાથે જાય છે. શ્રીસાઈનાથની કરણી અગાધ છે. માટે જ હેમાડપંતે તેમનાં ચરણોમાં શરણું લીધું છે. બાબાએ પણ તેમની ઉપર કૃપા કરીને આરીર્વથનો સાથે તેમને પોતાના ચિંતનમાં અખંડ રાખ્યા છે. (ઓ. ૧૨૬-૧૪૩)



## ॥ અદ્યાય ૪૬ ॥

### કાશી, ગયા, ગમનમું અજાજનમું કથનમું

(સાઈબાબાનું કાશી-ગયા ક્ષેત્રે છબીઓપે જવું અને બે બકરીઓની પૂર્વજન્મની કથા કહેવી.)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,  
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

હે શ્રી સાઈનાથ ! તારાં ચરણો પવિત્ર અને ધન્ય છે. તારું સ્મરણ માત્ર ધન્ય છે. તારા દર્શન પણ ધન્ય છે. તે બધા મનુષ્યોને ફળની આશાએ કરેલાં કર્મોમાંથી અને તેનાં બંધનોમાંથી મુક્ત કરાવે છે. સ્વરૂપે ભલે તું અદશ્ય છે છતાં શ્રદ્ધા અને પ્રેમપૂર્વક મનથી ભક્તિ કરવાથી તારું સ્વરૂપ સમાધિમાંથી પણ જગૃત થાય છે. ભક્તોને તેનો અનુભવ આજે પણ થાય છે. તું એટલી જીણી દોરી પકડે છે કે તે કોઈના જોવામાં આવતી નથી. પરંતુ પોતાના ભક્તોને દેશમાં હોય કે પરદેશમાં હોય છતાં તે દોરીની મદદથી ગમે ત્યાંથી ખેંચી લાવે છે અને પોતાનાં ચરણોમાં સ્થાન આપે છે. તેવા પ્રેમથી ગળે વળગાડે છે અને માતા જેમ પોતાના બાળકને પોષે છે એ જ પ્રમાણે તું તેમને સહજ રીતે સંભાળે છે. તું એવી કોઈ યુક્તિઓ અજમાવે છે કે તું પોતે કયાં છે તે કોઈ જોઈ શકતું નથી. પણ પરિણામ નજરે પડતાં, તું જ ભક્તોની પૂરે ઉલેલો છે એવો વિશ્વાસ મનમાં ચોક્કસપણે થાય છે. જ્ઞાની પંડિતો અને ડાયાઓ અભિમાનમાં સંસારદ્દી ભવરમાં અટવાઈ જય છે. પણ બોળા અજ્ઞાની અને અજાણ લોકોને તું પોતાની શક્તિથી મન ભરીને આનંદથી રમવા દે છે. ગુપ્ત રીતે બધી રમત રમે છે પણ પોતે કાંઈ જ કરતો નથી એવું બતાવે છે. વળી બધું જ કરીને પણ એવું કહેવડાવે છે કે બાબાને ખબર નથી. સાચેસાચ તારું આ ચરિત્ર કોઈને સમજાતું નથી. ત્યારે આ શરીર, વાણી અને મન તારાં ચરણોમાં અર્પણ કરીએ છીએ અને આ મુખેથી તારું સતત રટણ અને નામઃસ્મરણ કરીએ જેથી અમારા પાપોનો નાશ થાય. તું ઈચ્છા કરનારની ઈચ્છા પૂર્ણ કરે છે અને કોઈપણ ઈચ્છા વીનાના અને નિષ્કામીઓને પોતાનું શાશ્વત સુખનું સ્થાન મેળવી આપે છે. તારું નામ પણ એટલું સુખકારક છે અને ભક્તો માટે સહેતામાં સહેલો ઉપાય છે. જેને લીધે પાપોનો નાશ થાય છે, રજેગુણ અને તમોગુણ ખાત્રીપૂર્વક દૂર સરકી જય છે. સાત્ત્વિક ગુણોને ધીમે ધીમે સંગ્રહ થવા લાગે છે અને તેના કારણે નૈતિક અને ધાર્મિક ગુણોનો ભંડાર ભેગો થાય છે. આમ ધર્મવૃત્તિ જગૃત થતાં વૈરાગ્ય તેની પાછળ દોડતો આવે છે. ઈન્દ્રિય સુખ ભોગવાની લાલસા નામ માત્ર બાકી રહી જય છે અને આત્મજ્ઞાન તરત જ પ્રગટ થાય છે. હંમેશાને માટે આવું વિચાર વિવેક સાથેનું જ્ઞાન પ્રાપ્ત થયું કે આત્મસ્વરૂપ તરફ આપોઆપ ધ્યાન થાય છે. તેને જ ગુરુ ચરણોમાં લીન થવું અને ગુરુને સર્વસ્વ અર્પણ કરવું એમ કહેવાય. મન સાઈ ચરણોમાં અર્પણ થયાની એક જ નિશાની છે કે સાધકની શાંતિ તરફની વૃત્તિ વળે છે અને તેની ભક્તિ સંપૂર્ણપણે ઉલ્લાસિત થાય છે. સપ્રેમ ગુરુભક્તિને જ 'ધર્મ' કહેવામાં આવે છે. અર્થાત્ તે તું જ છું એવો જ્ઞાનનો સાર છે. વિષય વાસના તરફ ઉદાસીનતા તે જ શ્રેષ્ઠ વૈરાગ્યની નિશાની છે અને સંસારથી નિવૃત્તિ ત્યાં જ થાય છે. જે અનન્યપણે જીવભાવે કરવાથી શાંતિ, વિરક્તિ, કીર્તિ આ ત્રણે જેને સર્વદા આધિન હોય છે એવી ભક્તિનો મહિમા ધન્ય છે. જેની આવી ગુરુભક્તિ હશે એવાને શું ઓછું પડવાનું છે ? જેવી જેની પોતાના મનમાં ઈચ્છા હશે તે તે વસ્તુઓ તેને પ્રયત્ન સિવાય મળશે. તેવી એ ભક્તિ પાશ્કૃપી બ્રહ્મસ્થિતિ મળતાં જણે કે લગ્નમાં છોકરીનાં મા-બાપે

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

જમાઈને આપેલી બેટ સોગાદો અને પહેરામણીની માફક એક દાસી થઈ જય છે. ત્યાં મોક્ષને કોઈ પૂછતું નથી અને તીર્થોં તો પગે પડતાં આવે છે. (ઓ. ૧-૧૭)

પાછલા અધ્યાયમાં દીક્ષિતના ભાગવત વાંચનનું, નવનાથની ભક્તિનું અને મહારાજના ચરણ દર્શનનું વર્ણિન કરવામાં આવ્યું છે. તેમજ પાખાડે અટક ધરાવનાર આનંદરાવના સ્વભનું અને સાઈનાથની ભક્તિનું કથન કરવામાં આવ્યું છે. સાઈબાબા જેને પોતાની છત્રછાયામાં લે છે તે ભલે નજીક હોય કે પછી ભૂખંડના કોઈ દ્વીપોની પણ પેલે પાર હોય, એની સાથે રાત-દિવસ શ્રીસાઈ નિઃસંશ્યપણે રહેતા હોય છે. ભક્ત જ્યાં જય તે સ્થળે તેઓ જઈને ઉભા રહે છે અને અકલ્યિત રીતે તેને દર્શન આપે છે. એના અનુસંધાનમાં એક નવાઈ ભરેલી વાત આપ શ્રોતાઓ માટે હું કહી રહ્યો છું. તે સાંભળીને તમને આશ્ર્ય પણ થશે અને આનંદ પણ મળશે. તેમાના શ્રીસાઈનાથ મહારાજના મુખેથી નીકળોલા એ શાખ્દો, જે આ કાન વડે ભાવથી સાંભળશો તો સમાવિનું સુખ પણ નાનું પડશે. અને સારી મનોવૃત્તિવાળા ભક્તો સ્વાઆનંદમાં પ્રકુલ્પિત અને તરબોળ થઈ જશે. જેમાં પગલે પગલે ચમત્કાર ભરેલા છે, એવી આ રસભર કથા સાંભળીને શ્રોતાઓ પોતાની જતને ભૂલી જશે અને તેમનાં હદ્ય અત્યંત આનંદી ગદગદ થઈ જશે. (ઓ. ૧૮-૨૪)

કાકાસાહેબ દીક્ષિતના મોટા દીકરા ‘બાબુ’નું નાગપુર મુકામે જનોઈ દેવાનું નક્કી થયું. તેવી જ રીતે નાનાસાહેબ ચાંદોરકરના મોટા દીકરા વાસુદેવનું લગ્ન હોવાથી તે પ્રસંગે જ્વાલિયર જવાનું થયું. જનોઈનો પ્રસંગ પૂરો થયા બાદ લગ્નમાં જ્વાલિયર જવા માટે કાકાસાહેબના ઘરના પ્રસંગે મોડું પહોંચાય નહીં એવું નાનાસાહેબને મનમાં લાગ્યા કરતું હતું. નાગપુરથી કાકાસાહેબ લગ્ન માટે સ્વસ્થ ચિત્તે આવી શકે તેવું બંનેને અનુકૂળ એવું શુભ મુહૂર્ત ચાંદોરકરે નક્કી કર્યું. પછી તે ભક્તોના શિરોમણી જેવા નાનાસાહેબ લગ્નનું આંત્રેણ આપવા માટે અને બાબાસાઈના દર્શન કરવા માટે ઉત્સાહભેર શિરડી આવી પહોંચાયા. તે સમયે કાકાસાહેબ દીક્ષિત પણ ત્યાં જ હતા. નાનાસાહેબે મસ્નિજદમાં જઈને બે હાથ જેઠીને બાબાને લગ્નનું આંત્રેણ આપ્યું. તે સાંભળી બાબાએ કહ્યું ‘સાંનું’. તું માધવરાવ દેશપાંડને લગ્નમાં લઈ જને. પછી બે દિવસ પછી કાકાસાહેબે પૂછ્યું અને બાબાને જનોઈનું આંત્રેણ આપ્યું. તેમને પણ ત્યારે બાબાએ એવું જ કહ્યું કે સાથે શામાને લઈ જાવ. પરંતુ કાકાએ સાઈબાબાને ડબ્બડ પદ્ધત માધવરાવનો આગ્રહ કર્યો. એ સાંભળતા બાબાએ તરત જ જવાબ આપ્યો, ‘કાશી પ્રયાગ પતાતીને તરત જ | શ્યામાથી પણ વહેલો આવીશ | મને આવવામાં કેટલી વાર ?’ હવે શ્રોતાઓએ આ શાખ્દો ઉપરથી તેનો ભાવાર્થ સમજવા માટે અને બાબાની સર્વવ્યાપકતા સમજવા માટે ધ્યાન દઈને એનો અર્થ સમજી લેવો. જમ્યા બાદ માધવરાવે વિચાર કર્યો કે, એક વખત જ્વાલિયર સુધી જઈએ તો ત્યાંથી કાશી કેટલું દૂર છે? તેમણે નંદુરામ મારવાડી પાસેથી સો ઢિપિયા ઉછીના લીધા અને બાબાની સંમતિ મેળવવા માટે તેઓ મસ્નિજદમાં ગયા. તેમણે અત્યંત માનથી બાબાને પૂછ્યું, ‘આ લગ્ન અને જનોઈ નિભિતે જ્વાલિયર સુધી જવાનું છે, તો પ્રસંગ અનુસાર ‘કાશી’ અને ‘ગયા’ ની યાત્રા પણ સાથે કરી આવું એવું મને લાગે છે. તો પણ હે દેવા! હું તારા પગને પડીને પૂછી રહ્યો છું, કે આ કાશી અને ગયાની યાત્રા માટે જાઉ કે?’ મહારાજે માધવરાવને જવા માટે આનંદી આજ્ઞા આપી અને તે ઉપરાંત કહ્યું કે, ‘જે ઉચ્ચિત નથી એવું તું કયારેય પૂછે છે? પ્રયત્ન વગર જે સહેલાઈથી અને સહજ રીતે બનતું હોય એને કદી પણ ચૂકવું નહીં અને તેવી તક અવશ્ય ઝડપી લેવી જેઠાએ.’ (ઓ. ૨૫-૩૬)

જેવી આજ્ઞા મળી કે માધવરાવે ઘોડાગાડી કરીને સીધી કોપરગાંવની વાટ પકડી. રસ્તામાં અપ્પા કોતે પાટીલનો સાથે બેટો થયો. પોતાની પૌત્રીને લેવા માટે તેઓ ચાંદવડ ગામ તરફ જવા નીકળ્યા હતા. કાશી યાત્રાની વાત સાંભળીને એતો ઘોડાગાડીયાંથી ફૂદી પડ્યા. કાશી યાત્રાના પ્રવાસ કરવા ભલે ખિસ્સામાં પૈસા ન હતા. છતાં માધવરાવ જેવાનો સંગાથ છોડવાનું તેમને ગમ્યું નહીં. એટલામાં માધવરાવે તેમને ધીરજ આપી પણ અપ્પા કોતેનું મન માનતું જ નહિ.

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આવેલા મોકાનો ઉપયોગ કરવા માટે તેઓ તરત જ પાછા ટાંગામાં બેસી ગયા. આ અપ્પા પાઠીલ પૈસે ટકે સુખી હતા. પણ રસ્તામાં જડ્ઝર પહેલાં પૈસા મેળવી શકાય એવું કોઈ સાધન ન હતું. માટે કદાચ કાશીએ જવાનું ચૂકી જવાય તેની એમને મોટી ચિંતા થઈ. વહેતી ગંગામાં હાથ ધોવા, એટલે કે કોઈ પૂણ્યકર્મ કરતું હોય તો, એની સાથે સાથે પોતે પણ એ પુણ્યકાર્યમાં સહભાગી થવું. અને માધવરાવ જેવાની સોભતનો પૂરો લાભ ઉડાવવો તેવું અપ્પાના મનમાં હતું. અપ્પાની આવી અડચણને ધ્યાનમાં રાખીને તેમને સમયસર ધીરજ આપીને માધવરાવે તેમને પોતાની સાથે લઈ જઈને કાશીની યાત્રા પૂર્ણ કરાવી. પછી તેઓ બંને નાગપુર મુકામે જનોઈના સમારંભમાં હજરી આપવા માટે ગયા. ત્યાં કાકાસાહેબ દીક્ષિતે માધવરાવને અર્થ પેટે, વાપરવા માટે ડ્રિપિયા બસો આપ્યા. ત્યાંથી તેઓ જ્વાલિયર લગ્ન સમારંભમાં પણ ગયા. તે પ્રસંગે નાનાસાહેબે પણ માધવરાવને ડ્રિપિયા એકસો આપ્યા. નાનાસાહેબના દીકરાના સસરા શ્રીમંતુ રામવા કૃષણ જઠાર, મુમતાજુદ્દીલા બહાદુર લશકર, જ્વાલિયર હતા. તેમણે પણ ડ્રિપિયા એકસો આપ્યા. આ પ્રકારે નાનાના ગુરુબંધુ પાસે એટલે કે માધવરાવ પાસે પ્રેમપૂર્વક મળેલા ખાસ્સા ડ્રિપિયા બેગા થયા. કાશીમાં મંગળ ઘાટ ઉપર સોનાના પતરાથી મદાવેલું અને કોતરકામવાળું લક્ષ્મીનારાયણનું સુંદર મંદિર છે. જઠાર તેના માલિક હતા. અયોધ્યામાં આવેલું સુંદર રામ મંદિર પણ જઠારનું જ હતું. તેમણે આ બંને પવિત્ર સ્થળોએ આદર સર્કારથી વ્યવસ્થા ત્યાંના પોતાના ગુમાસ્તાને સોંપી હતી. માધવરાવ અને અપ્પા કોતે જ્વાલિયરથી મથુરા ગયા. એમની સાથે પળસાના ઈમાનદાર ઓઝે, નાનાસાહેબના સાઢુ બિનીવાલે અને નાનાસાહેબના જમાઈ પેંડારકર પણ હતા. આ તરણે જણ ત્યાંથી પાછા ફર્યા. માધવરાવ અને કોતે પાઠીલ ત્યાંથી પ્રયાગ ગયા અને પછી રામનવમીના ઉત્સવ સમયે અયોધ્યા પહોંચ્યા. ત્યાં એકવીસ દિવસ રહ્યા અને બે મહિના કાશીમાં વિતાવ્યા. ચંદ્ર અને સૂર્યગ્રહણ પત્યું. પછી બંને ગયા તરફ જવા નીકલ્યા. (ઓ. ૪૦-૫૪)

‘ગયા’ માં ગ્રંથિજ્ઞવરનો-પ્રેરણો વાવર ચાલે છે અને ગલીએ ગલીએ લોકો ખૂબજ ચિંતામાં અને ભયમાં દિવસો વિતાવી રહ્યા છે તેવી વાત આગગાડીમાં જ બંનેના કાન ઉપર પડી. આગગાડી જ્યારે ગયાના સ્ટેશન ઉપર આવી પહોંચી ત્યારે રાત પડી ગઈ હતી. તેથી તેઓ બંને જણા કોઈક ધર્મશાળામાં રહેવાનો બંદોબસ્ત કરીને ત્યાં જ રોકાયા. પછી સવાર પડતાં ‘ગયા’ ક્ષેત્રનો એક બ્રાહ્મણ આવ્યો અને કહેવા લાગ્યો કે, ‘ચાલો જલ્દી કરો બધા યાત્રાળુઓનો સમૂહ નીકળી રહ્યો છે.’ માધવરાવ મનથી જરાક ગભરાયેલા હતા. તેમણે ધીરે રહીને પેલા પંડાને પૂછ્યું, ‘અરે ભાઈ અહીંયા તો ગ્રંથિજ્ઞવરનો વાવર ચાલે છે. તમારી વસ્તીમાં પણ ફેલાયેલો છે કે ?’ પેલા બ્રહ્માણે જવાબ આપ્યો, ‘ત્યાં આવીને તો જુઓ ! તમે કહો છો એવું ત્યાં કશું જ નથી. તમે મારી સાથે વગર શંકાએ નિરાંતે ચાલો.’ પછી તેઓ બંને પંડા સાથે તેમને ધેર ગયા અને ત્યાં એમનું વિશાળ સહન જેઠિને પ્રસન્ન થઈ ગયા. પ્રસન્નતાનું બીજું પણ એક કારણ એવું હતું કે તેઓ જયાં બેઠા હતા તેની સામે સાઈભહારાજની એક મોટી છબી નજરે પડી અને માધવરાવનું મન એકદમ ભરાઈ આવ્યું. ગયા ક્ષેત્ર જેવા ડેકાણે બાબાની છબી નજરે પડ્યો એવું કદી ધાર્યું જ ન હતું. માટે બંને જણાના હદ્દયને આશ્રયની સાથે સાથે આતિ આનંદ થયો. માધવરાવ તો ગળગળા થઈ ગયા. તેમની આંખોમાંથી આનંદનાં અશ્વ વહેવાં લાગ્યાં. પેલા પંડાને ખૂબજ જ નવાઈ લાગી અને પૂછ્યા લાગ્યો, ‘કેમ રે ભાઈ તમે રો છો શાને માટે ?’ કોઈ કારણ વીના માધવરાવને આમ રડતા જેઠિને તેઓ ચિંતિત થઈ ગયા. ગયામાં તો ગ્રંથિજ્ઞ છે. આપણી યાત્રા નક્કી કર્યા મુજબ કેવી રીતે પાર પડશો ? એ વિચાર માધવરાવના મનમાં આવતો જ હોવા જેઠિએ, માટે પેલા પંડાને ચિંતા થવા લાગી, ‘પહેલેથી જ તમને જણાવી દીઘું હતું કે, અહીં ગ્રંથિજ્ઞવર નથી, છતાં તમે આટલી ફીકર કરો છો તે જેઠિને મને નવાઈ લાગે છે. જો મારા ઉપર વિશ્વાસ ન હોય તો અન્યને પૂર્ણી જુઓ. અહીંયા તમારો વાળ પણ વાંડો નહિ થાય. વગર કામનું આંખોમાં પાણી શા માટે લાવો છો ?’ પ્રેરણની બીમારીનો ખોટો ધ્રાસ્કો મનમાં રાખીને યાત્રાળુઓ વગર કામના એક સરખા રહ્યા કરે છે એમ કહીને પેલો

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

બ્રાહ્મણ આમ સમજવવા લાગ્યો. પરંતુ માધવરાવના મનમાં બીજી જ કોઈ વિચારો હતા, ‘મારા પહેલાં મારી માઉલી આજે પણ પહેલાં અહીં કેવી રીતે પહોંચી ? કારી પ્રથાગ કરીને સત્ત્વરે શ્યામાશી પણ પહેલાં હું ત્યાં આવું છું. એવા જે ઉદ્ગારો મહારાજના મુખેથી નીકળ્યા હતા તેનો આ પ્રત્યક્ષ અનુભવ તો નથી ને ?’ બારણામાં પેસતાંની સાથે જ માધવરાવને બાબાની આ છબી આંખો સમક્ષ દેખાતાં, આ કલ્પના બહારની વસ્તુ જોઈને તેમને આ એક મોટો ચમત્કાર જ લાગ્યો. ગળું ભરાઈ આવ્યું, આંખોમાંથી આંસુ પણ રોકાતાં ન હતા, રોમેરોમ પુલકીત થઈ ગયાં અને માધવરાવ પરસેવે રેબ્ઝેબ થઈ ગયા. માધવરાવની આવી વિચિત્ર સ્થિતિ હતી. પણ પેલા બ્રાહ્મણના મનમાં તો કાંઈ બજતા જ વિચારો આવતા હતા. ગ્રંથિજીવરના ડરના માર્યાં આ બાઈ વગર કામના રે છે એવું જ તેમને લાગ્યું. (ઓ. પ૪-૭૩)

શામાને આગળ વધુ પૂછ્યપરછ કરવાની ઈચ્છાથી તેમણે પેલા બ્રાહ્મણને પ્રશ્ન કર્યો, ‘આ છબી આપને કેવી રીતે મળી, તે અમને વિગતવાર કહો.’ બાર વર્ષ પહેલાં બનેલ હકીકત અને થયેલ ચમત્કાર પંડાજી માધવરાને કહેવા લાગ્યા, ‘એક નહીં, પણ ગયા ક્ષેત્રના બસો ત્રણસો પગારદાર નોકરો મનમાદ અને પુણીનાં બે સ્ટેશન ઉપર યાત્રાળુઓની સવિસ્તાર નોંધ કરી રહ્યા હતા. યાત્રાળુઓની સમસ્યાઓ માટે સગવડ કરી આપવાનો આ પંડાજીઓનો વ્યવસ્થાપ હતો. આમ ચાલતું હતું તે દરમિયાન પેલો બ્રાહ્મણ શિરડી ગયો હતો. સાઈ સમર્થ એક મોટા સંતપુરુષ છે તે વાત તેણે બહારથી પુષ્કળ લોકોના મોઢે સાંભળી હતી. તેમનાં દર્શન કરી પાવન થવું તેથો તેમણે નિશ્ચય કર્યો. સાઈબાબાનાં દર્શન કર્યો અને પગે લાગ્યા. તેમની ઈચ્છા સાઈનાથની છબી મેળવવાની થઈ. માધવરાવને ત્યાં ભીત ઉપર લટકાવેલી એક છબી હતી. પેલા પંડાજીએ છબી માંગતા, માધવરાવે બાબાની પરવાનગી મેળવી અને તે તેમને આપી દીધી. તે જ આ છબી અને આ જ પેલો બ્રાહ્મણ તે માધવરાવને બરાબર યાદ આવ્યું. તેમને થયું કે મને મહારાજે પાછો આટલા સમયબાદ કેવી રીતે મેળાપ કરાયો હશે ? આમ જેતા બાર વર્ષ પહેલાની વાત કયારે શા માટે કોઈને યાદ આવે ખરી ? પણ સાઈબાબાની લીલા અગાધ છે. તેમણે શામાને બરાબર ત્યાં જ મોકલ્યો અને ત્યાં જ પોતાનાં દર્શન કરાયાં. પંડાએ આ બધું સાંભળ્યું તેથી તેને ખૂબ જ સંતોષ થયો. મહારાજની આકાશ લઈને આ તસ્વીર બ્રાહ્મણને પોતે જ આપી હતી તે વાત માધવરાવને યાદ આવી. શિરડી આવીને તેમના જ ધરે પોતે ઉત્તો હતો અને તેમણે જ સાઈમહારાજનાં દર્શન કરાયાં. તેની યાદ પેલા બ્રાહ્મણ પંડાને પણ તાજ થઈ ગઈ. પછી એક બીજી ઉપર કરેલા ઉપકારને લીધે તેમના મનમાં આનંદનો પાર રહ્યો નહિ. ત્યારબાદ તે પંડાએ માધવરાવ માટે ગયામાં ઉત્તમ વ્યવસ્થા કરી આપી. આ બ્રાહ્મણના ઘરની જલ્હોજલાલીના શું વર્ણન કરવાં ? હાથી તો એના દરવાજામાં ઝૂલતા હતા. એ પોતે પાલણીમાં બેસતો અને શામાને પણ હાથી ઉપર સવારી કરાવતો. વિષણુ ભગવાનની પાદુકા પાસે જઈને અને બધી પૂજન સામગ્રી સાથે લઈને તેમણે વિષણુ ભગવાનને અભિષેક સાથે સ્નાન કરાયું અને વિધિપૂર્વક પિતરાઈઓને પિંડદાન પણ કરાયું. પછી બ્રાહ્મણને દક્ષિણા આપીને તૃપ્ત કર્યા અને નૈવેદ્ય બનાવીને બોજન કર્યું. આ પ્રકારે બાબાએ સમગ્ર યાત્રા આનંદથી પૂરી કરાવી. આ કથાનો સાર જોઈએ તો એ જ છે કે, બાબાના મુખમાંથી નીકળેલા શર્ફો હંમેશા ખરા પડતા તેમાં કોઈ બેમત નથી, તેમનો પોતાના ભક્તો પર અવર્ણનીય પ્રેમ હતો.’ (ઓ. ૭૪-૬૦)

આ તો બાબાનું ભક્તો ઉપર પ્રેમનું વર્ણન થયું પરંતુ તેઓ બીજી જાવો પ્રત્યે પણ સમદિદ્ધિ જેતા હતા. તેમની સાથે પણ તેમનું એકથ રહેતું હતું અને તે એમને ખૂબ ગમતું હતું. કયારેક લેંડીબાગથી મસ્નિજદે પાછા વળતાં રસ્તામાં ઘેટાં બકરાનું ટોળું જે આવી જતું તો બાબાને ખૂબ જ આનંદ થતો. પછી બધા ઉપર તેમની અમૃત તૂલ્ય દષ્ટિ ફેરીને તેમાંના એક બે સરસ જલનવરોને પસંદ કરી લેતા. તેમનો માલિક જે માગે તે કિંમત આપીને તે ખરીદી લેતા. એ ખરીદીલાં ઘેટાં બકરાને તેઓ કોંડાજી નામના ભક્તને આપી હેતા. બાબાની આવી રીત હતી. એક વખતે બત્રીસ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

દ્વિપિયાની કિંમત ચૂકવીને બાબા બે બેકરાં ખરીદીને લઈ આવ્યા. લોકોને આ જેઠ બહુ આશ્રમ્ય થયું. એ બે બેકરાંને જેઠને તેમની તરફ એકાએક પ્રેમ ઉભરાઈ આવ્યો અને એમની પાસે લઈને તે જનવરોને પંપાળીને તેમની પીઠ થાબડી. તેમને પશુયોનીમાં જન્મેલાં જેઠને સાઈસમર્થને ખૂબ દ્વારા આવી. તેમની આવી દ્વારા જેઠને બાબાનું મન અનુંગપાથી ભરાઈ આવ્યું અને પ્રેમનો ઉમળકો આવ્યો. બાબાએ તેમને પાસે લઈને ખૂબ જ પંપાળ્યાં. આવી રહેમ દાટિ જેઠને બક્તોને ખૂબ આશ્રમ્ય થયું. પૂર્વ જન્મમાં તેમની ઉપરનો પોતાનો પ્રેમ અને મમતાની તેમને એકાએક યાદ આવી. પણ તેમનો આવો પશુયોનીમાં લીધેલ જન્મ જેઠને બાબાનો જીવ ખૂબ જ વ્યાકુળ થઈ ગયો. જે બેકરાં તે સમયે ત્રણા-ચાર દ્વિપિયામાં મળતાં હોય તેને માટે બાબાએ દૈક ઘેટાંના શા માટે સોળ સોળ દ્વિપિયા આપ્યા હશે? આ બાબતમાં તાત્યા કોટેને ખૂબ જ આશ્રમ્ય થયું, ‘આપે વ્યાપારીને લે પ્રાઇસી’ આ અવસર પ્રત્યક્ષ પણ જેઠને તાત્યા અને માધવરાવે બાબાના કૃત્ય માટે પોતાનો વિરોધ દર્શાવ્યો. બે દ્વિપિયાના માલના બાબાએ સોળ દ્વિપિયા શા માટે આપ્યા હતા? શું તેમને પૈસાની કિંમત નથી? માટે જ તેઓ મન ફાવે તેવું કંઈ પણ કરે છે. આવી સમજૂતી તેમને કંઈ ઢીક લાગી નહિ. બંને ઉંચાનીયા થઈ ગયા, બાબા આવા સોદા કેમ કરે છે? આ તો કંઈ સોદો કરવાની રીત છે? આમ બંને જણા બાબા ઉપર દોષનું આરોપણ કરવા લાગ્યા. સમર્થ આવામાં કેમ પડ્યા અને શાશ્વી ફસાયા હશે તે જેવા લોકો ભેગા થઈ ગયા. પરંતુ મહારાજ તો એકદમ સ્વસ્થ હતા. જાણે કે કંઈ થયું જ નથી. તાત્યા અને શામા ભલેને ધૂવાપૂવા થઈને સાઈનાથ મહારાજને દોષિત ઠરાવતા હતા પણ બાબા કિંચિત પણ અસ્વસ્થ ન થતાં પોતાની જ મસ્તીમાં અચળ હતા. પછી સ્વસ્થ થઈને પેલા બંનેએ બાબાને પૂછ્યું, ‘તમારી આ વળી કઈ ઉદારપણાની રીત? દ્વિપિયા બત્તીસ ગયાને?’ ફક્ત પૈસાની વાત સાંભળીને મહારાજ હસીને મનમાં બોલ્યા, ‘કેવા ગાંડા છે આ લોકો! હું તેમનું સમાધાન કેવી રીતે કરી શકીશા?’ બાબાના મુખ પરની આ શાંતિ ગજબની હતી. તેમના મનની સ્થિરતા જરાએ ઓછી થઈ નહિ. પરમ શાંતિનું આવું લક્ષણ જેઠને લોકો વિચારમાં પડી ગયા. કોધ જેનો વિષય જ નથી, જે સદાએ પરમ શાંતિનો અનુભવ કરે છે, પ્રાણીમાત્રમાં જે ઇશ્વરનું દર્શન કરે છે, એવાને કોધ કેવી રીતે પોસાય? જેઓ સાર અસારનો વિચાર કરવા સમર્થ છે, તેઓ કોધને સામે આવવા દેતા નથી. કવચિત્ જે આવો પ્રસંગ આવીને ઊભો રહે તો તેમની શાંતિનો ભંડાર જ ઉધી જય છે, ‘અલ્લાહ માલિક’ એવું સતત જેનું વિંતન છે, તેના મહિમાનું હું શું વર્ણન કરું? તેમનું આખું ચરિત્ર અગાધ અને ગાહન, અતિપાદન અને કલ્યાણકારી છે, જે સંપૂર્ણપણે જ્ઞાનસ્વરૂપ છે, વૈરાગ્યનો અજનો અને શાંતિનો સાગર છે. જેની બુદ્ધિ કર્ણાથી છલોછલ ભરેલી છે તેઓ ખરેખરમાં શું બોલ્યા તે સાંભળો. બંને બક્તોનો આગ્રહ જેઠને બાબાએ નક્કી કર્યું કે, જ્યાં મારા જેવાને બેસવાની જગ્યા નથી અને રહેવા માટે ઘર નથી, એવાએ કોઈપણ વાતનો સંગ્રહ શા માટે કરવો? તેઓ બોલ્યા, ‘દુકાને જઈને અદ્યો શેર દાળ વેચાતી લાવો, આ જનવરોને પેટ ભરીને ખવડાવો અને પછી તેમને ભરવાડને સૌંચી હો.’ મહારાજની આજ્ઞા થતાં તરત જ બેકરાંને દાળ ખવડાવવામાં આવી, અને થોડા જ સમયમાં તેમને તેમના ઝૂંડમાં પાછા છોડી મૂકવામાં આવ્યાં. (ઓ. ૬૧-૧૧૫)

સાઈ સબકા માલિક મૂર્તિમંત પરોપકારી અવતાર હતા. તેમને વળી તાત્યા કોતે અને શામા જેવા કોઈ પણ અન્ય કેવી રીતે વર્તવું શું શિખવવાના હતા? આમ અતિ પ્રેમથી દાળ ખવડાવ્યા પછી બચ્ચાંઓને તૃપ્ત થયેલાં જેઠને બાબા બોલ્યા, ‘હવે આ બચ્ચાંઓને એમના માલિકને સુપ્રત કરી દો. તેમને તેમના ઠોળામાં જ આરામ મળશે.’ આમ દ્વિપિયાએ ગયા અને ઘેટાં બેકરાં પણ ગયાં તે ફોગટમાં. પછી બાબાએ તેમના પૂર્વજન્મની આશ્રમ્યકારક કથા કહી સંભળાવી. જેવો તાત્યા એવો જ શામા. આ બંને ઉપર બાબાને અનહૃદ પ્રેમ હતો. તેમનો ઉગ્રવેગ શાંત કરવા માટે બાબાએ એક મનોરંજક આપ્યાન કહી સંભળાવ્યું. મહારાજે પોતે તે બંને જણાને એ બચ્ચાંની પૂર્વજન્મની હકીકત વર્ણન કરીને સંભળાવી,

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

‘સદ્ગુરુએ પાછલા જન્મમાં આ બંને જીવ મનુષ્ય અવતારમાં હતા, તેમજ તેઓ મારી પાસે જ રહેતા હતા. તેમણે કરેલા કર્મનું ફળ ભોગવવાનું તેમના નસીબમાં પ્રાપ્ત થયું છે. આ જે બકરાના ડ્રેપમાં દેખાય છે તે ગયા જન્મમાં બે સગા ભાઈઓ હતા. એકબીજ સાથે લડતાં જઘડતાં એમનો અંત આવ્યો અને તેનું પરિણામ આ આવ્યું. આરંભમાં આ બંને ભાઈઓમાં ખૂબ જ પ્રેમ હતો. તેઓ ઉઠતા, બેસતા અને સૂતા પણ સાથે. હંમેશા એકબીજનું કુશળ અને કલ્યાણ જ છિદ્ધતા હતા. આમ એકબીજમાં તેઓ પુષ્કળ ખોવાયેલા રહેતા. બંને સગા ભાઈઓ હોવા છતાં કોણ જાણે કર્મ ધર્મ સંયોગથી દ્રવ્યલોભને કારણે પરસ્પર વેર બંધાયું. આ બંને પૈકી મોટો ખૂબ જ આગસ્તું હતો, જ્યારે નાનો દિવસ રાત ઉદ્ઘમ કરનારો, અને મહેનતું હતો. તેને સારા એવા પૈસા કમાઈને લેગા કરેલા, જેની પેલા મોટાને ઈર્ષા રહેતી. ‘એનો કાંટો કાઢી નાખું તો મને પૈસાનો તોટો પડશે નહિં.’ એવા ખરાબ વિચારમાં તે અટવાવા લાગ્યો. ઘનની લાતસા માણસને આંધળી કરી નાખે છે. આમ છતીની આંખોએ આંધળો થયો. બાંધવ પ્રેમ અને એ નિખાલસ સંબંધ પણ ભૂલી ગયો અને નાના ભાઈનો ઘાટ ઘડવા માટે એ તૈયાર થયો. પ્રારબ્ધના ભોગ ખૂબ વિચિત્ર હોય છે, જેને કારણે ભાઈઓ ભાઈઓમાં કારણ વગરનું વેર ઉત્પન્ન થયું. ગૂપચૂપ ચોરી ધૂપીથી કરવામાં આવેલાં કારસ્તાનો અને ગુપ્ત કપટી પ્રયોગો ખુલ્લાં પડતાં એકબીજને સમજન્યા. બંનેના મનમાં આંચ્યકો લાગ્યો. તેમના આયુષ્યનો જાણે લગભગ અંત આવ્યો. બાંધવ પ્રેમ તેઓ સરંદર ભૂલી ગયા હતા. કોધમાં પાગલ થયેલા તેઓ વેરવૃત્તિમાં મારામારી ઉપર ઉત્તી આવ્યા. તેમાંના એકે બીજના માથામાં દંડનો પ્રહાર કરીને જમીન ઉપર પછાડ્યો, અને નીચે પહેલાએ કુહાડી હાથમાં આવી જતાં, પહેલાની ઉપર કુહાડીના ઘા જીકિયા. પછી છિન્નબિન્ન થયેલા અને લોહીલુહાણ હાલતમાં તેઓ મૂર્છિત દશામાં પડ્યા અને થોડા સમયમાં તેમનું પ્રાણ પંખેનું ઉડી જઈને તેઓ બંને પંચતત્વને પાખ્યા. આમ એમનો અંત આવતાં તેઓ આ પશુયોનીમાં જન્મ્યા. તેમને જોતાં જ મને તે બધો તેમનું પાછળનું વૃત્તાંત ચાદ આવ્યું. કરેલાં કર્મને ભોગવવા માટે જ તેઓને પશુ ચોનીમાં જન્મ મળેલો છે. એકાએક જ આ ટોળામાં તેમની ઉપર મારી નજર પડી જતાં મને પ્રેમ ઊભરાઈ આવ્યો. માટે એવું લાગ્યું કે ગાંધના પૈસા ખર્ચને પણ તેમને આરામ આપું. પરંતુ તમારે નિભિસે, તેમને જ તેમનાં આગળનાં કર્મો આડાં આવ્યાં. મારા દિલમાં એ જીવો માટે દયા હતી. પરંતુ તમારા આગહને વશ થઈને હું પણ છેલ્યે તેમને તે માલધારી વણજારાને સુપ્રત કરવા માટે તૈયાર થયો. (ઓ. ૧૧૬-૧૩૫)

અહીંથા આ કથા પૂર્ણ થાય છે. શ્રોતાઓએ મને ક્ષમા કરવી. આગળનો અધ્યાય સાંભળવાથી શ્રોતાઓને આનંદ થશે. એ અધ્યાય પણ પ્રેમરસથી ભરેલો છે. અને તેમાં પણ સાઈમુખેથી નીકળેલી અમૃતવાણી જ હશે. હેમાડપંત સાઈચરણોમાં વિનાન્દું જઈને શ્રોતાઓને આ રીતે વિનંતી કરી રહ્યા છે. (ઓ. ૧૩૬-૧૩૭)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજની પ્રેરણા પામેલા ભક્ત હેમાડપંત રચિત.

શ્રી સાઈસમર્થના સત્ય ચરિત્રના ‘કાશી-ગયા-ગમનમ્-અભજનમ્-કથનમ્’ નામનો છેતાળીસમ્બો.

અધ્યાય અહીં સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણ.



## ॥ અદ્યાય ૪૭ ॥

**શ્રી સાઈ મુખ, શ્રુત, કથા કથનમ्**

(શ્રીસાઈબાબાના શ્રી મુખેથી સાંભળેલી કથાનું વર્ણન)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,  
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

જેમના મુખ તરફ એક ક્ષણ પણ જેવાથી અસંખ્ય જન્મોનાં દુઃખોનો નાશ થાય છે તેવા શ્રીસાઈનાથ મહારાજના અતિશય આનંદ આપનાર શ્રીમુખને ઘન્ય છે. મહારાજની એક કૃપા દાખિને લીધે તો કરેલાં કર્મના બંધનમાંથી તરત જ છૂટકારો મળે છે અને ભક્તગણોને આત્માનંદની કૃપા એક ક્ષણના પણ વિલંખ વીના પ્રાપ્ત થાય છે. એમની દ્યાભરી દાખિથી કર્મ અને અકર્મ જેવી ગૂંઘો એક પછી એક ઉક્તાછ જય છે. તેમનો કૃપાઙ્કપી સૂર્યપ્રકાશ પડતાં જ સંસારઙ્કપી આગિયાઓ નિસ્તેજ થઈને સંતાઈ જય છે. ગંગાનદી આખા વિશ્વનાં પાપ ધૂએ છે એને કારણે તે પોતે પણ મેલી થાય છે અને તે ભેગો થયેલો મેલ દૂર કરવા માટે સાધુસંતની ચરણરાજની ઈચ્છા સેવે છે. સાધુ સંતોનાં ચરણો પોતાના કિનારે ક્યારે પડશે અને તે મારા પાણીમાં નહાવા માટે ક્યારે આવશે તેની તે રાહ જુએ છે. કારણ કે તેના વીના પોતાની પાસે ભેગો થયેલો પાપનો મેલ સાફ્ કરવા માટે ભીજે કોઈ માર્ગ જ નથી. તે બાબતની તેને પાકી ખબર છે. એવા આ સાધુઓના શિરોમણિ સાઈસમર્થની કથામાંના એમના પોતાના શબ્દો છે, તો બાવિક સજજનો ધ્યાન દઈને અતિ આદરપૂર્વક આ પાવન કથા સાંભળો. દેરેક આંખોમાં જેવાની શક્તિ અને બધા કાન દ્વારા સાંભળવાની શક્તિ શ્રી સાઈનાથ મહારાજ પોતે જલ્દે જ છે. તેમણે જ મારા હદ્યમાં પ્રવેશિને આ વાત કહી છે. સાઈબાબા પોતે જ એક શ્રેષ્ઠ વિભૂતિ છે. આ કથાની નવાઈ સાંભળ્યા બાદ શ્રોતાઓ પોતાનું દેહભાન ભૂલશે અને તેમનાં હદ્યમાં પ્રેમનો અષ્ટભાવ પેદા થશે. સાઈ મહારાજના મુખેથી નીકળેલ આ કથાના અભિપ્રાય પર ધ્યાન આપવાથી અને પરિણામો ઉપર દાખિ રાખવાથી શ્રોતાઓને કૃતાર્થતા પ્રાપ્ત થશે. તેમ છતાં શ્રોતાઓને મારી એક વિનંતી છે કે જે હું આ કથાનો વક્તા પણ હોત તો હું પણ તમારા જેવો જ કથાનું તાત્પર્ય ન સમજનારો એક નિરર્થક માણસ છું. સાઈબાબાનો ભક્તો ઉપરનો પ્રેમ યાદ આવતાં મન પોતાનો ચિંતા કરવાનો સ્વભાવ ભૂલી જાય છે અને સંસારની તકલીફ અને કષ્ટી ત્રાસેલા જીવાતમાને શાંતિ મળે છે. તેના કરતાં વિશેષ શ્રેષ્ઠ લાભ તે વળી કર્યો હોઈ શકે ? (ઓ. ૧-૧૨)

પહેલાંની કથાનું અનુસંધાન શ્રોતાઓએ સાવધાનીપૂર્વક સાંભળવું. કથા વચ્ચે ન અટકી પડતાં બરાબર ધ્યાનથી સાંભળવાથી જીવને સમાધાન થશે. પાછલા અદ્યાયના અંતે શ્રોતાઓએ પેતી બે બકરીઓની વાત સાંભળી. તેમના પાછલા જન્મની યાદ આવવાથી બાબાને તેમની ઉપર પ્રેમ ઉભરાયો હતો. તેવી જ આ દ્વાય લોભની પરમ અવસ્થા અધઃપતન તરફ કેવી રીતે ધરેડી જાય છે તે કથા પણ ધ્યાન દાખિને સાંભળજે. સાઈનાથ મહારાજ પોતાની કૃપા દાખિ રાખીને એક પછી એક કથાઓ સૂચવી રહ્યા છે, અને તે સાંભળવામાં વચ્ચે અંતર વિરામ ન પડવા દેતાં સુખ અને સંતોષ વધારી રહ્યા છે. સાઈસમર્થ જલ્દે જ એ કથા છે. તે કહેનાર મુખ પણ તેમનું જ છે. ત્યાં આ હેમાઈ તો નામ પૂરતો જ છે. સાઈકથાઙ્કપી મહાસાગરના કઠે બેઠા હોય ત્યારે અમારે કથા માટેની ખટપત શા માટે કરવી ? કલ્પવૃક્ષની નીચે બેઠા હોય

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ત્યારે જે ઈચ્છા ઉદ્ભવે તે તરત જ પૂર્ણ થાય છે. સૂર્યના ધરમાં ભલા દીવાની વિંતા કોણ કરે ? જેને સતત અમૃતનું જ પાન કરવા મળતું હોય તેને વળી ઝરી પીવાની ઈચ્છા થાય ખરી ? સાઈનાથ જેવા સહેલ અમારી પાછળ ઊભા હોય પછી કથાડપી અમૃતની અમને શી ઓટ હોય ? મન બરાઈને તૃપ્ત થઈ જય ત્યાં સુધી એનું રસપાન કરો. (ઓ. ૧૩-૨૦)

કર્મના સિદ્ધાંત અને સૂત્રો સમજવાં ખૂબ જ અધરાં છે. કોઈને પણ તે સારી રીતે સમજતાં નથી. મોટા મોટા ઉત્તમ જ્ઞાનીઓ એમાં ફસાઈ જય છે. પરંતુ બોળાબલા તેને પાર કરી જય છે. તેવી જ રીતે ઈશ્વરનો નિયમ (કાયદો) તોડવો ખૂબ જ કઠીન છે. તેનું ઉલ્લંઘન કોણ કરી શકે ? માટે જ હંમેશા આપણાં વ્યવહારિક કર્તવ્યો પાળવા અને તેને લગતાં બીજાં બધાં કર્મો કરતા જયું. નહીં તો શાસ્ત્ર વિરુદ્ધનાં અધાર્મિક આચરણો થશે. મરણ થતાં જેવાં જેનાં કર્મો હશે તે જ પ્રમાણે તેની ગતિ અને પુનર્જન્મ મળે છે. ‘થથા કર્મ થથા શ્રુતં’ જેવાં જેનાં કર્મ તેવું તેને જ્ઞાન હશે. તે પ્રમાણે અમુક પુરુષોના બીજભાં ભજી જઈને સ્વીની અથવા તો માદાની યોનીના માર્ગમાં પ્રવેશો છે. તો બીજા અમુક સ્થાવર ભાવને પ્રાપ્ત થતા હોય છે. દા.ત. વૃક્ષ, વેલ, પર્વતના જેવી હુલનચ્છલન વીનાની યોનીમાં ઉત્પન્ન થાય છે. ‘થથાપ્રકં હિ સંભવ.’ જેવી જેની બુદ્ધિ હશે કે વિચારે હશે તે જ પ્રમાણે તેને આગળનો જન્મ મળે છે. આ શ્રુતિનો અર્થ કોને ખબર નથી ? માટે જીવને ગમે તેવો ફરી જન્મ લેવો પડે છે. ફરી વાર શરીર ધારણ કરવા માટે ઉત્સુક એવા આજાની મૂર્ખ લોકોએ ધ્યાનમાં રાખવું કે, જેની જેવી પુણ્યની કમાઈ હશે તે જ પ્રમાણેનું શરીર તેને પ્રાપ્ત થાય છે. માટે શરીર મરી પણ જય તે પહેલાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ ભળેલ નરજન્મની આણમોલ તક જે નકામી ગુમાવતો નથી તે જ ખરો ડાઢ્યો માણસ ગણી શકાય. તે જ સંસારનાં બંધનોમાંથી મુક્ત થાય છે, અને બીજા સર્વે સંસારની ધરેદમાં સપદાઈને પાછા પડે છે, અને શરીરનું ધારણ કરવું કયારેય છૂટતું નથી. (ઓ. ૨૧-૨૮)

આવા જ વિચારો પહેલાના અધ્યાય ટમાં આવેલા છે -

મનુષ્યના મૃત્યુ પછી જીવાત્માનું શું થાય છે, તે કયાં જય છે અને કયાં રહે છે એનો જવાબ ફક્ત હિન્દુ ધર્મનાં શાસ્ત્રોમાં નિરસંહિંઘપણે યુક્તિવાદ સાથે વિમોચન રૂપે જેવા મળે છે. શ્રીકૃષ્ણભગવાને પણ એ જ કહ્યું છે -

શરીરં યદવાનોઽિ યચચાયુત્કામતીશ્વરः ।

ગૃહીત્વૈતાનિ સંચાતિ વાયુગંધાનિવાશચાત् ॥ (અ. ૧૫ ૨લોક ૮)

જ્યારે દેહનો સ્વામી જીવાત્મા દેહ ધારણ કરે છે અથવા તો દેહમાંથી નીકળી જય છે ત્યારે વાયુ જેવી રીતે પુણ્ય આદિમાંથી સુંગંધ લઈ જય છે તેવી જ રીતે મન અને ઇન્દ્રિયોને લઈને જય છે.

કઠોપનિષદ્ધમાં યમરાજને નિયિક્તતાને નીચેના મંત્રમાં આ વાત વધુ સારી રીતે સમજલી છે. જેનો ઉલ્લેખ હેમાડપંતે ઉપર ૪૭ના અધ્યાયની ૨૪મી ઓવીમાં અને ટમા અધ્યાયની ૪૪, ૪૫ અને ૪૬ની ઓવીઓમાં કરેલ છે -

યોનિમન્યે પ્રપદન્તે શરીરત્વાય દેહિન : ।

સ્થાણુમન્યેનુસંયન્તિ યથાકર્મ યનાશ્રુતમ ॥૭॥ (અધ્યાય ૨. વલ્લી ૨)

બૃહદ્બારણ્યક ઉપનિષદ્ધમાં તો જીવાત્માના એક શરીરમાંથી નીકળી જય બીજા શરીરમાં જય છે તેનું વર્ણન કરતી વખતે ખૂબ જ સુંદર ઉપમાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે પ્રમાણે ધાસ ઉપર ચાલનારા, ઈયળ જેવા કિડા ધાસના એક તણાખલા ઉપરથી બીજા ધાસની દાંડી ઉપર જતી વખતે પહેલાં બીજી દાંડીનો આધાર લે છે અને પછી જ પાછળના તણાખલા ઉપરથી પોતાનો આધાર છોડી છે. તે જ પ્રમાણે જીવાત્મા પોતાનો પહેલો દેહ છોડતી વખતે બીજા દેહમાં પ્રવેશ કરવાની વ્યવસ્થા કરી રાખે છે. બીજી ઉપમા સુવર્ણ ઉપર કારીગરી કરનારની એટલે કે

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સોનીની છે. તે પણ પોતાની પાસેના જુના સોનાના દાળનાઓ ગાળીને બીજા નવીન અધિક સુંદર દાળનાના ઘાટ ઘડે છે. એકંદરે જેવા જતાં આગળનો જન્મ આપણા જ હથમાં છે, આ સિદ્ધાંત દર્શાવવામાં આવેલો છે. જે અ. ૪માં બ્રાહ્મણ પ અને મંત્ર ૩/૪માં દર્શાવ્યો છે.

આ જ બાબતમાં આપણાં શાસ્ત્રોમાં કહેલ બીજા સિદ્ધાંતો અનુસાર ‘અંતે મતિઃ સા ગતિઃ’ મરતી વખતે જેવી બુદ્ધિ કે વિચાર જે જીવાત્માના મનમાં હોય તે પ્રમાણે જ તેને આગળનો જન્મ મળે છે. શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે -

યં યં વાપિ સ્મરન્ભાવં ત્યજયન્તે કલેવરમ् ।  
તં તમેવૈતિ કૌન્તેય સદા તદ્ભાવભાવિતઃ ॥અ.૮/૬॥

મૃત્યુ સમયે મનુષ્ય જે જે મનોવૃત્તિની યાદ કરતાં કરતાં આ દેહ છોડે છે, તે તેવી જ મનોવૃત્તિમાં રંગાયેલો હોવાને કારણે તેને અનુરૂપ યોનીમાં જન્મ ધારણ કરે છે.

અંતકાલે ય મામેવ સ્મરન્મુક્તત્વા કલેવરમ् ।  
યઃ પ્રયાતિ સ મદ્ભાવં યાતિ નાસ્તત્ર સંશયઃ ॥અ.૮/૫॥

મૃત્યુ સમયે જે મારું જ સ્મરણ કરતાં આ દેહ છોડે છે તે મારા જ સ્વરૂપને પામે છે તેમાં કોઈ શંકા નથી.

આ વિષય અંગેની અજભિલની કથા પુરાણોમાં પ્રસિદ્ધ છે. જીવનભર પાપકર્મોમાં આળોટો મૃત્યુ સમયે ‘નારાયણ નારાયણ’ એમ પોતાના વહાલા પુત્રને ભૂમો પાડતો હતો. માટે યમરાજ તેને સ્પર્શ પણ કરી શક્યા નહીં અને વિષણુના દૃતો તેને વૈકુંઠમાં લઈ ગયા.

આથી વિશુદ્ધની જડભરતની વાત છે. ભરતરાજ ધણા જ મોટા તપસ્વી હોવા, ઇતાં હરણીનાં બચ્યાં ઉપર અખૂટ મમતાને લીધે તેમને હરણીની યોનીમાં જન્મ લેવો પડેલો.

પરીક્ષિત રાજને મરણ પહેલાં શુક્મુનિ પાસેથી સાત દિવસ સુધી ભાગવતપુરાણ સાંભળ્યું હતું, અને સાઈનાથ મહારાજે પણ દેહત્યાગ પહેલાં વજે નામના બ્રાહ્મણ પાસેથી ચૌદ દિવસ સુધી ભાવાર્થ રામાયણ વંચાવ્યું હતું.

મરણોત્તર ઉત્તમ ગતિ પામવા માટે બીજુ એક સહેલી રીત શ્રીસાઈસચ્ચરિત્રના ૩૧માં અધ્યાયમાં વર્ણવવામાં આવી છે. આ વિષે મદ્દાસી સંન્યાસી, બાળકરામ માનકર, તાત્યાસાહેબ નૂલકર, મેધો અને પેલો વાધ. જેનાં ઉદાહરણો અધ્યાય ૩૧માં આપ્યાં છે તે આપણે આગળ વાંચી ગયા છીએ.

તેના કરતાં ઉધુ ઉપર જણાવેલ કોઈ પણ માર્ગનો સહારો લેનાર, પાપી લોકોની અધોગતિ શ્રીકૃષ્ણ ભગવાને ગીતાના ૧૬માં અધ્યાયમાં આ પ્રમાણે કહી છે -

અનેક ચિત્તવિભાન્તા મોહન્લસમાવૃતા: ।  
પ્રસક્તા : કામભોગેષુ પતનિ નરકેઽશુચૌ ॥૧૬॥

અનેક મનોરથોમાં ચિત્ત ભમેલું, મોહન્લણમાં ફસાયેલું, કામ મોહમાં આસક્ત થયેલા આ લોકો ગંદા નરકમાં પડે છે. આ પ્રકારના નક્કામાના ફૂર અને પાપી નરાધમોને હું હંમેશા આસુરી યોનીમાં નાખ્યું છું.

આસુરી યોનિમાપના મૂઢા: જન્મનિ જન્મનિ ।  
મામપ્રાયેવ કૌન્તેય તતો યાન્ત્યધમાં ગતિમ્ ॥૨૦॥

આ પ્રમાણે હે અર્જુન ! એ મૂર્ખ લોકો દ્વારા જન્મમાં આસુરી યોનીમાં જ ઉત્પન્ત થાય છે અને મને ન પામતાં છેલ્લે

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ફરીથી અધોગતિ જ પામે છે.

આ કથાનું આશ્ર્વય એટલે કે તે સાંભળીને દુષ્ટ વૃત્તિનો અંતર્ભાવ થયેલાને, ‘હું હેહ છું’ આવી ભાવનાની યાદ ભૂસાઈ જઈ સાત્વિક અષ્ટભાવ જગૃત થશે. પાસે અખૂટ ઘનસંપત્તિ હોવા છતાં જે સ્વભાવે કંજુસ છે તેવાઓનાં જીવનને વિક્ષાર છે. મૃત્યુ સુધી તે વ્યર્થ પરિશ્રમ જ અનુભવતો રહે છે. તેમાં પણ દેહમાં વેરવૃત્તિનો સંચાર સારો નથી હોતો. આ દૂષણથી માણસે પોતાની જતને દૂર રાખવી જેઠાએ. કારણ તો પાતાનું જીવનનું સત્યાનાશ કરે છે. પરસ્પર વૈરનું પરિણામ તે છે કે આ જન્મે સારી યોનીમાં જન્મ દેવા છતાં બીજે જન્મ નીચ યોનીમાં થાય છે. ઝણ, વેર અને હત્યાનો સ્વાભાવિક ગુણધર્મ જ એવો છે કે તે ફેરફારીનું સુધી પુનર્જન્મની પરંપરા ચાલુ જ રહે છે. આ બાબતમાં સાઈના મુખેથી વદેલી પરમ પાવન અમૃતવાળી, હું શ્રોતાઓ માટે રજૂ કરી રહ્યો છું. ભક્તોએ સાંભળવા માટે સાવધાન થઈ જવું. આ જ તે કથા છે. જે મેં જેવી મેં સાંભળી અને જેટલી મારા સંસ્કરણમાં રહી તથા જેવી રીતે સાઈમાઉલી બોતી બસ તે જ શબ્દોમાં હું વર્ણન કરી રહ્યો છું. સાઈનાથ મહારાજ પોતે જ ચરિત્રકર્તા છે અને કથાનો વિસ્તાર લખાવી રહ્યા છે. હેમાંડપંત તો નિભિત્ત માત્ર છે. તેના સુત્રધાર તો સાઈમહારાજ જ છે. (ઓ. ૨૮-૩૫)

‘એક દિવસે સવારના આઠ વાગ્યાના સુમારે રોજનો નિત્યક્રમ પતાવીને હું બહારની ફેરી ઉપર નીકબ્બો. રસ્તામાં જતાં જતાં થાક્યો, એટલે એક નદી કિનારે હાથપગ ધોઈને સ્નાન પણ કરી લીધું. તેથી જરા સારું લાગ્યું. નદી પણ કેવી હતી ! આ રાહટાની નદી જેટલી જ હતી. છલોછલ ભરેલી નદી બંને કઠિ વહેતી હતી અને તેને અડીને જ કિનારે ચાર ફૂટ ઊંચા ધાસનાં બીડ હતાં. તેમાંથી એક પગદીની પસાર થતી હતી. ત્યાં ચોખ્ખો દેખાતો ગાડાચીલો પણ હતો. કિનારા ઉપર વિશાળ ઘટાદાર વૃક્ષને લીધે છાંયડો પણ સુંદર હતો. મંદ મંદ પવન વહી રહ્યો હતો. આશી મનને ઘણો જ આનંદ થઈ રહ્યો હતો. આ ગીય જાડીના છાંયડાને જેઠાને તેની નીચે હું ખુલ્લા મને જઈને બેઠો. પછી ચલમ ભરવા માટે છાપી ભીની કરવા હું નદી ઉપર ગયો ત્યાં ડ્રાઉં ડ્રાઉં આવો અવાજ કાને પડ્યો અને મને તે દેડકાનો અવાજ લાગ્યો. તેમાં વળી આશ્ર્વય શું ? જ્યાં પાણીનો ભરાવો હોય ત્યાં દેડકાં તો હોય જ. છાપી ભીની કરીને હું પાછો ફર્યો અને હાથમાં ચકમક ઘરી સૂક્ખ કર્યા ઉપર તણખો પાડી ચલમ સળગાવી તૈયાર કરી એટલામાં જ એક વટેમાર્ગું આવીને નમસ્કાર કરી મારી પાસે બેઠો. મારી પાસેથી નમ્રપણે ચલમ હાથમાં લઈને ‘ખૂબ દૂરથી આવ્યો છું.’ એવું બોલીને તે આગળ કહેવા લાગ્યો, ‘અહીંથાથી માસ્નિદ્વ ઘણી દૂર છે ત્યાં જતાં સુધીમાં તડકો ખૂબ જ વધી જરો. પેટી બાજું મારું ધર છે. ચલમ પીને ત્યાં જઈએ. થોડું કાંઈ ખાઈએ, થોડો આરામ કરીએ અને પછી નમતો પહોર થતાં આપ ખુશીથી પાછા ફરજો. હું પણ તમારી સાથે આવીશ.’ આવું બોતીને વટેમાર્ગું ચલમનો એક દમ માર્યો અને પછી મને પીવા માટે આપી. ત્યાં પેલો દેડકો મોટા અવાજે આંકંદ કરવા લાગ્યો. તે સાંભળીને વટેમાર્ગું બોલ્યો, ‘આ કોણ ખૂબ પાડે છે ?’ તે સાંભળીને હું બોલ્યો, ‘નદી કિનારે દેડકો સંકટમાં સપદાયો છે. તેનાં કર્મો જ તેની પાછળ પડ્યાં છે એ વાત તને કરું છું. તે તું સાંભળ. પાછલા જન્મમાં જે પ્રમાણે વર્તે છે તે પ્રમાણે આ જન્મમાં પામો છી. કરેલાં કર્મોનું ફળ ભોગવવા માટે તૈયાર રહેવું. હવે રડવાથી શો ફાયદો ?’ પછી પેલી ચલમ મારા હાથમાં આપીને, વટેમાર્ગું ત્યાં જવા ઉપડ્યો. તે બોલ્યો, ‘હું જરા જેઠ આવું, ખરેખર તે દેડકો જ છે કે બીજું કોઈ પ્રાણી છે ? ખાત્રી કરી લઈએ કે તેને શેનું ફુઃખ છે ?’ તેની એવી ઠચ્છા જેઠને હું બોલ્યો, ‘જ જેઠ આવ, એક મોટા સાપના મોટામાં સપદાયેલો દેડકો બૂમરાણ મચાવી રહ્યો છે. બંને મહા હરામખોર અને લુચ્યા છે. બંનેના ગયા જન્મોનાં કર્મો તો અધોર પાપી જેવાં હતાં. તેનાં ફળ ભોગવવા માટે તેમને આ બીજું શરીર ધારણ કરવું પડ્યું છે.’ (ઓ. ૩૬-૪૪)

આમ વાત ચાલી રહી હતી, એટલામાં તે મુસાફર ત્યાં પેલી જગ્યા ઉપર જતે જ જેઠને આવ્યો અને બોલ્યો, ‘તમે

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

કહેલી વાત તદ્દન સાચી છે. કાળ જેવા પેલા સાપનું જડબું વિશાળ છે. અને દેડકો પણ ખૂબ મોટો અને વિકરાળ છે. પણ તે સાપનું ભોજન થયો છે. સાપના મોઢામાં એની આહુતિ પડી છે. હવે ઘડી બે ઘડીની જ વાર છે. કર્મની ગતિ કેટલી વિચિત્ર છે ભાઈ ! દેડકાને તે સાપ હવે ક્ષણભરમાં જ ભક્ષ કરી નાખશો.’ ત્યારે હું બોલ્યો, ‘એ શું ખતાસ કરતો હતો ? હું અહીં એનો બાપ બેઠો છું ને ! પછી શા માટે હું અહીં આવીને બેઠો છું ? પોતાનું સ્થાન છોડીને જે હું અહીં આવીને બેઠો છું તો શું પેલા સાપને દેડકો ખાવા દઈશ ? જો હું તેને કેવો છોડાવું છું તે ! તેમને આ લડાઈમાંથી છોડાવીને આપણે આપણા ઘેર જઈશું. ચાલ ફરી એકવાર ચલમ ભર. પછી જોઈએ છીએ કે પેલો સાપ શું કરે છે ?’ તે સાંભળી મુસાફરે ફરી ચલમ તૈયાર કરી. મેં પણ તેને મોઢે લગાડીને બે દમ માર્યા. ત્યારબાદ વેટમાર્ગુને સાથે લઈને, ધાસના બીડની પગદીમાં થઈને પેલી જગ્યા ઉપર જઈ પહોંચ્યો. ત્યાં મોટા સાપને જોઈને વેટમાર્ગું પાછો ગભરાઈ ગયો, અને ‘કેવું પ્રચંડ આ જનવર’ કહીને ગભરાયેલો તે મને રોકવા લાગ્યો. ‘નહિ, નહિ આગળ ન જતા, એ સર્પ આપણો પીછો કરશે અને દોડવાની જગ્યા પણ ધાર્યી સાંકડી પડ્યો. ના ભાઈ, ના, મહેરબાની કરીને ત્યાં જતા નહિ.’ આમ આ દશ્ય જોઈને મુસાફરને ઘણો જ ડર લાગ્યો અને પછી બંનેને વેરવૃત્તિ સંબંધમાં મેં જે ઉપદેશ કર્યો તે સાંભળો, ‘અરે બાબા, વીરભદ્ર ! હજું પણ તારા વેરને લીધે બસસ્પાને દેડકાનો જન્મ મબ્બો તો પણ તને શાંતિ નથી ? તું પણ સર્પ યોનીમાં જનમ્યો છતાં હજુ સુધી વેર બાંધીને કેમ બેઠો છે ! હવે તો જરા શરમ કર અને વેર છોડીને જરા સ્વસ્થ બેસ.’ મારા મોઢામાંથી આ શાઢ્યો બહાર નીકળ્યા નથી ત્યાં જ પેલા દેડકાને મોઢાની પકડમાંથી છોડી દઈને વિકરાળ સાપ જલ્દીથી ઊંડા પાણીમાં ઉત્તરીને અદશ્ય થઈ ગયો. મૃત્યુના મુખમાંથી છૂટેલો દેડકો પણ ટપક દઈને છલાંગ મારી પાસેની ઝડાની જાડીમાં જઈ સંતાઈ ગયો. વેટમાર્ગુને ખૂબ આશ્વર્ય થયું અને બોલ્યો, ‘અરે આ શું પ્રકાર છે, તે સમજતું નથી. મોઢામાંથી શબ્દો શું નીકળ્યા અને પેલા સાપે દેડકાને છોડી દીધો અને પોતે પણ અદશ્ય થઈ ગયો. આ પૈકી વીરભદ્રપા કોણ અને બસસ્પા કોણ ? તેમને વળી વેરનું કારણ શું ! મહેરબાની કરીને એ બધું મને સમજલવો.’ એ સાંભળીને હું બોલ્યો, ‘સાચું, પહેલાં આપણે પેલા ઝાડ નીચે જઈએ. ચલમ પીએ પછી હું તારી જ્ઞાસા પૂર્ણ કરીને હું મારે ટેકાણો જઈશ.’ એવું બોલીને અમે બંને પેલા ઝાડ નીચે આવ્યા. ઘટાદાર છાંંયડો હતો અને ઢંડી ઢંડી મંદ પવનની લહેરીઓ ઉડી રહી હતી. પછી ફરી ચલમ પેટાવી પેલા વેટમાર્ગુએ પહેલાં પીધી અને બાકી રહી તે મારા હાથમાં સોંપી. મેં ચલમનો દમ મારતાં મારતાં આખી વાત પેલા વેટમાર્ગુને કહી સંભળાવી. (ઓ. પ૪-૭૪)

જુઓ ! મારા સ્થાનથી બે ત્રણ કોંસ એટલે લગભગ ૮ થી ૧૮ કિ.મી. દૂર એક જૂનું પ્રસિદ્ધ પવિત્ર સ્થાન આવેલું હતું. ત્યાં કોઈક કાળે મહાદેવનું એક જર્જરિત મંદિર હતું. જેનો લાર્ણોદ્વાર કરવા માટે સૌના મનમાં વિચાર આવ્યો. તે કારણ માટે મોટું ઉધરાણું કર્યું અને સારી એવી રકમ જમા થઈ. ત્યારબાદ પૂજન અર્થનાની વ્યવસ્થાનું નક્કી કરીને તેને લગતી બધી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી. ત્યાંના જ એક જવાબદાર શ્રીમંત માણસની વ્યવસ્થાપક તરફ નિમણૂક કરવામાં આવી. એના હાથમાં બધી ઉધરાવેલી રકમ પણ સુપ્રત કરવામાં આવી. બધા નિર્ણયો લેવાનો અવિકાર પણ તેને જ સોંપવામાં આવ્યો. તેને જુદા જુદા જમાખર્યાની નોંધ રાખવી અને તેમાં જ પોતાનો ફાળો પણ જમા કરાવવો, તથા આ કાર્ય ભૂલ વીના પ્રમાણિકપણે પાર પાડવું એવું નક્કી થયું. પરંતુ તે સ્વભાવે મહા કંજૂસ હતો. પોતાને કંઈ નુકશાન થાય નહિ તે પ્રમાણે અને તે ઘોરણો તે બધાં જ કામ ચલાવતો હતો. એની આવી કામ કરવાની વિચિત્ર રીતથી તે કાર્ય પૂર્ણ થઈ શકતાં નહીં. આમ તો મળેલી બધી જ રકમ ખર્ચાઈ ગઈ છતાં અદધું જ કામ થયું. આટલો બધો શ્રીમંત હોવા છતાં તે ગાંઠના પૈસા કાઢવા તૈયાર ન હતો. તેના હાથથી એક દમડી છૂટતી ન હતી. અને તે મોટો જાણો કે ચીંગુસપણાનો મૂર્તિમંત અવતાર હતો. ફક્ત મીઠી મીઠી વાતો જ કરતો પણ કામ આગળ વધતું ન હતું. જેમણે આ કાર્ય માટે પૈસા રોક્યા હતા

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તેઓ બધા જ ભેગા થઈને બોલ્યા કે, ‘તારી આ શાહુકારી અને શ્રીમંતાઈ શા કામની ? જ્યાં સુધી તું આ કામ માથે લે નહીં ત્યાં સુધી આ મહાદેવનો જીર્ણોદ્વાર કેવી રીતે પાર પડશે ? એનો તો વિચાર કર ! લોકોને મનાવીને બીજી થોડી વધારાની આથીક મદદ મેળવી લઈએ છીએ અને તે પણ તને મોકલી આપીએ છીએ. પણ એક વખત આ કામ પાર પાડ.’ થોડી વધારે રકમની સગવડ થઈ, ધાર્યા કરતાં પણ વધારે રકમ હાથ આવી. છતાં તેનો કંઈ ઉપયોગ થયો નહિં અને પેલો ઘનિક એમને એમ હાથ ઉપર હાથ રાખીને જ બેઠો. (ઓ. ૭૫-૮૬)

‘આમને આમ કેટલાયે દિવસો વીતિ ગયા. અને છેલ્લે ઈશ્વરને પોતે જ કંઈ કરવું પડશે. એવું લાગ્યું. એ અરસામાં પેલા ઘનિકનાં પત્નીને સ્વભન આવ્યું, ‘તું તો ઉઠ અને જગૃત થા. તું મંદિરનો ધૂમટ બંધાવ. તેને માટે તું જે કાંઈ ખર્ચ કરીશ તેનું સૌ ગણું ભગવાન શંકર તને અપાવશો.’ બીજે જ દિવસે પેલી બાઈએ પોતાના આ આખા સ્વભનની વાત પતિના કાન ઉપર સવિસ્તાર નાખી. પરંતુ એક દમડી ખર્ચ કરતાં જેનો પ્રાણ નીકળી જતો હોય તેવા શેષ માટે તો આ સ્વભન ત્રાસદાયક થઈ પડ્યું. સતત રાત દિવસ જે પૈસા ભેગા કરવાનું જ કામ કરતો હોય અને તે સિવાય બીજે કોઈ વિચાર પણ આવે નહિં તેવાને આ સ્વભનમાં જણાવ્યા મુજબ ખર્ચ કરવાનું કેવી રીતે યોગ્ય લાગે ? તેણે પોતાની પત્નીને કહ્યું કે, ‘હું સ્વભનની વાતોમાં માનતો નથી. મને તેની ઉપર જરાયે વિશ્વાસ નથી.’ એવું કહીને પોતાની પત્નીની મશકરી કરવા લાગ્યો. જેવી જેના મનની વૃત્તિ હોય છે તેવી જ તેને આ જગતની સ્થિતિ દેખાય છે. પોતાનો ખરાબ સ્વભાવ હોવાને કારણે બીજું બધું તેને એવું જ દેખાવા માંડ્યું. તે બોલ્યો, ‘ઈશ્વરના મનમાં જે મારો જ પૈસો કઢાવવાનું ધાર્યું હતું તો હું વળી તારાથી કયાં દૂર હતો ? એ તારા જ સ્વભનમાં કેમ આવ્યો ? તને જ શા માટે આવું સ્વભન આવ્યું ? ઈશ્વરે મને તે કેમ ન આવ્યું ? માટે મને એ તારી વાત ઉપર જરાયે વિશ્વાસ બેસતો નથી અને એનો હેતુ પણ મને સમજતો નથી. આ સ્વભન ખોટું જ હોવું જેઈએ એવું જ મને લાગે છે. અથવા તો આપણે પતિ-પત્નીમાં કોઈ ગેરસમજ ઉત્પન્ન થાય તે માટેનો જ કોઈ ઈશ્વરીય પ્રયત્ન કે ઈશારો છે એવું મને લાગે છે. મંદિરના જીર્ણોદ્વાર માટે મારી મહેનત કંઈ ઓછી છે ? અમારી ભરેતી થેલી મહિને મહિને ખાલી થઈ જય છે. બધી રકમ જે લોકો લાવે છે તે ઉપર ઉપરથી દેખાય છે ખરી પરંતુ આ જમાખ્યાની અને વ્યાપારધંધાની રીત મારે ખૂબ જ નુકશાનકર્તા સાબિત થશે. લોકોને જ જે સમજતું નથી, તો તેને કયાંથી સમજશે ? આ સંજ્ઞેગોમાં તારું આ સ્વભન સાચું માની શકાય નહિં. તેને જે ખરું માનીશું તો અવશ્ય ફસાવાનો વારો આવશે. ઉંઘ ઊડી ગયા બાદ આ તારા સ્વભનને સાચું થોડું માની શકાય ? શ્રીમંતે આવી રીતે પોતાના વિચારો રજૂ કર્યા અને આવા વગર કામના સિદ્ધાંતો મનમાં ઠસાવવા માટે પ્રયત્નો કર્યા. તે બાબી આ બધું સાંભળીને નિરુત્તર ચૂપ બેસી ગઈ. તે પતિની સામે બોતી શકી નહિં. લોકો પૈસા જમા કરાવતા હતા છતાં તે ખુશીથી કયારેક ભાગ્યે જ આપતો હતો. પ્રેમ વગરનું, જબરજસ્તીથી કોઈના આગ્રહને લીધે અથવા તો મુશ્કેલી આવ્યાને કારણે જે દાન આપવામાં આવે છે તે ઈશ્વરને ગમતું નથી. શ્રદ્ધા દેયમ્ । અશ્રદ્ધા અદેયમ્ ॥ તૈત્તિરીય ઉપનિષદ વલ્લી ૧ અનુ. ૧૧. આપો નિત્ય શ્રદ્ધાથી દાન । વિના શ્રદ્ધા ન પહોંચે તે ॥ અ. ૧૪ ઓ. ૧૪૪ ॥ પ્રેમથી તથા મનથી અને ભક્તિભાવથી થોડું પણ અર્પણ કરો તો ઈશ્વરને મન તે ખૂબ જ કિંમતી છે. પત્રં પુષ્પં ફિલં તોચં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ । તહું ભક્ત્યાપહ્યતમશાભિ પ્રયત્નાત્મનઃ ॥ ગીતા અ. ૮/૨૯ ॥ જે કોઈ મને પાન, ફૂલ, ફળ અને પાણી ઇત્યારી ભક્તિભાવથી અર્પણ કરે છે, તેવા શુદ્ધ ચિત્ત મનુષ્યના ભક્તિના ભાવનો હું ખૂબ આનંદથી સ્વીકાર કરું છું. જેમ જેમ પૈસા ભેગા થતાં, તેમ તેમ કામ આગળ વધતું હતું. પૈસો આવતો રોકાઈ જતો કે તરત જ કામ પણ થોભી જતું. આવી રીતે ખેંચાઈ ખેંચાઈને અને ચિકાશથી આ કામ ચાલતું હતું. ઘનિક રહ્યો કંબુસ. પોતાની ગાંધનો એક પણ પણ પૈસો પણ ઉમેરતો નહિં. પછી તેનાં પત્નીને ફરી પાછું સ્વભન આવ્યું તે વિષે હવે સાંભળો.’ (ઓ. ૮૭-૧૦૩)

‘મંદિર માટે પૈસા આપવા કે દાન કરવા પતિને આગ્રહ કરીશ નહિં. તારા મનનો જે ભાવ છે તે ઈશ્વર માટે પૂરતો છે.

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

તને કેટલી ઈચ્છા થાય તેટલું જ તું આપણે. સાચા મનથી આપેલો પોતાની માલિકીનો પૈસો પણ લાગ્યો રૂપિયા બરાબર છે. પતિના વિચારને જાણીને તું તે આપણે. વગર કામનો નક્કામો ત્રાસ ભોગવતી નહીં. પોતાના મનમાં યોગ્ય લાગે તેટલું જ આપણે આપવું. તારી પોતાની માલિકીનું જે કંઈ છે તે તું ઈશ્વરને અર્પણ કર. અહીં માત્ર ભક્તિ અને શ્રદ્ધાનું જ કારણ હોવું જોઈએ. તે તારા પોતાના છે. એવું સમજુને એમાંથી થોડો હિસ્સો આપ એવો ઈશ્વરનો આગ્રહ છે. થોડું તો થોડું જે કંઈ ઘન હશે તે આપીને દાન કર અને નિશ્ચિત થા. શ્રદ્ધા વીનાનું દાન યોગ્ય નથી અને તે ઈશ્વરને પસંદ પણ નથી. શ્રદ્ધા વગરનું જે કોઈ આપે છે તે ધૂળ સમાન છે. અંતે તે જરૂર મણથી નિષ્ફળતા વહેરે છે. જેનો અનુભવ માણસને તાત્કાલીક થાય છે.' આવું સાંભળીને પેલી બાઈએ મનમાં નિર્ધાર કર્યો કે મારા પિયરથી જે દરદાગીના મને મળ્યા છે તેને વેચીને ઈશ્વરની આ માંગણી પૂર્ણ કરીશ. પછી તેણે પોતાના મનના વિચારો પતિને જણાવ્યા. તે સાંભળી પતિ તો ખૂબ જ દુઃખી થયો. જ્યાં લોલ છે ત્યાં ડાહ્યપણભર્યો વિચાર કર્યાંથી આવી શકે અને દાનધર્મ કે દેવધર્મની તો વાત જ કર્યાં રહી છે? તે મનમાં બોલ્યો, 'કેટલો મૂર્ખતાપૂર્ણ આ વિચાર છે! ખરેખર આનું મન ભ્રમિત થઈ ગયું છે એવું મને લાગે છે. આના બધા દાગીનાની અંદાજે કિંમત એક હજાર રૂપિયા નક્કી કરી જમીન તેના નામે જ ચઢાવી દેવી.' પછી તેણે દાગીના જાતે જ વેચાતા લઈ લીધી અને તે દરમિયાન જ પોતાની પાસે ગીરવે મૂડેલી કોઈની આરા પાણીવાળી રેતાળ જમીન તેને આપી દીધી. તે જમીનનું કંઈ પણ ઉપજ શકે તેવું ન હતું. ભર ચોમાસે પણ એમાં કંઈ પાકતું નહિ. ઘનિકે પત્નીને કહ્યું કે, આ જમીન તું શંકરને આપી હે એક હજાર રૂપિયાની આ જમીન દાન કરવાથી, સ્વભનમાં તને જણાવ્યા પ્રમાણે ઈશ્વર પ્રસન્ન થશે, અને તું આણમાંથી મુક્ત થઈશ. પતિના આમ બોલવા ઉપર વિશ્વાસ મૂકીને કંજૂસની પત્નીએ તે જમીન પ્રેમભાવથી શંકરને પ્રસન્ન કરવા અર્પણ કરી દીધી. વસ્તુસ્થિતિ એવી હતી કે, બસો રૂપિયા રોકડાના કર્ણની સામે તે જમીનનો ટુકડો પેલા શ્રીમંત પાસે ગીરવે મૂકવામાં આવ્યો હતો. અસલમાં એ જમીન ઉપર રૂબકી નામની માલકણની સત્તા હતી. પૈસાની અહૃદયને લઈને તેણે આ જમીન પેલા શ્રીમંત પાસે ગીરવે મૂકી હતી. પરંતુ તે શ્રીમંત હતો બડો લોભી. ભગવાન શંકર જેવાને ઠગતાં તને જરાયે ડર લાગ્યે નહિ. પોતાની પત્નીનું પણ સ્વીધન દખાવીને બેસી ગયો. લુચ્યાઈથી દ્રવ્ય કર્માવવામાં તને ખૂબ સુખ મળતું હતું. આ ઈન્દ્રિય સુખની ઈચ્છા ખૂબ જ અધમ અને નક્કામી છે. આવા વિષયબોણી લંપટોનો એ નાશ કરે છે. મનુષ્યને બલે જવતા રહેવાની ઈચ્છા હોય તો આ વિષય ભોગના બંધનમાં ફસાવું નહિ. સાંભળવાની પ્રબળ ઈચ્છાને કારણે હરણા, માથા ઉપર સુંદર મણી ધારણ કરેલો નાગ, અને પ્રકાશ તરફ જેવાની અને ઊડવાની મનોકામના કરનારું પતંગિયું આખરે મરણને જ શરણ થાય છે.

વિષયોનું ચિંતન કરનારા પુરુષોના મનમાં વિષયોની આસક્તિ ઉત્પન્ન થાય છે. તે આસક્તિમાંથી તેનો પ્રતિબંધ થતાં કોઈ ઉત્પન્ન થાય છે. કોઈમાંથી મગજમાં વિચારોના ગોટાળા અને વિચારોના ગોટાળામાંથી સ્મૃતિભંસ થાય છે અને તેમાંથી બુદ્ધિનાશ થાય છે. બુદ્ધિનાશમાંથી સર્વસ્વનો નાશ થાય છે. આ લોકમાં વસ્તુનો ઉપભોગ કરવા માટે દ્રવ્યની જરૂર પડે છે અને તેને મેળવવા માટે પ્રયત્ન કરતી વખતે ઈન્દ્રિય સુખની આસક્તિ વધે છે, જેને રોકવી આશક્ય થઈ જય છે. ખાત્રીપૂર્વક જે નુકશાનકારક જમીન છે જેમાં પ્રયત્ન કરવા છિતાં કંઈ પાકવાનું નથી. તેને કહે છે કરો દેવને અર્પણ. આવા દાનનું પૂણ્ય તે વળી શું મળે? જેને આપવા પાઇણ કોઈ હેતુ જ રહેતો નથી, એવું દેવને અર્પણ કરવાથી, કરેલું દાન નિર્વિકલ્પ અથવા નિઃસ્પૃહ મનાય છે. પણ એ દાન લેનારાને અતિ દુઃખદાયક બને છે. તે કોઈ નિર્વિકલ્પ દાન નહીં પણ તે દાન પાપ કર્યા બરાબર છે. (ઓ. ૧૦૪-૧૨૫)

'અહીં દેવનું પૂજન કરનારો ગરીબ બ્રાહ્મણ દેવ માટે જમીન દાન મળતાં અત્યંત સંતુષ્ટ થયો. પરંતુ અમુક સમય બાદ કાંઈ બળતું જ થયું. કૃતિકા નક્ષત્રમાં બેસુમાર વરસાદ પડ્યો અને ભયંકર નાસભાગ થઈ. કડાકા સાથે મહાન

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

શક્તિશાળી વીજળી તૂઠી પડી. તેમાં ધનિક કંબૂસની પૂરી ભિલકત જમીનદોસ્ત થઈ ગઈ. પણ પેલી બિનવારસી ઉપજ વગરની જમીન ફક્ત સુરક્ષિત રહેવા પામી. બાકી બધું બળીને ભસ્મીભૂત થઈ ગયું. તે ધનિક કુટુંબ ઉપર આભ તૂઠી પડ્યું. પોતાની પત્ની સાથે તે પણ આ દુર્ઘટનામાં મરણ પામ્યો. તે દૂબકીની અસલ માલિકણ પણ મરી ગઈ. આવો એ ત્રણેનો અંત આવ્યો. ફરી પાછો આ ધનિક મથુરા નગરીમાં એક ગરીબ બ્રાહ્મણને ત્યાં જન્મ્યો અને એની ભાવિક શ્રદ્ધાવાન પત્ની અંતુરીએ એક પૂજલરીને ત્યાં નવો જન્મ લીધો. ત્યાં એનું નામ ગૌરી રાખવામાં આવ્યું. માલિકણ ‘દૂબકી’ની પણ એવી જ દશા થઈ. તેનો જન્મ શંકરપોરને ત્યાં થયો. ગયા જન્મમાં તે સ્વી હતી. આ જન્મમાં પુરુષ રૂપે જન્મી એને તેનું નામ ચનબસપા પાડવામાં આવ્યું. આમ એ ત્રણેની અવસ્થા બદલાઈ ગઈ અને કરેલાં કર્મોનાં ફળ મળ્યાં. ધનિકનો પુનર્જન્મ થતાં તેનું નામ વીરભદ્ર રાખવામાં આવ્યું. પ્રારંભ કર્મોનું આ જ રહેસ્ય હોય છે કે જે ભોગવતાં જ અંત આવે છે. (ઓ. ૧૨૬-૧૩૩)

‘શંકરનો જે પૂજલરી હતો, તે મને ખૂબ ગમતો હતો. હંમેશા મારી પાસે આવતો અને મારી સાથે ચલમ પણ પીતો. પછી અમે આનંદબેર રાતભર ગાપ્યાં મારતા બેસી રહેતા. ગૌરી ઉમરલાયક થઈ અને લશ્ની વાતો ચાલવા લાગી. કયારેક તેને પણ શંકરનો પૂજલરી સાથે લઈ આવતો. તેણે પણ મારી ભક્તિ કરવા માંડી. એક દિવસે પેલો પૂજલરી બોલ્યો, ‘બાબા! બધાં સ્થળો જેઠ લીધાં, પણ કયાંયે આ છોકરીનું ઢેકાણું પડતું નથી. હવે તો છોકરા જેઠ જેઠને થાક્યો. મારાથી થયા તે બધા જ પ્રયત્નો મેં કરી જેયા પણ હવે હારી ગયો છું. અને હવે હું પણ હઠીલો થઈ ગયો છું.’ ત્યારે મેં એને દીરજ આપી, ‘ચિંતા શા માટે કરે છે? તેનો થનારો વર સામે ચાલીને આવી રહ્યો છે. તારી છોકરી ભાગ્યવાન છે. એ મોટી પૈસાવાળી થશે. તેને જ શોધતો શોધતો તેનો વર પગે ચાલતો આવી રહ્યો છે. થોડા જ દિવસમાં તે સામે ચાલીને તારે ત્યાં આવશે અને તારી બધી જ મનોકામના પૂર્ણ થશે. તેમજ તારા કહ્યા પ્રમાણે એ તારી ગૌરીને સ્વીકારશે તથા તેની સાથે જ લશ્ન કરશે.’ અહીંચા વીરભદ્રની ગરીબ પરિસ્થિત હોવાને કારણે માખાપને આશ્વાસન આપીને ઘર છોડીને તે નીકલ્યો. એ ગામે ગામ લિખ માંગતો, તો કદી મહેનત મબૂરી કરી જે મળે તે ખાઈને દિવસ પસાર કરવા લાગ્યો. ફરતાં ફરતાં એ એક દિવસે ઈશ્વર કૃપાથી પેલા પૂજલરીને ત્યાં જઈ પહોંચ્યો. અલ્લા ભિયાંની કરણી અપૂર્વ છે. બધાને એ ગમવા લાગ્યો. આમ થતાં પેલા પૂજલરીનો તેની ઉપર સ્નેહ વધ્યો અને એમ લાગવા માંડયું કે ગૌરી માટે આ છોકરો સારો છે. નાડી, ગૌત્ર, ગુણ અને યોગ પણ મળતાં આચ્યાં. લશ્ન નક્કી કરવા માટે જન્મપત્રિકાઓ પણ સરખાવી જેઠ અને શુભગ્રહો મળતા આવ્યા. પૂજલરીના આનંદનો તો પાર ના રહ્યો. એક દિવસ વીરભદ્રને લઈને પૂજલરી મારી પાસે આવ્યો અને બંનેને સાથે આવેલા જેઠને મારા મનમાં પણ એકાએક વિચાર આવ્યો. વિચારો પ્રમાણે જ મોઢામાંથી ઉદ્ગાર નીકળી પડ્યાં અને હું બોલ્યો, ‘હાતમાં જે સારું મુહૂર્ત હોય તો આના હાથમાં તારી ગૌરીનો હાથ આપીને લગ્ન કરાવી આપ અને તું પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાની.’ પૂજલરીએ પણ પોતાની પત્નીની અનુમતિ લઈને વીરભદ્રને જ પોતાનો જમાઈ બનાવવો એમ નક્કી કરી લીધું. અને શુભ મુહૂર્ત જેઠને તેમનાં લગ્ન કરી આચ્યાં. બધી લશ્ન વિવિ પત્યા બાદ તે જેઠું સંસારમાં સકળ થવા માટે મારા આશીર્વાદ મેળવવા માટે મારાં દર્શને આવ્યું. મેં પણ તેમને ખૂબ મનથી સારા આશીર્વાદ આપ્યા. વીરભદ્રને પણ સુખ મળતાં એ સુખ સંપત્ત થયો અને તેનો ચેહેરો પણ બદલાઈ ગયો. એ પણ મારો ભક્ત બની ગયો અને થોડા જ દિવસોમાં એનો સંસાર બરાબર જમી ગયો. પૈસા પૂરતા ન હોવા છતાં તે કંટાળતો નહીં. આવો ભાગ્યવાન કદી મળે ખરો? દ્રવ્યનો મોટો ત્રાસ હોય છે. નાના મોટા બધાને એ છણે છે. વીરભદ્રને વચ્ચમાં વચ્ચમાંથી એની તૂટ જણાવા માંડી. તે પૈસા વીના કયારેક લાયાર અને હેરાન પરેશાન થઈ જતો. વીરભદ્ર બોલ્યો, ‘બાબા મને કોઈક ઉપાય બતાવો જેથી હું આ સંસારનું ગાડું ખેંચી શકું. હવે હું આપની સામે દંડવત્ પ્રણામ કરું છું. આવી ફસામણ સારી નહીં. આપ જ અમાર આ લશ્નનું કારણ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ઇલો.’ હું પણ તેને સમજનવતો અને ઉપદેશો પણ આપતો તથા પ્રેમથી આશીર્વાદ પણ આપતો હતો. ‘અલ્લા માલિક છે. તેને બધું જ ખબર છે. તે જ તાં આ સંકટ દૂર કરશે.’ વીરભદ્રનું મન સમજુને તેના મનોરથ પૂર્ણ થાય માટે હું તેને આશ્વાસન આપતો અને જરા પણ દુઃખી થઈશ નહીં એવું તેને કાયમ જ સમજનવતો. ‘તારો ભાગ્યોદય હવે પાસે જ છે. કારણ વીનાનો અસ્વસ્થ થઈશ નહીં. પૈસો તો તારા હાથનો મેળ થઈ જવાનો છે, અને તારા સારા દિવસો જરૂર આવવાના છે.’ છતાં વીરભદ્ર કહેતો જ રહેતો, ‘આ બધી પૈસાની જ રામાયણ છે. પત્નીનું આ લાબો, પેલું લાબો એ રોકાતું જ નથી. એક સરખું ચાલુ જ રહે છે. હવે બસ, મારી આ ફનેતી પૂર્તી છે. જેઠ લીધા બધા લઘના લહાવા.’ (ઓ. ૧૩૪-૧૫૬)

‘પછી વખત જતાં દિવસો ફર્યા. નવાઈની વાત તો જુઓ, ગૌરીના ગ્રહે રંગ લાવતાં ખારા પાણીની રેતાળ જમીનના ભાવમાં ઉછાળો આવ્યો. ઇશ્વરની લીલા અગાધ છે. એક ઘરાક આવ્યો અને એક લાખ રૂપિયા આપીને વેચાતી લેવા તૈયાર થયો. દરવર્ષે વ્યાજ સાથેના બે હજાર રૂપિયા આપવાનું નક્કી કરીને પચ્ચીસ વર્ષમાં બાકી નીકળતા પચાસ હજાર પણ પૂરા કરી આપવાનું નક્કી થઈ ગયું. આ દરાવ બધાને જ પસંદ પડ્યો. પરંતુ ચનબસસ્પા ગુરવ ઊભો થયો અને બોલ્યો, શંકરને જે પૈસો અર્પણ થાય તેનો પહેલો હક્કદાર ગુરવ જ હોય છે. દર વર્ષે મળનારા વ્યાજની અધી રકમ મને ગુરવના હિસાબે મળવી જેઠેએ. તેના વીના મને સમાધાન થવાનું નથી. વીરભદ્ર ય તેને પાઈ પણ આપે નહીં અને બસસ્પા સ્વસ્થ બેસે નહીં. આથી બંનેમાં ખૂબ વાદવિવાદ થયો અને તેઓ મારી પાસે આવ્યા. મેં તેને કહ્યું, ‘શંકર ભગવાન પૂર્ણપણે આ જમીનનો માલિક છે. એ બીજી કોઈને પણ કામમાં આવવાની નથી. વગર કામના ભાંજગાહમાં પડતા નહીં.’ મેં એવું બંનેને કહ્યું, ‘ભગવાન શંકરને જે જમીન અર્પણ કરેલી તેની જ આ કિંમત ઉપજુ છે. ગૌરી સિવાય જે કોઈ આ રકમની અપેક્ષા કરશે તે ભૂખે મરવાનો છે. ઇશ્વરની આજ્ઞા વીના આ મૂડી સાથે જે છેડછા કરશે તેની ઉપર દેવનો કોષ ઉત્તરશે. આ ઇશ્વરની મિલકત છે. જે જમીન ઉપર પૂજનીની માલિકી હતી, અને ગૌરીનો વારસાઈ હક હતો, ત્યાં પારકાનો શું લાભ કે શો ભાગ ? ગૌરીના પોતાના હક્કનું આ ઘન છે.’ તેમ એ બંનેને મેં સમજનવ્યાં. ‘ગૌરીની માલિકીનું ધ્યાન રાખીને તેની અનુમતિથી વર્તશો તો તરી જશો. પણ જે તેની ઇચ્છા વિસુદ્ધ કરશો તો ઇશ્વર પણ નારાજ થઈ જશે. વીરભદ્રને સ્વતંત્ર વ્યવહાર કરવાનો અધિકાર નથી.’ આવા મારા સ્પષ્ટ વિચારો મેં તેમની સામે મૂક્યા. આ સાંભળીને વીરભદ્ર ગુર્સે ભરાયો અને તે મારી ઉપર ગાળોનો વરસાદ વરસાવતાં બોલ્યો, ‘તમારા મનમાં મારી પત્નીની માલિકી સ્થાપિને બધી રકમ જાતે હડપ કરી જઈને પોતાનું હિત સાચવીને ચૂપચાપ બેસી જવાનો વિચાર લાગે છે.’ એના આવાં કંદૂ વચ્ચનો સાંભળીને હું તો સ્તબ્ધ થઈ ગયો અને મનમાં ને મનમાં બોલ્યો, ‘અલ્લાં મિયાંની કરણી અગાધ છે. વગર કામનો એદ શા માટે હડપ કરવો ?’ વીરભદ્રસ્પા મારી સાથે આવો ઉગ્ર વર્તાવ કરીને ઘરે જઈને પોતાની પત્ની સાથે પણ ચડભડમાં ઉતરી પડ્યો. માટે તે બાપડી બપોરના સમયે મારી પાસે આવીને મને વિનવવા લાગી.’ ‘બાબા ! કોઈના બોલવા ઉપર ધ્યાન ન આપતાં મારી ઉપર તમારો શ્રાપ ઉત્તરવા દેતા નહીં. હું મારી ઉપર દ્વારા કરવા માટે ઓળિ ફેલાવું છું. આ કંન્યા ઉપર રહેમ રાખનો.’ આવા પ્રેમાળ શંદ્દો સાંભળીને મેં તેને પૂર્ણ આશ્વાસન આપીને કહ્યું, ‘સાત સમુદ્ર પાર આવીને પણ મારી હૃપા તારી ઉપર કરીને તારો ઉદ્ધાર કરીશા. તું જરા પણ દુઃખી થતી નહીં.’ એ જ રાતે ઉઘમાં ગૌરીબાઈને દાઢાંત પડ્યું. ભગવાન શંકરે સ્વભન્માં આવીને કહ્યું કે, ‘આ બધો પૈસો તારો જ છે. તેમાંથી તું કોઈને કંઈ આપતી નહીં. હું કહું તેમ તેની વ્યવસ્થા કરજે કે જેથી સદાય રહે. જેમ હું કહું છું તેવી રીતે કરી નાખ. મંદિર માટે જે જે પૈસા ચનબસસ્પા કહે તે પ્રમાણે ખર્ચ કરવાનો નિયમ પાળજો. તેના પર મને વિશ્વાસ છે. બીજે કોઈ પણ પ્રકારના પૈસાનો કારભાર કરતાં પહેલાં મસ્તિષ્ઠમાં બાબાશ્રીને પૂછ્યા વગર કરવો નહીં. તેમની ખાસ સલાહ લેવી.’ ગૌરીએ પોતાને આવેલ સ્વભન્ મને સવિસ્તાર કહી સંભળાવ્યું. મેં પણ એ દાઢાંત માન્ય રાખી, જરૂર પૂર્તી શિખામણ આપી,

### શ્રી સાઈનું સત્ય ચરિત્ર

‘મુદ્દલ તારું તારી જ પાસે રાખ. ચનબસપ્પાને વ્યાજનો અર્ધો હિસ્સો હંમેશા આપતી રહેલે. વીરભદ્રને આની સાથે કોઈ લેવાદેવા નથી કે કોઈ સંબંધ નથી.’ અમારી વચ્ચે આવો વાર્તાલાપ ચાલુ હતો એવામાં પેલા બંને જણા ત્યાં લડતા ઝગડતા આવ્યા. બંનેને શાંત પાડવા મેં ઘણો જ પ્રયત્ન કર્યો. ગૌરીને આવેલ ભગવાન શંકરનું સ્વપ્ન પણ બંનેને કહી સંભળાવ્યું. પણ તે સાંભળીને તો વીરભદ્ર ગુસ્સામાં પાગલ જેવો થઈ ગયો. સામેની વ્યક્તિ ઉપર ગાળોનો વરસાદ અને ગમે એવા ભળતા ન બોલવાના શબ્દો પણ બોલ્યો. ચનબસપ્પા ડરનો માર્યો ગભરાઈ ગયો. વીરભદ્ર તો આવેગમાં આવી ગમે તેમ બડબડતો ગાળો ભાંડતો બોલ્યો, ‘સામે આવ્યો તો હું તને મારી નાખીશ.’ એવું ચનબસપ્પાને જેરશોસ્થી કહેવા લાગ્યો. તેની તરફ તે ગુસ્સામાં લાતપીળો થઈને બોલ્યો, ‘હું તારા તો દુક્કે દુક્કા કરી નાખીશ અને તને ગળી જઈશ.’ ચનબસપ્પા ડરનો માર્યો મારી પાસે આવીને મારા પગમાં રક્ષણ માટે નમી પડ્યો અને કહેવા લાગ્યો, ‘પ્રભુ મને આ સંકટમાંથી છોડાવો,’ મેં તેને અભય વચન આપ્યું અને ચનબસપ્પાને કહ્યું કે, ‘વીરભદ્રને હાથે તને હું મરવા નહીં દઉં. તું જરા પણ ચિંતા કરતો નહીં.’ (ઓ. ૧૫૭-૧૮૭)

‘આમ વાત વધી અને વીરભદ્રપ્પા મરણ પાખ્યો અને સર્પની યોનીમાં જન્મ્યો. તેના શરીરનું આ પ્રમાણે ઢપાંતર થયું. ચનબસપ્પા દ્રદેશતનો માર્યો જીવતો હતો. છેવટે તેનો પણ ટૂંક સમયમાં અંત આવ્યો. અને તેનો દેડકાની યોનીમાં જન્મ થયો. તેમનું આ પ્રમાણે ચરિત્ર છે. પાછળના જન્મના વેરને કારણે વીરભદ્રપ્પા સાપ થયો અને દેડકા જેવા ગરીબ બસપ્પાનો પીછો પકડીને છેલ્લે તેને પકડમાં લીધો. બસપ્પાનું દેડકાના ઢેપે કરણ ઢણ સાંભળીને મારું મન પીગળી ગયું. મેં આપેલા પાછળના જન્મના વચન અનુસાર મેં તેને વીરભદ્રઝીપી સાપના મુખમાંથી છોડાવ્યો. અલ્લા પોતાના ભક્તો માટે સંકટના સમયે આમ દોડીને આવે છે. તેણે જ મને અહીંથા મોકલીને ભક્તનું રક્ષણ કરાવ્યું અને તેનો પ્રત્યક્ષ અનુભવ આપ્યો. વીરભદ્રને ભગાડીને બસપ્પાને સંકટમાંથી ઉગાર્યો. તે સર્વ ઈશ્વરની જ લીલા છે. ચાલ હવે ચલમ ભર તે પીને હું મારી જગ્યા ઉપર પાછો જઈશ. તું પણ તારે ગામ પાછો જ. મારા નામસ્મરણ તરફ તારું ધ્યાન કેન્દ્રિત કર. એમ બોતીને મેં ચલમનો દમ માર્યો. સત્સંગનું સુખ મળ્યું. ફરતો ફરતો પાછો આવ્યો અને મનનું સમાધાન થયું.’ (ઓ. ૧૮૮-૧૯૬)

સર્વેનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલ, ભક્ત હેમાડપંત રચિત શ્રી સાઈ  
સમર્થના સત્ય ચરિત્રનો ‘શ્રી સાઈ-મુખ-શુત-કથા-કથનમ્’ નામનો સુડતાળીસમો  
અધ્યાય અહીંથા સમાચાર થાય છે.

શ્રી સદગુરુ સાઈનાથને અર્પણા.



## અધ્યાય ૪૭નું અર્� વિવરણ

પાછળના અધ્યાયના અંતે બે બકરાના પૂર્વજન્મની વાત કહી, તેવી જ પણ થોડી વધારે વિસ્તૃતદ્વારા અને મનોરંજક રીતે સર્પ અને દેડકાની ત્રણ જન્મોની કહાણી આ અધ્યાયમાં કહેવામાં આવી છે. આ અધ્યાયનું વિશેષ મહત્વ કે, વાતાડુપે જેમાં મહારાજે ઘણો બધો ઉપદેશ કર્યો છે અને કેટલાંય સત્યો સ્પષ્ટ કરીને બતાવ્યાં છે -

(૧) પહેલું એટલે કે, ‘દ્રવ્યલોભની પરમ અવસ્થા | કેવી લઇ જાય અધઃપતન તરફ’। તે કહેવામાં આવ્યું છે. શ્રીમંતુ પાસે સારો એવો પૈસો હતો. લોકોમાં તેનું માન સંન્માન હતું, પત્ની પણ પોતાના મન પ્રમાણેની નિષ્ઠાવાન અને ઈશ્વર ભક્તિપરાયણ મળી હતી. પણ તેના કંજુસપણાને કારણે અને દ્રવ્ય લોભને કારણે ‘દૂબકી’ નામની અનાથ બાઈની ગીરવે ખૂંકલી જમીનને પચાવી પડાવા માટે તથા પત્નીના દાગીનાની ગેરવ્યાજભી કિંમત કરીને તેને ફસાવવાનો પ્રયાસ કર્યો અને અનીતિથી ખરડાયેલું દાન ભગવાન શ્રી મહાદેવને અર્પણ કરીને ઈશ્વરને પણ ઠગવા માટે તે તૈયાર થયો. તેના ફળસ્વરૂપે કડાકા સાથે વીજળી તેના ઉપર તૂટી પડી અને તેમાં જાતે તો માર્યો ગયો અને પોતાની પત્નીને પણ મૃત્યુના મુખમાં ધકેલી. આમ પાછ પાછ ભેગી કરીને ભેગું કરેલું ઘન નકામુ ગયું અને તેનું સુખ ન ભોગવતાં પત્નીસહ અત્ય આયુષ્ય ભોગવીને જ આ જગતને છોડવાનો વારો આવ્યો.

(૨) બીજે ઉપદેશ વેરવૃત્તિ માટેનો છે -

આ વેરવૃત્તિને લીધે જ વીરભદ્ર અને ચન્દ્રસંપાને સર્પ અને દેડકા જેવી અધમ યોનીમાં જન્મ લેવો પડ્યો હતો. અને ત્યાં પણ તેમની તે જ વૃત્તિ કાયમ રહી હતી. પરંતુ સાઈનાથ જેવા સંતના ઉપદેશને કારણે તે વાતમાં થોડું બંધન આવ્યું.

(૩) ત્રીજું એ કે મનુષ્યના મૃત્યુભાદ તેને પોતાના કર્મ અનુસાર સારો અથવા તો ખરાબ જન્મ મળે છે. તે સિદ્ધાંત બાબાએ અહીંથા મગજમાં ફસાવવા પ્રયત્ન કર્યો છે -

‘લેવું જે કરશે તેવું તે ભરશે । અમોલ છે આ શબ્દો બાબાના’ ॥૨૧૦॥ અ. ૧૮ ‘યથા કર્મ યથાશ્રુત’ જેવાં જેનાં કર્મ હોય તેવું જ તેને જ્ઞાન થાય છે.

પેલા ધનિક કંજુસે, દૂબકીને, પોતાની પત્નીને, અને ખુદ ભગવાન શ્રી શંકરને પણ ઇપિયા પૈસાના વ્યવહારમાં ફસાવ્યા. માટે બીજે જન્મે ગરીબ બ્રાહ્મણને ઘેર જન્મ લઈને તે ઘેર ઘેર ભિંભ માંગવાનો અને મહેનત મજૂરી કરી ગુજરાન ચુલાવવાનો તેનો વારો આવ્યો. પરંતુ એ કંજુસની જ પત્ની ઈશ્વર ભક્તિમાં ઓતપ્રોત રહેતી માટે એક મંદિરના પવિત્ર પૂજારીને ત્યાં જન્મ લીધો. અને સાઈબાબા જેવા સંત સાથે પણ મુત્કાત થઈ. વીરભદ્ર અને ચન્દ્રસંપાએ પૈસાની બાબતે એકળીજ સાથે વેર કરીને મોટા ઝગડાઓ ઊભા કર્યા. માટે જ બીજી જન્મમાં પણ સર્પ અને દેડકો થયા, અને ત્યાં પણ વેરવૃત્તિમાં જીવતા રહ્યા.

(૪) ચોથું એ કે ધર્મ કાર્યોમાં પૈસા ખર્ચવાથી તેનું અનેક ગણું ઘન મનુષ્યને આ જન્મે નહિ તો, પછીના જન્મમાં પ્રાપ્ત થાય છે. ધનિક કંજુસમાં પત્નીએ પોતાના પિતાના પક્ષ તરફથી મળેલાં પોતાનાં સ્વીધનના અલંકારો વેચીને જમીન ભગવાન શ્રી શંકરના મંદિરના લાણ્ડિંગ માટે દાન આપી એટલે બીજી જન્મે તે એક લાખ ઇપિયાની માલિકણ થઈ.

(૫) પાંચમો ઉપદેશ એટલે કે સાચા સંતોને શરણે જવાથી આ જન્મોના તો શું, પણ તે પછીના જન્મમાં પણ તે રક્ષણ કરવા માટે હોડી આવે છે. વીરભદ્ર જ્યારે મારવા માટે ઘસી આવ્યો ત્યારે ચન્દ્રસંપાએ બાબાના પગ પકડી લીધા

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

હતા. અને ઘોર સંકટમાંથી છોડાવવા માટે વિનંતી કરી હતી. તેને કારણે જ દેહકાના બીજા જન્મમાં પણ સર્પદ્રોપી વીરભદ્ર પાસેથી છોડાવવા માટે બાબા હોડીને ગયા હતા.

(૬) છુંક કારણ એટલે કે સંતોનું કહેવું ન સાંભળવાથી કેવું નુકશાન થાય છે તેમજ નસીબમાં જે પૈસો લખ્યો હોય તો મળે છે જ. પણ મનુષ્ય દ્રવ્યના લોભનો માર્યો ઉતાવળે કેવાં પાપ કર્માનો સહારો લઈને પોતાનું સત્યાનાશ કરી બેસે છે તે પણ બાબાએ ચોપખું સમજાવ્યું છે. વીરભદ્ર બાબા પાસે જ્યારે સંસારદ્રોપી ગાડું ચલાવવાની અડચણો સમજાવવા માટે આવ્યો ત્યારે તેને ધીરજ ધરવા માટે કહ્યું હતું.

એ પ્રમાણે આગળ ઉપર તેનાં પત્નીને પુષ્કળ દ્રવ્યનો લાભ થયો છતાં દ્રવ્ય લોભને કારણે થોડી અમસ્તી વ્યાજની રકમ ખાતર તેણે ચનબસપ્પાની સાથે વેર વહોરી લીધું અને પોતાનો પણ સર્વનાશ વહોરી લીધો.

(૭) સાતમો ઉપદેશ એ કે મનુષ્ય મૃત્યુ પછી તેનું શરીર અહીંયા છોડીને જય છે, પરંતુ પોતાના સૂક્ષ્મ દેહ સાથે પોતાનો સ્વભાવ પણ સાથે લઈ જય છે. શ્રીમત દ્રવ્યલોભી હતો. તેના દ્રવ્યલોભને કારણે તે આગલા જન્મમાં બ્રાહ્મણના ફૂળમાં જન્મ મેળવીને ગૌરી જેવી સુશીલ પત્ની મળવાથી એને ફરીથી જુસ્સો આવ્યો. તેને કારણે તેને થોડી અમસ્તી વ્યાજની રકમ ખાતર ચનબસપ્પાની સાથે જગડો કર્યો અને અંતે મરણ પામ્યો. પછી આગળ આ વેરવૃત્તિ બીજ જન્મે સર્પ યોનીમાં કાયમની રહી, અને તે દેહકાના રૂપમાં બસપ્પાને મારીને ગળી જવા માટે વધારાનું પાપ પણ માથે વહોરી લેવા માટે તૈયાર થયો.

એટલે જ સમજુ માણસે સદ્વૃત્તિ કેળવવી અને સાથે સાથે પોતાના સ્વભાવમાની પાપી અને આસુરીવૃત્તિ છોડી દેવા માટે દરેક જન્મમાં પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે તે જ આવતા જન્મમાં તમારી સાથે આવનાર છે.

(૮) આઠમો અને છેલ્લો ઉપદેશ એટલે કે પોતાની જ વાત કહેતી વખતે અને પોતે જ પોતાના ભક્તોનું રક્ષણ કરવા છતાં પણ સાઈબાબાએ તેનું અભિમાન ન વાગોળતાં તેમનું કતૃત્વ નમ્રપણે છેવટે પરમેશ્વરને જ અર્પણ કર્યું છે. આ પ્રકારે શ્રોતાઓને નિરહંકાર કતૃત્વ અને નમ્રતાનું શિક્ષણ આપ્યું છે.



## ॥ અધ્યાય ૪૮ ॥

### સારંક ભક્ત અનુગ્રહ કરણમુ

(જેને વિદ્યાસ નથી એવા શંકાશીલ ભક્તો ઉપર કૃપા કરવી)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,  
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદ્ગુરુ સાઈનાથ મહારાજને વંદન.

હવે આ અધ્યાય શરૂ કરતી વખતે જેને સાંભળવાની અત્યંત ઉત્સુકતા છે એવા શ્રોતાઓ પૂછવા લાગ્યા કે, સાઈમહારાજ ગુરુ છે કે સદ્ગુરુ છે ? તેમના સમાધાન માટે સદ્ગુરુનાં લક્ષણો ટૂંકાણમાં નિવેદન કરીએ, જેથી સાઈસમર્થની જગ્યાએ સદ્ગુરુનાં લક્ષણો શ્રોતાઓને દેખાઈ આવશે. જેમના દ્વારા વેદોનો અભ્યાસ કરવામાં આવે છે અથવા છ એ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, કે પછી જેમની પાસેથી વેદાંતનું એટલે કે ઉપનિષદનું વર્ણન સાંભળવા મળે છે તેને જ્ઞાની લોકો સદ્ગુરુ નથી કહેતા એ કેવળ ગુરુ જ છે. કોઈ શાસ રોકીને સમાધિમાં બેસે છે તો કોઈ તપાવીને લાલ કરેલ તાંબા વગેરે ધાતુઓની મુદ્રાથી પોતાના શરીરે ડામ દઈને ચિહ્નનો ઉપસાવી કાઢે છે. તો વળી કેટલાક પરમાત્મા વિષેનું કે વેદાંતનું આખ્યાન કરીને શ્રોતાઓને મનોરંજન પૂરું પાડે છે, તેમને વિદ્ધાનો સદ્ગુરુ કહેતા નથી. કેટલાક જણ શિષ્યોને શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે વિદ્યિપૂર્વક મંત્રો પણ આપે છે, અને જ્ય કરવા માટે આજા પણ કરે છે. પરંતુ આ બધાની ફળ પ્રાપ્તિ ક્યારે થશે તેની ખાત્રી કોઈને જ નથી હોતી. બ્રહ્મનું વર્ણન એકદમ ચટકાર શૈલીમાં, શાબ્દિક જ્ઞાન પણ અનહિં, પરંતુ પોતાનો જ્ઞત અનુભવ જેવા જઈએ તો જ્યાં દુકાળ છે એવું જ્ઞાન ફક્ત શાબ્દિક અથવા તો પોકળ હોય છે. આ વાતને જે ઊંડાણથી સારી રીતે સમજુએ તો, લૌકિક અને પારલૌકિક ભોગ ઉપર ધૂણા ઉત્પન્ન થશે, પરંતુ પરમાત્મા સાથેની એકદ્વિતાનો જેને મધુર સ્વાદ એકવાર જ્ઞતે અનુભવ્યો હોશે તે જ આ ઉત્તમ સ્થિતિનો સાક્ષાત્કાર કરાવી શકે. જેને વૈદિક શાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન છે અને જેની પાસે પોતાના શિષ્યને પ્રત્યક્ષ પ્રતીતિ કરાવવાનો પૂર્ણ અનુભવ છે તેને જ ફક્ત શિષ્યને ઉપદેશ કરવાનો અધિકાર છે અને તેને જ સદ્ગુરુ કહેવાય છે. જેને પોતાને જ કોઈ ખાસ અનુભવ નથી એ બીજને શો ઉપદેશ કરવાનો છે ? જેને કોઈ પણ બાબતનો પ્રત્યક્ષ અનુભવ નથી તેને સદ્ગુરુ ક્યારેય માનશો નહીં.

શિષ્ય પાસેથી સેવા ચાકરી કરાવવી એવો જેના મનમાં સ્વાને પણ વિચાર નથી. ઉલ્લંઘન શિષ્ય ખાતર પોતાનો દેહ ખપાવી દેવો તેવી જેની ઈચ્છા છે તે સદ્ગુરુ છે એ ચોક્કસ સમજજ્ઞે.

શિષ્ય એટલે એક સાધારણ તુચ્છ અને ગુરુ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવા અહંકાર વીનાનો તે જ સાચા અર્થમાં કલ્યાણકારક ખરો સદ્ગુરુ હોઈ શકે. શિષ્ય શુદ્ધ અને પૂર્ણ બ્રહ્મ જ છે. માટે આપણા કરતાં જે જરા પણ ઓછા મહત્વનું નથી એવું જે માને છે અને શિષ્ય ઉપર જે પોતાના સંતાનની માફક પ્રેમ કરે છે તથા તેની પાસેથી પોતાના ઉદ્ધર નિર્વાહની પણ જે ફીકર કે અપેક્ષા કરતો નથી તે જ આ જગતનો પરમશ્રેષ્ઠ સદ્ગુરુ છે. પરમ શાંતિનો જે ભંડાર છે, વિદ્ધતાનું જ્યાં અભિમાન નથી, નાનામોટાનો જેને બેદભાવ નથી, તે જ સદ્ગુરુનું સ્થાન છે એમ જાણવું. આવા સદ્ગુરુનાં સર્વસાધારણ લક્ષણો હોય છે. જે અનન્યપણે શરણે ગયા છે અને મારા જેવા એ શ્રોતાઓ માટે જે લક્ષણો કહ્યાં છે તેને ટૂંકાણમાં વિગતવાર સમજવવાના પ્રયત્નો કર્યા છે. સાઈદર્શનથી જેની આંખો તૃપ્ત થયેલી છે તેવા ભાગ્યશાળીઓ કરતાં સદ્ગુરુનાં લક્ષણો

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તેનાથી વિશેષ તો હું શું વર્ણવી શકું ? (ઓ. ૧-૧૫)

જન્મોજન્મના પુણ્યોનો સંગ્રહ અમારી ગઠિ બંધાયેલો હશે માટે જ સહાગુરુરાયાનાં ચરણો અમને મળ્યાં. ભરજવાનીમાં તેમની પાસે ઘનદોલત અથવા કુટુંબ પરિવાર જેવું કંઈ હતું નહિ. કોઈનો આધાર કે કોઈનું અવલંબન તેમને ન હતું કે તેમને ઘરબાર પણ ન હતાં. ફક્ત તેમની પાસે ભયંકર મનોનિગ્રહ, તંબાકુ અને ચલભ, બસ આટલી જ વસ્તુઓનો સંગ્રહ તેમની પાસે હતો. પોતાના આયુષ્યના અડારમા જ વર્ષેથી તેમણે પોતાના મન ઉપર પૂર્ણ અંકુશ મેળવી લીધો હતો અને કોઈ પણ જાતના ડર વીના આત્મસ્વરૂપે તન્મય થઈ તેઓ સદ્ગ્ય એકાંતવાસમાં રહેતા. ભક્તોની એકમાત્ર શુદ્ધ ભક્તિ જોઈને, ‘ભક્ત પરાધીન હું’ એવું વ્રત ભક્તવૃદ્ધમાં સ્પષ્ટ કરીને બતાવવા માટે જે જે ઠેકાણે ભક્તોનો પ્રેમ મળતો તે બધેજ ઠેકાણે તેઓ પ્રેમથી આનંદમાં મગ્ન થઈને ફરતા હતા. (ઓ. ૧૬-૧૮)

હે સનાતના પરખ્રલ ! દીનદુઃખીઓના ઉદ્ધાર કરનારા અને સદા પ્રસન્ન મુખાદૃતિ ધરાવનારા તેમજ ચૈતન્યથી પરિપૂર્ણ એવા અને ભક્તોને આધીન સહાગુરુ તારો જય જયકાર હો. પોતાના ભક્તોને તું દર્શન આપ. સુખ દુઃખ ફાયદો કે ગેરફાયદો વગેરે દ્વંદ્વોની પેલે પાર એવા, સગુણ અને નિર્ગુણ બંને ગુણો સાથેના સર્વ સાક્ષી, તેમજ બધી જ વસ્તુઓથી ખૂબ આગળ વદેલા એવા સાઈ આપનો જય જયકાર થાઓ. તારી ભક્તિ ન કરનારા બધાને તારી લીલા સમજલતી નથી. હે સંસારનાં દુઃખો, કલેશો અને ચિંતાઓનું હરણ કરનારા, સંસારક્રૂપી રાક્ષસનું શિરચ્છેદન કરનારા, આશ્રયે આવેલાઓને પ્રેમ કરનારા અને તેમની આપદાઓ દૂર કરનારા સહાગુરુરાયા ! તારો હંમેશા જય જયકાર થાઓ. તું અવ્યક્તમાં લીન થઈને નિરકાર થયો છે. પરંતુ દેહત્યાગ કર્યા પછી પણ તારા ભક્તોનું કલ્યાણ કરવાનું કાર્ય તે છોડચું નથી. દેહનું અસ્તિત્વ હતું તે સમયે જે જે તારા ઉપકારો હતા તેનો જ અનુભવ તું અવ્યક્તમાં લીન થયા બાદ તારી ભક્તિ કરનારા ભક્તોને આજે પણ કરાવી રહ્યો છે. મારા જેવા પામરને નિમિત્ત બનાવીને અજ્ઞાનક્રૂપી રાત્રીને પાર કરવા માટે ભક્તોનો ઉદ્ધાર કરવામાં સમર્થ એવા આ પોતાના ચરિત્રક્રૂપી સૂર્યને તેં પ્રગટ કર્યો છે. (ઓ. ૨૦-૨૫)

પરમેશ્વરના અસ્તિત્વ વિષે વિશ્વાસ હોવો તેમજ પરમેશ્વર વિષે નિષ્ઠા અને આદર હોવો, એ જ ભક્તો માટેનો હફ્યક્રૂપી દીવડો છે. તેમાંની વાટ પ્રેમક્રૂપી તેલમાં ચેતાવો એટલે જ્ઞાનની જ્યોત પ્રગટ થશે. પ્રેમ વીનાનો શુદ્ધ જ્ઞાન તેનો શું ઉપયોગ ? પ્રેમ વીના મનને ક્યારેય સંમાધાન કે શાંતિ મળતાં નથી, પ્રેમ વિભાગિત નથી. પ્રેમનો મહિમા કેવી રીતે વર્ણવી શકાય ? તેની સામે બધું જ તુરણ અને વ્યર્થ હોય છે. જ્યાં ગાડ પ્રેમ નહીં હોય તો શ્રવણ વાંચન વળે અર્થ વગરનું છે. પ્રેમથી જ ભક્તિનો આનંદ હોય છે ત્યાં જ શાંતિ અને વિરક્તિ હોય છે, અને ત્યાં જ પોતાની બધી જ સંપત્તિ સહ મુક્તિ આપોઆપ પાછળ આવે છે. ભાવ વીના પ્રેમ ઉત્પત્ત થતો નથી. જ્યાં ભાવ છે, ત્યાં જ ઈશ્વર છે તે પણ ધ્યાનમાં રાખો. જ્યાં ભાવ છે ત્યાં જ પૂર્ણ પ્રેમ હોય છે અને સંસાર સાગર પાર કરીને જવા માટે પણ ભાવ જ કારણભૂત છે. (ઓ. ૨૬-૩૦)

આ અતિ મધુર સાઈચરિત્ર ગંગાળુના જળની માફક પવિત્ર છે. તેની પદ્ધરચના સાઈબાબાએ પોતે સન્જવેલી છે, હેમાદપંત તો નિમિત્ત છે. આ સાઈચરિત્ર સાંભળવાથી શ્રોતા અને વક્તા બંને શુદ્ધ થઈ જશે. પાપ પુણ્યનો નારા થઈને તે બંનેને મુક્તિ મળી જશે. મન સાફ રાખી, સારી મનોવૃત્તિથી આ ચરિત્ર જે કોઈ સાંભળશે તેના મનમાંની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે. ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને પૂજયભાવથી, આ સત્યચરિત્ર સાંભળવાથી અથવા સાઈનું નામ સ્મરણ કરવાથી ઈન્દ્રિયોથી ફાવે તેવું વર્તન થતું નથી, અને આ સંસાર સહેલાઈથી પાર કરી શકાય છે. ચાતક જેવા ભક્તો માટે આ સાઈચરિત્રનું કથન જ તેમને માટે જીવન જીવવાનું સાધન છે. શ્રોતાઓએ તે સાંભળ્યા બાદ તેનું મનન કરવું અને સાઈનાથની કૃપા મેળવવી. દેરેક અવસ્થામાં સાવધાન થઈને શ્રોતાઓ જે આ સાંભળશે તો તેમનાં કર્મોનાં બંધનો તૂઠીને તેમને આરામથી વારંવાર જન્મ ધારણ કરવાની માથાકૂટમાંથી મુક્તિ મળી જશે. (ઓ. ૩૧-૩૮)

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

શ્રોતાઓને મનમાં થતું હશે કે કથાનો આરંભ કયારે થશે ? માટે પ્રસ્તાવનાની શરૂઆત કરીને તેમની અસ્વસ્થતા દૂર કરું છું. પાછલા અધ્યાયમાં વેર, ઋણ અને હત્યાને ફેડવાળાને માટે અને કરેલાં કર્મોને બોગવલા ખાતર પૂનર્જન્મ લેવો પડે છે તેનું વર્ણન થયું. ભક્તોને પહેલાંના જન્મની કે કર્મની કોઈ પણ યાદ હોતી નથી. પરંતુ સંત એ બધું જ જ્ઞાનતા હોય છે. પછી ભક્તનો ફરીથી ક્યાં જન્મ થાય તો ત્યાં જઈને તેઓ તેમનું રક્ષણ કરે છે. આવી જ એક બીજી કથા હું તમને કહું છું. આપતાં લેતાં, બેસતાં ઉઠતાં, સંતનાં ચરણમાં જ સંપૂર્ણ વિશ્વાસ મૂકવાથી ભક્તોને પોતાનાં કાર્યોમાં સિદ્ધ પ્રાપ્ત થાય છે. કોઈ પણ કાર્ય કે કર્મ શરૂ કરતાં પહેલાં ઈશ્વરનું ક્યાં તો ગુરુનાં ચરણોનું સ્મરણ કરવાથી તે કર્મ કે કાર્યમાં કોઈ પણ ક્ષતિ રહી જતાં ઈશ્વર અથવા તો સંત પોતે જ ભક્તોની ચિંતા દૂર કરે છે. હું માત્ર કર્મ કરવાને આવિન છું અને તેનું ફળ આપનારો ઈશ્વર અને ગુરુસમર્થ છે. એવો જેનો દદ વિશ્વાસ છે તેવાનાં કાર્યો સિદ્ધ થઈને તેનો બેડો પાર થઈ જય છે. સંત પહેલાં કઢોર અને ઉગ્ર દેખાય છે. પરંતુ તેમના હૃદયમાં કોઈ પણ પ્રકારના લાભ કે અપેક્ષા વીનાનો શુદ્ધ પ્રેમ હોય છે. આપણા મનમાં થોડી ધીરજ હોવી જોઈએ, એટલે અંતે તેઓ કલ્યાણ જ કરે છે. સત્તસંગનો યોગ આવતાં બીજાં કોઈ અનિષ્ટો ઈચ્છાવાથી અથવા તો પોતાના દ્રોદ્વિવથી થનારી યાતનાઓ અને માનવીના જીવનમાંની માયા મમતા પોતાની જીવ્યાએ જ રહી જય છે, માટે જ સંતના ચરણમાં ભક્તે લીન થયું જોઈએ. નગ્રપાણે અને ગર્વરહિત થઈને સંતોનું શરણ લેવું જોઈએ. તેમને પોતાના મનની ગુપ્ત ઈચ્છાઓ પ્રાર્થનાપૂર્વક કહેવાથી તેઓ મનને નિશ્ચિત સમાધાન કરાવે છે. થોડા અમસ્તા જીવનના અહંકારને લીધે સંતોનાં વચ્ચે ઉપર જે શંકા સેવે છે તે પહેલાં પોતાનું નુકશાન નોતરે છે પરંતુ તેમનામાં સંપૂર્ણ વિશ્વાસ મૂક્યા બાદ તેનું છેવટે કલ્યાણ જ થાય છે. શુદ્ધ મનથી કે કપટથી પણ જે સાચા સંતનાં ચરણોમાં શરણ લેવામાં આવે તો અંતે તે મનુષ્ય સંસારમાંથી ખરેખર મુક્ત થાય છે. આ અર્થ સમજનવતી એક ઉપરેશકારક કથા હવે શાંતિપૂર્વક સાંભળશો. શ્રોતાઓને તે સાંભળવાથી આનંદ થશે ને વક્તાને કથા કહેવાનો ઉલ્લાસ વધશે. (ઓ. ૩૮-૫૦)

અક્ષલકોટ કે જે હાલમાં સોલાપુર જિલ્લાનો એક નાનો તાલુકો છે. અક્ષલકોટ સ્વામી સમર્થનો વસવાટ અહીં જ હતો અને આ જ સ્થળે તેમની સમાધિ આવેલી છે. ત્યાં રહેનારા સ્વ. માધવ વામન સપટણેકર નામના વકીલ જેમને થયેલા અનુભવો સાંભળવાથી મન પ્રસન્ન થશે. તે વિદ્યાર્થી અવસ્થામાં રાત દિવસ વકીલાતનો અભ્યાસ કરતા હતા ત્યારે તેમને શેવડે નામના એક પોતાની સાથેના વિદ્યાર્થી સાથે મુલાકાત થઈ અને બંનેએ ભેગા મળીને એક બીજલાના અભ્યાસ વિષેની પૂછપરછ કરી. એવામાં બીજાં વિદ્યાર્થીઓ પણ આચ્યા અને ત્યાં જ ઓરડીમાં ભેગા થઈને બેદા. તેઓ કોનો કેટલો અભ્યાસ થયો છે તે અજમાવી જેવા અંદરો અંદર એક બીજલને પ્રશ્નો પૂછ્યા લાગ્યા. પોતાની શંકાનું નિરાકરણ કરવા અને મનને શાંતિ મળવી જોઈએ માટે તેઓ કોણ ક્યાં ભૂલ કરે છે અને કોણ સરસ જવાબ આપે છે તે વાત ઉપર ધ્યાન આપવા લાગ્યા. એમાં છેવટે શેવડેના બધા ઉત્તરો ભૂલ ભરેલા નીકળ્યા માટે બધા વિદ્યાર્થીઓ બોલ્યા, ‘આ કેવી રીતે પરીક્ષા પાસ કરશે ? આનો તો બધો અભ્યાસ અપૂર્તો છે !’ આમ ભિત્રોએ શેવડેની મજનક ઉડાવી પણ તેને પોતાને પૂરેપૂરી ખાત્રી હતી કે, તેનો અભ્યાસ પૂરો થયો હોય કે નહિ, પણ તે ચોક્કસ પાસ થશે. તે બોલ્યો, ‘ભલે મેં જોઈએ એવો અભ્યાસ કર્યો નથી, પણ મારા માલિક સાઈબાબા મને પાસ કરાવવા માટે બેઠેલા છે. હું ચિંતા શા માટે કરું ?’ આ શેવડેના શાબ્દી સાંભળીને સપટણેકરને અતિશાય આશ્વર્ય થયું. શેવડેના ખભા ઉપર હાથ મૂકીને અને એક તરફ લઈ જઈને તેઓ પૂછવા લાગ્યા, ‘અરે ભાઈ, આ સાઈબાબા છે કોણ કે જેના તમે આટલા બધા ગુણગાન ગાયો છો તથા જેમની ઉપર તમને આટલો બધો ભરોસો છે ? એમનું રહેવાનું ડેકાણું ક્યાં છે ?’ આ પ્રશ્નોના જવાબમાં શેવડેએ તેમને સાઈબાબાનો મહિમા વર્ણિયો. અને પૂર્ણ મનથી તેમની પ્રસંશા અને પોતાની બાબા ઉપરની સંપૂર્ણ શ્રદ્ધાનું વર્ણન પણ કર્યું. ‘સુપ્રસિદ્ધ અહમદનગર જિલ્લામાં શિરડી નામના ગામની મરિજદામાં એક ફીરી બેઠો છે. તે ખૂબ જ માનનીય અને મશાહૂર સંતપુરુષ છે. આ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

પૃથ્વી ઉપર સંતો તો અનેક ડેકાણે વસેલા છે, પણ આ સંતની સાથેની મુલાકાતનો યોગ પૂર્વજનમનાં પુરુષના પ્રતાપ સિવાય ફક્ત પ્રયત્નોથી મળતો નથી. આ મારા સંત સાઈભાબા પર મારો પૂર્ણ વિશ્વાસ છે. તેઓ જે કરે છે તે જ થાય છે. તે જે બોલે છે તે જ થઈને રહે છે. તેમનું બોલેલું ક્યારેય ભિથ્યા જતું નથી. પરંતુ આવતા વર્ષે કોઈ પણ પ્રયત્ન કર્યા વગર હું નક્કી પાસ થવાનો. મને પૂરેપૂરો ભરોસો છે. તેમનું બોલેલું કદીએ ખોટું પડતું નથી. તે વાતની મેં મારા મનમાં ગાંધી બાંધી દીધી છે. અદે, આમાં વળી આશ્રય શું છે ? આ પરીક્ષા શું પણ આના પછીની પરીક્ષા પણ પાસ કરી બતાવીશ.' શેવડેનું આવું બોલવું સપટણેકરને બિલકુલ હાસ્યસ્પદ અને તથ્ય વિનાનું લાગ્યું. સપટણેકરનો સ્વભાવ થોડો સંશયવાળો હતો. તેમને આવી વાતો કર્યાથી ગમે ? તેઓ ત્યાંથી નીકળી ગયા. હવે તે પછી શું બન્યું તે જુઓ. (ઓ. ૫૧-૬૭)

થોડો સમય વિત્યા બાદ શેવડેના બોલ ખરા પડ્યાનો અનુભવ થયો. તે પરીક્ષા પાસ થયો અને સપટણેકરને ખૂબજ નવાઈ લાગી. ત્યાર બાદ દર્શા વર્ષનો ગાળો વિત્યા પછી સપટણેકર અમુક કારણોસર નિરાશ અને ઉદાસ રહેવા લાગ્યા. તેમની ઉપર એકાએક કમનસીભીનાં વાદળો છવાઈ ગયાં. તેમનો એકનો એક પુત્ર કંદરોગ-ડીએરિયાથી ૧૯૧૩ની સાલમાં ભરણ પામ્યો અને ત્યારબાદ તેમને જીવન ઉપર અણગમો આવી ગયો. તે પંદરપૂર, ગાણગાપૂર એમ અનેક તીર્થ યાત્રાઓ કરી આવ્યા. પણ મનને કંઈ સુખ લાગે નહિ. પછી તેમણે બ્રહ્મજ્ઞાનથી ભરપૂર વેદોનાં અંતિમ ચરણો વાંચવાનું શરૂ કર્યું. આમ ઘણો સમય વિત્યા બાદ જીવને કંઈ કરતા કંઈ શાંતિ મળે એ વિચારોમાં તેમને શેવડેએ કરેલી વાત યાદ આવી. શેવડેની વકીલાતની પરીક્ષા માટેની ખાત્રી અને સાઈનાથનાં ચરણોની નિષ્ઠા યાદ આવતાં પોતે પણ શ્રીના દર્શને જવું તેવું તેમના મનમાં થવા લાગ્યું. સપટણેકરે સંતર્દર્શનનો મક્કમ નિશ્ચય કર્યો અને તેમણે સને ૧૯૧૩ની સાલમાં પોતાના સગા નાનાભાઈ સાથે શિરડી જવાનો કાર્યક્રમ નક્કી કર્યો. શેવડેની યાદ એ તો માત્ર એક નિમિત્ત હતું. ખરેખર તો પોતાનાં ચરણોમાં આશ્રય માટે મહારાજે જ તેમને યોગ્ય સમયે પોતાની પાસે બોલાવવાની પ્રેરણા આપી હતી. પોતાના નાના ભાઈ પંડિતરાવને લઈને સપટણેકર સરસામાન સાથે શિરડી જવા માટે નીકળ્યા. તેઓ બંને શિરડી પહોંચ્યા અને તરત જ શ્રીભાબાના દર્શન માટે ગયા. દૂરથી જ બાબાનાં દર્શન થયાં અને મનમાં ને મનમાં બંને ભાઈઓ સંતુષ્ટ થઈ ગયા. આમ દૂરથી જ આંખો મળતાં તેઓ ઉતાવળથી બાબા પાસે ગયા અને હાથ જોડીને સામે જ ઊભા રહ્યા. બંને ભાઈએ બાબાને દંડવત્ત પ્રણામ કર્યા અને તેમનાં ચરણોમાં શુદ્ધ ભાવનાથી શ્રીફ્રણ અર્પણ કર્યું. સપટણેકરે જેવું મહારાજનાં ચરણો ઉપર શ્રીફ્રણ મૂક્યું કે મહારાજે તેમને 'ચલ હટ' કહીને વિક્કાર્ય. સપટણેકર તો એકદમ વિનાતુર થઈ ગયા અને કોઈ જણકાર અને બાબાના સ્વભાવથી પરિચિત એવા વ્યક્તિને શોધીને પૂછ્યા માગતા હતા કે મહારાજ કેમ પોતાને માટે આમ શા માટે મને બોલ્યા, તેનું રહસ્ય શું છે ? બાબાના દર્શનથી મન પ્રસન્ન થવું જોઈએ. તે જ બાબાના મુખે જ્યારે આવા શબ્દો સાંભળ્યા ત્યારે સપટણેકર ખિન્ન થઈને નીચું મો કરીને બાજુમાં ખસી ગયા. 'હવે કોની પાસે જવું ? કયા ભક્તને પૂછ્યું ? બાબાશ્રીના આવા વિક્કારવાચક શબ્દોનો અર્થ શું કાઢવો ? કોને પૂછ્યું ?' આવો તેમનો મનનો હેતુ સમજુને કોઈએ તેમને સમાધાન માટે બાળાંશિંપીનું નામ સૂચયું. સપટણેકરે તેમનું સરનામું શોધી કાઢ્યું અને તેમને મળી બધી હીકીકત કહી સંભળાવી. તે બોલ્યા, 'આજે મહારાજે ખૂબ જ કડક શબ્દોથી મને વિક્કાર્યો છે. આપ અમારી સાથે આવીને શાંતિથી તેમનાં દર્શન કરાવો અને મહારાજ અમારા ઉપર ગુસ્સો ન કરતાં ફૂપાઈ વરસાવે એવું કંઈ કરો.' બાળાંશિંપીએ વાત માની લીધી તેથી સપટણેકરને શાંતિ થઈ. બાળાંશે સાઈનાથની છબી વેચાતી મંગાવી અને સપટણેકર બાળા શિંપી સાથે ફરી મહારાજના દર્શન માટે નીકળ્યા. બાળાંશે મહારાજની છત્રી પોતાના હાથમાં લીધી અને તે બાબાના હાથમાં મૂક્તા વિનંતી કરી કે, 'દેવા ! આ શેનું ચિત્ર છે ?' એ જોઈને બાબાએ સપટણેકર તરફ આગંગી બતાવતાં જવાબ આપ્યો, 'આ ફોટોમાં એનો યાર છે' આવું કહીને મહારાજ હસી પડ્યા અને આજુબાજુ બેઠેલા બધામાં

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

પણ હાસ્યનું મોજું ફરી વળ્યું. બાબાએ ભલે મશકરીમાં ‘ધાર’ શબ્દ વાપર્યો અને બધાને હસાવ્યા પણ એ શબ્દ એમણે ખરા મનથી ઉચ્ચાર્યો હતો. ગમ્મત, મશકરી વગેરે કરવાની તો મહારાજની ટેવ હતી જ. સપટણેકર ઉપર તો તેઓ ખરેખર તો ગુસ્સે ભરાયા જ ન હતા.

બાબા મેધા ઉપર, તાત્યાસાહેબ નૂલકર ઉપર, કલ્યાણના સિદ્ધિકી ફાળકે ઉપર, અને દૃહાણૂના દેવ ઉપર પહેલાં કેવા ગુસ્સે થયા હતા ? આખરે તે સૌ ઉપર સાઈબાબાએ કેટલી બધી કૃપા કરી ? તેવું જ આ સપટણેકરનું પણ થયું. પણ તે વખતે તેમને સમજયું નહીં. પછી બાળા શિંપીએ મહારાજને પૂછ્યા, ‘બાબા ! આ શું ? આનો અર્થ શો ? અને તરત જ સપટણેકરને બોલ્યા કે, ‘ચાલો જલ્દી કરો અને દર્શનનો લહાવો લઈ લો.’ સપટણેકરે હાથ જોડતાં જ, ‘ચલ હટ’ શબ્દ તેમના કાને ફરી પાછો પડ્યો, તે પહેલાં જે સાંભળેલો તે જ શબ્દ, ત્યારે હવે કયો માર્ગ અપનાવવો તેનો મોટો પ્રશ્ન સપટણેકરના મનમાં થયો. પછી તેઓ બંને ભાઈઓ હાથ જોડીને બાબાની સામે ઉભા રહ્યા હતા. તે સમયે છેલ્લે, ‘સત્ત્વરે અહીંથી નીકળી જવ’ એવી બાબાની આજા થઈ. તે સાંભળીને તેઓ બંને વિનયપૂર્વક બોલ્યા, ‘સ્વામી સમર્થ ! આપની આજાનો ભંગ કરવો કોઈથી પણ શક્ય નથી તો અમારા જેવા પામરની તો વાત જ કયાં ? આ જ ક્ષણે અમે નીકળી જઈએ છીએ. આપ ઘણા જ ઉદાર છો તે સાંભળીને અમે આપનાં દર્શન માટે આવ્યા હતા. પણ, ‘ચલ હટ’ આ ધિક્કરયુક્ત શબ્દથી અમારો સત્કાર થયો. આ શું ચમત્કાર છે તે અમને સમજાતું નથી. અમારી ઉપર અમિદાણ રાખો. અમને આશીર્વાદ આપો અને ફરી આપનાં દર્શન કરવા દો.’ તેમણે આવા આશાસનની માંગણી કરી. એવો તે વળી કોણ વિજ્ઞાન હોય તે બાબાના મનની અંતર્ગત વાત સમજ શકે ? માટે થયેલી આજાને શિરોમાન્ય ચઢાવી સપટણેકર બંધુઓ પોતાના રહેવાના સ્થળે પાછા ફર્યા. આવું તેમની પ્રથમ મુલાકાતમાં બન્યું, માટે બંને ભાઈઓ ખૂબ જ નિરાશ થયા હતા. તેથી આવ્યા તેવા પોતાને ઘેર પાછા ફર્યા.’ (ઓ. ૬૮-૬૯)

ફરી એક વર્ષ વીતિ ગયું છતાં સપટણેકરના મનને સ્થિરતા મળી નહિ. ફરી પાછી ગણગાપુરની યાત્રા કરી, તો ચિત્ત ઉલ્ટું વધારે અસ્વસ્થ થયું. પછી વિશ્રાંતિ માટે પોતાના પિતાને ઘેર માટેગાંવ ગયા. ત્યાંથી આખરે કાશીની યાત્રાએ જવાનો વિચાર કર્યો. હવે જ્યારે કાશીની યાત્રાએ જવાના બે દિવસ બાકી રહ્યા હતા, ત્યારે તેમનાં પત્નીને એક સ્વખન આવ્યું અને કાશીનો કાર્યક્રમ મુલાત્વી રહ્યો. સ્વખનનો ચમત્કાર કેવો હતો, તે હવે હું કહી રહ્યો છું. શ્રોતાઓએ સાંભળવા માટે તૈયાર થઈ જવું. બિધાના ઉપર સૂતેતી પાછને સ્વખન આવ્યું, ‘પોતે ઘડો લઈને લક્ઝદશાના કૂવા ઉપર ગઈ. ત્યા આગળ લીમડાના ઝાડ નીચે માથા ઉપર કટકો વીટાળેલો એક ફીરી એની તરફ આવ્યો અને અતિ મૂદુ અવાજમાં બોલ્યો, ‘વગર કામનું કષ્ટ કરતી નહિ. શા માટે ખોટી મહેનત કરે છે. હું તારો ઘડો સ્વચ્છ પાણીથી ભરી આપું છું.’ સપટણેકરની પત્નીને પેલા ફીરીની બીક લાગી અને ખાતી ઘડો લઈને તેણે પોતાના ઘરની વાટ પકડી. પણ પેલો ફીરી પીછો પકડીને પાછળ આવતો હતો. બસ એટલામાં મારી આંખો ખુલ્લી ગઈ.’ પત્નીને આવેલા આ પ્રકારના સ્વખનની વાત જ્ઞાનીને સપટણેકરને સાઈનાથ મહારાજની યાદ તાજ થઈ અને ફરીથી શિરડી જવાનો વિચાર નક્કી કર્યો. તે સમયે બંને પતિપત્ની જવા માટે નીકળી પડ્યાં અને બીજે દિવસે શિરડી ગામે આવી પહોંચ્યાં. પહોંચતાની સાથે જ મસ્નિજદમાં ગયા તે સમયે બાબા લેંડીબાગ ગયા હતા. ત્યાંથી બાબા પાછા ફરે તેની રાહ જોતા અમે ત્યાં જ બેસી રહ્યાં. એટલામાં બાબા પાછા આવતા દેખાયા. સ્વખનમાં જે મૂર્તિએ દેખા દીધેલી એ જ નખરીખ સામે આવતી જોઈને સપટણેકરનાં પત્નીના આશ્વર્યનો પાર રહ્યો નહીં. અને તે બાઈ સાઈબાબાની સામે એકીટસે જોતી જ રહી. મહારાજે લેંડીબાગથી આવીને પગ ઘોયા, અને ત્યારપણી તેઓ ગાઢી ઉપર બેઠા કે તરત જ તે બહેન દર્શન માટે ગયાં અને ચરણોમાં વંદન કર્યાં. તે બહેન બાબાને જોતાં રહ્યા. તેના મનના આવો પૂજયભાવ જોઈને મહારાજના મનમાં આનંદ થયો અને બાઈસાહેબના

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

મનની વ્યથાનું નિવારણ કરનારી કથા આસ્તે આસ્તે કહેવાની શરૂઆત કરી. તેમની હંમેશાની રીત પ્રમાણે બાબા ત્યાં ઉપસ્થિત કોઈ ત્રીજી વ્યક્તિને ઉદ્દેશીને પોતાના મનની વાત સખિસ્તારપૂર્વક વર્ણવીને કહેવા લાગ્યા. આમ જોઈએ તો તે બાઈની વાત તેને ન કહેતાં તે ભળતા જ માણસને ઉદ્દેશીને કહેવા માંચા. પણ બાઈએ તેમની વાત ધીરજપૂર્વક સાંભળી. ‘મારા હાથ, પેટ અને કમ્મર કેટલાયે દિવસોથી ખૂબ જ દુઃખી રહ્યાં છે. દવાઓ ફાડી ફાડીને હું કંટાખ્યો પણ તેનો ઉપાય લાગ્યો નહીં. પણ હવે મને સમજન્ય છે કે એ દુઃખાવો એકાએક કેવી રીતે સારો થઈ ગયો ?’ આમ એ કથા પેલી બાઈનું નામ ન લેતાં ત્રીજને કહેવામાં આવી. પણ એ આખી વાત એ બાઈને જ લાગુ પડતી હતી. તે વાતનો સંબંધ એ બાઈને જ લાગુ પડતો હતો. પછી આગળ ઉપર બે મહિના વિત્યા બાદ મહારાજે જે કાંઈ પોતાના વિષેની વ્યથાનાં વર્ણા કર્યા હતાં તે તે બધી જ વ્યથા પેલી બાઈની પોતાની જ વ્યથા, સુધી જતાં તેને ખાત્રી થઈ અને તેના મનની દ્રચ્છા પૂર્ણ થઈ. (ઓ. ૮૮-૧૧૮)

અહીં સપટણેકર દર્શન માટે ગયા તો બાબાએ પહેલાની માફક જ ‘ચલ હટ’ કહીને પાછો સત્કાર કર્યો. તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા, ‘મને સમજનું નથી, કે મારી ભૂલ કયાં થાય છે ? મહારાજ હંમેશા મારો જ વિક્કાર કેમ કરે છે ? હું ન મસ્કાર કરું તો તેમનો નક્કી કરેલો તે જવાબ તૈયાર હોય છે. પાછલા જન્મનાં મારાં કોઈ દુષ્કર્મ હોવાં જોઈએ જેને કારણે તેઓ મારી ઉપર નારાજ છે, અને ગુસ્સામાં છે. જ્યારે બીજાઓ સાથે અતિશય પ્રેમથી વર્તે છે ! આમ જોઈએ તો સવાર સાંજ લોકો બાબાશ્રી પાસેથી જલજલતાનાં અનુભવો મેળવતા હોય છે. પછી મારા જ નસીબે આ ‘ચલ હટ’ કેમ ? કયાં મારાં કર્મો મારી જ્ઞાન વગર અધર્મનું આચરણ કરી આવ્યાં અને પાપનો માલિક હું બન્યો ? કદાચ સાઈબાબા એટલે જ મારાથી નાખુશ છે ! શરૂઆતના દિવસોમાં હું બાબાશ્રીના વિષયમાં વાંકાચુંકા વાંધાવયકા અને તર્ક કરનારો અને શંકા કરનારો હતો માટે તો કદાચ બાબા મને તે કારણે દૂર રાખી રહ્યા છે.’ એવું જલજલતાનું તેમને મનમાં લાગવા માંડ્યું. માટે સપટણેકરે મનમાં નિર્ધાર કરી લીધો કે જ્યાં સુધી મહારાજની કૃપા થાય નહીં અને મનને સમાધાન મળે નહીં ત્યાં સુધી સાઈબાબામાં જ ચિત્ત સ્થિર કરીને શિરડી મુકામે જ રોકાઠ જવું. ત્રણ પ્રકારના દુઃખોથી પીડાતા લોકો પણ મહારાજના દર્શનના ભૂખ્યા એવા કોણ હશે જેમના મનને સમાધાન મળ્યું ન હોય અને નિરાશ થઈને શિરડી પાછા ફર્યા હોય ? સપટણેકર તે દિવસે પાછા દુઃખી અને નિરાશ થઈ ગયા હતા. તેમને આન્ન પાણી પણ ગળે ઉત્તરતાં નહીં અને કયાંય જવા આવવાનું મન થતું નહીં. પથારીમાં ઉંઘ ન આવતાં ખુલ્લી આંખે પડી રહેતા હતા. પણ તેમણે નક્કી કર્યું કે જ્યારે કોઈ પાસે હોય નહીં અને બાબા ગાઢી ઉપર એકલા શાંત બેઠા હોય ત્યારે જઈ તેમના પગ પકડી લેવા. એવી તક મળતાં તેમના મનનો નિશ્ચય ફિલ્યો. શ્રીનાં ચરણોમાં તકનો લાભ લઈ માથું મૂકી દેતાં બાબાએ તરત જ માથા ઉપર પોતાનો હાથ મૂક્યો. પછી સપટણેકર બાબાશ્રીના પગ દબાવતા બેસી રહ્યા. એટલામાં એક ઘેટાં પાળનારી બાઈ આવી અને બાબાની કમ્મર દાખતી ત્યાં બેસી ગઈ. હંમેશાની માફક બાબાએ ત્રીજી જ વ્યક્તિ સાથે વાતો કરવાની શરૂઆત કરી. સપટણેકર ધ્યાન આપીને સાંભળવા લાગ્યા. એ વાતનો ચમત્કાર એવો થયો કે વાતનો શર્ઝે શર્ઝ અને એ બધી જ વાતો તેમને પોતાને જ લાગુ પડતી હતી. ભલે પેલી શૂદ્ધ સ્વી હુંકાર ભણતી હતી છતાં સાપટણેકર પોતાની જ વાત આશ્ર્યચકિત થઈને સાંભળતા બેસી રહ્યા. તેમને આશ્ર્યનો પાર ન રહ્યો. એ એક વાણિયાની વાત હતી. પણ બધીએ વાત તેમને જ લાગુ પડતી હતી. તેમાંથી એમના મૃત છોકરાની બાબતમાં વાત નીકળી. એકાદ કોઈ અત્યંત પાસેના સગાવહાલાઓને કહેતા હોય તેવી જન્મથી માંડીને મૃત્યુ લગીની બધી હકીકત વિસ્તારથી તેમને કહી સંભળાવી. બાબા પેલી શૂદ્ધબાઈને વાત કહેતા હતા. પણ તે વાત સાથે પેલી બાઈને કોઈ જ નિસ્ખત હતી નહીં. એ તો એક છોકરો અને બાપની વાત હતી. વિષય ફક્ત બંનેનો હતો. આમ પોતાની વાત બાબાના મુખે સાંભળીને સપટણેકરના મનને ખૂબ જ નવાઈ લાગી અને બાબાના

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

ચરણોમાં તેમની પૂજય ભાવના સ્થિર થઈ ગઈ. તેમને નવાઈ એ વાતની લાગી કે બાબાને આ બધી વાતની ખબર કેવી રીતે પડી ? જેઓ પરમાત્માથી એકદ્વિપ હોય તેમને સમસ્ત વિશ્વ પોતાના કુટુંબ જેવું જ ભાસતું હોય છે. એટલું જ નહિ તેઓ પોતે જ જગતવ્યાપી વેષમાં સજેલા હોય છે. સાઈબાબામાં પણ તે બધાં લક્ષ્ણો હતાં. મહારાજ સર્વ પ્રાણીઓ સાથેના એકદ્વિપતાના સાક્ષાત્ અવતાર હતાં. તેમને ‘પોતાનો’ અને ‘પારકો’ એવો બેદભાવ ન હતો. તેઓ પોતે જ સવિસ્તારપણે વિશ્વદ્વિપ હતા. પરમાત્મા સાથે જે તલ્લીન હોય તેને અલગતાની વાત કેવી ! જેમ આકાશને કોઈ રંગ કે કદાવ અડકી શકતો નથી. તેવી જ રીતે દદ્યા દર્શન અને દશ્ય આ ત્રણેનું જુદ્ધાપણું તેમને દેખાતું ન હતું. મહારાજ અંતર્જાની છે અને બીજના મનની ગુપ્ત વાતો જણાવાની તેમનામાં શક્તિ છે. એ વાત સાપટણેકરના મનમાં ઠસ્તાં જ બાબાએ તેમને શું કહ્યું તે હે સજજન શ્રોતાઓ હવે સાંભળો. (ઓ. ૧૧૬-૧૪૨)

સાપટણેકર તરફ આંગળી બતાવીને આશ્વર્ય દર્શાવતા બાબા બોલ્યા, ‘મેં એનું બાળક મારી નાખ્યું છે એમ આ માણસ મારી ઉપર આરોપ લગાવી રહ્યો છે. અરે ! હું કંઈ લોકોના બાળકોને મારી નાખતો હોઉં છું ? મસ્ઝિદમાં આવીને આ શું કામ રે છે ? તો હવે હું કાંઈ આવું કરું છું કે એના બાળકને એને ઘેર પાછો લાવું છું. પેલી બાઈને એનો મરેલો ‘રામદાસ’ નામનો પુત્ર જેવી રીતે પાછો લાવી આપ્યો છે તેવી જ રીતે એના બાળકને પણ ફરી લઈ આવું છું.’ આ સાંભળતા સાપટણેકર બાબા તરફ સ્થિર નજર કરીને વાટ જેતા બેઠા. મહારાજે તેના માથા ઉપર હાથ મૂક્યો અને ધીરજ આપતાં બોલ્યા કે, ‘આ ચરણો ધણા જ પુરાતન છે, તારી ચિંતા હવે દૂર થઈ. મારી ઉપર સંપૂર્ણ ભરોસો રાખ. તું કૃતાર્થ થઈશ.’ શ્રીના ચરણની સેવા કરવા બેઠેલા એવા તેમના કાનને મધુર લાગે તેવાં વચ્ચનો કાને પડતાં સાપટણેકરની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. તેમણે શ્રીનાં ચરણો ઉપર પોતાનું મસ્તક ટેકવીને અંતરમનથી નમસ્કાર કર્યા. તેમનામાં અષ્ટભાવ જગ્નૂત થયો, આંખમાંથી આંનદનાં અશ્રુ વહેવાં લાગ્યાં અને અશ્રુઓથી બિન્દુલ્યેલાં બાબાશ્રીનાં ચરણો દોયાં. બાબાએ ફરી પાછો મસ્તક ઉપર હાથ મૂક્યો અને બોલ્યા, ‘હવે શાંત થઈ જ અને સ્વસ્થ બેસ.’ ત્યારે સાપટણેકર મન શાંત કરીને પોતાના મુકામે પાછા ગયા. નૈવેદ્યનો થાળ તૈયાર કરી અને પોતાની પત્નીના હાથમાં તેને મૂકી દીધો. પછી એ થાળને ચારે તરફ પાણી ફેરવીને વિધિપૂર્વક આંખોએ સ્પર્શ કરીને, ‘અં પ્રણાય સ્વાહા, અં અપાનાય સ્વાહા’ એમ બોલીને તે નૈવેદ્ય બાબાશ્રીને અર્પણ કર્યું. ત્યાં જ હંમેશાની જ રીતે પ્રમાણે બાબાએ પેલા થાળને હાથ વડે સ્પર્શ કરીને નૈવેદ્યનો સ્વીકાર કર્યો, સાપટણેકરને તેથી ખૂબ આનંદ થયો. પછી તે પ્રસંગે બીજી ભક્તો મહારાજને પગે લાગી રહ્યા હતા. તેનો લાભ લઈ સાપટણેકરને ફરી બાબાશ્રીનાં ચરણોમાં નમસ્કાર કર્યા. આમ ઉતાવળમાં માથે માથું ભટકતા જેઠીને બાબા સાપટણેકરને ધીમેથી શાંત ચિંતે શું બોલ્યા તે જુઓ, ‘અરે ! શા માટે આમ ફરીફરીને નમસ્કાર કરે છે ? એકવાર આદરપૂર્વક કર્યા એટલે બસ !’ એ રાતે ચાવડી સરધસનો હિવસ હતો. સાપટણેકર ખૂબ પ્રેમથી અને ભક્તિભાવથી પાલખીની આગળ હાથમાં દંડ લઈને આનંદભેર નીકળ્યા. ચાવડીથી સરધસની વાત શ્રોતાઓને પહેલેથી જ ખબર છે. ફરીથી તેનું વળણન કરવું યોગ્ય નથી, માટે જતું કર્યું છે. તે રાતે બાબાશ્રીની અગાધ લીલા જુઓ ! શ્રીની તરફ નજર નાખતાં લાળે કે પોતે સાક્ષાત્ પાંડુરંગને જ જેઠી રહ્યા હોય એવો સાપટણેકરને ભાસ થયો. પછી પાછા ફરવાની આજા માંગવા જતાં, બાબાએ કહ્યું, ‘જમીને જ’ સાપટણેકરે એ આજા વિનાસંકોચે પાણી અને જમ્યા બાદ સેંદ્રશો લેવા માટે બાબાશ્રીના દર્શન માટે ગયા. એટલામાં તેમનાં મનમાં આવ્યું કે રહેને બાબા દક્ષિણા માગે તો કેવી રીતે આપીશ ? સાથે આણેલા પૈસા તો લગભગ બધા જ વપરાઈ ગયા હતા અને માંડ ગાડી ભાડા પૂરતી જ રકમ બધી હતી. બાબા જે ‘દક્ષિણા આપ’ એમ બોલે તો શું જવાબ વાળવો તે એમણે મન સાથે નક્કી કરી લીધું. ‘માંગતા પહેલાં જ એક ડિપિયો હાથમાં મૂકી દેવો અને ફરી માંગો તો બીજે મૂકવો. પણ ત્યાર પછી અગર દક્ષિણા માંગો ના પાડી દેવી.’ આગગાડીના ભાડા જેટલા જ પાસે રહેવા દીધા છે

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

એવું મહારાજને સ્પષ્ટ કહી દેવું. આમ નકી કરી તેઓ શ્રીને ભળવા ગયા. પહેલાં નકી કર્યા પ્રમાણે તેમણે બાબાના હથ પર એક ડિપિયો મૂકી દીધો. બાબાએ બીજા ડિપિયા માંગતા તેમણે ફરીથી એક ડિપિયો મૂક્યો. ત્યાં જ બાબાએ સ્પષ્ટ કહી દીધું, ‘આ લે નારિયેળ, તારી પત્નીના ખોળામાં મૂકી હે અને આ જીવની બેચેની છોડી દઈને ખુશીથી, શાંતિથી તારા ઘર ભેગો થઈ જા.’ (ઓ. ૧૪૩-૧૬૬)

પછી બરાબર બાર મહિના પછી સપટણેકરને ત્યાં પુત્રનો જન્મ થયો. આઠ મહિનાનો થતાં તે બાળકને લઈને એ દંપત્તિ ફરી પાછાં સાઈબાબાનાં દર્શને આવ્યાં અને બાળકને બાબાશ્રીનાં ચરણોમાં મૂકી દીધું. સંતોની કરણી કેવી અગાધ હોય છે. પછી બંનેએ હથ જોડીને બાબાને શી વિનંતી કરી તે હવે સાંભળો, ‘તેઓ બોલ્યા, બાબા! આ તમારા ઉપકારનો બદલો અમે કેવી રીતે વાળીએ અમને તે જરાપણ સમજતું નથી. માટે અમે ફક્ત અમારાં મસ્તક આપનાં ચરણો ઉપર મૂકી દઈએ છીએ. અમે દીન હીન પામર છીએ. અમારા જેવા અનાથો ઉપર કૃપા કરો અને હવે પછી અમને આપનાં જ ચરણોમાં સદ્ગ સર્વહા આશ્રય આપો. હરતાં અને ફરતાં અમારા મનમાં અનેક પ્રકારના વિચારોના તરંગો ઉઠતા રહે છે. તેમજ અમારા મનને વિશ્રાંતિ મળતી નથી. તો અમને નાદ લગાડો અને તમારા ભજને લગાડો.’ પછી પોતાની પત્ની સાથે દ્વારા સાઈનાથને નમસ્કાર કરીને તથા પોતાના ચંચળ મનની સ્થિરતા પ્રાપ્ત કરીને પોતાના કામમાં યશસ્વી થઈને પોતાના ઘેર પાછા ફર્યા. ત્યારબાદ દીકરો મુરલીધર અને બીજા બે પુત્રો ભાસ્કર અને હિન્કરની સાથે સપટણેકર પરિવારે ખૂબ જ આનંદમાં જીવન પસાર કર્યું. (ઓ. ૧૬૭-૧૭૩)

આરંભમાં વાત ટૂંકાણમાં પતાવવી એવો હેતુ મનમાં હતો. પણ સાઈનાથ બોતાવતા હોવાથી ગ્રંથના અધ્યાયનો વિસ્તાર વધ્યો. તેમના શરણો જઈને આ હેમાઉપંત આગળની કથાનો સંબંધ અને સાર શ્રોતાઓ માટે સૂચવી રહ્યા છે. તે કથા આ કથા કરતાં પણ મનને વધારે આનંદ આપનારી છે. ચમત્કાર જેવાની જેને હોંશ હતી તેવા એક ભક્તના મનની વાત બાબાએ કેવી રીતે પૂરી કરી તે દર્શાવ્યું છે. લોકો સાઈના ગુણોનું વર્ણન કરે છે પણ હંમેશા દોષ જ શોધવાની રીતથી ટેવાયેલા માણસને તેમાં અવગુણો જ દેખાતા હોય છે. પોતાને ના દુનિયાદારીની ઈચ્છા કે ના પરમાર્થની પરવા છે પરંતુ માત્ર દોષ જ જેવાનો તેમનો હેતું હોય છે. સાઈબાબા જે ખરા સંત હશે તો મને આ વાતની ખાત્રી કરી આપશે. અને પોતાને આ વાતનો જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી તેમની મહાનતાને હું કયારે પણ સ્વીકાર કરવાનો નથી. આ પ્રકારે ફક્ત પરીક્ષા કરવા માટે શિરડી જનારાઓની પણ ઈચ્છાઓ પૂર્ણ થતી. આવી જ કથા આગળના અધ્યાયમાં હેવામાં આવી છે. સજજન શ્રોતાઓએ તેને પ્રેમથી સાંભળવી.

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલ, ભક્ત હેમાઉપંત રચિત, શ્રીસાઈ

સમર્પણના સત્ય ચરિત્રનો ‘સાશંક-ભક્ત-અનુગ્રહ-કરણમ્’ નામનો અડતાળીસમો અધ્યાય

અહીં સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણ.



## અધ્યાય ૪૮નું અર્થ વિવરણ

આ કથામાં અક્કલકોટ નિવાસી સપટણેકરનાં પત્ની શ્રીમતી પાર્વતીબાઈને મળવાનો મોકો મને સહભાગ્યે, તા. ૧૪-૮-૧૯૮૮ના રોજ મધ્યો. તે સમયે એમની ઉભર ૮૮ વર્ષની હોવાને કારણે તેઓ લગભગ મોટાભાગે પથારીવશ હતાં. છતાં મળવા જતાં જ તેઓ બેઠા થઈને તેમણે તે પ્રસંગોનું વર્ણન અત્યંત ઉત્સાહભેર અને વિસ્તારથી કર્યું હતું. જે મૂળ પોથી જેટલું જ હતું વધારે નહીં પણ, પ્રત્યક્ષ હજર હોય એવી વ્યક્તિએ કરેલ બધાન હોવાને કારણે મને જરા વિશેષ આનંદદાયક પણ લાગ્યું. શ્રીસાઈલીલાના જન્મુઆરી ૧૯૮૪ના અંકમાં આ ગ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. વાંચકોએ એ વાંચવાનો લહાવો જરૂર લેવો.

આ વર્ણનમાંની કંઈક વાતો અહીંથા ઉમેરવી જોઈએ એવું મને લાગે છે. પાર્વતીબાઈએ મને કહ્યું કે, બાબા સપટણેકરને ફક્ત ‘ચલ હટ’ કહીને લદ્યા જ નહીં પણ હાથથી તેમને એટલા જેસુથી ઘેરેલ્યા કે તેમની પાદડી ઉથલી પડી. ફક્ત પાર્વતીબાઈને માત્ર બાબાએ ચરણો ઉપર માથું મૂકવા દીધું. એટલું જ નહીં પણ મુશ્કી ભરીને ઉદ્દી તેમના માથા ઉપર વેરી અને બોલ્યા, ‘લે ! એક, બે, ત્રણ, ચાર જેટલા જોઈએ એટલા લે.’ પણ ખરેખરમાં પાર્વતીબાઈને એક મુરલીધર જ નહીં, ત્યાર બાદ ભાસ્કર દિનકર બધા મળીને એકંદરે આઠ દીકરાઓ અને એક દીકરી પણ થઈ.

બીજી વાત, ચાવડીના સરધસમાં પાર્વતીબાઈએ એને માટે ‘છબીના’ શબ્દ વાપર્યો હતો. તેઓ બોલ્યા, ‘બાબા પાલભીમાં કયારેય બેસતા ન હતા. ભક્તો ઉચ્કિને બેસાડતા છતાં તરત તેઓ પગે ચાલતા જ દેખાતા. બાબા જતે પણ નાચતા હતા. એક વખત એક પગ આગળ તો બીજે પાછળ એકદમ અદ્દામાં તેઓ નાચતા હતા.’ આ કહેતાં કહેતાં પાર્વતીબાઈ એટલા રંગાઈ ગયા કે હાથના ઈશારાઓ કરીને તેમણે મને બાબાની નકલ કરી બતાવી હતી.

ત્રીજી વાત પાર્વતીબાઈએ કહી કે પહેલો અમારો દીકરો મુરલીધર થયા બાદ સપટણેકરની બાબા ઉપર શ્રદ્ધા અને ભક્તિ ખૂબ જ દઢ થઈ ગઈ હતી. તે પછી આગળ ઉપર વધતી જ ગઈ, અને ત્યાર પછી અધ્યાત્મમાં અને વૈરાગ્યમાં તેમની એટલી બધી પ્રગતિ થઈ કે જ્યારે અમારો બીજો દીકરો ભાસ્કર ૧૦ વર્ષનો હતો ને ગુજરી ગયો ત્યારે તેમણે બાબાની છબી સામે બધાં બાળ બચ્ચાઓને ભેગાં કર્યાં અને બોલ્યા, ‘અરે ! તું આ બધાને જોઈતાં હોય તો લઈ જ. મને ચાલશે. પણ તારી ભક્તિ હું છોડવાનો નથી.’ પછી દિનકરશવ સાથે બોલતાં સમજયું કે, તેમના પિતા તો પહેલેથી જ દત ઉપાસક હતા. તે ગાણગાપુર કામય જતા. એક વખત તેમની પહેલી પત્ની અને દીકરો મરી જતાં નિરાશ થઈને નદીમાં આત્મહત્યા કરવા માટે તેમણે ભૂસકો માર્યો હતો. પણ સાક્ષાત્ શ્રીદૃતાત્રય ભગવાને તેમને બહાર કાઢીને બચાવી લઈ ફરીથી અક્કલકોટ જઈને વકીલતા શરૂ કરવાની આજા આપી હતી. પછી બાબાએ ઉપર અધ્યાત્મમાં જણાવ્યા પ્રમાણે તેમને પોતાની ભક્તિ તરફ ખેંચી લઈને કાયમ જ પોતાની નાલુકના કરી લીધા હતા.

આ ઉપરથી એક વાત સિદ્ધ થાય છે કે, પૂર્વનાં પુણ્યો અને તપશ્ચર્યા વીના સંતની મુલાકાત કે ફૂપા થતી નથી. આ સાંભળીને મને શંકા થવા લાગી કે શ્રી દત્તાત્રેય, અક્કલકોટ સ્વામી સમર્થ અને આપ પોતે બાબાસાઈ એક જ છો, તે સમજવવા માટે અને સપટણેકરને પોતાનાં પહેલાંનાં સંસારનાં દુઃખોને કારણે આવેલો વૈરાગ્ય અયોગ્ય અને વ્યર્થ હતો. તેને છોડાવી અને તેનાથી તેમને દૂર કરીને તેમને પોતાની ભક્તિમાં તીન કરી દીધા અને પછી જ ખરો જ્ઞાનજન્ય વૈરાગ્ય અને સ્થિતપ્રકાશતા ઉત્પન્ન કરીને તેમનો ઉદ્ધાર કરવાનો હતો, માટે જ બાબાએ ‘ચલ હટ’ની લીલા તો નહીં કરી હોય ને ? બાબાની આ ભક્તોને સન્માર્ગે લઈ જવાની અને તેમની આધ્યાત્મિક પ્રગતિ સધાવી લેવાની આશ્ર્યકારક અને અગમ્ય આવદત હતી તે ખું છે.



## ॥ અધ્યાય ૪૮ ॥

### સંતપરિક્ષણ - મનોનિગ્રહ

(સંતોની વ્યવસ્થિત તપાસ અને ખાત્રી કરવી અને મનને નિયંત્રણમાં રાખવું.)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,  
શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

બધી નાની મોટી વાતો સાથે યથાસ્થિત સદગુરુની સ્તુતિ કરતાં કરતાં વેદ અને પુરાણો પણ થાક્યાં, ત્યાં મૂર્ખ,  
ગમાર અને અજ્ઞાણ એવા મને કંઈ જ ન સમજતાં મારા જેવાને ચૂપ રહેવામાં જ ફાયદો છે. વાસ્તવિકતા જેતાં મૌન ધરવું  
તે જ ખરેખર સદગુરુનું સ્તવન છે. પરંતુ સાઈભાબાનો એક એક ગુણ મને બોતલા માટે મને મજબૂર કરે છે અને મૌન  
ધારણ કરેલું ભૂલાવી હે છે. તેમની અગાધ લીલાઓ જેઠેને મારાથી ચૂપ બેસી રહેવાતું નથી. તે પક્વાન જ્ઞાને મીંદું  
લાગવાથી મનમાં શ્રોતાઓની યાદ આવી. તેમને પણ એ પિરસેલી પંગતમાં બેસાડવાથી મીઠાશનો સ્વાદ બમણો થાય  
એવું મને લાગ્યું. માટે આ ભોજનમાં રંગત આવી. જમણવાર ભલેને અતિશય સ્વાદિષ્ટ હોય પણ તેમાં જો સંગતમાં  
સજ્જન મિત્રમંડળ પંગતમાં જેડાય નહીં ત્યાં સુધી તે ભોજન એકલાં એકલાં ગ્રહણ કરવું ગમતું નથી અને ઘણીવાર તેની  
મજા પણ ફિક્કી પડી જાય છે. સાઈનાથની તો બધી દુચ્છાઓ પરિપૂર્ણ થયેલી છે. સાઈભાબા પોતે જ બધા સંતોની  
લાલીમાં ભૂષણ જેવા છે. સાઈનાથ પોતે જ પોતાના ભક્તો માટેનું વિશ્રામસ્થાન છે. સંસાર ચકના સહન કરવાના અધરા  
ફેરાઓમાંથી પણ તે જ બચાવે છે. તેમની લીલાઓનું શબ્દકાંન કરી શકાય તેમ જ નથી. મારી વાણીમાં તેમનાં વખાણ  
કરવાની તાકાત રહી નથી. જેમની કલ્પના કરી શકતી નથી તો તેમની કલ્પિત કલા મારા જેવાથી કેવી રીતે સમજશે ?  
કલ્યાણોમાં પણ કલ્યાણ જેવા આ સાઈ કૃપા કરીને આ અંથ પૂર્ણ કરાવવા માટે પોતાની કથાની મને યાદ કરાવે છે. તેમના  
અગાધ મહિમાનાં વર્ણન કરવા માટે કોઈ સમર્થ છે ખું ? પરા જ્યાંથી ફરીને પાછી ફરે છે, ત્યાં પશ્યંતી અને મધ્યમા  
વાણીની ત્રીજી અવસ્થા એની શી વાત ? આ પણે જ્યાં મોહું ઉધાડી શકતી નથી ત્યાં વૈખરી જેના દ્વારા જ્ઞાની શબ્દો  
નીકળે છે તે વાણીની ચોથી અવસ્થા તે વળી શું કરી શકે ? જેની મને પૂર્ણપણે ખબર છે, છતાં આ મારું મન સ્વસ્થ બેસી  
શકતું નથી. સદગુરુનાં ચરણોમાં તલ્લીન થયા વીના ખું સ્વર્ગપ સમજતું નથી. સંતપોતે ઈશ્વર સ્વર્ગપ છે. તેમની કૃપાના  
વરદ હસ્તની હંમેશાં પ્રાર્થના કરવી. ગુરુચણોની મનમાં ઉત્કંઠા ઉત્પન્ન થવી અને તે જ અમારે માટે સર્વસ્વની પ્રાપ્તિ છે.  
સંત સહવાસનો નાદ અને અનેક પ્રકારના પ્રેમનો લહાલો અમને પ્રાપ્ત થાઓ. જેને પોતાના દેહ માટે પૂર્ણ અભિમાન છે  
તેને 'ભક્ત' એવું વિશેખણ શોભતું નથી. જે પૂર્ણપણે નિરાભિમાની છે તે ભક્ત તરીકી શોભી ઊં છે. જેને પોતાના જ્ઞાનનો  
ગર્વ છે, મોટાઈનો ખોટો ઢોળ હોય છે અને જ્યાં ફક્ત ધાર્મિક ભાવનાઓના દંબનું અસ્તિત્વ છે, તેની વળી પ્રતિષ્ઠા  
કેવી ? જે પણ દૂર્દીવીઓ અને અભાગીઓ પ્રેમથી પોતાના ગુરુની કીર્તિ ગાતા નથી કે કાનથી સાંભળી શકતા હોવા છતાં  
જે એને સાંભળવા પ્રયત્ન પણ કરતાં નથી તેઓ ખરેખર મતિમંદ થયેલા બેવક્ફો છે. તીર્થયાત્રા, વ્રત, યજા કે દાન કરવું  
તેના કરતાં તપ વધારે શ્રેષ્ઠ છે. સાઈભક્તો માટે શ્રીસાઈનાથ મહારાજ એ જ ધ્યાન અને ધરણા છે. સાઈ એટલે જ દેવ  
દેવી, દેવતાઓની પૂજા છે, અને સાઈ એ જ તેમને માટે એક ગુપ્ત પૂજા છે જેનું તેમને કાળજીપૂર્વક રક્ષણ કરવું પણ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

કળુંસાઈથી નહીં. મતબલ કોઈ પણ ખરા ભક્તને ભાગીદાર કરવા માટે તૈયાર જ રહેવું. (ઓ. ૧-૧૭)

અમુક સમયે મને આગસ આવે છે. પણ આ હદ્યનિવાસી અંતયાભી સાઈનાથને ક્યારે પણ આગસ આવતી નથી. મારાથી કથા ભૂલાઈ જતાં તેઓ મને તરત જ સમયસર યાદ કરાવે છે. એક ક્ષણ પણ નિરાંતે બેસું એવું લાગે પણ મારું અહીં કંઈ જ ચાલતું નથી. કલ્પના પણ ન હોય એવી કથાની સ્કુરણા થાય છે કે તરત જ કલમને હથમાં લેવી જ પડે છે. એવી અનેક અગાધ કથાઓ પોતાના ભક્તોને સંભળાવવા ખાતર, અને મારા પોતાના કલ્યાણ ખાતર તેમને મને આ સત્ય ચરિત્ર લખાવવા માટે ઉત્તેજિત કર્યો છે. આમ પણ સંતોની કથાના તો સંતો જ રચયિતા અને લેખક હોય છે. તેમની જે આવી પ્રેરણા ન હોય તો તે કથા રસ વીનાની નીરસ થઈ ગઈ હોત. કૃપાળું સાઈભાબાએ મારા મનમાં પ્રવેશ કરીને પોતાનો ગ્રંથ પૂર્ણ કરાવ્યો અને મારા મનની ઈચ્છા પૂર્ણ કરી. મુખેથી શ્રીસાઈના નામનો જપ, હદ્યમાં તેમનાં વચ્ચેનોનું ચિંતન, મનમાં તેમની મૂર્તિનું ધ્યાન જેથી મને પૂર્ણ સમાવાન પ્રાપ્ત થયું. જેના મુખમાં સાઈમહારાજનું નામ છે, હદ્યમાં બાબા પ્રત્યેની ભક્તિ છે અને જેનું કોઈ પણ કર્મ સાઈ માટે જ હોય છે તેવા શ્રીસાઈ મોટા ઝાણી છે તથા મદદ કરનારા અને કૃપા કરનારા છે. સંસાર બંધનોમાંથી છૂટવા માટે આ સિવાય અન્ય કોઈ સાધન નથી. સાઈકથા મહા પાવન પવિત્ર અને પાપમુક્ત કરનારી છે. તેને સાંભળવી કે વાંચવી તે પણ હંમેશા સુખદ્વારાયક છે. સાઈની જમણી બાજુએથી પ્રદક્ષિણા ફર્વી, કાનથી તેમનું સત્યચરિત્ર સાંભળવું, સર્વાંગથી તેમને પ્રેમે આદિગન આપવું અને આંખોથી એમનાં દર્શન કરવાં, તેમને સાણાંગ પ્રણામ કરી તેમનાં ચરણોમાં મસ્તક મૂકી દેવું. તેમના જ નામસ્મરણ માટે પોતાની લુભનો ઉપયોગ કરવો અને નાકથી એમના ઉપરથી ઉત્તેલાં ફૂલોની સુવાસ લેવી. (ઓ. ૧૮-૨૬)

હું પાછલી કથાના અનુસંધાનમાં એટલે કે પાછલા અધ્યાયમાં શ્રોતાઓને મેં ચમત્કારથી જેને હોંશ હતી, એવા ભક્તની વાત તેમને કહીશ એવું વચ્ચન આચ્યું હતું. સંત પાસેથી પોતાના જીવનનું કલ્યાણ સાધવાની ઈચ્છા નથી અથવા તો પરમાર્થ સિદ્ધ કરવાનું મન નથી. સાથે સાથે સંતના અધિકારોની જાણકારી પણ નથી. એવા સંન્દેશોમાં જે કોઈ સંતના ભાહિમાનું વર્ણન કરે તો મનમાં વિશ્વાસ બેસતો નથી. મિત્ર મંડળમાં સાઈની વાતો થતી હોય ત્યારે તે ભક્ત તેને સાંભળતો હતો. પણ હંમેશાં હોષ જ જોવાનો સ્વભાવ ધરાવનારો તથા તેને જ્યાં સુધી જત અનુભવ થાય નહીં ત્યાં સુધી ખાત્રી થયા વીના જગતની કોઈ પણ વાત તે માનવા તૈયાર જ ન હતો. એનું નામ હરિકાનોબા હતું. તે મુંબઈથી મિત્રોની સાથે સાઈનાથની તપાસ કરીને અને તે અંગે ખાત્રી કરવા માટે શિરડીના પ્રવાસ અર્થે નીકળ્યો. પરંતુ સર્વેના હદ્યમાં પ્રકાશનારા સાઈની કલાકસબની રીત અને એની કુશળતા અને અપૂર્વતાને કોણ ખાત્રીપૂર્વક જાણી શકે છે? એ હરિભાઉ જ્યારે મુંબઈથી શિરડી તરફ આવવા માટે નીકળ્યો ત્યારે શિરડીમાં બેઠાં બેઠાં એનું આવવાનું શું પ્રયોજન છે તેની તરત જ બાબાને જાણ થઈ ગઈ. હરિ ફક્ત બાબાના માત્ર ચમત્કાર જોવા માટે જ આતુર હતો. અને આ બાબતમાં તેની યોગ્યતા કે પાત્રતા પણ આટલી જ હતી. છતાં પણ બાબાએ તે શિરડી આવે ત્યારે આ વાતની જલક બતાવીને તેને પોતાનો સંપૂર્ણ કરી લીધો અને તેના મનમાં ઊંલી જીજાસા સંતોષવા જે શ્રમ એણે ઉદાહરણ્યો હતો તેને પણ સાર્થક કરી બતાવ્યો. સંત ખરેખર યુક્તિભાજ હોય છે. કોપરગાંબથી હરિભાઉ મિત્રો સાથે ઘોડાગાડીમાં બેઠા અને ગોદાવરી નદીમાં મજાનું સ્નાન કરી જરાપણ ખોટો સમય બરબાદ ન કરતાં શિરડી તરફ આવવા માટે નીકળ્યા. શિરડી આવતાં જ ફરીથી હાથપગ ઘોઇને પ્રત્યક્ષ સંતસાઈને જોવા અને તેમને સમજવા માટે તે ગયો. પગમાં નવા કોરા ચંપલ હતા. અને માથા ઉપર જરીનો ફૂટો બાંધેલો હતો. હરિભાઉનું મન સાઈમહારાજનાં દર્શન કરવ માટે ભારે ઉત્સુક હતું. મસ્જિદ તરફ પહોંચ્યતાં દૂરથી જ મહારાજને જેઠિને તેને લાગ્યું કે, પાસે જઈને તેમને દંડવત્ત પ્રણામ કરવા જેઠાયે. પણ નવા ચંપલ નહ્યાં તેથી અડચણ ઊભી થઈ. તે ચંપલને સાચવીને મૂકવો માટે બીજું કોઈ સુરક્ષિત સ્થાન હતું નહીં. પછી ત્યાં જ એક ખૂલ્ણો જેઠિને તેમણે

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ચંપલ એક ખૂણામાં સરકાવી દીધા અને ઉપર દર્શન કરવા માટે ગયા. હરિએ પ્રેમથી સાઈને નમન કર્યું. અને ઉદ્દી પ્રસાદ લઈને તે પાછા ફર્યા અને પાછા વાડામાં જવા નીકળ્યા. જેવા ચંપલ પહેરવા જય છે તો તેનાં ચંપલ ગાયબ ! શોધી શોધીને તે થાક્યા પણ ચંપલ મબ્યાં જ નહિ. તેથી તે ચંપલ હવે મળવાના નથી. તે જ આશાએ અને દૃષ્ટિ ચહેરે ઉધાડા પગે પાછા આવ્યા. કારણું કે બાબા પાસે સારા એવા ભક્તો બેગા થયા હતા અને અવર જવર પણ ઘણી જ હતી. તપાસ કરવા ખાતર પણ પૂછે તો કોને પૂછે ? તેમને ઉપાય સૂઝે નહીં. આમ તેમનું મન અસ્વસ્થ થઈ ગયું. કેમ કે નજરો સામે નવા લીધેલા ચંપલ દેખાવા લાગ્યા. તેના મનમાં પણ ચંપલનું જ ચિંતન ચાલ્યું, ધ્યાન પણ તેમનું લોકોએ પહેરેલા ચંપલ તરફ સતત રહેવા લાગ્યું અને મનમાં વિચારવા લાગ્યા કે મેં આટલી હેંશથી નવા ચંપલ ખરીદેલા તે ખોવાઈ ગયાં. નક્કી કોઈ ચોરે જ એનો બંદોબસ્ત કરી નાખ્યો હોવો જોઈએ એવું તેમને લાગવા માંડ્યું. (ઓ. ૨૭-૪૪)

પછી નાહી ધોઈને, પૂજા, નૈવેદ્ય પતાવી પંગતમાં બેસીને હરિએ જમી લીધું. પણ તેનું મન તો અસ્વસ્થ જ રહ્યું. કંઈ ચેન પડે નહીં. સભામંડપ એ તો સાઈબાબાનાનું સ્થાન છે. ત્યાંથી બાબાની નજર ચૂકાવીને મારા નવા ચંપલને કોઈ લઈ જય એ કંઈ નાનું સૂનું આશ્રય કહેવાય ? હરિબાઉના મનમાં ચિંતા પેઢી. જાવા પીવામાંથી પણ મન ઉડી ગયું અને તે શૂન્યમનસ્ક જેવા થઈ ગયા. જમ્યા બાદ બીજા બધા લોકોની સાથે હાથ મોંઢું ધોવાને માટે તેઓ બહાર આવ્યા, એટલામાં એક મરાઠા જીતનો છોકરો ખોવાયેલાં ચંપલને લાકડીના ટેકે ઉપર ખોસી વાવટાની જેમ લગાવીને એકાએક ત્યાં આવી ચઢ્યો. લોકો જમીને હાથ મો ધોતા હતા. છોકરો શોધતો આવ્યો અને જોરથી બૂંઘો પાડવા લાગ્યો. તે કહેવા લાગ્યો, ‘આ લાકડી હાથમાં લઈને બાબાએ મને મોકલ્યો છે અને ‘હરિ કા બેટા, જરી કા ફેટા’ આમ બૂંઘો પાડતા જવા માટે કહ્યું છે. ‘આજ મારા ચંપલ’ એવું જે ખૂબ જોરથી ઉત્સુકતાથી બોકે તેને તે ચંપલ આપી દેને. પણ પહેલાં એ ‘હરિ કા બેટા’ હોવો જોઈએ, અને એનો પહેરેલો માથા પરનો ફેટો જરીનો હોવો જોઈએ તે જરૂરથી જણી લઈને પછી જ તેને ચંપલ આપજે. ખૂબ બૂમરાણ મચાવતો નહીં એવી સાઈબાબાની મને આજા છે.’ આમ એ છોકરો ભર ટોળામાં એકાન કરતો હતો ત્યાં જ હરિની નજર પોતાના ચંપલ ઉપર પડતાં તે તેણે ઓળખી કાઢ્યા અને દોડતો દોડતો તેની પાસે ગયો. હરિના મનમાં ખૂબ જ આશ્રય થયું. તેઓ રડી પડ્યા, આનંદનાં આંસુ નીકળી પડ્યાં. ગળું ભરાઈ આવ્યું અને ખોવાયેલા ચંપલ મળેલા જોઈને તેને ચ્યાતર લાગ્યો. તેણે પેલા છોકરાને કહ્યું ‘આવ, આવ, અહીંથા લાવ, જેવા દે જોઉં. પેલા ચંપલ જોઈને તેને પૂછ્યું, ‘અચ્યા તને આ ક્યાંથી મખ્યા ? તે મને જલ્દીથી કહે.’ ત્યાં છોકરો બોલ્યો, ‘તે મને ખબર નથી. હું તો ફક્ત બાબાની આજા પાળનારો જ છું. હરિનો જે બેટો હશે તે મને જરીનો ફેટો બતાવશે તો જ આ ચંપલ આપીશ. બીજી કોઈ પણ પ્રકારની વાત હું જાણું નહિ. બાબાએ દર્શાવેલી આ નિશાનીઓ જેની પાસે હશે તેને જ આ ચંપલ આપીશ.’ હરિબાઉ બોલ્યા, ‘અરે બાળક ! એ ચંપલ મારા જ છે.’ આવું કહ્યું છાતાં પેલો છોકરો તેમને ચંપલ આપવા તૈયાર ન હતો. પછી હરિબાઉએ એ છોકરાને બાબાશ્રીએ કહેલી અને તપાસી જેવા માટેની બધી જ નિશાનીઓ બતાવી. તેઓ બોલ્યા, ‘અરે છોકરા ! હું જ હરિ છું. કાનહોબાનો દીકરો. આ શબ્દો તો ખરેખર મને જ દરેક રીતે લાગુ પડે છે અને આ રહ્યો મારો જરીનો ફેટો. જે એટલે તારો સંશય દૂર થઈ જશે અને આ ચંપલનો ખરો માલિક હું જ છુ તેની તને ખાત્રી થઈ જશે. બીજી કોઈનો પણ આ ચંપલ ઉપર હક્ક દાવો ચાલશે નહીં.’ ત્યારે પેલા છોકરાના મનનું સમાધાન થયું અને નવા ચંપલ હરિબાઉને આપી દીધા. આ રીતે હરિબાઉના મનની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ અને સાઈબાબા ખરેખર મહાન સંત પુરુષ છે તે બાબતનો અનુભવ પણ થયો. (ઓ. ૪૫-૬૦)

મારો ફેટો જરીનો છે એવું કહેવું કાંઈ મોટો ચ્યાતર નથી, ફેટો તો મારા માથા ઉપર બધાને દેખાય તેવો છે. પરંતુ હું

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

એક પારકા ગામનો વતની, શિરડી મારી આ પ્રથમ ફેરી, હોવા છતાં સાઈબાબાએ મારું નામ કેવી રીતે જાણ્યું ? મારા ભાપ કાનહેબા જેને કોઈએ જેથા નથી કે જાણ્યા નથી, તો પછી, ‘કા’ આ અક્ષરથી એમનું નામ સુચિત કર્યાનું મને ખૂબ જ આશ્વર્ય લાગે છે. પહેલાં મારા મિત્રો તરફથી સાઈબાબાનો મહિમા ઘણી વાર સાંભળ્યો હતો. તેઓ બાબા વિષે જ્યારે કહેતા હતા, ત્યારે મેં તેમની ખૂબ ઉપેક્ષા કરી હતી. જેનો મને હવે ઘણો જ પસ્તાવો થાય છે. મારા પોતાના અનુભવથી બાબાનો પ્રભાવ હમે મને સમજન્યો છે અને હવે મારી શંકાને કોઈ સ્થાન રહ્યું નથી. સાઈમહારાજ તો સાચેસાચ એક મહાત્મા જ છે. જેના મનમાં જેવી શ્રદ્ધા કે ભાવના હોય છે, તેવો જ અનુભવ પણ થાય છે. હરિભાઉને પણ તેમની પોતાની ભાવના અનુસાર અનુભવ થયો. સંતોની પરીક્ષા લેવી એવી એને એક ઘેલછા હતી અને એવો જ એમનો સ્વભાવ હતો. પણ મનમાં પરમાર્થની કોઈ તીવ્ર ઈચ્છા હતી નહીં. સાઈસમર્થ મહાપ્રભાવશાળી સત્પુરુષ હોવાના અનુભવો આપ્તમિત્રો કહેતા હતા, એ હકીકિતનું આશ્વર્ય પોતે જતે નજરે નીરખવું એ જ એમનું શિરડી જવા માટેનું મુખ્ય કારણ હતું. સંતના ચરણમાં જવ પરોવવાથી ઈશ્વરનું ટેકાણું આપોઆપ મળી જશે. એવો એમના મનમાં જરાય વિચાર ન હતો. સરડાની છલાંગ કેટલે સુધી હોઈ શકે ? વધારેમાં વધારે ઝડાની ડાળીની કુંપળો સુધી જ, એથી વધારે તો નહીં જ. સંતના બારણો જઈને નમસ્કાર જેવાનું નક્કી કર્યું તો ચંપલની નવી કોરી જેડ કમસે કમ પાછી ઘરે પહોંચવા માટે હાથ તો લાગી ! આમ પણ અમસ્તા ચંપલ ખોવાઈ જવાથી કર્યું મોટું નુકશાન થવાનું હતું ? પરંતુ તેને માટે મનની જે વ્યર્થ મથામણ થઈ. જે એ મખ્યા વીના રોકી શકાઈ ન હોત. (ઓ. ૬૧-૭૦)

સંત પ્રાપ્તિના બે જ માર્ગ છે. એક ભક્તિનો અને બીજો જ્ઞાનનો. જ્ઞાન માર્ગમાં કષ પડે છે અને તે વધારે અધરું અને ગહન હોય છે, જ્યારે ભક્તિનું સાધન સરળ હોય છે. જે ભક્તિ કરવી સહેલી હોય અને પ્રાપ્ત થવા માટે જે સુલભ હોય તો બધા લોકો ભક્તિ કેમ કરતા નથી ? તો એને માટે પણ મહાન ભાગ્ય સંપત્તિનો સાંધો મળવો જોઈએ. અને તો જ આવી ભક્તિની પ્રાપ્તિ થઈ શકે છે. અનેકો જન્મોનાં પુણ્યના પ્રતાપે સંત પુરુષો સાથે ગાંઠ બંધાય છે, અને સંત સહ્બાસનું સુખ મેળવે છે તથા એની સાથે સાથે પોતાના ભક્તિભાવનો પણ વિકાસ થાય છે. આપણને સૌને સંસારની બસ આટલી જ પ્રવૃત્તિઓની માહિતી હોય છે અને તેમાં જ આપણી આસક્તિ રહેલી છે. તેની ઉપાધીઓમાંથી પોતાની જતને કેવી રીતે મુક્ત કરવી તેની ખબર માણસને નથી હોતી. મનની જ્યાં આવી જ વૃત્તિ હોય તો એને શું ભક્તિ કહી શકાય ? જેવી અમારી ભક્તિ હોય છે, એની પ્રાપ્તિ પણ એટલી જ હોય છે. અને એવું જ આવી પૂર્વક બનતું હોય છે. એમાં જરાયે શંકા નથી. વિષયભોગ મેળવવા માટે જે રાત દિવસ સાઈની પાસે ભેગા થઈએ તો તેની આશીર્વાદ્યાપી બેટ પણ મળશે. પરંતુ પરમાર્થની જેની ઈચ્છા હશે તેને માત્ર પરમાર્થ જ પ્રાપ્ત થશે.’ (ઓ. ૭૧-૭૬)

એક સોમદેવ સ્વામી નામના વ્યક્તિ સમર્થની કસોટી કરવા માટે શિરડી આવ્યા. ઠ.સ. ૧૯૦૬માં ભાઈજીને ઉત્તરકારીની ધર્મશાળામાં આ વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી. (પ્રવાસીઓને ઉત્તરવા માટેની ધર્મશાળા જેમાં ગોળ લપેટેલી અને બાંધેલી શેતરંજુઓ મળે છે.) પ્રસિદ્ધ સ્વ. કાકાસાહેબ દીક્ષિતના ભાઈજી એ વિષ્યાત બંધુ હતા. તેમને હિમાલયના બદ્રીકિદારની યાત્રા કરતી વખતે આ સ્વામી સાથે રસ્તામાં ભેટો થયો હતો. બદ્રીકિદાર પાછળ છૂટ્યાં અને ભાઈજી નીચે ઉત્તરવા લાગ્યા. માર્ગમાં ડેકેકાણે વિશ્રાંતિનાં સ્થાનો આવવા માંડયાં અને ત્યાં ઉતારુંઓ પણ બેઠેલા દેખાયા. તેમાંના એક ગૃહસ્થ જે પાછળથી હરિદ્વારના સ્વામી આ નામથી પ્રસિદ્ધ થયા. તેઓ સાઈબાબાના પ્રભાવ નીચે આવેલા. એમની બોધદાયક કથા, બાબાનો સ્વભાવ સ્પષ્ટ કરીને બતાવશે જે સાંભળનારાઓ માટે સંતોષદાયક છે અને તેનાથી દરેકને આનંદ પણ મળશે. ભાઈજી શૌચ માટે જતા હતા, તે સમયે આ સ્વામીજી સાથે રસ્તામાં મુલાકાત થઈ. સહજ રીતે તેઓને એકબીજી સાથે પ્રેમથી વાતો કરતાં, એકબીજી માટે અનુકૂળતા ઉદ્ભબી. ગંગોત્રીથી નીચેનો આ પ્રદેશ. ત્યાંથી

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ઉત્તરકાશી મુકામે સ્વામીભુવા હતા, તે દરમ્યાન દહેરાદુન અહીંથી ૭૦ કોસ એટલે કે એકસો ચાતીસ માઠલ અથવા તો બસો ચોવીસ કિ.મી. દૂર આ સહૃદાસ થયો. લોટો લઈને સ્વામીભુવા શૌચ માટે ખુલ્લી જગ્યા શોધવા માટે નીકળ્યા અને એ જ જગ્યા તરફ ભાઈજી પણ તે જ કામ માટે નીકળ્યા. શરૂઆતમાં તો તેઓ બંનેની નજર મળી, પછી આગળ રસ્તામાં પ્રત્યક્ષ મુલાકાત થઈ અને ત્યારબાદ એકબીજના કુશળમંગળની વાતો ચાતી. આમ વાતો કરતાં કરતાં પરસ્પરનો સ્નેહ વધ્યો અને એકબીજનું સરનામું પૂછવા લાગ્યા. ભાઈજી બોલ્યા, ‘આપનું હરિદ્વાર મુકામે રહેઠાણ છે, જ્યારે અમે નાગપુરમાં રહીએ છીએ. ક્યારેક એ તરફ આવવાનું થાય તો અમને જરૂરથી આપનાં દર્શનનો ફરીથી લાભ આપશો. અમે પણ આપની થોડી સેવા ચાકરી કરી શકીએ એવો મોકો આપજે અને અમારા ધરના આંગણાને પાવન કરજો. અમારો આ આગ્રહ ભૂલશો નહીં. અમારા ધરને આપનાં ચરણોનો લહાલો મળે એ જ અમારી વિનંતી છે.’ તે સાંભળીને સ્વામીજી બોલ્યા, ‘નારાયણ તમારી આ ઈચ્છા પૂર્ણ કરે.’ ઈ.સ. ૧૯૦૬ની સાલમાં ઉત્તરકાશીની નીચે એકબીજ સાથે આ પ્રકારે વાતચીત થઈ. બંનેએ એકબીજનાં સરનામાં લઈ લીધાં અને છૂટા પડ્યા. (ઓ. ૭૭-૮૨)

પછી ત્યારબાદ પાંચ વર્ષ જેવો સમય વિતી ગયો. ત્યારબાદ સાઈના સમાગમનો અવસર આવ્યો અને સ્વામીજીને ભાઈજી સાથે મુલાકાત માટેની તાત્ત્વાવેતી લાગી. ઈ.સ. ૧૯૧૧ની સાલમાં સ્વામીજી નાગપુર આવ્યા. ત્યાં મહારાજશ્રીની પવિત્ર વાતો સાંભળીને ખૂબ જ આનંદ થયો. ભાઈજીએ ભલામણનો પત્ર આપીને શિરડીક્ષેત્રે સુખે પહોંચવાની બધી વ્યવસ્થા કરતાં સ્વામીએ નાગપુર છોડ્યું. મનમાદ સ્ટેશન પર ઉત્તરતાં કોપરગાંવની ગાડી તૈયાર જ હતી. પછી કોપરગાંવથી ઘોડાગાડીમાં સવાર થઈ અને આનંદભેર તેઓ સાઈભાબાના દર્શન માટે શિરડી જવા નીકળ્યાં. ક્યાં પણ જલ પરંતુ સાધુઓની વર્તણૂક અને તેમની રહેણીકરણીની રીત બિન્ન અને ન્યારી હોય છે. એક સરખી ક્યારેય હોતી નથી. ઉદાહરણ તરીકે સાઈભાબા મુસલમાન ફીરની માફક કફની ધારણ કરી કટકો શરીર બાંધતા હતા, જ્યારે કેદગાંવના નારાયણ મહારાજ, રાજ મહારાજાનોની માફક રેશમી કિનારવાળું ધોતિયું, મલમલનો સહરો અને જરીનું જકીટ ધારણ કરતા હતા, જ્યારે શેરગાંવના સંત શ્રી ગજનન મહારાજ તો સહાને માટે હિંગંબર અવસ્થામાં જ ફરતા હતા. એક સંતની વર્તણૂક ક્યારેય બીજા સંતને મળતી આવતી નથી અને માન્ય પણ નથી હોતી. દાખલા તરીકે સાઈસમર્થનું આઠ આઠ હિંદુસ સુધી સ્નાન ન કરવું, કે રોજ ધોઇને કપડાંથે ન બદલવાં જ્યારે શ્રી વાસુદેવાનંદ સરસ્વતી ઉંફું ટેમ્બેસ્વામી સ્નાન સંધ્યા અને નિત્ય કર્મ વિષે ખૂબ જ ચીવટ રાખતા હતા અને પવિત્રતા પણ તેઓ એકદમ કદક રીતે પાળતા હતા. માટે જ ખાસ કરીને સંતોની યોગ્યતા કે અયોગ્યતાનો અંદાજ કાઢવા માટેનું આ સાધન કે કારણ બરાબર નથી. સંતોના દર્શને જવા માટે કે જનારાને આ વિષે વિચાર શા માટે કરવો જોઈએ ? તેમનાં વર્તન તરફ જે ધ્યાન આપવામાં આવે તો પોતાનું કટ્યાણ કરવાનો સમય ગુમાવી દેવાનો વારો આવે. સ્વામીના સ્વભાવની પ્રકૃતિ જ એવી હતી કે તેમના મનમાં હંમેશા તર્ક વિતર્ક ઉઠતા રહેતા. દૂરથી શિરડીની મસ્નિદ્વાર ઉપરના નિશાનો અને ઝંડાઓ દેખાતાં જ તેમના મનમાં શંકાઓ ઉત્પન્ન થવા લાગી. તેમની સાથે આવેલા લોકોએ મસ્નિદ્વાર ઉપરના કળરાનાં દર્શન દૂરથી નજરે પડતાં જ પ્રેમથી તેને નમસ્કાર કર્યા. હવે સાઈનાં દર્શન થવાનાં છે માટે મન ઉત્સુક થયાં હતાં. તેમ છતાં સામે જ નિશાન દેખાતાં એની અવગણના એમનાથી કરી શકાઈ નહીં. નિશાનના દર્શનથી મનમાં પ્રેમ પ્રગટ થવો એ તો દેરેક સ્થાનોનો હંમેશનો અનુભવ છે. એ તો ભક્તિ અને પ્રેમનું લક્ષણ છે. એમાં કોઈ જ વિચિત્રતા નથી. પરંતુ પેલા સ્વામીના કુત્સિત મનમાં દૂરથી આ નિશાનીઓ જોઈને જત જતના વિચારો ઉઠવા લાગ્યા. તેમના મનની કેવી વિચિત્ર સ્થિતિ હતી ? ‘આવા નિશાન મૂકવા તે કંઈ સાધુત્વનું લક્ષણ કહેવાય ? નિશાન તો મંહિરો ઉપર જ લગાડવામાં આવે. પોતાના નિવાસસ્થાન પર નિશાન લગાવવા એટલે કે સાધુત્વને હીનપણું લાગવા બરાબર છે. આ પ્રકારે સાધુ માન સન્માન માંગે છે. આ તો તેની કેવળ માન-મર્ત્યા પ્રત્યેની આસક્તિ

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

છે. આવા સાધુનું સાધુત્વ મનને પરવડતું નથી. આ તેમની ઉણાપ છે.’ કહેવાનો અર્થ એ કે, જેવો સ્વામીના મનમાં પૂર્વગ્રહ હતો. તે જ પ્રમાણેનો સાઈબાબાના સાધુત્વ માટેનો તેમણે નિર્ણય લીધો અને પોતાને તેમની ફૃપાની કોઈ જરૂર નથી તેવો મક્કમ નિર્ધાર કર્યો. પોતે વગર કામના અહીં સુધી આવ્યા એવું મનમાં લગાડીને સ્વામીના મનમાં સાઈનાથ પ્રત્યે ખૂબ અનાદર ઉત્પત્ત થયો અને ત્યાંથી તાત્કાલિક જ પાછા ફરવાનો તેમણે પાક્ષો નિર્ધાર કરી નાખ્યો. ‘આ તો માનમરતભાનો પોકળ દેખાવ લાગે છે. સાધુને તો વળી માનની શી જરૂર ? આવા નિશાનો દ્વારા આ સાધુ પોતાની મોટાઈ જ બતાવવા ઈચ્છે છે. તે જ તેના સાધુત્વની ખામી છે. આવા સાધુના દર્શને મારે શા માટે જરૂર જોઈએ ? તેમના દર્શનથી મન શાંત શી રીતે થશે ? આ તો એક ઘાર્મિકતાનો દંબ નિશાનીઓ ઢ્રે પ્રદર્શિત કરવામાં આવ્યો છે. તેનાથી મનને કંઈ સમાધાન મળવાનું નથી. આવ્યા એ જ રસ્તે પાછા જવામાં જ માત છે. દર્શનનો વિચાર કંઈ બરાબર દેખાતો નથી. ખરેખર હું તો ફસાયો.’ આ સાંભળતાં જ સાથે આવેલા પ્રાણીઓએ એ સ્વામીને કહ્યું, ‘પછી આટલા ફૂર તમે શા માટે આવ્યા ? ફક્ત નિશાનીઓ જોઈને તમારા મનની વૃત્તિઓ આટલી બધી બહલાઈ કેમ ગઈ ? હવે આપણે તો શિરડી ગામ પાસે આવી પહોંચ્યા છીએ. ત્યાં રથ, પાલખી, ઘોડો વગેરે સરંજામ અને માનમરતભાની બીજી સાધન સામગ્રી જોઈને તમારા મનને ડેટલી બેચેની વધરો ?’ એમનું આવું બોલવું સાંભળીને સ્વામી વધારે ચિડાયા. ‘નગારા, પાલખી, રથ, ઘોડા પાસે હોથ એવા મોટા મિનજી સાધુઓ મેં કંઈ જેયા નથી ? શિરડીનો વિચાર બરાબર નથી. હવે નદીની વાટ સેવી જોઈએ.’ મનમાં આવો વિચાર કરીને સોમદેવળું સ્વામી પાછા ફર્યા. ત્યારે સાથે આવેલા વેટમાર્ગુંઓ તેમને આગ્રહ કરવા લાગ્યા. ‘જ્યારે તમે અહીંયા સુધી આવ્યા છો તો પાછા ફરતા નહીં. જે આવ્યા જ છો તો થોડું આગળ વધારે ચાલો. ભળતા જ વિચારો છોડી હો. મસ્તિજ્ઞ ઉપર જે આ નિશાનો ફરકી રહ્યાં છે તેની સાથે આ સાધુને કોઈ નિસબ્ત નથી. આ સાધુને એની પરવા પણ નથી. તેમને મોટાઈની કે માનપાનની પરવા નથી, કે આસક્તિ પણ નથી. ગામના માણસોને આવી સંજવટ ગમે છે, માટે તેમણે આવો શાણગાર કર્યો છે. તેમની બાબા પ્રત્યેની ભક્તિનું આ પ્રતિક છે અને તે જ આ નિશાનો પાછળનું મુખ્ય કારણ છે. તમે એ નિશાનો તરફ ધ્યાન આપતા નહીં. જરૂરને ફક્ત દર્શન કરી આવો. ત્યાં ક્ષાળભર પણ રોકાતા નહીં. તરત જ પાછા ફરજે પછી કાંઈ વાંધો છે ?’ એટલામાં શિરડી ગામની અંદર પ્રવેશતાં ત્યાં તેમને વેટમાર્ગુંએ કરેલા સાદા અને સરળ વાર્તાલાપ પરથી લાગ્યું કે એક વખત દર્શન કરી જોઈએ. મનની બધી અકળામણ કાઢી નાખ્યી જેથી પાછળથી પસ્તાવવાનો વારો ન આવે. (ઓ. ૮૩-૧૨૧)

શ્રીસાઈસમર્થનાં દર્શન થતાં જ સ્વામી તો પીગળી જ ગયા, તેમની આંખોમાં પ્રેમ ઊભરાઈ આવ્યો અને કંઈ ગદ્ગદ થઈ ગયો. તેમનું મન પ્રસ્ત્ર થઈ ગયું અને આંખો ઉત્તાસિત થઈ ગઈ. તથા બાબાની ચરણરઘમાં આળોટવાનો મોકો ક્યારે મળે તેવો ઉમળકો થયો. બાબાનું આવું સુંદર ઢ્રે જોઈને સ્વામીનું મન અને દણ્ણ એકાગ્ર થઈ ગયું. અને તેઓ સાઈમહારાજની સામે બસ જેતા જ રહી ગયા. પ્રેમના અતિરેકમાં અટવાયા. મનમાંના ખરાબ તર્કો લુર્ણ થઈ ગયા, ચિત્ત દર્શનના આનંદમાં ખોવાઈ ગયું, બાબાશ્રીનું સગુણાદ્ર્ય આંખોમાં સમાઈ ગયું અને સ્વામી તલ્લીન થઈ ગયા. ઉમહા મહાત્માને નજરે જોઈને સોમદેવ સ્વામીને પુષ્કળ આનંદ થયો. તેમનો આત્મા શાંતિ પામ્યો અને હવે અહીંયા જ રહેવું જોઈએ બીજે ક્યાંયે જરૂર નથી તેમ લાગવા માંડચું. દર્શન માત્રથી જ શંકાઓ ઓસરી ગઈ અને બુદ્ધિ સ્થિર થઈ ગઈ. જુદા પણ બધું જ વિસરાઈ ગયું તથા બધે જ એકડૃપતા નજરે પડવા લાગી અને શબ્દો મોઢામાં થંભી ગયા તેથી આપોચાપ જ મૌન ધારણ થઈ ગયું. આંખોની પાંપણોની હુલયલ રોકાઈ ગઈ અને હૃદય બધી બાજુઓથી ચૈતન્યથી ઘેરાઈ ગયું. મન તલ્લીન થઈ પૂરેપૂરું સમાધાન પામ્યું. પહેલાં તો નિશાનના જંડા જોઈને પાછા ફર્યા હતા પણ હવે પ્રેમના આવેશમાં આંસુ સરી પડ્યાં. સાત્વિક અષ્ટભાવ ઉમટ્યા, અને સમર્થના પ્રેમમાં વણાઈ ગયાં. ‘જ્યાં મન પૂર્ણપણે રંગાઈ જય તે જ ખરું

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આપણું સ્થાન હોઈ શકે.’ એ પોતાના ગુરુના શબ્દો સ્વામીને યાદ આવ્યા. બાબા પ્રત્યેનો પ્રેમ અને માન વધ્યાં. સ્વામી ધીમે ધીમે આગળ વધવા માંડ્યા, તેમ તેમ સાઈનાથ મહારાજનો ગુસ્સો ઉપર ચઢવા માંડ્યો અને ગાળોનો વરસાદ વરસવા લાગ્યો. તેમ તેમ સ્વામીનો પ્રેમ પણ બમણો વધતો ગયો. સમર્થની કરણી કેવી વિચિત્ર હતી? તેમણે નરસિંહનો અવતાર આબેહૂબ ધારણ કર્યો. એકાએક ચઢ્યો ગુસ્સો ॥ જાણો પ્રત્યક્ષ નરસિંહનું રૂપ ॥ તેઓ બોલ્યા, ‘અમારા બધા ઢોંગ ઘતિંગ અમારી પાસે રહેવા હે અને તું પોતાને ધરે પાછો જી. મારી મસ્નિદ્રા તરફ પણ જે પાછો ફર્યો છે તો ખબરદાર! જે મસ્નિદ્રા ઉપર નિશાન લગાડે છે, એના વળી દર્શન તારે શા માટે કરવાં? આ તો કાંઈ સંતોનાં લક્ષણ છે? અહીંથા પલભર પણ રોકાઠશ નહીં.’ ડરના માર્યા અંત: કરણથી સ્વામી સભામંડપમાં તો ઘૂસ્યા પણ દૂરથી જ શ્રીનું આવું તાંડવ રૂપ જેઠિને તેમનાથી સ્વસ્થ રહેવાયું નહીં. પોતાના જ મગજના વિચસોનો પડ્યો સાંભળતા સ્વામી પોતાની જગ્યા ઉપરથી ઊભા ઊભા શરમના માર્યા બોલ્યા, ‘મહારાજ તો અંતર્જાની છે. પોતે કેટલો મૂર્ખ અને મહારાજ તો કેટલા વિદ્ધાન છે! મારા વિચારો કેટલા અધમ હતા અને આ તો કેટલા શુદ્ધ મનના છે! સાઈનાથ કોઈને આલિંગન આપતા તો કોઈને હાથ લગાડતા. કોઈને ધીરજ આપતા અને કોઈની સામે કૃપા દદિથી જેતા, તો કોઈની સામે હસ્તા ચેહેરે જેતા. કોઈના દુઃખમાં સહભાગી થઈ સાંત્વના આપતા તો કોઈને વળી ઉદ્દીપ્રસાદ આપતા. આમ બધાંને સંતુષ્ટ કરતા હતા. પછી મારા ઉપર જ આવો કોધ કેમ? મારા પહેલાંના વર્તાવને અનુસરીને કહાચ હોઈ શકે એમ મને લાગે છે. આ કોધ નથી તે મારી ઉપર કરેલો ઉપદેશ જ છે. પાળછથી તેનો ફાયદો સુખદાયી નીવડશે.’ પછી આગળ ઉપર એમ જ બન્યું. સ્વામી બાબાના પ્રેમમાં ખૂબ રમી રહ્યા અને સાઈકૃપાથી નિર્મળ થયા તથા સમર્થનમાં ચરણોમાં જ કાયમના સ્થિર થઈ ગયા. (ઓ. ૧૨૨-૧૪૧)

સાઈ ભક્તિના પ્રભાવની શક્તિ, ખરાબ આદતો અને ઈર્ષાને સદાને માટે દ્બાવી હો. શાંતિ, ઐશ્વર્ય અને વૈધ્ય ઉપજલો અને ભક્તોને તેમના પોતાના કાબમાં યશસ્વી કરો. ગાંધર્વ, યક્ષ, સુરાસુરથી આ સળવ નિર્જવ સૂચિ ભરેલી પડી છે. તે અભિત વિશ્વમાં આ વિશ્વંભર ભરે નિરંતર ભરેલો છે, વ્યાપેલો છે, ઇતાં તેને આકાર લીધો ન હોત અને સદાને માટે નિરાકાર જ રહ્યો હોત તો પણ અમારા જેવા સાકાર માનવીઓ ઉપર જરા પણ ઉપકાર થયો ન હોત. સારાંશ કે લીલાથી આ શરીર ધારણ કરીને સાઈ સમર્થે સમાજ વ્યવસ્થાના રક્ષણ કાંઈ અથવા તો દુષ્ટ અને દુર્જન લોકોના મતોનો વિરોધ કર્યો ન હોત તો ભક્તો ઉપર તેમની કૃપા કેવી રીતે થઈ શકી હોત? (ઓ. ૧૪૨-૧૪૫)

હવે આ અધ્યયા અહીં પૂર્ણ થયા આવ્યો છે, એટલામાં મને એક આખું દાઢાંત યાદ આવ્યું. મહારાજના ઉપદેશનો એ એક બેનેન નમૂનો યાદ આવ્યો. જે તેની ઉપર વિશ્વાસ મૂકવામાં આવે તો તે ઝરેખર હિતકારક પૂર્વવાર થશે. આમ આ વૃત્તાંત ખૂબ જ નાનો છે, પણ તેમાં જે ધ્યાન પરોવશે તેનું કલ્યાણ થશે. માટે હું શ્રોતાઓને વિનંતી કરું છું કે, ક્ષણ માટે મારી તરફ તમારું મન વાળો. એક હિવસ ભક્ત મહાળસાપતિ અને નાનાસાહેબ ચાંદોરકર મસ્નિદ્રામાં બેઠા હતા તે સમયે, એક અપૂર્વ ચર્મતકારિક ઘટના બની. કોઈ એક બીજાપુરમાં રહેનાર શ્રીમંત ગૃહસ્થ પરિવારસહ સાઈસમર્થના દર્શનાર્થે ઉત્સુકતાથી શિરડી આવી પહોંચ્યા. તેમાની શ્રીઓને બુરખામાં જેઠિને નાનાસાહેબના મનમાં સંકોચ થયો અને દર્શને આવેલ સંધના સમાધાન માટે ઉઠીને બાજુએ સરકી જઈ તેમણે થોડી જગ્યા કરી આપવી જેઠિએ તેવો મનમાં વિચાર કર્યો. પરંતુ નાનાસાહેબ જેવા ઉઠવા ગયા ત્યાં બાબાએ ટકોર કરી. તેમને રોક્યા અને બોલ્યા, ‘આવનાર આવ્યા કરશે, ઉપર આવરો, પણ તમે સ્વસ્થ ચિત્તે બેશો.’ એટલામાં કોઈએ પેલા ગૃહસ્થને સૂચવ્યું કે નાનાસાહેબ પણ દર્શન માટે જ આવ્યા છે. તમે પણ આવો. કંઈ વાંધો નહિ. માટે તે સૌ ઉપર આવ્યા. અને તેઓએ બાબાને નમસ્કાર કર્યા. એમાંની એક શ્રીએ બાબાને આદાબન્દ કરવા માટે પોતાનો બુરખો આંખો પાસેથી સહેજ સરકાયો, તે સમયે એનું સૌંદર્યવાન અને અત્યંત રૂપાળુ મુખ્યું જેઠિને નાનાસાહેબ મનથી થોડા મોહિત થયા. લોકોની નજરો સામે જેલું એ તો ચોરી કહેવાય પણ

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

જેયા વીના પણ રહેવાય નહીં. આ સમયે કેવી રીતે વર્તવું. તે તેમને સમજતું ન હતું અને મોહનો આવેશ પણ રોકાતો ન હતો. મનમાં બાબા સામે બેઠેલા તેનો સંકોચ હતો. જેથી ચહેરો ઉપર કરતો ન હતો. નાનાની નજર અછડતી એ તરફ જવા લાગી અને તેઓ અહૃતાણમાં મૂકાયા. આ તો નાનાના મનની પરિસ્થિતિ હતી. પરંતુ સર્વના હદ્યમાં વાસ કરનારા બાબા આ જાણતા હતા. બીજાઓને એનો શો ઘ્યાલ આવે ? તેઓ તો શાખ્દોના અર્થ બેસાડવાની અને સમજવાની જ ખરપટમાં હોય છે. નાનાની આવી બાવરી સ્થિતિ જેઠિને અને તેમની વૃત્તિ સમજણે તેમને પોતાની અસલ સ્થિતિમાં લાવવા માટે બાબાશ્રીએ જે ઉપદેશ કર્યો તે હવે સાંભળો. ‘નાના મનમાં શા માટે ગૂણવાયા કરે છે ? જેનો જે ગુણધર્મ હોય તેને શાંતપણે આચરણમાં મૂકવા હે, તેને આડ કે પઢ્યો ન કરીશ. જેમ કે આંખોનો ગુણધર્મ જેવાનો છે. તો સ્વસ્થપણે આંખોને તેમનું કામ કરવા માટે કોઈ અંતરાય ઊભા ન કરીશ.. એમાં કોઈ નુકશાન નથી. બ્રહ્મદેવે સૂછિની રચના કરી છે. આપણે જે એનું કૌતુક ન કરીએ તો એનું કૌશાલ્ય નિરર્થક જશો. ‘બનતાં બનતાં બનશો.’ આગળનો મુખ્ય દરવાજે જે ઉધાડો હોય તો પાછલા દરવાજે શા માટે જવું ? જ્યાં મન શુદ્ધ છે ત્યાં કોઈ જ અહૃતાણ નથી. જેના મનમાં કોઈ ખરાબી નથી તેને વળી કોની ચોરી. દશ્ટ દશ્ટનું કામ કરે છે. ત્યાં પછી સંકોચ શા માટે રાખવો ?’ માધવરાવ ત્યાં જ ઊભા હતા. જેમનો સ્વભાવ અધીરો અને ઉત્સુક હતો. તેમણે પોતાની લજાસા પૂરી કરવા માટે સમર્થના પેલા શાખ્દોનો અર્થ નાનાને પૂછ્યો. તે સાંભળીને નાના બોલ્યા, ‘અરે હમણાં ઊભો રહે ! વાડામાં પાછા જતી વખતે બાબાના મનમાં શું હતું તે હું તને કહીશ.’ મસ્તિજ્ઝમાં બધો કાર્યક્રમ પૂર્ણ થતાં શ્રીને નમસ્કાર કરીને નાના પોતાના મુકામે પાછા ફરવા નીકબ્યા, માધવરાવ પણ એમની સાથે જ હતા. તેમણે તરત જ નાનાને પૂછ્યું, ‘નાના ! બાબા ‘બનતાં બનતાં બનશો’ એમ બોલેલા તેમના શાખ્દોનો અર્થ મને જરા વધારે ચોખવટ કરીને સમજલવશો ?’ અર્થ સમજલવવા માટે નાનાનો જીવ ચાલતો ન હતો. માટે તેમણે વાત ટાળી દેવા માટે કોશિષ કરી, તેને કારણે માધવરાવના મનમાં શક વધારે મજબૂત થયો. પછી તે શાંત શાને બેસે ? તેથી નાના માધવરાવના આગ્રહને માન આપીને બોલ્યા અને પોતાનું મન પૂરેપુરુષ ખુલ્લું કરી નાંખ્યું. ત્યાં જે મસ્તિજ્ઝમાં બન્યું હતું તેનું વિસ્તારથી વર્ણન કરીને તેમના મનનું સમાધાન કર્યું. (ઓ. ૧૪૬-૧૬૭)

સાચેસાચ સાઈબાબા કેટલા કાબેલ હતા ? કોઈનું પણ ધ્યાન કર્યાંયે જય, બાબા જાતે અંત:કરણને ઓળખનારા હતા. તેમની નજરો સામે બધુંજ ચોખ્યુ હેખાતું. આવી નાની પણ આશ્ર્યકારક વાત સાંભળીને શ્રોતાઓને નવાઈ લાગશે. તેમાં રહેલો જે ગૂઢ અર્થ જેવા જઈએ તો ખૂબ જ મૂલ્યવાન સ્થિરતા અને ગંભીરતા જાણવા મળશે. મન ચંચળ છે. તેને તેની ઈચ્છા પ્રમાણે વર્તવા દેવું નહીં. ઈન્દ્રિયો જે બડકે તો શરીરને કે મનને અધીનું થવા દેવું નહીં. ઈન્દ્રિયોનો ભરોસો નથી હોતો. વિષય ભોગની લાલસા રાખવી નહીં. ધિરિધીર તેના અભ્યાસથી મનની અસ્વસ્થા શાંત થઈ જાય છે. ઈન્દ્રિયોને આધિન થવું નહીં. તે હંમેશા દબાઈને રહેતી નથી. યોગ્ય પ્રસંગ જેઠિને યોજના બદ્ધ એમનું નિયમન કરવું. રૂપ એ તો દશ્ટિનો વિષય છે. કોઈ પણ પ્રકારનું સૌંદર્ય ગભરાયા વગર જ નિહાળવું. ત્યાં શરમાવાનું કારણ શું ? ખરાબ વિચારોને મહાન આપવું નહિ. મનને વાસનારહિત કરીને ઈશ્વરની કૃતિનું નિરીક્ષણ કરવું જેથી વિષય ભોગની યાદે બુક્ઝાઈ જાય છે અને ઈન્દ્રિયોનું દમન આસાનીથી થઈ શકશે. રથને પોતાની ચોક્કસ જગ્યા ઉપર હંકવા માટે જેવી રીતે સારથી મૂળ કારણ હોય છે, તેવી જ રીતે આપણું હિત જેનારી આ બુદ્ધિ ઈન્દ્રિયોને કાબૂમાં રાખવા માટે સદાએ સાવધ રહે છે. સારથી જ રથને કાબૂમાં રાખે છે. બુદ્ધિ પણ ઈન્દ્રિયો પર દમન કરીને શરીરના ગેરશિસ્તબ્ધ્યા વર્તનને અને મનના અધિતિત એવા ચંચળપણાને લગામ નાખે છે. શરીર, ઈન્દ્રિયો અને મનની સાથે જે જવને તેના વિષયોનું બોગવવું પૂર્ણ થતાં તેને વૈષણવપદ પ્રાપ્ત થાય છે તેવું આ બુદ્ધિનું સામર્થ્ય છે. ઈન્દ્રિયોના સમૂહ પૈકી આંખો જે ઈન્દ્રિયોને, જુદા જુદા રથમાંના ઘોડાઓના સ્થાને જાણવી અને રૂપ, રસ વગેરે જે વિષયો હોય છે તે નરકમાં લઈ જનારા માર્ગો છે એમ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સમજવું. વિષય ભોગની થોડી પણ અભિલાષા પરમાર્થના સુખનો નાશ કરનારી છે. માટે તેનો સંપૂર્ણપણે ત્યાગ કરવાથી જ તમને મોક્ષની પ્રાપ્તિ થશે. બહારની ઠન્ડિઓ નિવૃત્ત હોવા છતાં અંતઃકરણ પર જે આસક્તિ હશે છતાં આ જન્મમરણના ફેરાનો અંત આવવાનો નથી. વિષય આસક્તિઓ અત્યંત નિરર્થક હોય છે. વિવેકી ડાખ્યો સારથી મળે તો જ તે વિવેકની વિચારપૂર્વક લગામ હાથમાં સંભાળી લઈને ઠન્ડિઓક્ષપી ઘોડાઓને સ્વપ્નમાં પણ જરાયે ગેરમાર્ગે ઢોડવા દેતો નથી. આવું મનને સમાધાન આપનાર નિશ્ચાલી, કાબેલ, કુશણ અને ચતુર સારથી સદ્બાળ્યે મળતાં વિષણુપદ દૂર કેવી રીતે રહી રહે ? કઠોપનિષદ અ. ૧ વલલી ઉ મંત્ર દમાં જણાવ્યું છે કે વિજ્ઞાન સારથિર્યસ્તુ મનઃ પ્રથહવાનનરઃ । સોડધ્વનઃ પારમાજ્ઞોતિ તદ્વિજ્ઞાપો: પરમં પદમ् ॥ જે મનુષ્યની વિવેકશીલ બુદ્ધિ સારથી હશે અને મનદ્વપી લગામને તાબામાં રાખનારી હશે તે સંસાર માર્ગ પાર કરીને શ્રીવિષણુનું સુપ્રસિદ્ધ શ્રેષ્ઠ પદ ગ્રાપ્ત કરશે. તે પદ એટલે જ સર્વવ્યાપી પરબ્રહ્મ પરમેશ્વર છે. એનું જ બીજું નામ અંતર્યામી વાસુદેવ છે. વાસનાદ્વાસુદેવસ્ય વાસિતં બુવનત્રયમ् । સર્વભૂતનિવાસોડસિ વાસુદેવ નમોડસ્તુ તે ॥ અને તે જ સર્વમાં ઉત્કૃષ્ટ આખરનું શ્રેષ્ઠ મોક્ષનું સ્થાન પરમધામ છે. (ઓ. ૧૬૮-૧૮૩)

હવે આ અધ્યાય પૂર્ણ થયો. આગળનો અધ્યાય આનાં કરતાં પણ વધારે મધુર હશે, અને ભક્તો માટે મનોરંજન પૂરું પાડનારો હશે. કમવાર જે કાંઈ આવશે તેમ તેને સાંભળતાં રહેજે. છીલ્સે જગતનો ચાલક અને બુદ્ધિનો પ્રેરક જે સદ્ગુરુ. તેના ચરણમાં આભારપૂર્વક આ હેમાડપંત પોતાનું મસ્તક અર્પણ કરી રહ્યા છે. (ઓ. ૧૮૪-૧૮૫)

સર્વેનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજ્જનોની પ્રેરણા પામેલા, ભક્ત હેમાડપંત રચિત

શ્રીસાઈસમર્થના સત્યચરિત્રનો ‘સંતપરિક્ષણ-મનોવિગ્રહ’ નામનો ઓગણપચાસમો અધ્યાય

અહીંથાં સમાપ્ત થાય છે.

શ્રી સદ્ગુરુ સાઈનાથને અર્પણ.



## અધ્યાય ૪૮નું અર્થ વિવરણ

આ અધ્યાયમાં હરિ કાન્હોબા અને સોમદેવજી સ્વામીની કથા સાંભળીને આપણને શ્રીસાઈનાથ મહારાજની મહાન ઉદાર મનસ્થિતિની કલ્પના આવે છે. આ બંનેને બાબા પ્રત્યે કોઈ ભક્તિ કે પ્રેમ ન હતો. ઉલ્લાની સાઈબાબા વિષે કોઈ ભળતી જ શંકા હતી. સોમદેવ સ્વામીને તો બાબા ઉપર ગુસ્સો હતો. છતાં ઉદાર મનના સાઈસમર્થે તેમને પણ ચમત્કાર બતાવીને પોતાના કરી લીધા. તેના પહેલાં પણ એક મૂર્તિપૂજનો વિરોધી અને નિરાકારનો ઉપાસક ગૃહસ્થ ફક્ત ગુણદોષોની પરખ ખાતર જ બાબાની સામે ગરદન નમાવીને નમસ્કાર ન કરવાની જુદે કાકા મહારાજની સાથે શિરડી આવેલો. પરંતુ તેને પણ તેના સ્વર્ગસ્થ પિતાના અવાજમાં યાદ અપાવીને અને મધુર ઉપદેશ કહીને બાબાએ એની શ્રદ્ધા પોતાની ઉપર બેસાડી હતી. તેવી જ રીતે કાકામહારાજનીના મુંબઠના શેઠ ઠક્કર ધરમસિંહ જેઠાભાઈને પણ સાઈના પ્રભાવની શોધમાં તેમની સામે ભસ્તક ન ઝૂકાવતા કે દક્ષિણા પણ નહીં આપવાના દઢ નિર્ધાર સાથે શિરડી આવ્યા હતા. પરંતુ તેમણે પણ બી સાથેની દ્રાક્ષોને બી વગરની કરીને બાબાએ પોતાને આધીન કરીને યોગ્ય ઉપદેશ આપીને તેમનું કલ્યાણ કર્યું હતું. નાશિકના ઢીલ્યુસ્ટ પવિત્રતા પાળનારા અશ્રિહેત્રી મૂળે શાળી શિરડી મુકામે શ્રીમંતુ બાપૂસાહેબ બુદ્ધીને મળવા માટે આવ્યા હતા. સાઈને મુસલમાન સમજુને તેમને દક્ષિણા આપવા માટે તેઓ ખચકાતા હતા. પોતાનું અશ્રિહેત્રીયનું તેમને ધારું જ અભિમાન હતું. પરંતુ તેમને પણ તેમના બ્રહ્મીભૂત ધોલપગુરુનું દર્શન કરાવીને મહારાજે તેમનો પોતાની ઉપરનો વિશ્વાસ દઢ કર્યો હતો. એકદ્વારા કોઈ પણ વ્યક્તિ, ગમે તે હેતુથી બાબાના દર્શને જય, તો બાબા તેના મનમાં પોતાની પ્રત્યે પ્રેમ અને દઢ શ્રદ્ધા પેદા કરીને તેને સારા માર્ગ ઉપર લાવીને કલ્યાણ જ કરતા હતા.

આ અધ્યાયના અંતે નાનાસાહેબ ચાંદોરકરની બુરખામાંની સ્ત્રીનો મોહક સુંદર ચહેરો જોઈને મોહિત થવા માટેની સંક્ષિપ્ત કથા જુઓ. વિષયભોગ એ કેટલા ધાતક હોય છે, તે શ્રીસાઈએ તેમની ચરિત્ર ગાથામાં ડેક ડેકાણે ભાર દઈને કહેલું છે.

શ્રીકૃષ્ણ ભગવાને પણ પવન જે પ્રમાણે નાવડીને ખેંચી જય છે તે જ પ્રમાણે ઈન્દ્રિયો વિષયોમાં રમતી હોવાને કારણે મન તેની પાછળ જય છે અને તે પુરુષની બુદ્ધિને ખેંચી લે છે એવું ગીતામાં કહીને વધારે આગળ ધોખા તરફ ઈશારે કર્યો છે.

વિષયોનું ચિંતન કરનારા પુરુષોમાં તે માટેની જ વિષયોની આસક્તિ ઉત્પત્ત થાય છે, તે આસક્તિમાંથી કોથ ઉત્પત્ત થાય છે. કોથથી મનમાં વિચારોનાં વભગો થાય છે, અને તેમાંથી સ્મૃતિભંશ થાય છે. અને સ્મૃતિભંશમાંથી બુદ્ધિનો વિચાર કરવાની શક્તિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થતાં સર્વનાશ થાય છે.

આમ જેતા વિષય ભોગ સંસારના, માનવીઓની શક્તિને ક્ષીણ કરી બુદ્ધિ નષ્ટ કરી નાખે છે અને સાથે સાથે પરમાર્થની ગતિ માટે મોટો મોટો અવરોધ પેદા કરે છે.

ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવનારને જ પરમાર્થનું અંતિમ દ્યેય કે પરમગતિ અથવા મોક્ષ કહેવાય છે. અને તે પ્રાપ્ત થાય છે.

કાચબો જેવી રીતે પોતાના અવયવો બધી બાજુએથી અંદર પોતાની પીઠની ઢાલ નીચે સરકાવી લે છે, તે જ પ્રમાણે જ્યારે આ મનુષ્ય પોતાની ઈન્દ્રિયોને તેના વિષયોથી આટોપી નથી લેતો ત્યાં સુધી એની બુદ્ધિ સ્થિર થતી નથી.

યોગ અભ્યાસ કરતાં કરતાં જ્યારે મન સાથે પાંચેય ઈન્દ્રિયો એકદમ સ્થિર થઈ જય છે અને બુદ્ધિ પણ કોઈ પણ જતની અયોગ્ય ચેષ્ટા કરવાનું અટકાવી હે છે. તે સ્થિતિને યોગની પરમ સ્થિતિ કહેવામાં આવે છે.

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

માટે ૪ વિષય બોગોથી નિવૃત્ત થવા માટે અને ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવવા માટે હેમાડપંતે બે ઉપાય શ્રીસાઈ સત્યચરિત્રમાં ઉમેર્યો છે.

(૧) પહેલો ઉપાય એટલે ઇન્દ્રિયોડ્વી ઘોડાઓને મનની લગામથી બુદ્ધિદ્વી સારથી દ્વારા કાબૂમાં રાખવા. આ માટેનું મૂળ કઠોપનિષદ્ધમાંનું સુંદર રૂપક એકવાર નહીં પણ ત્રણવાર કહીને આ ઉપાયનું મહત્વ મનમાં ઠસાવવા પ્રયત્ન કર્યો છે.

(૨) ઇન્દ્રિયો વિષયો વગર રહી શકતી નથી. માટે બીજી ઉપાયમાં એ બધી ઇન્દ્રિયોને હરિના અથવા તો ગુરુના શરણે લગાવી દેવાથી તે ધાતક ન થતાં કલ્યાણકારક થઈ જાય છે એવું કહ્યું છે.

પરંતુ સાઈએ આ બે કરતાં પણ સહેલા અને અચૂક ઉપાય એટલા સરળતાથી સમજાવીને કહ્યા છે તે જુઓ -

(૧) પહેલો ઉપાય અધ્યાય ૨૪માં હેમાડપંતની મશકરી કરીને લીલા વટાણા ઉપરથી બાબાએ બતાવ્યું છે જેમાં કોઈ પણ વિષયનું સેવન કરતી વખતે બીજી કોઈને પણ સહભાગી કરી લો. દાખલા તરફી પોતે કંઈક ખાતા હોય તો પાસે જે કોઈ ઊભું હોય તેને પહેલાં આપીને પછી આપણે પોતે ખાવા પ્રયત્ન કરવો. એટલે મતલબીપણું અથવા તો તેની તીવ્ર તૃણા આપોઆપ ઓછી થઈ જાય છે. કોઈ પાસે ન હોય તો સાઈબાબાનું સ્મરણા કરવું અને પહેલાં એમને અર્પણ કરવું જેથી ભોગવાય તેવા વિષયોની ઇચ્છાથી મન નિવૃત્ત થશે.

(૨) બીજે મહત્વનો અને એકદમ વાસ્તવિક ઉપાય આ અધ્યાયમાં નાનાસહેબ ચાંદોરકરની નજરની ચોરી પકડીને બાબાએ કહ્યું છે કે એ તો, ‘બનતાં બનતાં બનશે’ પ્રયત્ન કરવાથી આખરે ઇન્દ્રિયોને ધીરે ધીરે કાબૂમાં લાવી શકાય છે. મન ઉપર કાબૂ મેળવવા માટે શ્રીકૃષ્ણભગવાને પણ અર્જુનને ગીતામાં આ ૪ સંદેશો આપ્યો હતો.

હે મહાબાહો અર્જુન, આ મન ખૂબ ૪ ચંચળ છે. અને તેને વાળાંનું પણ ખૂબ ૪ અધું છે. પણ હે કુંતિ પુત્ર, અભ્યાસથી અને વૈરાય દ્વારા તેને જીતી શકાય. માત્ર ઇન્દ્રિયો ઉપર વિશ્વાસ ન રાખતાં સહાય સાવધ રહેવું જોઈએ. નહીં તો તેમાં ગમે ત્યારે એકદમ ઉછાળો આવે છે. મુખ્ય વાત એ કે વિષયોના સેવન કરતી વખતે મનમાં પાપ દશ્ચ અથવા તો દુર્વાસના ન હોવી જોઈએ. બ્રહ્મદેવે ઉત્પન્ન કરેલી દરેક સુંદર અને મનોહર વસ્તુ જેવા માટે અથવા તો ઇશ્વર કૃપાથી અને દૈવ્યવશ થઈને મળેલા વિષયભોગો પણ, શુદ્ધ મનથી અને તેમાં આસક્ત ન થતાં ભોગવામાં કોઈ પણ જીતની હરકત નથી.

રાગ દ્રેષ રહિત અને પોતાને સ્વાધીન હોય તેવી ઇન્દ્રિયોના વિષયમાં વર્તીને પણ એટલે કે વિષયભોગ ભોગવીને પણ આત્મસંયમી પુરુષ પ્રસન્ન રહે છે.

સારાંશ એ કે આ અધ્યાયમાં બુરાખામાંની સ્ત્રીના સુંદર ચહેરા અંગેની આ માત્ર તે ઓવીઓની સંક્ષિપ્ત કથા એટલે જાળો કે એક સાઈઉપદેશનો ઉત્તમ નમૂનો છે. કેટલું ગણ અને ઉપયોગી તત્ત્વ, પરંતુ કેટલી સરળ ભાષામાં હસ્તાં હસ્તાં સહેલાઠથી મહારાજે તેને સમજાવ્યું છે !



## ॥ અદ્યાય ૫૦ ॥

### અજ્ઞાન નિરસન

(અજ્ઞાન એટલે અવિદ્યા, માયા અથવા બ્રમ્યુક્ત જ્ઞાનનો નાશ કરવો.)

શ્રી ગણેશજીને વંદન, શ્રી સરસ્વતીને વંદન, શ્રી ગુરુ મહારાજને વંદન, શ્રી કુળદેવતાને વંદન,

શ્રી સીતામાતા અને શ્રી રામચંદ્રજીને વંદન અને શ્રી સદગુરુ સાઈનાથ મહારાજને વંદન.

જન્મ આપનારાં મા-બાપના ઉપકારોનો કોઈ અંત નથી. તેમણે જ મને આ માનવ દેહ આપ્યો. માઝું નસીબ કે તેમના પેટે આંતરડામાં પહેલાં જંતુઓની જેમ હું જન્મ્યો નહીં કે માતાના ઉદ્ઘરને છાજે એવો કે છણે એવો આંધળો, પાંગળો, કાંણો, મૂળો કે બહેરો જન્મ્યો નહીં. હું સંપૂર્ણપણે હષ્ટપુષ્ટ જન્મ્યો. ઉત્તમ બ્રાહ્મણવાર્ષમાં કે જ્યાં દેવો પણ કેના પગમાં શિશ નમાવે છે ત્યાં ઈશ્વર કૃપાથી મારો જન્મ થયો અને હું પૂર્ણ ભાગ્યશાળી પેદા થયો. દેરેક જન્મોમાં જન્મ લેતાં લેતાં કંઈ કોઈ માતા-પિતા થયાં હશે. પરંતુ આ જન્મ મરણના ફેરા ચૂકવનારા માતા-પિતાની મુલાકાત થવી તે અત્યંત કરીન છે. જન્મ આપનાર તો આખરે બાપ જ છે જે બીજે સંસ્કાર સિંહિને જનોઈ દઈને ગાયત્રીમંત્રનું દાન કરીને વિવિપૂર્વક મોટો કરનાર છે. ત્રીજે સંસ્કાર અન્ન આપીને પાતનપોષણ કરનાર પિતા જ છે. ચોથો સંસ્કાર ભય અને સંકટોમાંથી છોડવનાર પણ બાપ જ છે. આખાયે વિશ્વમાં આ રીતે સંસ્કાર દેનારા બધા સરખા જ મહત્વના છે. પરંતુ કૃપાળું સદગુરુ સિવાય ખરો બાપ અન્ય કોઈ પણ નથી. તેમની આશ્રમ્યકારક કુનેહ તો જુઓ ! માતાના ગર્ભાશયમાં વીર્ય મુક્નારો અને યોનીમાર્ગે જન્મ અપાવે છે તે તો આ લોકનો સામાજિક વ્યવહાર પુરતો પિતા છે. પરંતુ સદગુરુ તો અસામાન્ય પિતા છે. તે નીચે યોની માર્ગ વીના તેમજ વીર્યનું એક ટપકું પણ ન ખર્યતાં પોતાના બાળકને જન્મ આપીને તેની ઉપર પોતાની સંપૂર્ણ કૃપા ઉતારે છે. તે જન્મ મરણના ફેરા નાખું કરનારા, અતિશય દ્વારા કરનારા, જ્ઞાનનો પ્રકારા પાડનારા અને વેદાંતના ગૂઢ જ્ઞાનનું રહસ્ય સમજલવીને કહેનાર કે જે સર્વત્ર વ્યાપેલા ગુરુ શ્રેષ્ઠ છે તેમને મારા કોઈ કોઈ નમસ્કાર કરજો. હે સંસારધી અંધારાના સૂર્ય, આત્માનુભવ પામેલા સંતોના શિરોમણિ એવા ભક્તોને ચિત્તદૂષી ચકોરના ચંદ્ર અને શ્રેષ્ઠ કલ્પવૃક્ષ જેવા ગુરુર્વિદ્ય ! તને મારા કોઈ કોઈ વંદન કરજો. ગુરુમહારાજનો મહિમા અમર્યાદિત અને અગાધ છે. જેનું વર્ણન કરતાં કરતાં વાળીનું અભિમાન ઓગળી જય છે અને શબ્દો પણ ખૂટી જય છે. માટે જ ગુરુચરણમાં શીશ નમાવીને એક મુંગાની માફક ચૂપચાપ બેસી રહેવામાં જ ફાયદો છે. પૂર્વજન્મનાં ખૂબ મોટાં તપ કર્યા વીના આ જન્મે કોઈને પણ, ત્રણેય મોટા તાપેનો નાશ કરનાર એવી સંત વિભૂતિનાં દર્શન થતાં નથી. પરમાર્થ, મોક્ષ અને પોતાનું કલ્યાણ સાધવાની જેમની અંતિમ ઈચ્છા છે, તેમણે સંતોને જ આધીન થયું. તેવાને જરાય ઉણાપ રહેતી નથી. ધન્ય ધન્ય છે એ સંતસમાગમને જેના મહત્વનું શું વર્ણન કરી શકાય ? ત્યાં જ સદ્ગુરુનો વિવેક, વૈરાગ્ય અને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. સંતોનો મહિમા અને સત્સંગનું માહાત્મ્ય, શ્રીસાઈ સત્યરિત્રમાં આના પહેલાં પણ અનેક ડેકાણે વર્ણવવામાં આવ્યું છે. (ઓ. ૧-૧૪)

શ્રી સાઈબાબા મૂર્તિમંત માત્ર શુદ્ધ ચૈતન્યરૂપ હતા. પોતે અવ્યક્ત હોવા છતાં વ્યક્ત થયા હતા. તે વિષયોમાં જરા પણ ગુંચવાયેલા ન હતા એવી, તેમની સ્થિતિ કેવી હતી એ નિશ્ચિતપણે કોણ કહી શકે તેમ છે ? ભાવાર્થી ભક્તો અને પ્રેમાણ શ્રોતાઓ માટે તેઓ પરમ કૃપાળું હતા. પોતાનું આ ચરિત્ર પણ એમને જલ્દે જ પ્રેમથી અને રસપૂર્વક કહ્યું છે, અને

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

મારી મારફતે લખાવ્યું છે. શ્રીસાઈનાથ મહારાજનું ચરિત્ર એટલે તે અભનું એક મંદિર જ છે. આ ચરિત્રદ્વારી ગ્રંથના મંદિરમાં તેમનો કાયમનો વાસ છે. તેમનો વરહ હસ્ત એકવાર માથા ઉપર મૂકાય કે અહંકારનો ચૂરેચૂરો થઈ જાય છે. અને ‘સોડહું’ આ જપનો મનમાં જ્યથદ્વનિ ચાલુ થાય છે. આ જગતમાં દિનિને ન પહનાર દેરેક બીજ પણ આનંદમય ભાસવા માંડે છે. મારા જેવા પામરને તેમની કીર્તિના વખાણ કરવાની શક્તિ પણ ક્યાંથી હોય? મહારાજે પોતે જ ભક્તોના પ્રેમને ખાતર ફૂપાવંત થઈને આ પોથી પ્રગટ કરાવી છે. આ સાઠ ચરણોમાં હું દંડવત્ પ્રણામ કરું છું, શ્રોતાઓનું પણ અભિવાદન કરું છું, સાધુ અને સંતમહાત્માને નમસ્કાર કરું છું અને દેરેકને પ્રેમપૂર્વક આવિંગન આપું છું. શ્રી સાઈસમર્થ પોતાની સાધારણ લીલાઓથી સંપૂર્ણ નીતિનિયમોની અને સહાચારની વાતો કહેતા હતા. તેમનું શાંતિ એ હંમેશાનું ભૂષણ હતું. મોટા સત્પુરુષો અને મહાનુભાવો પણ તેમનું ધ્યાન ધરતા હતા અને આજરોજ પણ કરી રહ્યા છે. મહારાજને સૂર્યની પણ ઉપમા આપી શકાય તેમ નથી કરણ કે તે પણ અમુક સમય પછી અસ્ત થાય છે. ચંદ્રની ઉપમા આપીએ તો તેનો પણ દિવસે દિવસે ક્ષય થતો જાય છે. જ્યારે સાઈમહારાજ તો સમર્થ છે અને સહાને માટે તેઓ તો સંપૂર્ણ જ હતા, અને આજે પણ પરિપૂર્ણ અને સંપૂર્ણ જ છે. તેમનાં ચરણોમાં હેમાદપંત નમ્ર થઈને પ્રેમથી શ્રોતાઓને વિનંતી કરી રહ્યા છે કે આ કથા શ્રદ્ધાથી અને બરાબર મન પરોવી અને ધ્યાન દીને સાંભળશો. જમીન ઉત્તમ રીતે ખેડીને તેમાં બીજ વાવીને રોપવામાં આવ્યું હોય છીતાં તમારી દ્વારાધી વર્ષા થયા વીના ખેતી શકાય છે ખરી? સંતકથાનું શ્રવણ થતાં જ પાપી વાતો નાખુદ થઈને પુણ્યનો ઉદ્ઘય થાય છે. આવી, પુણ્યશાળી સંધીનો લાભ ઉઠાવીએ. (ઓ. ૧૫-૨૪)

અમને ‘સાલોક્ય’ એટલે કે ઈષ્ટદેવતાના લોકમાં પ્રજનની માફક રહેવા મળવું તે ‘સામિષ્ય’ અર્થાત્ ઈષ્ટદેવના સાંનિધ્યમાં સેવકદ્વારે સતત રહેવા મળવું તે અને ‘સારુષ્ય’ અર્થાત્ ઈષ્ટ દેવતા જેવું રૂપ પ્રાપ્ત થવું તથા ‘સાયુજ્ય’ એટલે ઈષ્ટદેવતાની સાથે એકરૂપ થવું આ ચારેય મુક્તિની સ્થિતિ ઉપર આસક્તિ નથી. સાઈસમર્થમાં અમારી નિશ્ચલ ભક્તિ સ્થાપિત થાઓ તે જ અમારે માટે પરમશ્રેષ્ઠ પ્રાપ્તિ છે. અમે સંસારના બંધનોમાં જરા પણ ગુંચવાયેતા નથી, તો પછી મુક્તિને અને અમારે શું સંબંધ છે? અમારામાં સંત પ્રત્યેની ભક્તિ જગૃત થાઓ કે જેને લીધે અમારું અંત:કરણ શુદ્ધ થાય. જ્યાં હું અને તું પણાની યાદ ન રહે અને જે સહજસ્થિતિ અને ‘અભેદ ભક્તિ’ અમને જેઠાએ છે અમે તો માત્ર સાઈનાથ પાસેથી તેની માંગળી કરીએ છીએ. હવે શ્રોતાઓને એક જ વિનંતી છે કે, આ ગ્રંથ વાંચવા માટે હથમાં લેતી વખતે ‘વાંચ્ય’: વાંચવાનો વિષય, ‘વાંચન’ : વાંચવાની કૃતિ અને ‘વાંચક’ : વાંચવાલાની વ્યક્તિની એકરૂપતાવાળી સ્થિતિ હોવી જરૂરી છે. હેમાદપંતને છોડી દેવા કરણે કે આ સત્યચરિત્રના તેઓ કર્તા નથી. ભક્તોના કલ્યાણ પૂરતા જ તેઓ તો માત્ર એક નિમિત્ત છે. ઈશ્વરફૂપાથી મળેલાં મોતીના છીપલાં જે ફૂકી દે છે, તેમના હાથમાં આવેલાં મોતી જતાં કરવા પડે છે. પવિત્ર માનેલા પીપળાના વૃક્ષની ઉત્પત્તિ સાથે આપણે શું સંબંધ છે? ‘કાકાવિજેમાલ પિંપળ’ કાગડાના મળોત્સર્ગમાંથી પણ જે પીપળાની ઉત્પત્તિ થઈ હોય તેમ છીતાં તેને અપવિત્ર માનીને છોડી દેતા નહીં. પોતાના કલ્યાણાર્થી માણસે કયારેય ઉદાસીનતા કેળવવી નહીં. અહીંયા શબ્દ માત્ર બોલાવનાર શ્રી સાઈબાબા સિવાય બીજું કોઈ નથી. તેઓ પોતે જ ‘શ્રાવ્ય’ એટલે કે સાંભળવાનો વિષય ‘શ્રવણ’ અર્થાત્ સાંભળવાની ક્રિયા અને ‘શ્રોતા’ અર્થાત્ સાંભળનાર વ્યક્તિ છે, આ એકરૂપતા ઓછી થવા દેતા નહીં. જ્યાં સાંભળવા માટે ડોક ઉપરના કાન તૈયાર નથી કે વૃત્તિ એકાગ્ર નથી તેને વાંચન જ ન કહેવાય. પછી ત્યાં શબ્દોના અર્થને કોણ ઓળખશો? આ કથા સાંભળતી વખતે શ્રોતામાં અહંકાર ન હોવો જેઠાએ. શ્રોતાઓ પોતે જ સાઈસ્વરૂપ છે, એવી હૃદયમાં ભાવના રાખવી જેઠાએ. તેમણે અખંડ એકાત્મ થઈને રહેવું જેઠાએ. તો જ તે શ્રવણની સાર્થકતા છે. પાણી ઉપરના મોઝાં જેમ પાણીમાં જ ઓસરી જાય છે તેમ ઈન્દ્રિયોની બધી જ પ્રવૃત્તિઓ પણ નિશ્ચિતપણે સાઈસ્વરૂપ જ થઈ જશે ત્યારે જ

## શ્રી સાઈનું સત્ય ચિહ્ન

જ્ઞાની જનોને પરમાર્थનો ઉપદેશ, તેનો વિનોદજન્ય આનંદ અને કાવ્યના રસનું ગૃહણ કરી જાણારને આ ગ્રંથમાં કવિતાઙ્ક્રી જુદી જુદી છંદોબદ્ધ કાવ્ય રચનાઓનો આનંદ મળશે. (ઓ. ૨૫-૩૫)

આ સત્ય ચિહ્નમાં પહેલા છદ્માં અધ્યાત્મમાં પોતાના એક ઉત્તમ ભક્તને સમર્થ શ્રીસાઈબાબાએ જે ઉપદેશ કર્યો તેનું વર્ણન થયું. તે ભક્ત બાબાની પાસે જ્યારે હતા તે સમયે તેઓ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાત્મનું આસ્તંભથી વાંચન કરી રહ્યા હતાં. તેઓએ હાથે બાબાના પગ દ્વારાવતા હતા અને બીજુ બાજુ તેનો ધીરે ધીરે પાઠ કરતા હતા. આમ બોલતાં ઉત્તમો શ્લોકપૂર્ણ થયો અને ઉત્તમો શ્લોક બોલવાનું શક્ય કરવાના હતા. તેઓ અકાશ મને બોલી રહ્યા હતા, પણ લોકોને સમજન્ય નહીં, તો તેનો શો અર્થ કે ઉપયોગ ? માટે ઉત્તમો શ્લોક બોલવા જતા હતા ત્યાં જ બાબાના મનમાં આવ્યું કે હવે મારા ઉત્તમ ભક્ત ઉપર અનુગ્રહ થયો જોઈએ. તેને સન્માર્ગ વાળાઓ જોઈએ. એ ભક્તનું નામ નાનાસાહેબ ચાંદોરકર હતું. તેમને બાબા બોલ્યા, ‘નાના મનમાં ને મનમાં શું ગણગણે છે ! સ્પષ્ટ ઉચ્ચાર કરીને બોલ. ક્યારનો હું જોઈ રહ્યો છું કે હવે કાંઈ ગણગણી રહ્યો છે, પણ ખુલ્લા મને મોટેથી બોલ. તેમાં આટલું ગુપ્ત શું રાખવા જેવું છે ?’ તે સાંભળીને નાનાસાહેબે ખુલાસો કર્યો કે, ‘હું ગીતાનો પાઠ કરી રહ્યો છું. બીજાઓને તકલીફ થાય નહીં માટે મનમાં ને મનમાં ધીમેથી બોલી રહ્યો છું.’ તે સાંભળીને બાબા બોલ્યા, ‘એ તો પારકાની વાત થઈ. પણ મારે માટે તો મોટેથી બોલ. મને તો સમજવા હેડે, તને એનો અર્થ સમજન્ય છે કે નહીં.’ પછી નાનાએ પ્રણામ કરી, ‘તદ્વિક્ષિ પ્રણિપોતન’ આ શ્લોક મોટા અવાજે ગાયો. તે સાંભળીને મહારાજને સંતોષ થયો. પછી આ શ્લોકનો અર્થ પૂછવામાં આવતાં નાનાએ પહેલાંના આચાર્યોએ કહ્યા પ્રમાણેનો ભાવાર્થ સાર સહિત કહી સંભળાવ્યો. તે સાંભળતા બાબાએ પોતાનું માથું ધૂળાવ્યું અને ‘ખૂબ સરસ’ બોલ્યા. ફરી પ્રક્રિયાએ, ‘નાના ! ઉપદેશ્યંતિ તે જ્ઞાનં’ આ તીવ્ઝું ચરણ ધ્યાનથી જો અને એનું મનન કર. એમાંનો ‘તે’ આ અક્ષર પછી ‘અ’ કાર અર્થનો અવગ્રહ (‘અ’ નો લોપ બતાવનારો ‘ડ’ એવું ચિહ્ન) નાખવાથી થનારો ‘અજ્ઞાન’ આ શબ્દને કારણે તેનો ઢઢ અર્થ ઉલ્લો થઈ જય છે કે નહીં તે જે. શંકરાનંદ, જાનેશ્વર, આનંદગિરી, શ્રીધર, મધુસુહન વગેરેએ જે જ્ઞાનપૂર્વ અર્થ કર્યો છે તે બધાને માન્ય છે તેની મને ખબર છે. પરંતુ અવગ્રહ નાખવાથી પેહા થતી ગમ્ભતને લીધે જાણી જોઈને આપણે વર્થ શા માટે મૂગા રહેવું ?’ આમ કહીને કૃપાઙ્ક્રી મેઘ જેવા સાઈબાબાએ ભક્તઙ્ક્રી ચકોર અથવા તો ચાતક પક્ષી માટે જે બોધઙ્ક્રી અમૃત કણિકાઓનો વર્ષાવ કર્યો તેનું વર્ણન પહેલાં આપે જોયેલું છે. પરંતુ આ ‘સાઈલીલા’ માસિકના બધા જ વાંચકોએ આ અર્થનું ડીતુક સમજયું નહીં અને અમુક લોકોને એ અર્થ વિષેની શંકા રહી ગઈ. તે આશ્રય નથી ? એમનું જેવી રીતે સમાધાન કરાવી શકાય એવા, ‘અજ્ઞાન’ શબ્દના અર્થની છણાવટ માટે વધારે એક નાનો સરખો પ્રયત્ન હું કરી જોઉં છું. અમુક લોકોને એવી શંકા થશે કે બાબાને સંસ્કૃત ભાષાનું જ્ઞાન ક્યાંથી ? પરંતુ એ શંકાનું ખરું કારણ તો કંઈક જુદું જ હોવું જોઈએ. કારણ સંતોષી કંઈ પણ અજ્ઞાત કે શ્વરું હોતું નથી. અરે, ‘એકેન જ્ઞાતેન સર્વ હિ વિજ્ઞાતં ભવતિ’ એક જ્ઞાનવાથી બધું જ્ઞાનાઈ આવે છે. આ વેણું વચન કોને માન્ય નથી ? સાઈ મહારાજને બધી જ વાતોનું પ્રત્યક્ષ રૂપે જ્ઞાન હતું. હથેળી ઉપર મૂકેલું આમળું જેમ ચોપણું દેખાય છે, તેવું જેને સંપૂર્ણ વિશ્વ દેખાતું હોય અને જેમના હિસાબે સૂર્ય પણ પ્રકાશતો હોય એવા સંતપુરુષને તેની ખબર ન હોઈ શકે એવું બને કે ? જેમને આવું સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં અજ્ઞાન કેવી રીતે રહી શકે ? તેમને સર્વ વિદ્યાઓ પચાવેલી હોય, તો પછી ત્યાં સંસ્કૃત ભાષાની તો શી વિસાત ? એની જ્ઞાનકારી તો તેમને સહેલાઈથી હોય જ. (ઓ. ૩૬-૪૭)

આ સાઈલીલા માસિકના અમુક વાંચકો કહે છે કે ‘નાનાસાહેબ અપ્રમાણિક અને અવિશ્વસનીય છે. તેમણે પોતાના મનથી ઉપજન્યેલ કારણ વગરનો ‘અજ્ઞાન’ દર્શાવનારો અવગ્રહ છે. એમણે જ આ અવગ્રહ જેઠે સંબંધતી અજ્ઞાનના પ્રકરણનો ઢોંગ કર્યો છે અને વગર કામનો પોતાના જ્ઞાનને દર્શાવવા માટે આ નિર્થક વાદ ઊભો કર્યો છે. મૂળમાં જ ન હોય

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

તેવો અવગ્રહ પ્રસ્થાપિત કરીને, ‘જ્ઞાન શબ્દની જગ્યાએ, ‘અજ્ઞાન’ શબ્દ તેઓ વાપરી રહ્યા છે, અને ગીતાનો કોઈ ભણતો જ અર્થ કરી રહ્યા છે.’ પરંતુ વસ્તુસ્થિતિ જેઠને અને મનમાં જીણવટભયો વિચાર કરતાં તો શ્રીસાઈલીલા માસિકના છદ્દના અધ્યાયના નિવેદનમાં કંઈ પણ અર્થાહીન લાગતું નથી. કોઈનો કેવો મત હોય અથવા નાનાસાહેબ પ્રમાણિક હોય કે અપ્રમાણિક જે હોય તે પરંતુ તેમણે જે કંઈ કહ્યું છે તે વાતને વગર કામનો બબડાટ કહેવો યોગ્ય નથી. વાંચકોએ નાનાસાહેબ માટેનો દ્રેષ છોડી દેવો જેઠાએ. અને વિકારોને વશ ન થતાં દણિનો દોષ દૂર કરવો જેઠાએ. જેથી નાનાનું સંપૂર્ણ નિઝપતપણું દેખાશે. ઉત્તમમાં ઉત્તમ સાઈલીલા માસિક અને તેમાં પણ છદ્દમો અધ્યાય વાંચ્યા વીના આ પચાસમાં અધ્યાયમાં સહજપણે આગળ જતાં ફાયવાનું નથી. કૃષ્ણાના મુખેથી પ્રગટ થયેલી ભગવદ્ ગીતાના ‘જ્ઞાનયજ્ઞ’ વિષે ચોથા અધ્યાયના ઉચ્ચમાં શ્લોકનું ‘અજ્ઞાન’ વિષય ઉપરનું આ પ્રવચન થયું.

તદ્વિક્ષિ પ્રણિપાતેન પરિપ્રેન સેવયા ।

ઉપદેશ્યંતિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્વવદર્શિનઃ ॥ (અ, ૪ શ્લોક ૩૪)

આ ગીતાનો મૂળ શ્લોક. એમાનું ત્રીજું ચરણ જુઓ. ‘જ્ઞાન’ પદની પહેલાં એક અવગ્રહ-૫ જે નાખવામાં આવે તો તે ‘અજ્ઞાન’ એવું પદ રચાશે. મનમાં જે કોઈપણ પ્રકારનો પૂર્વગ્રહ રાખીએ નહિ તો ‘જ્ઞાન’, આ પદ નિઃસંદેહપણે થાય છે. એની વિરુદ્ધ કોઈનો પણ દુરાગ્રહ નથી, અને તે અર્થ બધી જ જગ્યાએ માન્ય છે. ‘જ્ઞાનદેવ તુ કૈવલ્યમ्’ જ્ઞાનને કારણે જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ શ્રુતિનું વચન સર્વત્ર માન્ય છે. તે પણ તત્ત્વજ્ઞાનીએ જ્ઞાનનો જ ઉપદેશ કરવો જેઠાએ, એવા કોઈ પણ બંધનોની આવશ્યકતા નથી. (ઓ. ૪૮-૬૬)

હું આત્મા કેવળ સાક્ષી છું ફક્ત કર્મ જેનાર છું કરનાર નહિ અને નિર્મળ અને શુદ્ધ હોઈને સર્વ કંઈ જાણનાર છું. હું સહાયે મુક્ત છું. સર્વ પ્રાણીમાત્રમાં રહેલું શુદ્ધ ચૈતન્ય એ પણ હું જ છું. ક્યારેય ન ભૂતનારો હોવાને કારણે હું અદ્વિતી મતના આનંદથી પરિપૂર્ણ છું. પણ હું અજ્ઞાન નથી કે અજ્ઞાની કાર્ય પણ મારું નથી. ‘અયમાત્મા બ્રહ્મ’ આ આત્મા બ્રહ્મ છે. આ અથર્વવેદના મહાવાક્યનું આત્મા એ હું જ છું અને ‘પ્રજ્ઞાનમાનંદ’ જ્ઞાન એટલે જ આનંદ છે આ ઋગ્વેદનું મહાવાક્યનું નિદાન હું જ છું તે જણા. ‘અહંબ્રહ્યાસ્મિ’ હું જ બ્રહ્મ છું આ યજુર્વેદના મહાવાક્યનું નિત્ય મનન એટલે આ વિદ્યા અને હું પાપી, અભાગી અને કમનસીબ એવી ભાવનાની ઉત્પત્તિ એટલે અવિદ્યા અથવા તો અજ્ઞાન છે. આ બંને વિદ્યા, અવિદ્યા = જ્ઞાન, અજ્ઞાન માયાની અનાદિ અને પુરાતન શક્તિઓ છે. એકના પગે આ જીવાત્માને બંધન મળે છે. અને બીજના પગે બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. નામ અને રૂપનો આ જે ભ્રમ છે, તે સમસ્ત માયાનાં ભ્રમનાં જ જળાં અથવા તો ગોટાળા હોય છે. આ માયા વર્ણન કરવા માટે ખૂબ જ અધરી છે, અને તેને પાર કરીને જવું એ તો એનાથી પણ વધારે અધરું છે. સર્વની માફક ગઈ માયા વીટણાઈ । અસદ્ય જેમ આંતરે ચઢે વળ । બાધ્ય રીતે પણ સર્વાંગે વળગીને । સમર્થ સંપૂર્ણ કોણ એને ટાળી શકે ॥ જે જે કાલ્પનિક પ્રેરણાઓ છે તે જ માયાનાં નિવાસ સ્થાનો છે. બંધન અને મુક્તિ આ બંને સ્થિતિઓ કલ્પનામાંથી જ ઉગમ પામે છે. (ઓ. ૭૦-૭૫)

‘જ્ઞાન એવ કૈવલ્યમ्’ જ્ઞાનને કારણે મોક્ષ પ્રાપ્ત થાય છે. આ સિદ્ધાંત એકદમ સાચો છે. પરંતુ પાપકર્મોનો જ્યાં સુધી નાશ થતો નથી ત્યાં સુધી જ્ઞાનનો ઉદ્દ્ય થવો શક્ય નથી. જેને શુદ્ધ જ્ઞાન થાય છે. તેની ઈચ્છા કે સંકલ્પ દૂર ભાગી જય છે. તેને માયાનું બંધન હોતું નથી, અને વિકારોનું પણ ત્યાં સ્થાન રહેતું નથી. શુક્રદેવજી જેવા મહર્ષિ વ્યાસના પુત્ર અને શિષ્ય પરમ જ્ઞાનીને પણ સંશયને કારણે પુષ્પ નુકશાન થતું હતું. સંશયને કારણે જ અજ્ઞાન પ્રગટ થાય છે, તે ગુરુકૃપા વીના દૂર કરી શકાતું નથી. જ્ઞાનમાં પણ સંશય ઉમેરાતાં જ્ઞાની પુરુષને પણ અભિમાન નુકશાન કરે છે. ઉત્તરી ગયેલા અને ખોટા થઈ ગયેલા દહીના એક ટીપાથી મોટા ભરેલા ઘડાનું દૂધ ફાટી જય છે અને બગડે છે. માટે, ‘અજ્ઞાન’ને પહેલાં સમજી લો. તેનું

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

નિવારણ થતાં જ મન શુદ્ધ થઈને નિર્દોષ આંતરિક જ્ઞાન પ્રગટ થાય છે અને અભેદ સમાધિ લાગે છે. (ઓ. ૭૬-૮૦)

જેનું ચિત્ત કાયમ દ્રવ્ય અને વૈભવ તરફ જ વળેલું હોય છે તથા જેનું મન વિષયોના સેવનમાં અતૃપ્ત હોય છે, અને જે પોતાની સ્ત્રી અને પુત્ર પુત્રીઓ તરફ મોહિત થયેલો અને અખંડ ચિંતામાં રહે છે, તે મનુષ્ય જ્ઞાની હોવા છતાં પોતાનું હિત જાણતો નથી, માટે જ્યાં સુધી મનુષ્ય ભક્તિહીન હોય છે ત્યાં સુધી તેનામાં રહેલું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું છે એમ જ સમજવું. આ આખો જીવંત પ્રાણીઓનો સમુદ્દ્રાય અજ્ઞાનનું ધેરાયેલો છે. આ અજ્ઞાનમાંથી મુક્ત થઈને જ્ઞાની થવું અને તે જ્ઞાનની પેલે પાર જવું તે જ નિર્શ્વિત બ્રહ્મદ્વય થવું એમ કહેવાય. અજ્ઞાન જતાં જ્ઞાન પ્રગટ થાય છે. જે ક્ષમા કરી જાણે છે તે જ ખરો જ્ઞાની છે. જ્યાં સુધી આ દેહમાંથી અભિમાન જતું નથી ત્યાં સુધી તે પ્રકૃતિ અથવા તો માયાને આદીન હોય છે. રામ, કૃષ્ણ વગેરે જે અવતારો થયા અને સનત, સનક જેવા જે શ્રેષ્ઠ જ્ઞાનીપુરુષો થઈ ગયા તેમની અજ્ઞાની પ્રકૃતિ-માયા-દાસીઓ છે. પણ બીજી બધા લોકોનું તે ભાન ભૂલાવે છે. પ્રાણીમાત્રના હૃદયમાં ઈશ્વર વસેલો હોવાને કારણો તેમને કોઈને પણ પોતાની આ સ્થિતિની જાણકારી હોતી નથી. એવી આ માયાની કલ્પના ન કરી શકાય તેવી આવરણની શક્તિ છે. ‘હું જ કર્તા અને હું જ ભોગવનાર’ આ ખોટું અભિમાન છોડ્યા વીના અને પેલા હૃદયસ્થળે શરણે ગયા વીના આપણને મુક્તિ મળતી નથી. નિત્ય અને અનિત્ય વસ્તુઓનું વિવેચન કરો. શ્રવણ, મનન અને સતત ગાઢ ચિંતન કરો અને શમ, દમ વગેરે છ નો સમુદ્દ્રાય (ષટક) સંપાદન કરો. જે આ પ્રમાણે છે. શમ, દમ, ઉપરાંત, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન ચતુષ્યમાંની ષડ સંપત્તિ. તો જ અજ્ઞાનનો નાશ થશે. આ જગત મારાથી બિજ્ઞ છે, હું તો મર્યાદિત અને પરિચિન્તન વહેંચાયેલો છું. હું એટલે આ દેહ એવો જે ભાવ છે તેને શુદ્ધ અજ્ઞાન કહી શકાય છે. (ઓ. ૮૧-૮૮)

જ્ઞાનનું પ્રતિપાદન કરનારા વેદાંત શાસ્ત્રોમાં, પરમ કૃપાળું ભાસ્યકાર અનુબંધ ચતુષ્યનું વિસ્તારપૂર્વક વર્ણન કરે છે. તેમાંના ‘અધિકારી’ ‘વિષય’ અને ‘સંબંધ’ એ ત્રણ અને ચોથું એટલે કે ‘પ્રયોજન’ અર્થાત્ તેનો હેતુ છે. આ પ્રયોજનનું વિવેચન થયું કે અજ્ઞાનના નાશનો માર્ગ સમજન્ય છે. જીવ અને બ્રહ્મ તે બંને એક જ છે. એ જ વેદાંતના મુખ્ય ‘વિષયો’ છે. આ ઔક્ય પ્રમેય અંતર્ગત જે અજ્ઞાનતા આવેલી છે, તેનો નાશ તેને જ ‘પ્રયોજન’ કહેવાય છે. અજ્ઞાનની નિવૃત્તિ થવી. અર્થાત્ સ્વસ્વરૂપની પ્રાપ્તિ થવી તેજ તેનો હેતુ છે. માટે અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિ કરીને અજ્ઞાનનો નાશ કરવાનું જરૂરી થઈ જાય છે. જેના બેનું નિરાકરણ થતું નથી. દૈતનો તે બેદ એટલે બ્રહ્મ અને સૂષ્ટિ અથવા તો જીવાત્મા અને પરમાત્મા એ જુદા છે એવો જે મત છે તેને જ્ઞાની કહી શકાય નહીં. દેહઅભિમાનવાળાને માટે જ્ઞાન એ જ અજ્ઞાન કહી શકાય. જ્ઞાની સમજને ફરે છે પરંતુ અજ્ઞાન અયોગ્ય અહિતકર કર્માનું આચરણ કરે છે. તેનું જગૃતપણું પણ નાશ પામેલું છે એમ કહી શકાય. એ તો સૂતેલો કુભકર્ણ જ કહેવાય. જેનું વેદોની વિરુદ્ધનું વર્તન છે, જે વર્ણ કે આશ્રમનો નિયમ પાળતો નથી, તેની ચિત્ત શુદ્ધિની સાધન અજ્ઞાનનો નાશ એ જ હોઇ શકે. સત્ત્વ, રજ, અને તમ આ ત્રિગુણાને હિસાબે, શષ્ઠ, સ્પર્શ, ઇપ, રસ અને ગંધ આ વિષયોના વિકારથી અને જનનેન્દ્રિય અને જીબ પાસેથી બ્રહ્મદેવ વગેરે પણ છેતરાઈ જાય છે. જગતનાં બધાં હાલતાં, ચાલતાં, બોલતાં પ્રાણી અનાદિ કાળના અજ્ઞાનથી અને માયાથી રંગાયેલાં છે. તે રાગદેશ વગેરે વિકારથી મોહિત થયેલાં છે. અને અજ્ઞાનથી ઘેરાયેલાં છે. આ જીવ પણ અજ્ઞાનથી બંધાયેલો છે. તેનું શુદ્ધ ઇપ પ્રગટ થવા માટે અજ્ઞાન, કામ અને કર્મનાં બધાં જ બંધનો તૂટવાં જેઠાં. ગાયના આંચળો દૂધથી તસતસ ભરેલા ગળતા હોય છે. ત્યારે તેની મીઠાસને કારણે નાનાં બારીક જીવાં ચોટી રહે છે. પણ તેમને લોહીની તરસ હોવાને લીધે તેમને દૂધની પરવા નથી હોતી. જુઓ ! દેહકો અને ભમરો આ બંનેને માટે, સુંદર કર્મ પુષ્પ એ ઘર સમાન છે. પરંતુ ભમરો કર્મની સુવાસિત પરાગમાં વિહાર કરે છે. જ્યારે દેહકો કર્મણંડી નીચે આવેલા કાદવમાં પોતાનો આહાર શોધે છે. જ્ઞાનનો દગ્લો સામે દેખાતો હોવા છતાં મૂર્ખાઓને અજ્ઞાન તરફનું જ બેંચાણ હોય છે. મૂર્ખાઓને અજ્ઞાન જ જ્ઞાન લાગતું હોય છે. તેની

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સામે જ્ઞાનનો પાઠ વાંચવાથી પણ કોઈ ફરક પડતો નથી કે ઉપયોગ થતો નથી. અજ્ઞાન નિર્મળ થતાં જ બ્રહ્મજ્ઞાન સ્વયં પ્રગટ થાય છે. માટે જ અજ્ઞાનને પહેલાં સમજ વિવેચન કર્યું આવશ્યક છે. (ઓ. ૬૦-૧૦૩)

આ બ્રહ્મજ્ઞાન જેવું પવિત્ર આ ત્રણે લોકમાં બીજું કાંઈ નથી. તેનો જ ઉપરેશ મહત્વનો છે, અને તેના વીના આ જીવન પણ વ્યર્થ છે. બુદ્ધિના પ્રયત્નોનો બ્રહ્મ એ જે વિષય હોત તો, એકાદ ઇન્દ્રિયે તો છે એવું દેખાડી દીધું હોત. ‘બુદ્ધિગ્યાદ્યમતીન્દ્રિયં’ ગીતા અ. ૬, ૨૫૦ક ૨૧ ઇન્દ્રિયોથી અગોચર, પણ બુદ્ધિને ગમ્ય એ વચન જુઓ. ગીતા એ બ્રહ્મને બુદ્ધિથી જાણવું શક્ય છે. એવું ભારપૂર્વક કહીને પણ વેદોને તે માન્ય નથી. બુદ્ધિનો જે અભાવ થાય તો તેને જે જાણવું છે તે જ નહિ હોય. પછી બ્રહ્મના અસ્તિત્વ ભાવને માનવા માટે કોઈ જગ્યા રહેતી નથી. જુઓ, ઇન્દ્રિયોથી જે સમજ શક્ય છે. તે જ અસ્તિત્વ ધરાવે છે, બાકી બીજાઓનું અસ્તિત્વ નથી એવું કહેવું જગ્યાનહેર છે. પણ જે એવું કહીએ તો પછી બ્રહ્મ ક્યારેય હોવું જ ન જેઠાએ એવો અર્થ નીકળે છે. કારણ કે એ ‘અતીદ્રિય’ એટલે ઇન્દ્રિયો ગોચર નથી હોતી, અને તેને કારણે બધો જ અનર્થ થાય છે. ખૂબ ઊંડાઝાથી વિચારપૂર્વક તારણ કાઢવાથી દશ્યિ કરેતા, પારંપરિક અર્થને લીધે બુદ્ધિ એ નિરંતર સદાએ ટકનારી છે. એ નહીં જેવી થઈ જય છીતાં એ ત્યાં અસ્તિત્વના અનુભવૃપે હાજર હોય છે. પરમાત્મા નિઃસંશય વિશ્વનું મૂળ છે. માટે જ કોઈ પણ વસ્તુ નાખૂં થયેતી દેખાય છે, છીતાં તેનું અસ્તિત્વ સહાય માટે રહેતું હોય છે. માટીના ઘડા ઉપર પથ્થર મારતાં તેના આકારનો નાશ થઈને ઘડાનાં ઢીકરાં થઈ જય છે. ઘડાનો આકાર જ રહેતો નથી. છીતાં એ ઘડાના ઢીકરાંઓ ઘડાનું અસ્તિત્વ જરૂરથી બતાવે છે. ઘડાના કાર્યનો નાશ છીતાં ઘડાના અસ્તિત્વનો નાશ થતો નથી. ઘડાના ટુકડા ઘડાના અસ્તિત્વના અખંડિતાનું કારણ બને છે. તેમના આકારોને કારણે તેમના કાર્યના અસ્તિત્વના અંશ તેમનામાં બાકી રહી જય છે. કોઈ પણ કાર્યના વિસર્જનનો અંત શૂન્યમાં પરિણમતો નથી. જય એ તો સહા અસ્તિત્વનિષ્ઠ હોય છે. જય થતાં તે વસ્તુનું અસ્તિત્વ સુફક્ષમપે કાયમ જ રહેતું હોય છે. તેનું પ્રમાણ એટલે સારી બુદ્ધિ અથવા તો સારી પ્રવૃત્તિ એ સત્યના અનુભવોમાં છુપાઈને બેઠેલી હોય છે. (ઓ. ૧૦૪-૧૧૩)

બધાં જ તીર્થો પવિત્ર હોય છે, પણ જ્ઞાન તો પવિત્રમાં પણ પવિત્ર છે. આ બ્રહ્મજ્ઞાન વગર ભજન પૂજન બધું જ વ્યર્થ હોય છે. અજ્ઞાનથી મહિન થયેતા ચિત્તનું શુદ્ધિકરણ ઇશ્વરની ભક્તિ વગર થતું નથી. અને ભક્તિ વીના જ્ઞાન ઉપજતું નથી. માટે પહેલાં અજ્ઞાનને સમજ લેવું અને તેની સ્પષ્ટ માહિતી અને વર્ણન સાંભળી લેવાથી તેનાં બંધનોમાંથી છૂટકારો થાય છે. ભક્તિ એ જ તેને જાણવા માટેનું સાધન છે. પગમાં જે આંખો હોય તો તે આંખોમાં અંજન લગાડતાં તેને જમીનમાં દાટેલું ધન દેખાય છે. તે પ્રમાણે ભક્તિનો આશ્રય કરતાં અજ્ઞાનનો નાશ થાય છે અને જ્ઞાનનો ઉદ્ઘાટન થાય છે. જ્ઞાન એટલે જ આત્મસ્વરૂપની પ્રાપ્તિ અને તેનું મૂળ કારણ અજ્ઞાનની નિવૃત્તિ જ હોઈ શકે. ઇશ્વરની ભક્તિ પ્રગટયા વીના માયાની શક્તિ પાર કરવી અશક્ય છે. જ્ઞાન અને અજ્ઞાનની ભેળસેળ હોય છે. તેમાંથી નાના પથ્થર, કચરો કાઢીને તેને સાફ કર્યા પછી ચોખાના દાણા ઉકળતા પાણીમાં નાખવામાં આવે છે ત્યારે તે ચેઢે માટે ચોખાના દાણા પહેલાં સાફ કરી લેવા જેઠાએ. સર્વત્ર અને પ્રાણીમાત્રમાં ઇશ્વર જ છે એવી ભાવનાથી જ્ઞાનય્ઝની ઉપાસના કરીને જે સર્વબ્યાપી શ્રીકૃષ્ણને જેઠાં શકે છે તે જ જ્ઞાન માટે અજ્ઞાનને બાળી નાખે છે. હવે આ જ્ઞાનમયનું સ્વરૂપ જુઓ. ‘અહું બ્રત્યાસ્મિ’ આ તેમાંનો પશુભલી બાંધવાનો સ્થંભ છે. પંચમહાભૂતોનો આ યજમંહપ છે. જીવ અને શિવ વર્ચ્યેનો લેદ એ જ આ પશુ છે. પાંચ ઇન્દ્રિયો, પાંચ પ્રાણ એ જ આ યજના ઉપચારોનું સાહિત્ય છે. મન અને બુદ્ધિના કુંડમાં અન્તિ પ્રજ્વલિત કરવામાં આવે છે. જીવ એ યજકર્તા યજમાન છે. તે જ અજ્ઞાનદ્વારી ધીની આહુતિ આપે છે. અને તેને લીધે આત્માનંદના રસમાં વિમગ્ન થઈને તે જીવને યજ પૂર્તિ પછીના અમૃત સનાનનો લાભ મળે છે. સારાંશ એ કે, અજ્ઞાનદ્વારી ધી વીના જ્ઞાનદ્વારી અન્તિ ક્યારેય પ્રગટો નથી અને જીવ અને શિવ વર્ચ્યેના બેદને પણ બાળીને એની એકરૂપતાનું સત્ય જ્ઞાન પ્રગટ થતું નથી. (ઓ. ૧૧૪-૧૨૪)

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

સ્વચ્છ આયનો જેવી રીતે ધૂળથી જાંખો થઈ જાય છે અને અત્રિનો પ્રકાશ પણ જેમ પેદા થયેલા ધુમાડાના ગોટાઓમાં ઘેરાયેલ રહે છે. તેવી જ રીતે કામ અને કોધને કરણે જ્ઞાન પણ અજ્ઞાનથી ઢંકાયેલું રહે છે. ચંદ્રના શીતલ પ્રકાશને જેવી રીતે રાહુ ગળી જાય છે અથવા શેવાળ જેવી રીતે પાણીને ઢાંકી હેઠળ તેવી જ રીતે સ્વયંપ્રકાશદ્વારા જ્ઞાનને આ માયા ઢાંકી હેઠળ. મોટા મોટા જ્ઞાનીઓની ભત્તિ ભ્રષ્ટ થઈને અધોગતિને પામે છે. જ્ઞાનીઓ ઉપાય જાણતા હોવા છતાં બચવા પામતા નથી અને મનમાં આવે તે પ્રમાણે વર્તે છે. વાનપ્રસ્થ ધારણ કરેલા લોકો ફરીથી ગૃહસ્થાશ્રમ તરફ વળે છે અને ન કરવાનું અચૂક કરે છે. જે વસ્તુથી પહેલાં ચીડ ચેડે છે તે જ વસ્તુઓ તરફ તેમની પસંદગી ઉત્તરે છે અને તેને સ્વીકારતા થઈ જાય છે. જે લોકો મહા પ્રયત્ને પાપોથી દૂર રહે છે તેવા જ હૈવ યોગથી પાપ આચરવા માટે પ્રવૃત્ત થાય છે. આવી સ્થિતિને શું કહી શકાય ? આ કાંઈ જ્ઞાનીજનોની જમાત કહી શકાય ? ભલેને મોટો જ્ઞાની માણસ હોય અને પાપની છાયાથી દૂર રહેતો હોય કે ઇચ્છા પણ કરતો ન હોય તેમ છતાં જેવી રીતે પતંગિયાં હીવાના પ્રકાશમાં અંજલિ જઈને ભૂલા પડે છે તેવી જ રીતે એક જ્ઞાની મનુષ્ય પણ સારાં નરસાં ફૂટ્યોને સમજજવાનું ભૂલી જાય છે. પાપ આચરવું તે સરાસર અજ્ઞાન છે તે પૂર્ણપણે જાણવા છતાં કામવાસના તેને ઉત્તેજિત કરે છે. તેની એ પરવા કરતો નથી. આ બધી ડિયાઓની જત એટલે માત્ર કામવાસનનાં જ કાર્યો છે. કામ એ સર્વ અનથોનું મૂળ કારણ છે, અને તેનું જ કોધમાં ઝ્રપાંતર થાય છે. કામવાસનાની પરિપૂર્ણતામાં જે અવરોધો પેદા થાય છે તે જ કોધદ્વારે પ્રગટ થાય છે. તેજ ડગલે ને પગલે મોક્ષ માટે વિરોધ પેદા કરે છે. જ્ઞાનનો અવરોધ કરનારી કે પ્રતિબંધક વૃત્તિ તે આ જ છે. જીવને કામકોધનો ત્રાસ કાયમનો ચોટીલો હોય છે. કામ કોધ પાણી વિના દૂબાડે છે, અતિન વિના બાળીને ખાખ કરી નાખે છે. શાસ્ત્રો વિના છેદી નાખે છે અને વગર દોરડે બાંધી હેઠળ તેમની સામે ભલભલા જ્ઞાનીઓ ટકી શકતા નથી. જ્ઞાનીજનો સાથે તો શરતમાં ઉત્તીર્ણે તેમને તે પરાભૂત કરી નાખે છે. તેમનામાં મહાપ્રલય રચવાનું પણ સામર્થ્ય છે. કામ, કોધ પ્રાણી માત્રને આણસાર આખ્યા વીના ગળી જાય છે. ચંદ્રનૃવૃક્ષની નીચે થડ પાસે જેમ કાળસર્પનો વસવાટ હોય છે, તેવી જ રીતે કામકોધની નાળ જ્ઞાનદ્વારી ગર્ભને બહારથી વીટળાયેલી છે. ઇન્દ્રિયો, બુદ્ધિ અને મન પણ તે કામવાસનામય હોય છે. એના યોગથી જીવનું જ્ઞાન ઢાંકીને પેલા જીવાત્માને તે પોતાના મોહમાં નાખે છે. જે તમને ખરેખર ચંદ્રન મેળવવું હોય તો આ કાળસર્પનો પ્રથમ નાશ કરો. કામકોધનું આવરણ દૂર કરીને જ્ઞાનનો ખજનો મેળવી લો. આ કાળસર્પનો નાશ કર્યા વીના કોને ચંદ્રન મળવાનું છે ? તેવી જ રીતે તમને પરબ્રહ્મ અને આત્મજ્ઞાન મળે તે માટે માયાનો પડ્દો દૂર કરવો તે જ એક સાધન છે. માટે સૌ પ્રથમ ઇન્દ્રિયોનું દમન કરવું જેઠાએ જેથી આપોઆપ કામકોધનો નાશ થશે. જીમ માત્ર કામકોધને આધીન હોય છે અને જ્ઞાનને અજ્ઞાનનું આવરણ હોય છે. કામ, કોધ અને લોભ એ ત્રણ નરકનાં દ્વારો છે જે આત્માનો નાશ કરનારા છે. માટે આ ત્રણેનો ત્યાગ કરવો. (ઓ. ૧૨૫-૧૪૩)

દેહ કરતાં ઇન્દ્રિયો સૂક્ષ્મ અને બળવાન છે. તેનાં કરતાં મન વધારે સૂક્ષ્મ છે. મન કરતાં વધારે બુદ્ધિ અતિસૂક્ષ્મ છે. અને બુદ્ધિ કરતાં પરમાત્મા બધામાં સૂક્ષ્મ છે. દ્રેક સંસાર ધર્મોની પેલેપાર આવેલું આ સર્વોચ્ચ પરમ સત્ય તે જ આ અત્યંત કલ્યાણકારી પરમાત્મા અને તે જ અમૃતમય સ્વરૂપ છે. શુદ્ધ, બુદ્ધ, નિત્ય અને મુક્ત એ જ તે અભેદ્ય સ્થિતિમાં આવેલું તત્ત્વ છે. તે જ પરમાનંદમાં ઉત્પત્ત થયેલું અંતર્યામી ચૈતન્ય છે. જેને પંચીકરણ એટલે કે પંચમહાભૂતોનાં તત્ત્વો પૃથ્વી, જળ, વાયુ, અતિન અને આકાશ દ્રેકનું પ્રમાણમાં મિશ્રણ કરવું તેને કહેવાય છે. તે જ માયાદ્વારનું દર્શન છે. અને તેને સમજજવા માટે અદ્યારોપ અને અપવાદ આ એક જ સાધન છે. પંચીકરણ થઈને ભેગા ન થયેલાં સૂક્ષ્મ પંચમહાભૂતોને પંચતન્માત્રા કહેવામાં આવે છે. તેમનું મુખ્ય કાર્ય, પ્રાણ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને આત્માના ‘સૂક્ષ્મ’ શરીરમાં દેહપણું લાવવું એમ થાય છે. પંચીકૃત પંચમહાભૂતોને જુઓ. ત્યાંથી જ વિરાટ નો ઉદ્દ્ય થાય છે. તે આત્માના વિશ્વબ્યાપી સ્થૂળ દેહને જ્ઞાનીઓ ‘વિરાટ’ એમ કહે છે. સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું કારણ તે કેવળ સ્વરૂપનું અજ્ઞાન હોય

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

છે. એ ભાસનારું અવ્યક્ત શરીર એટલે આત્માનું ‘કારણ’ શરીર છે. આ કારણ શરીર જેમાં ચૈતન્ય પ્રતિબિંબિત થયેલું હોય છે. અને તે માત્ર અજ્ઞાનને લીધે ઉત્પન્ન થયેલું છે. તેને જ અવ્યક્ત અથવા તો અવ્યક્ત એવું નામ આપવામાં આવ્યું છે. આત્માનું અજ્ઞાન તે જ આ માટે કારણભૂત હોય છે. અને તે અવયવો સિવાય નથી હોતું, અને અવયવો સાથે પણ નથી હોતું અથવા તો બંને સાથે નથી હોતાં. બ્રહ્મ અને આત્મા બંને એક જ છે. એવું જ્ઞાન થાય એટલે આ દેહનો નાશ થાય છે. સ્વસ્વરૂપે રહેવું તેને જ ‘મોક્ષ’ એ નામ આપવામાં આવ્યું છે. આ સિવાય બીજો કોઈ જ મોક્ષ નથી. (ઓ. ૧૪૪-૧૫૩)

ફક્ત બ્રહ્મ અને આત્મા આ બંનેની એકૃપતાનું જ્ઞાન થતાં અજ્ઞાનનું નિરાકરણ થાય છે, માટે જ અજ્ઞાનને સમજવા માટે તેનું વર્ણન આવશ્યક છે. અજ્ઞાનથી અસંખ્ય ભાગોમાં વહેંચાઈ જતા બ્રહ્મને બહુત્વ પ્રાપ્ત થયું. તેને ‘સત’ આ નામ આપવામાં આવ્યું, અને તેને હિસાબે એ એક ચર્ચાનો વિષય થઈ ગયો મૂળમાં એ ખરેખર ઇન્ડ્રિયો દ્વારા ગ્રહણ ન થનારો હતો. છતાં વાચાએ તેને ‘બુદ્ધિગ્રાહ્ય’ કર્યો. ત્યારે જ તે મનમાં સમાયો અને ઊંકારના આકારમાં સ્પષ્ટ થયો. આ ઊંકાર બ્રહ્મનાં ધ્યાન સાથે દુશ્ચરસું સ્મરણ કરતાં કરતાં જેનો દેહ દ્શ્રેષ્ઠ છે, તેનું જીવન સાર્થક થાય છે. ‘ઊં’ આ એકાક્ષર બ્રહ્મનો ઉચ્ચાર કરતાં અને સાથે સાથે મારું સ્મરણ કરતાં જે બ્યક્તિ આ દેહ છોડીને જય છે, તેને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. ઊંનો મોથી ઉચ્ચા થઈ શકતાં હોવાથી તે બ્રહ્મનું ઉચ્ચારણ છે. માટે ઊંકારમાંથી અવ્યક્તનો પ્રાદુર્ભાવ થાય છે. અવ્યક્તમાંથી મહત્વની ઉપજે છે અને તેને કારણે બુદ્ધિ સાથે અહંકાર ઉત્પન્ન થાય છે. અહંકારની જગ્યાએ પંચતન્માત્રા અને તેમાંથી પંચમહાભૂતો સમર્જન્ય છે. છેલ્દે આ પંચમહાભૂતો દ્વારા નિશ્ચિત રૂપે આ જગતની ઉત્પત્તિ થાય છે. અજ્ઞાન અને માયાનાં રૂપોનું દર્શન તે જ આ જગતના અસ્તિત્વનું લક્ષણ છે અને આ જ્ઞાનનું નિરાકરણ કરવા માટે અજ્ઞાનના જ વિવેચનની આવશ્યકતા રહે છે. અત્યંત વિશુદ્ધ અને નિર્મળ જે શુદ્ધ જ્ઞાન યુક્ત કેવળ સ્વરૂપ અને તેનાથી જુદું જે પુર્ખળ ભાગોમાં વહેંચાઈ ગયેલું સ્વરૂપ છે, તે બંનેને બેગાં કરી શકતાં નથી. બ્રહ્મ એ સ્વતંત્ર શક્તિ છે તે સાથે જ જ્ઞાનવા યોગ્ય છે. વાણીથી ઉચ્ચારતા બ્રહ્મ કરતાં અર્થાત્ ઊંકારથી તે જુદું જ છે. માટે અજ્ઞાનના પડાને ઉપદેશની શક્તિથી દૂર ખરેખરો જેઠીએ. ઉધતાં સ્વભન્માં, જગૃત આંખો સાથેનું મન આંખો ન હોવાં છતાં અભિલ બ્રહ્માંડને જેઠી શકે છે. આ બધાનું મુખ્ય કારણ અવિદ્યા અથવા તો અજ્ઞાન છે. ઘરું જેતાં વસ્તુ એક જ છે. પરંતુ તે અલગ ભાસે છે. દોરંડું સાપ જેવું લાગે છે, અને છિપલાંનાં પેટમાંની ચમક રૂપું હોય એવો ભાસ થાય છે. અરે ! ફક્ત સૂર્યનાં કિરણોને લોકો ‘મૃગજણ’ એવું કહે છે. આ એક માત્ર સ્પષ્ટ માયાનો ખેલ છે, અને ભલભલા જ્ઞાની માણસો પણ તેની સામે હૃતાશ થઈ જય છે. સળગતું લાકડું હાથમાં લઈને તેને ગોળગોળ ફરેવતાં તે જગ્યાએ અશ્કણોનું એક ચક નજરે પડે છે અને માયાની અફાઈ કરણી ધ્યાનમાં આવે છે. આમ જેવો જતાં ખરેખર તો તે અશ્નિ જ છે. અશ્નિના ચકનું તો ત્યાં સ્થાન જ નથી હોતું પરંતુ માયા અને મોહનો ફેલાવો ન હોય તેવો સંસાર ઉત્પન્ન કરે છે. આમ બુદ્ધિનો નિશ્ચય થતાં ભ્રમ, મનના ગોટાળા અને ગેરસમજ દૂર થાય છે, અને સંસારનો લય થાય છે. હું દેહ છું, મારી પત્ની, મારું ધર આ બધો વ્યર્થ પરિભ્રમ છે. પુત્ર પશુ આદિ તૃષ્ણાઓના પાશથી વશ થઈ જનારા જ્ઞાની અને પોતાને પંડિત કહેવઢાવનારાઓને સુખો લેશમાત્ર પ્રાપ્ત થતાં નથી. આપણે શાસ્ત્ર પ્રચીણ છીએ અને પ્રજ્ઞાવાન છીએ. આપણા જેવો જગતમાં જીને કોઈ નથી તેવું તેમના મનમાં મોહું અભિમાન હોય છે અને તેને લીધે જ તેઓ સહાને માટે સમાધાન વગરના રહી જય છે. તેને જ માયા કે અજ્ઞાન અથવા તો પ્રધાન પ્રકૃતિ કહેવામાં આવે છે. તેનું જ આરંભમાં જ્ઞાનીજનો દ્વારા નિરાકરણ કરવાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. (ઓ. ૧૫૪-૧૭૧)

જ્ઞાન તો જાતે જ વ્યક્ત થનારું સ્વયં પ્રકાશિત છે. તેને ઉપદેશ કરવો પડતો નથી. અજ્ઞાનનો નાશ થતાં જ જ્ઞાન આપોઆપ પોતાની મેળે જ સ્વૂર્તિથી પ્રગટ થાય છે. એકાંકું તેજ પુંજ રત્ન કોરી માટીમાં દટાઈ જય છે અને વર્ષોનાં વર્ષો સુધી એની યાદ પણ ભૂલાઈ જય છે. કોઈ સમયે સંયોગોથી તે હાથ લાગે છે, છતાં તેનું બધું તેજ પદ્ધતર માટીની સંગતમાં

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

ઉંડી ગયેલું દેખાય છે. પણ તેની ઉપરની માટી અને ખરાબી ઘરીને કાઢી નાખતાં. તેનો પહેલા જેવો જ ચળકાટ ફરીથી મેળવે છે. તેવી જ અવસ્થા સાચા જ્ઞાનની હોય છે. ઉપરની માટી અને કચરો એટલે જ પેલું અજ્ઞાન એને આ જ અજ્ઞાનથી જ્ઞાન ઢંગથેલું હોય છે. કચરો અને ઉપરની માટીનું સાફ્ફસુફ્ફ થતાં તે રત્ન સહજ રીતે ચળકી ઉઠ છે. નિત્ય અને અનિત્ય વસ્તુઓનો વિવેક તે પાપકર્મોનો નાશ કરનારો અને સત્ત્વશુદ્ધિ પ્રાપ્ત કરી આપનાર હોય છે. તે જ જ્ઞાન ઉત્પન્ન કરનાર છે. આ જગત એટલે જ માયાથી ભરેલું બજર છે અને ત્યાં નકલી અનેક છે. તેવી જ રીતે અસલ સમજને નકલી ખોટી વસ્તુઓ લેનારા ગ્રાહકો પણ પુષ્ટ મળે છે. માટે નકલી વસ્તુઓ ચૂંટીને બાજુએ કેવી રીતે કાઢવી તેને સમજવા માટે ભલભલાની બુદ્ધિ થાકી જય છે, જેને કારણે ફસાઈ જવાય છે. માટે જ તે સૂચયક લક્ષણોને વ્યવસ્થિત સમજવાનું જેઠાંએ. જેથી તજજ્ઞ, નિષ્ણાત, માહિતગાર અને પારખુ માણસને સાથે રાખવો પડે છે. એક નકલી વસ્તુ સાચી વસ્તુ જેવી કેવી રીતે દેખાય છે, તે પારખુ અથવા તો સદ્ગુરુ એક નજરે સહેલાઈથી જેઠાંને બતાવે છે અને અજ્ઞાન આંખો સામેથી દૂર કરે છે. અજ્ઞાનની બાદબાકી થતાં ફક્ત જ્ઞાન જ રહે છે અને માયાનું સહેલાઈથી નિરાકરણ થાય છે. વધેલું જ્ઞાન એટલે જ સદ્ગુરુને ઓળખવી આંખો સામે દેખાનારી પ્રત્યક્ષ વસ્તુને પુરાવા કે પ્રમાણની જરૂરત નથી હોતી. બુદ્ધિદ્વારી આંખો ભલે સ્વચ્છ અને ચોળખી હોય છી તાં કલ્પનાના તિભિરને લીધે તેને જાંખ વળો છે. અંધારાનો ઉપદેશ થતાં તે જાંખ દૂર થઈ જય છે અને બુદ્ધિદ્વારી આંખો વડે વધેલું બધું જ જ્ઞાન સ્પષ્ટ દેખવા માંડે છે. ખેરેખર તો તે રસ્તામાં પહેલી ફૂલોની અથવા તો મણકાઓની માળા હોય છે, પરંતુ સંદ્યાકાળે અંધારું થતાં તે જ વસ્તુ સાપની જેમ ભાસે છે. તેનું કારણ અજ્ઞાનનો પઢ્હો છે. જિસ્સાનો ગુપ્ત દીવો ચેતાવતાં અજ્ઞાન લોપ થાય છે જેથી માળાનું ખરું સ્વરૂપ આપોચાપ દેખાઈ આવે છે અને એનું સર્પપણું નહિવત્ત થઈ જય છે. ત્યારે આ અજ્ઞાનનો દોષ ઓછો કરવા માટે ઉપદેશ માત્ર એક ઉપાય છે. માટે જ જ્ઞાની પુરુષો અજ્ઞાન શું છે તેનો ઉપદેશ કરે છે. (ઓ. ૧૭૨-૧૮૫)

સંસારમાં રહેતાં પ્રારબ્ધના કે નસીબના ભોગે સમય અનુસાર જે ભોગ ભોગવવા પડતા હોય તે અજ્ઞાનના કારણે સજ્જનીયેલાં કર્માને લીધે જ હોય છે તે સમજ લેવું જેઠાંએ. ‘સત્યં જ્ઞાનમનતં પ્રભ્લ’ જ્ઞાન એ જ સત્ય છે, અને બ્રહ્મ એ જ અનંત એટલે સદાયે ટકનાર છે અને અજ્ઞાન અને માયા આ બધો બ્રહ્મ છે. ખોટા અવિચારી ગોટાળા છે અને ખોટી સમજ છે. તે જ્યારે નહિવત્ત થાય ત્યારે જ જ્ઞાનનો બ્રહ્મ દૂર થાય છે. જેનું દેહભિમાન ગયું નથી તેને જ્ઞાની કોણ કહી શકે ? અભિમાનનું જે રહેઠાણ તે જ મૂર્તિમંત અજ્ઞાન છે. જેને માયાનો અતિરેક કહેવામાં આવ્યો છે, જેમાં આ આખંય વિશ્વ ચૂર અથવા તો મન રહે છે એવા આ ભૂલભૂલામણીમાં પાડનાર સંસારનો મૂળ આધાર તે અજ્ઞાન જ છે. અજ્ઞાનમાંથી જ તેનો ઉદ્ગમ છે. તેનો વૈભવ પણ અજ્ઞાનમાંથી જ ઉદ્ભબે છે. અને એકત્વની જગ્યાએ અનેકત્વની જે ભાવના થાય છે, તેનું પણ મૂળકારણ અજ્ઞાન જ છે. થોડુંક અજ્ઞાનાં અને થોડુંક અંધારું એવા સમયમાં રસ્તામાં પડેલું દોરડું મોટે ભાગે દોરડું જ હોવાં છી તાં સર્પનો ભાસ પેઢા કરીને અતિશાય ડર પેઢા કરે છે. આ સર્પનો ભાસ તે માત્ર અજ્ઞાન છે. આવા અજ્ઞાનનો નાશ થયા વીના મન બયમુકત થતું નથી. કોઈને તે ફૂલોનો હાર દેખાય છે તો કોઈને આંખે લાકડીનો દંડો દેખાય છે. એકદ્વારે જેવા જઈએ તો આ બધો એક ભાસ જ છે. અને મિથ્યા જ્ઞાનની ન રોકી શકાય તેવી અને ન સરખાવી શખાય તેવી ખરાબ પરિસ્થિતિ જ છે. આ ભાંતિમાં થતી અવદશાન ન નિવારી શકાય તેવી જ છે. વેદશાસ્ત્રમાં વચ્ચનોને અનુસરીને જે આસ્તિક બુદ્ધિ ધારણ કરે છે, તે જ બ્રહ્મજ્ઞાનનો ખરો અધિકારી છે. જન્મ જન્માંતરનો નાસ્તિક ક્યારેય બ્રહ્મજ્ઞાનનો અધિકારી થાય તે શક્ય નથી. આ વિશ્વ ઉલ્લું એટલે કે અયથાર્થ દસ્તીની જેનારા લોકોને ચરાચર વિશ્વ આ વિશ્વાત્મ્યનો એટલે વિશ્વવ્યાપી પરમેશ્વરના ઝેણે ન દેખાતાં વિશ્વરૂપે દેખાય છે તે તેનો બ્રહ્મ અથવા તો ગેરસમજ છે. તેના જન્મ મરણનો ક્રમ પૂર્ણ થતો નથી. તેમને જે બ્રહ્મતાત્ત્વ દુર્ગમ છે. તે જ અધિકાર ધરાવનારી વ્યક્તિને એકદમ સુગમ થઈ જય છે. અહીંથા પ્રવચનો કામ લાગતાં નથી. અથવા તો અનેક વેદો ઉપરના હક્ક,

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

અથવા અનેક ગ્રંથોના અર્થ જાણવાની બુદ્ધિ અથવા તો અનેક ગ્રંથોનું વાંચન કે વધારે પડતું શ્રવણ પણ કામમાં આવતું નથી. શબ્દોને લીધે શબ્દોનું જ્ઞાન થાય છે પણ તેને લીધે ખરી વસ્તુનું કે બ્રહ્મનું જ્ઞાન થરે ખરું? બુદ્ધિને નિત્ય અને અનિત્ય વચ્ચેનો ભેદ જાણવાની ઉત્તમ શક્તિ છે પરંતુ વસ્તુ બ્રહ્મ તેની હૃદમાં કયારેય આવતું નથી. ખેડ્રશનથી જુદે ચઢીને અને હજુ સુધી વાદવિવાદ જ કરતા રહ્યા, છતાં આત્મ તત્ત્વ પોતાના સ્થાને રહીને અને શબ્દોની માયાજળમાં કયારેય ગુંચવાતું નથી. મોટા શબ્દપંડિતો થઈ ગયા છતાં બ્રહ્મઙી સૂર્યની સામે તેઓ આગિયા જ ઠર્યા. એક વખત ખરી વસ્તુ એટલે કે બ્રહ્મ પ્રાપ્ત થયું કે શબ્દોનાં જળાં ઉકલી જય છે. જગતમાં જુઓ કે અંધારામાં રાત્રીના દીવાના પ્રકાશમાં બધી જ ડિયાઓ ચાલે છે. પરંતુ સૂર્યોદય થતાં જ સવારે તે દીવાને કોઈ પૂર્ણતું નથી. છતાં જે વાચાનો વિષય નથી તેનો ઉપદેશ કેવી રીતે કરી શકાય? માટે જ દિશાંતર્દ્વારી કથા કહેતી વખતે વક્તાના અજ્ઞાનનું નિવારણ થાય તે જ ધ્યેય હોવો જોઈએ. આસ્તિકતાની બુદ્ધિથી ઉપાસના કરવાથી, આત્મા પ્રસન્ન થઈને આત્મતત્ત્વભાવ પ્રગટ કરે છે અને ઉપાસકોને તે ઉપલબ્ધ થાય છે. આત્માની જગ્યાએ પરમાત્માનું ધ્યાન કરવાથી અનુભૂતિ અનુસંધાન રાખીને ઉપાસના કરવાથી આત્મા જાતે જ ઉપાસક ઉપર પ્રસન્ન થાય છે. તેને માટે બીજું સાધન નથી. આત્માને જાતે જ પ્રસન્ન થવું પડે છે. સાધકની આત્મા તરફની કરામત જોઈને આત્મા જ તેની ઉપર પોતે જ કૃપા કરે છે. આ આત્મા એટલે પરબ્રહ્મ પરમાત્મા, પ્રવચયનોથી એટલે કે અનેક પ્રકારે વર્ણિન કરીને, તર્કશીલ બુદ્ધિથી અથવા તો અનેક ગ્રંથોના વાંચનથી કોઈને પણ પ્રાપ્ત થતો નથી. આત્મા જેનો સ્વીકાર કરે છે તેને જ તે પ્રાપ્ત થાય છે. તેને માટે તે આત્મા પોતાનું ખરું સ્વર્ગપ જાતે જ પ્રગટ કરે છે. (ઓ. ૧૮૬-૨૦૫)

ગ્રંથોના વિષયોની સમાપ્તિ થતાં વક્તાઓ શ્રોતાઓને હંમેશાં પ્રાર્થના કરે છે અને સાંભળવાના શ્રમ બદલ ક્ષમા માંગે છે. આ શિષ્ટ રીતે બધે જ પ્રચલિત છે. પરંતુ આ સાઈ ચરિત્ર માટે આવી કોઈ પદ્ધતિ અનુસરવામાં આવી નથી. કારણ કે તેનું કર્તૃત્વ મારે માથે નથી. સાઈબાબા એ જ મારા હાથમાં કલમ મુકીને પોતાની કથા લખાવી છે. માટે હું ગ્રંથ કર્તાં નથી. અને અહીંથાં મારા કારણે શ્રોતાઓ પણ આવતા નથી. જે હું શ્રોતાઓને ક્ષમા કરવાનું કહું તો આ ગ્રંથનું કર્તૃત્વ મારા માથે આવશે. મારે માટે આ કોઈ ભૂષણ નથી અને મારે માથે કોઈ દોષ પણ લાગતો નથી. જ્યાં ‘સાઈ’ જ કર્તાં ત્યાં આ વિષય પણ તેની જ કૃપાથી સંપૂર્ણ થયો છે. મહારાજની જ આજ્ઞા લઈને તેમણે જે પ્રમાણે કહ્યું એ જ પ્રમાણે બધાએ સાંભળવું. માટે મેં આ અજ્ઞાનનું નિવેદન લખી કાઢ્યું છે. પોતાનો વૈભવ, પોતાનો પ્રતાપ અને પોતાનું ગૌરવ પ્રગટ કરવા માટે મારા મનમાં પ્રવેશ કરીને ગુરુદેવે વિષયનો અર્થ પ્રકાશિત કર્યો છે. આ ગ્રંથને જે દોષ આપશે અથવા તેને જે ભૂષણ માનશે તેઓ બંને મને પૂર્ણપણે વંદ્નીય છે અને સાક્ષાત્ નારાયણ સ્વર્ગપ છે. ભક્તોના અત્યંત કલ્યાણ ખાતર હેમાદ્પંતને હાથમાં રાખીને શ્રી સાઈનાથ મહારાજે જ આ ચરિત્ર લખાવ્યું છે. તેમનું આ શરીર ધારણ કરવું લોકો ઉપર અનુગ્રહ કરવા માટે, ખરાબ તર્કાનું અને દુરાગ્રહોનું ખંડન કરવા માટે, અને લોકસમૂહ ભેગો કરી કલ્યાણ કરવા માટે જ હતું. માટે જ હેમાદ્પંત તેમનાં ચરણોમાં અનન્યભાવથી દંડવત્ પ્રણામ કરે છે અને આગળની રસાળ કથા સાંભળવા માટે શ્રોતાગણોને એકાગ્ર ચિત્ત થવા માટે વિનંતી કરી રહ્યા છે. (ઓ. ૨૦૬-૨૧૫)

સર્વનું કલ્યાણ થાઓ. આ પ્રકારે સંત અને સજજનોની પ્રેરણા પામેલા. અને ભક્ત હેમાદ્પંત રચિત.

શ્રી સાઈસમર્થના સત્યચરિત્રનું ‘અજ્ઞાન-નિરસન’ નામનો આ પચાસમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે.

શ્રી સદગુરુ સાઈનાથને અર્પણ.



## અધ્યાય ૫૦નું અર્� વિવરણ

આ અધ્યાય અને તેની પહેલાંનો આ જ વિષય ઉપરનો અ. ૩૮ આ બંને મોટા ભાગે ભક્તો બરાબર સમજી શકતા નથી. શક્તિઓમાં તો મને પણ સમજવા માટે ખૂબ અધરા લાગ્યા હતા. પછી સંસ્કૃત ભાષાનો અને ગીતા ઉપનિષદ જેવા આધ્યાત્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યા બાદ જ અને સાઈનાથ મહારાજની અસીમ ફુપાને કારણે જ તેનો સારો એવો ભાવાર્થ મારા ધ્યાનમાં આવ્યો. તે મારા બહાલા સાઈ ભક્તો માટે બંને એટલી સહેલી ભાષામાં અને સારાંશકૃપે નીચે આપું છું -

ગીતાના યોથી અધ્યાયના ‘તદ્વિજ્ઞ પ્રણિપાતેન પરિપ્રેન સેવયા’ના અર્થ ઉપર નિવેદન કરીને સાઈનાથ મહારાજે સૌભક્તોને આશ્રમચક્રિત કરી દીધા છે. અશિક્ષિત અને ગામડિયા જેવા દેખાતા આ ફરીરને સંસ્કૃતભાષાનું વ્યાકરણ સહિતનું જ્ઞાન ક્યાંથી થયું અને ગીતા જેવા ગ્રંથના તત્ત્વજ્ઞાનનો ગૂઢાર્થ કેવી રીતે સમજલયો? પરંતુ તેમાં કોઈ આશ્રમાં પહુંચા જેવી વાત નથી. સંતોને જગતની દેરેક વસ્તુઓ હુથેળી ઉપર મૂકેલી વસ્તુની માફક સ્વરૂપ અને સાફ દેખાતી હોય છે અને તે વાતનું તેમને સંપૂર્ણ અને સવિસ્તાર જ્ઞાન હોય છે. બાબાએ આ પ્રસંગ ઊભો કરીને કંઈ પોતાના જ્ઞાનનું પ્રભુત્વ જલ્દેર કરવા માટે નહીં પણ નાનાસાહેબ ચાંદોરકરનું સંસ્કૃત ભાષા ઉપરના જ્ઞાનનું અભિમાન તોડવા માટે કર્યો હતો અને બેગા થયેલા ભક્તોને પોતાનું અજ્ઞાન નાચ કરીને ખું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું તેનો ઉપદેશ કરવો હતો. માટે જ બાબાશ્રીએ આ પ્રસંગ ઊભો કર્યો હતો.

પરંતુ સંસ્કૃત શલોકનો આ સરળ અર્થ ગુજરાતી ભાષામાં કંઈક આ પ્રમાણે થાય -

કહે ગુરુપદે પ્રણિપાત | વેચી દે ગુરુસેવામાં જીવન |

ને પ્રમાદિકમાં જે આદરવંત | તેને જ્ઞાની ઉપદેશો જ્ઞાનાર્થ ||૪૮||

અ. ૩૮

બાબાએ તેનો જ ભાવાર્થ વ્યવસ્થિત રીતે સ્પષ્ટ કરીને કહ્યો છે એટલું જ નહીં પણ ‘જ્ઞાન’ શબ્દની જગ્યાએ ‘અજ્ઞાન’ શબ્દનો પ્રયોગ કરીને ગુરુએ જ્ઞાન કરતા શિષ્યને અજ્ઞાનનો ઉપદેશ કરવાથી તે કેટલો ઉપયોગી અને ફળજાયક નિવઠે છે તે નવીનતાપૂર્ણ તત્ત્વને દેરકને માટે તેમને સંયુક્તકૃપે સમજલયું છે.

‘પ્રણિપાત’ એટલે ફક્ત સાધારણ નમસ્કાર નહિ પણ જેવી રીતે એક લાકડીનો દંડ જમીન ઉપર પડે છે તે જ પ્રમાણે એક ખરા શિષ્યે પોતાનું શરીર પોતાના સમર્થ ગુરુનાં ચરણોમાં આ પ્રમાણે ઢાળી દેવું જોઈએ. આપણે પોતે જ્ઞાણે કંઈ જ નથી, બિલકુલ શૂન્યવત્ત હોઈએ અને ગુરુ એટલે જ સર્વસ્વ, એવી સંપૂર્ણ નમ્રતાથી અને કાયા, વાચા અને મનથી સ્વીકારેલી સંપૂર્ણ શરણાગતિની ભાવના હોવી જોઈએ. ‘પરિપ્રેક્ષ’ એટલે ખરી જ્ઞાનસાથી અને પોતાની શંકા વ્યવસ્થિત સમજને તેનું નિવારણ કરવા માટે પોતાના ગુરુને અનેકવાર પ્રશ્નો પૂછ્યા એમ થાય છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે, ગુરુની એકાદી ભૂત પકડી રાખીને અમસ્તા સત્તાવવા કે તેમને અપમાનીત કરવા અથવા તો એક સાધારણ ગમ્મત સમજને ગમે તેવા પ્રશ્નો પૂછ્યા. ‘સેવા’ એટલે ફક્ત ગુરુના પગ દ્વારાવવા પૂરતી ચાકરી નથી. પણ તે સેવામાં પોતાના સહગુરુને પોતાનું તન, મન, અને ધન સર્વસ્વ રીતે અર્પણ કરેલું હોવું જોઈએ. તેમજ આ સેવા હું કરી રહ્યો છું અને તે કરવા કે થોભાવવા હું સ્વતંત્ર છું તેવી અહંકારની ભાવના પણ ન હોવી જોઈએ. મારું સર્વસ્વ એટલે કે શરીર પણ મેં મારા ગુરુને અર્પણ કર્યું છે અને તેની ઉપર સંપૂર્ણ રીતે તેમની જ માલિકી છે. તેને પોતાના શરીર દ્વારા જ્યારે તેમની સેવામાં જોઉવામાં આવે અને તે અંગે મારી પાસે કોઈ પણ જતની ખોટી બડાઈ અથવા તો નિણિય લેવાનો અધિકાર નથી, એવી હીનપણાની ભાવના હોવી જોઈએ.

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

‘જ્ઞાન’ કોઈ ઉપદેશનો વિષય નથી. તે દ્વારા મનુષ્ય માત્રમાં સ્વયં પ્રકાશિત હોય છે. ફક્ત અજ્ઞાનને કારણે તે ઢંકાયેલું રહે છે. ધૂળ જેવી રીતે એક અરીસાને અને શેવાળ જેવી રીતે શુદ્ધ પાણીને ઝાંખું પાડી હે છે તેવી જ રીતે અજ્ઞાન તે જ્ઞાન ઉપરનું આવરણ છે. આ મેલ અથવા શેવાળ જે કોઈ ડાહ્યો માણસ દૂર ખસેડી શકે છે. તેને જ એક સ્વચ્છ પ્રતિબિંબ દેખાવા માર્ટે છે અથવા તો શુદ્ધ પાણી મળે છે. ગુરુનો ઉપદેશ અજ્ઞાનતા વિષેનો હોય છે અને તેનું પરિણામ જ્ઞાનમાં રૂપાંતર થાય છે. જ્ઞાન આપોઆપ ઉત્પન્ન થઈ શકતું નથી. એ તો ત્યાંનું ત્યાં જ હોય છે. તેને ઉચ્ચારવાની પણ જરૂર નથી. ઉપદેશકૃપી શબ્દોથી ડૉક્ટરનાં ઓનરર્ની માફક શિષ્યની આંખમાંથી મોતિયાનો પડ્દો કાઢી નાખવામાં આવે છે. ત્યારબાદ શિષ્યને ચોખ્યું અને સ્પષ્ટ દેખાવા માર્ટે છે અને તેને પોતાના ચૈતન્યકૃપી (જ્ઞાન) સ્વરૂપનું ભાન થાય છે.

ગુરુ જેનો ઉપદેશ કરે છે, અને શિષ્યોને જે છોડવાનું હોય છે તે, ‘અજ્ઞાન’ એટલે વળી શું ? તો એના પ્રકારો નીચે પ્રમાણે છે.

(૧) નજરે દેખાનારું આ આખું વિશ્વ માયાનો જ એક ખેલ છે. પરંતુ તેને ખરું માનવું એટલે જ અજ્ઞાન, ઉંઘમાં સ્વપ્ન આવતાં જાગૃત મન વીના આંખે પોતે અભિલ ત્રિભુવનને જેઠ શકે છે. આ બધાંનું મૂળ કારણ અવિદ્યા અર્થાત્ અજ્ઞાન છે. ખરું જેતાં વસ્તુ હોય છે કંઈ અને તે દેખાય છે કંઈક બીજું. દોરું સાધ જેવું દેખાય છે અને છિપલામાં રહેલો ચળકાટ રૂપા જેવો દેખાય છે. અરે, એટલું જ નહિ સૂર્યનાં કિરણોને પણ ‘મૃગજળ’ માનવામાં આવે છે. સળગતું લાકડું હાથમાં લઈ ગોળગોળ ફેરવતાં તે જગ્યાએ એક અભિનું ચક દશ્ચિમાન થાય છે. આમ માયાનું શક્તિનું દર્શન થાય છે. આમ જેવા જઈએ તો ખરેખરમાં અભિજ્ઞાનનું તો ત્યાં નામોનિશાન પણ નથી હોતું. પરંતુ માયા, મોહનો આ પ્રસારો વગર લેવે દેવે અતિગ સંસારને ઉત્પન્ન કરે છે.

(૨) આપણો પોતે જ અનાદિ, અનંત, સાક્ષી, શુદ્ધ, પુદ્ધ અને મુક્ત આત્મા હોવાને કારણે આ મર્યાદિત, બિજ્ઞ અને મરણ આવિન દેહ જ છીએ. એવું માનવું તેને જ અજ્ઞાન કહેવાય. દેહબુદ્ધિ અથવા તો દેહાભિમાનને કારણે જ આ શરીરને આવિવ્યાધિ વગેરે હોય છે. ખરું જેતાં આ દેહનું હલનયલન અને વર્તન નસીબના આધારે અને પૂર્વ જન્મની સાથે જેડાયેલા સ્વભાવને અનુસરીને થાય છે. સુખ, દુઃખ, યશ, અપયશ, લાભ અને હાનિ જેવાં દ્વંદ્વો પણ નસીબ પર અવલંબિત હોય છે. તેમ છીતાં કરેલાં કર્મોના આપણો પોતે જ કર્તા છીએ. એવું માનવું તે પણ શુદ્ધ અજ્ઞાનની જ નિશાની છે. તેને કારણે દુઃખો પહતાં મન ચિંતિત અને અસ્વસ્થ થઈ જય છે અને સુખ મળતાં તેની આસક્તિ વધે છે.

(૩) બ્રહ્મ અને સૃષ્ટિ તથા જીવાત્મા અને પરમાત્માને જુદા સમજવા તે પણ અજ્ઞાન જ છે. ‘સર્વ ખલિવંદ બ્રહ્મ’ આ બધું જ બ્રહ્મ છે અને ‘અયમાત્મા બ્રહ્મ’ આ આત્મા પણ બ્રહ્મ છે આ વેદ વાક્યો ઉપર વિશ્વાસ ન રાખવો એ પણ અજ્ઞાન જ છે.

(૪) ઉપર ઉપરની સાત્ત્વિકતાની હોંશ જણાય છે પરંતુ મનમાં હંમેશાં સંશય ધર કરી ગયેલો હોય છે. એક કાણ પણ અપમાન સહન ન થાય, તે પણ અજ્ઞાન જ છે.

(૫) મનનાં ઊંડાણમાં માન સન્માનની, કીર્તિની તીવ્ર ઈચ્છા, અને ઉપર ઉપરથી ધ્યાન કરવાનો ઢોંગ કરવો અને અંતર્મનમાં કામકોધ ધસમસતો હોય તેનું નામ પણ અજ્ઞાન જ કહેવાય.

(૬) માણસ અંદરથી દુષ્ટ કર્મો આચરનારો, આચાર વિચારનાં ડેકાણાં વીનાનો અને તેણે વિવેકનું દેવાળું ફૂકેલું હોય પણ બહારથી બ્રહ્મનિષ થઈને ફરવું તે પણ એક અજ્ઞાનનો પ્રકાર જ છે.

(૭) શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ વિષયોની પાછળ ઈન્દ્રિયો પહતાં શક્તિ વ્યર્� ખર્ચાઈ જય છે. તેને પગલે પગલે અધોગતિનો જ ડર રહે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે પાંચ વિષયોથી જે સુખ મળે છે તે અંતે તો દુઃખમાં

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

જ પરિણામે છે. શબ્દનાં વિષયમાં હરણ હુબે છે ત્યારે તે પોતાના પ્રાણ ગુમાવી બેસે છે. હાથી સ્પર્શના વિષયનો ઉપભોગ કરે છે, પછી તેને અંકુશના પ્રહારો સહન કરવા પડે છે. ઇથી જેતાં વિકારોમાં પતંગિયું થાપ ખાય છે અને પોતાના શરીરને ભસ્મીભૂત કરી નાખે છે. માછલું રસના વિષયના સુખનો ઉપભોગ કરતાંની સાથે જ પ્રાણ ગુમાવી બેસે છે. ભમરો ગંધના વિષયમાં મસ્ત થઈને કમળના પુષ્પમાં બીડાઈ જય છે અને મરણને શરણ થાય છે. એક એક વિષયોની પાછળ આવા પ્રસંગો આવતા હોય તો, પાંચ વિષયો બેગા થતાં કેટલું ભયંકર પરિણામ આવતું હશે ? આ તો પશુ પક્ષી અને જળચરોનો વ્યવહાર થયો, પરંતુ જાણવા છતાં મનુષ્ય પણ વિષયોની પાછળ ગાંડો થઈને તેની ખરાબ સ્થિતિનું અનુકરણ કરે છે. તેના કરતાં વધારે અજ્ઞાન તે વળી બીજું કર્યું ?

(૮) જેનું ચિત્ત ચોવીસે કલાક દ્રવ્ય અને વૈભવી દુનિયા તરફ વળેલું છે, જેનું મન વિષયોથી અતૃપ્ત છે, જેનું પોતાના જ સંસારમાં સ્વી, પુત્ર, પુત્રી તરફનું અખંડ ધ્યાન છે, તેના શાનને પણ અજ્ઞાન જ સમજવું. આવો ધન, સ્વી, પુત્ર વગેરેથી સંપત્તિ અને મોહિત થયેલો મનુષ્ય જ્ઞાની હોવા છતાં પોતાનું હિત સાધી શકતો નથી.

(૯) અજ્ઞાન અને માયાથી ઘેરાયેલા જીવાત્માને અજ્ઞાન અને પાપ તરફનું જ વધારે બેંચાણ હોય છે. ગાયના આંચળો દૂધથી ભરેલા હોય અને દૂધ ટપકતું હોય ત્યારે ત્યાં જ તેના શરીર ઉપર લોહી ચૂસીની જીવાતો ચોટેલી હોય છે. પરંતુ તેને લોહીની તરસ હોવાને કારણે તેને દૂધની પરવા હોતી નથી. ડેડકો અને ભમરો આ બંને માટેનો સુંદર વસવાટ એટલે પુષ્પ કમળનો સંગાથ હોય છે, પણ ભમરો કમળના સુવાસિત પરાગમાં વિહાર કરે છે જ્યારે ડેડકો કમળદંડીના નીચેના કાદ્યમાં જીવઠાં મારીને ખાય છે. જ્ઞાનનો પહાડ સામે હોવાં છતાં પણ મૂર્ખાંઓને અજ્ઞાન તરફનું જ ગાંડપણ રહે છે, અને તેમને અજ્ઞાન જ ભાસે છે. તેમની સામે જ્ઞાનનું ભાષણ કરવાથી પણ તેમાનામાં કોઈ ફરક પડતો નથી કે તેનો તેઓ સહૃદિપયોગ પણ કરી શકતા નથી.

(૧૦) કામ અને કોધના હિસાબે મોટા મોટા જ્ઞાનીઓની બુદ્ધિ ભષ થઈને તેઓ અધોગતિ પામે છે. તે લોકો ઉપાય જાણવા છતાં બચી શકતા નથી, અને મનમાં ફાંચે તેવું આચરણ કરે છે. તેઓ ન કરવાનું અચ્યુક કરે છે. જે વસ્તુ ઉપર ફહેલાં તિરસ્કાર હોય છે તેને જ પ્રેમથી સ્વીકારે છે. જે લોકો પ્રયત્નપૂર્વક પોતાનો પાપથી બચાવ કરે છે તેવા જ લોકો દૈવયોગથી પાછા પાપ કર્મમાં પ્રવૃત્ત થઈ જય છે. ભલેને મોટો જ્ઞાની હોય અને પાપઢ્યી છાયાની ઈચ્છા કરતો ન હોય તેમ છતાં જેમ એક પતંગિયું દીવાના જ પ્રકારામાં પોતાની જાતને ભૂલે છે, તેવી જ રીતે એ જ્ઞાની મનુષ્ય પણ સારાં નરસાં કૃત્ય સમજવાનું ભૂલી જય છે. પાપ કરવું તે અજ્ઞાન છે. તેની તેને સંપૂર્ણ જણકારી હોય છે, પરંતુ કામવાસનામાં તરબોળ માણસને પાપની જાણકારી હોવા છતાં તેની પરવા કરતો નથી.

(૧૧) સુખના ઝાડનાં મૂળ પાસે જેવી રીતે કાળસર્પ કુંડાળું કરીને બેસે છે, તેવી જ રીતે કામ અને કોધની આ નાળ જ્ઞાનઢ્યી ગર્ભને બહારની બાજુથી વાંટાયેલી રહે છે. ઠન્ડિયો બુદ્ધિ અને મન આ બધા પેલી કામવાસનાની સાથે જેડાયેલાં છે. તેમને ભોગે તે જીવાત્માનું જ્ઞાન ઢાંકી દઈને જીવાત્માને મોહમાં ધકેલે છે. તમારે જે ચંદ્ન જેઈતું હોય તો સાપનો નાશ કરો. કામ કોધનું આચછાદાન દૂર કરીને જ્ઞાનનો ખજનો મેળવી લો.

(૧૨) પોતાને જ્ઞાની સમજને ફરવું અને અયોગ્ય કર્મોનું આચરણ કરવું તે પણ અજ્ઞાન જ કહેવાય.

(૧૩) ગુરુના ઉપદેશ વિષે મનમાં શંકા રાખવી અને તેમનાં શબ્દો ઉપર ભરોસો કે શ્રદ્ધા ન રાખવી તે પણ અજ્ઞાન જ છે. સંશય ફેલાતાં અજ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનમાં સંશય આવતાં જ અભિમાન જ્ઞાની પુરુષનો પણ કોળિયો કરી જય છે. બગાડેલા દર્દીના ટપકાથી ભરેલો દૂધનો ઘડો ખાટો થઈ બધું દૂધ ફાટી જય છે. માટે અજ્ઞાનને ફહેલાં જ સમજ લો. તેનું નિરાકરણ થતાં જ અને મન શુદ્ધ થતાં જ, આંતરિક જ્ઞાન પ્રગટ થાય છે.

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

‘અજ્ઞાન’ તો સમજયું. પરંતુ તેને દૂર કરીને ‘જ્ઞાન’ પ્રાપ્ત કેવી રીતે કરવું ? તેના ઉપાય તે ક્યા છે ? તે બાબાએ અને ત્યારબાદ હેમાડપંતે આ પ્રમાણે બતાયેલ છે.

(૧) મુમુક્ષત્વ એટલે સંસારના બંધનમાંથી અને જન્મ ભરણના ફેરાઓમાંથી છૂટવું અને મોક્ષ મેળવવા માટેની તીવ્ર ઈચ્છા હોવી. વિષયોના ચક્કરમાં હું ગુંચવાયેલો છું, મારી મુક્તિ તેમાંથી કયારે થશે ? આમ સતત બોલનારા મુમુક્ષુને બચાવવા માટે શાસ્ત્રો છે. આવા મુમુક્ષુ ભક્તોને જેઠને સંતોનું મન અત્યંત કકળી ઉંચું હોય ત્યારે તેઓ કોઈ પણ નિમિત્ત ઊભું કરીને સહજ રીતે જ્ઞાનનો ઉપદેશ કરે છે.

(૨) વિષયોથી અને કામકોદથી દૂર થવું અને ઇન્દ્રિયોને તાબામાં રાખવી. રથની સાથે જેવી રીતે ઘોડાઓ જોડાયેલા છે, તેવી જ રીતે શરીર ઇન્દ્રિયોની સાથે જોડાયેલું છે. તે ઇન્દ્રિયોને મનની લગામ વડે બુદ્ધિ પોતાના હાથથી દાબમાં રાખે છે. સંકલ્પ અને વિકલ્પથી ભરેલું અને પોતાની ઈચ્છા પ્રમાણે ભટકનારું મન ફાવે તેમ ઢોડી જવા માંગે છે પણ બુદ્ધિ તેને પોતાના નિશ્ચય વડે રોકી રાખે છે અને લગામથી કાબૂ મેળવી પોતાની સત્તા તેની ઉપર પ્રસ્થાપિત કરે છે. બુદ્ધિ જેવો કુશળ નેતા રથનો સારથી હોય પછી રથના સ્વામીને શેની ચિંતા હોય ? તેણે તો બસ સ્વસ્થ ચિંતે જ વ્યવહાર કરવાનો દેહનાં સર્વ કાર્ય કરાવવા તે બુદ્ધિનું કામ છે મનનું નહીં. મનને આવી ટેવ પાડતાં બધો જ વ્યવહાર હિતકારક સાબિત થઈ જય છે. આ સિવાય ઇન્દ્રિયદમન માટે અ. ઉદ, ઓ. ટ્પ-૮૬માં ઇન્દ્રિયો વિષય સિવાય રહેતી નથી, માટે તેમને હરિના અથવા તો ગુરુના કામે લગાડવાના ઉપાય બાબાએ નાનાસાહેબ ચાંદોરકરને અ. ૪૮ ઓ. ૧૫૮-૧૫૯માં કહ્યા છે. ‘બનતાં બનતાં બનશો’ આ ઉપાય અને અ. ૨૪માં લીલા ચણા ઉપરથી ખૂબ હેમાડપંતે કહેલો કોઈ પણ વિષય ઉપરના સેવન કરતાં પહેલાં મહારાજનું સ્મરણ કરવાનો ઉપાય તે ધ્યાનમાં રાખવા જેવો છે.

(૩) ભક્તિ. અજ્ઞાનથી મલિન થયેલા ચિત્તને શુદ્ધિકરણ માટે ઈશ્વર ભક્તિ વગર બીજો કોઈ પણ રસ્તો નથી, અને ભક્તિ વીના જ્ઞાન ઉપજતું નથી. માટે પહેલાં જ્ઞાનને જાણવું જેઠાએ. તેની સ્પષ્ટ માહિતી અને વર્ણન સાંભળવાથી તેનાં બંધનોથી છૂટકારો થાય છે. ભક્તિ એ જ અને જાણવાનું સાધન છે. પગથી જન્મ લેનાર આંખમાં અંજન પડવાથી તેને જમીનમાં દટાઈ રહેતી ધન સંપત્તિનો ઘ્યાલ આવે છે. તે જ પ્રમાણે ભક્તિનો આશ્રય લેવાથી અજ્ઞાનનો નાશ થઈ જાનનો ઉદ્દ્ય થાય છે.

(૪) ‘હું કર્તા અને હું જ ભોક્તા’ આવું ખોટું અભિમાન છોડી દીધા વીના અને ગુરુના શરણે ગયા વીના આપણાને મુક્તિ મળતી નથી. નિત્ય અને અનિત્ય વસ્તુઓનું વિવેચન કરો. શ્રવણ, મનન અને ચિંતન કરો, અને શમ, દમ વગેરે છનો સમુદ્દ્રાય સંપાદન કરો. તો જ અજ્ઞાનનો નાશ થશે.

(૫) વેદશાસ્ત્રોનાં વચ્ચનોને અનુસરીને જે આસ્તિક બુદ્ધિ ધારણ કરે છે, એ જ બ્રહ્મજ્ઞાનનો અધિકારી થાય છે. અહીંથાં ભાષણો કામ આવતાં નથી કે અનેક વેદો ઉપરના હક્ક અથવા તો અનેક ગ્રંથોના અર્થ જાણવાની બુદ્ધિ અથવા તો અનેક ગ્રંથોનું વાંચન અથવા તો આધ્યાત્મિક પ્રવચનોનું શ્રવણ પણ કામ આવતું નથી. શબ્દોના સહિતે શબ્દોનું જ્ઞાન થશે પણ તેને કારણે ખરી વસ્તુનું જ્ઞાન થશે ખરું કે ? બુદ્ધિ પાસે નિત્ય અને અનિત્યનો બેદ સમજવાની ઉત્તમ શક્તિ છે પરંતુ બ્રહ્મ તેની હૃદમાં કયારેય આવતું નથી. પદ્ધતિન જુબે ચઢીને હજુ પણ વાદ જ કરે છે. છિતાં આ આત્મવસ્તુ પોતાના સ્થાને અચળ રહે છે. છિતાં જે બોલવાનો વિષય નથી તેનો ઉપદેશ કરતાં કેમ ફાવશો ? માટે દણાંતરુપે કથા કહેતી વખતે શ્રોતાઓનું ‘અજ્ઞાનનું નિવારણ’ થાય તે જ વકતાનું દ્યેય હોય જેઠાએ. આસ્તિકતાથી ઉપાસના કરવાથી આત્મા પ્રસન્ન થઈને આત્મભાવ પ્રગટ કરે છે અને તે જીતે ઉપાસકને ઉપલબ્ધ થાય છે.

